

# સામાજિક વિજ્ઞાન

## ધોરણ 6

### પ્રતિકાળિક

ભારત મારો દેશ છે.  
બધાં ભારતીયો મારાં ભાઈબહેન છે.  
હું મારા દેશને ચાહું છું અને તેના સમૃદ્ધ અને  
વૈવિધ્યપૂર્વી વારસાનો મને ગર્વ છે.  
હું સદાય તેને લાયક બનવા પ્રયત્ન કરીશ.  
હું મારાં માતાપિતા, શિક્ષકો અને વડીલો પ્રત્યે આદર રાખીશ  
અને દરેક જાણ સાથે સભ્યતાથી વર્તીશ.  
હું મારા દેશ અને દેશબાંધવોને મારી નિષ્ઠા અર્પું છું.  
તેમનાં કલ્યાણ અને સમૃદ્ધિમાં જ મારું સુખ રહ્યું છે.

રાજ્ય સરકારની વિનામૂલ્યે યોજના હેઠળનું પુસ્તક



ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ  
'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર-382010

ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, ગાંધીનગર

આ પાઠ્યપુસ્તકના સર્વ હક ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળને હસ્તક છે.

આ પાઠ્યપુસ્તકનો કોઈ પણ ભાગ કોઈ પણ રૂપમાં ગુજરાત રાજ્ય શાળા

પાઠ્યપુસ્તક મંડળના નિયામકની લેખિત પરવાનગી વગર પ્રકાશિત કરી શકાશે નહિએ.

## વિષય-સલાહકાર

ડૉ. જી. ટી. સરવૈયા

શ્રી નીતિન કોઠારી

ડૉ. મુકેશ એચ. બટીક

## લેખન

ડૉ. બિમલ ભાવસાર (કન્વીનર)	ડૉ. નવનીત જ્યસ્વાલ
શ્રી બી. એમ. મેટાલિયા	ડૉ. જયમલ જી. રંગિયા
ડૉ. પૂર્ણિમા એ. ત્રિવેદી	શ્રી પંકજ એ. પ્રજાપતિ
શ્રી અ. ટી. પટેલ	ડૉ. ભાવેશ પંડ્યા
ડૉ. અભિલ ડી. ઠાકર	ડૉ. જનક ગઠવી
શ્રી સલીમ એસ. કુરેશી	શ્રી વસંતરાય એમ. તેરૈયા
શ્રી વી. એમ. બલદાણિયા	

## સમીક્ષા

શ્રી નરેન્દ્રભાઈ રાવલ	શ્રી હરજીભાઈ પ્રજાપતિ
ડૉ. હસમુખ એસ. પટેલ	શ્રી સફીમહંમદ લોરા
શ્રી અનીલભાઈ પંડ્યા	શ્રી કાંતિભાઈ પરમાર
ડૉ. રાજેશ બી. કોઠારી	શ્રી ભાવિનગીરી ગોસાઈ
શ્રી દીપક ચૌહાણ	શ્રી હિતેશભાઈ બી. ગઢિયા
શ્રી સૌરભ પટેલ	શ્રી નિલમબા ચાવડા
શ્રી તરલ વ્યાસ	શ્રી તેજસ પટેલ
ડૉ. મહેશ કે. પટેલ	શ્રી પ્રકાશભાઈ એન. વસોયા

## ભાષાશુદ્ધિ

શ્રી અધ્યિન આણદાણી

## ચિત્રાંકન

શ્રી ગ્રાફિક્સ

## સંયોજન

ડૉ. ચિરાગ એન. શાહ

(વિષય-સંયોજક : કોમર્સ)

## નિર્માણ-સંયોજન

શ્રી હરેન શાહ

(નાયબ નિયામક : શૈક્ષણિક)

## મુદ્રણ-આયોજન

શ્રી હરેશ એસ. લીમાચીયા

(નાયબ નિયામક : ઉત્પાદન)

## પ્રસ્તાવના

ગુજરાત શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ, ગાંધીનગર દ્વારા તૈયાર થયેલ અને રાજ્ય સરકાર તરફથી મંજૂર કરવામાં આવેલ નવા અભ્યાસક્રમ અનુસાર તૈયાર કરવામાં આવેલ **સામાજિક વિજ્ઞાન, ધોરણ ૬** વિષયનું આ પાઠ્યપુસ્તક વિદ્યાર્થીઓ સમક્ષ મૂકૃતાં આનંદ થાય છે.

આ પાઠ્યપુસ્તકનું લેખનકાર્ય તથા સમીક્ષા નિષ્ણાત પ્રાધ્યાપકો અને શિક્ષકો પાસે કરાવવામાં આવ્યું છે અને સમીક્ષકોનાં સૂચનો અનુસાર હસ્તપ્રતમાં યોગ્ય સુધારાવધારા કરવામાં આવ્યા છે. નવા અભ્યાસક્રમ મુજબ તૈયાર થયેલા આ પાઠ્યપુસ્તકના અધ્યાપકાર્યમાં શિક્ષકોને સહાયરૂપ થાય તેવી સામગ્રીનો પણ આમાં સંક્ષેપમાં સમાવેશ કરવામાં આવ્યો છે. વાલીઓને પણ આ સામગ્રી ઉપયોગી થશે એવી આશા છે. વિદ્યાર્થી જે શીખે તે પાંકું શીખે તેમજ તેઓ જે શીખ્યાં હોય તેનું દરીકરણ થતું રહે તે માટે સ્વાધ્યાય-સામગ્રી પણ આ પાઠ્યપુસ્તકમાં આપવામાં આવી છે. આ કારણે વર્ગશિક્ષણ વિશેષ ફળાયી નીવડશે તેવી અપેક્ષા છે.

આ પાઠ્યપુસ્તકને રસપ્રદ, ઉપયોગી અને ક્ષતિરહિત બનાવવા માટે મંડળે પૂરતી કાળજ લીધી છે. આમ છતાં, પ્રસ્તુત પાઠ્યપુસ્તકની ગુણવત્તા વધારવા માટેનાં સૂચનો આવકાર્ય છે.

પી. ભારતી (IAS)

નિયામક

તા. 05-02-2020

કાર્યવાહક પ્રમુખ

ગાંધીનગર

પ્રથમ આવૃત્તિ : 2019, પુનઃમુદ્રણ : 2020

પ્રકાશક : ગુજરાત રાજ્ય શાળા પાઠ્યપુસ્તક મંડળ, 'વિદ્યાયન', સેક્ટર 10-એ, ગાંધીનગર વતી પી. ભારતી, નિયામક

મુદ્રક :

## મૂળભૂત ફરજો

ભારતના દરેક નાગરિકની ફરજો નીચે મુજબ રહેશે :\*

- (ક) સંવિધાનને વફાદાર રહેવાની અને તેના આદર્શો અને સંસ્થાઓનો, રાષ્ટ્રધ્વજનો અને રાષ્ટ્રગીતનો આદર કરવાની;
- (ખ) આજાદી માટેની આપણી રાષ્ટ્રીય લડતને પ્રેરણા આપનારા ઉમદા આદર્શોને હૃદયમાં પ્રતિષ્ઠિત કરવાની અને અનુસરવાની;
- (ગ) ભારતના સાર્વભૌમત્વ, એકત્તા અને અખંડિતતાનું સમર્થન કરવાની અને તેમનું રક્ષણ કરવાની;
- (ધ) દેશનું રક્ષણ કરવાની અને રાષ્ટ્રીય સેવા બજાવવાની હાકલ થતાં, તેમ કરવાની;
- (ય) ધાર્મિક, ભાષાકીય, પ્રાદેશિક અથવા સાંપ્રદાયિક ભેદોથી પર રહીને, ભારતના તમામ લોકોમાં સુભેણ અને સમાન બંધુત્વની ભાવનાની વૃદ્ધિ કરવાની, શ્રીઓના ગૌરવને અપમાનિત કરે તેવા વ્યવહારો ત્યજ દેવાની;
- (ઝ) આપણી સમન્વિત સંસ્કૃતિના સમૃદ્ધ વારસાનું મૂલ્ય સમજ તે જાળવી રાખવાની;
- (ઝી) જંગલો, તળાવો, નદીઓ અને વન્ય પણુપક્ષીઓ સહિત કુદરતી પર્યાવરણનું જતન કરવાની અને તેની સુધારણા કરવાની તથા જીવો પ્રત્યે અનુકૂંપા રાખવાની;
- (ઝ) વૈજ્ઞાનિક માનસ, માનવતાવાદ અને જિજ્ઞાસા તથા સુધારણાની ભાવના કેળવવાની;
- (ઈ) જાહેર મિલકતનું રક્ષણ કરવાની અને હિંસાનો ત્યાગ કરવાની;
- (ઠ) રાષ્ટ્ર પુરુષાર્થ અને સિદ્ધિનાં વધુ ને વધુ ઉન્ત સોપાનો ભણી સતત પ્રગતિ કરતું રહે એ માટે, વૈયક્તિક અને સામૃદ્ધિક પ્રવૃત્તિનાં તમામ ક્ષેત્રે શ્રેષ્ઠતા હાંસલ કરવાનો પ્રયત્ન કરવાની.
- (ડ) માતા-પિતાએ અથવા વાલીએ 6 વર્ષથી 14 વર્ષ સુધીની વયના પોતાનાં બાળક અથવા પાલ્યને શિક્ષણની તકો પૂરી પાડવાની.

\*ભારતનું સંવિધાન : કલમ ૫।-(ક)

## અનુક્રમણિકા



1. ચાલો, ઇતિહાસ જાણીએ	1
2. આદિમાનવથી સ્થાયી જીવનની સરફર	6
3. પ્રાચીન નગરો અને ગ્રંથો	11
4. ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા	17
5. શાંતિની શોધમાં : બૃદ્ધ અને મહાવીર	22
6. મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક	26
7. ગુપ્તયુગ અને અન્ય શાસકો	34
8. ભારતવર્ષની ભવ્યતા	41
9. આપણું ઘર : પૃથ્વી	47
10. પૃથ્વીનાં આવરણો	59
11. ભૂમિસ્વરૂપો	63
12. નકશો સમજાએ	69
13. ભારત : ભૂપૃષ્ઠ, આબોહવા, વનસ્પતિ અને વન્યજીવન	80
14. વિવિધતામાં એકતા	90
15. સરકાર	94
16. સ્થાનિક સરકાર	98
17. જીવનનિર્વાહ	108
● ચાલો, સમજ ચકાસીએ	117

### CERTIFICATE OF THE MAPS

The following foot notes are applicable :

1. © Government of India, Copyright 2019
2. The responsibility for the correctness of internal details rests with the publisher.
3. The territorial waters of India extend into the sea to a distance of twelve nautical miles measured from the appropriate base line.
4. The interstate boundaries amongst Arunachal Pradesh, Assam and Meghalaya shown on this map are as interpreted from the “North-Eastern Areas (Reorganisation) Act. 1971,” but have yet to be verified.
5. The external boundaries and coastlines of India agree with the Record/Master Copy certified by Survey of India.
6. The spellings of names in this map, have been taken from various sources.



1

# ચાલો, ઇતિહાસ જાણીએ

તમારા છઠા ધોરણના અભ્યાસમાં સામાજિક વિજ્ઞાનનાં એક રસપ્રદ વિષય ઇતિહાસ વિશે આપણે જાણીશું. સમાજવિજ્ઞાનો આપણાને મનુષ્યના સામાજિક વિશ્વથી માહિતગાર કરે છે. તે ભૂગોળ, અર્થશાસ્ત્ર, સામાજિક પરિસ્થિતિ અને સંસ્થાઓ, રાજકીય પ્રવૃત્તિઓ અને સંગઠનોની જાણકારી આપે છે. ઇતિહાસ વિષય સિવાયનાં સમાજવિજ્ઞાનો આપણાને વર્તમાન સમાજજીવનનો પરિચય કરાવે છે. જ્યારે ઇતિહાસ માનવસમાજના ભૂતકાળની માહિતી આપે છે. જેની મદદથી આપણે વર્તમાનકાળને જાણી શકીએ છીએ. શું આપણે ભૂતકાળના જ્ઞાન વગર વર્તમાન સમાજજીવનને સમજી શકીએ ? માનવે જ્યારે અભિનિંદો ઉપયોગ શરૂ કર્યો ન હતો ત્યારે તેનું જીવન કેવું હતું ? તમે એ બાબતની કલ્યાણ કરો કે માનવી ખેતીવાડી, રસ્તા, વાહનવ્યવહાર, મકાનો વગર કેવી રીતે રહેતો હશે ? ઇતિહાસ આપણાને માનવજીવનનાં આવાં વિવિધ રસપ્રદ પાસાંઓ વિશે જાણકારી આપે છે. ઇતિહાસ આપણાને ભૂતકાળના જુદા જ જીવનની સફર કરાવે છે. એક યુગમાંથી બીજા અને બીજામાંથી ત્રીજા એમ અનેક યુગોનાં માનવજીવનનાં રીત-રિવાજો, માન્યતાઓ, તેમના ખોરાક અને પોશાક વિશે માહિતી આપે છે. જાણો કે આપણે કોઈ જુદા જ વિશ્વમાં વિહરતા હોઈએ!

આપણે ભૂતકાળના માનવસમાજનું અધ્યયન શા માટે કરવું જોઈએ એવો વિચાર તમને આવતો હશે. ઇતિહાસ માત્ર ભૂતકાળની જ બાબતો સાથે સંકળાયેલો નથી, તે વર્તમાનકાળની વ્યવસ્થા સાથે કડીરૂપ છે. આપણા પૂર્વજી કેવા હતા ? તે ક્યાં રહેતા હતા ? શું ખાતા હતા ? તેમના જીવનની અનેક મહત્વપૂર્ણ બાબતોની માહિતી આપો ઇતિહાસ આપણાને માનવીના જીવનમાં આવેલા પરિવર્તનોથી માહિતગાર કરે છે.

## ઇતિહાસ જાણવાનાં સાધનો—સ્કોર્ટ



ચિંતને વર્તમાનપત્રમાં વાંચ્યું ‘ગુજરાતના કચ્છમાં 4000 વર્ષ જૂનું શહેર મળી આવ્યું.’ તેને આશ્રય થયું ! આપણે કેવી રીતે જાણી શકીએ કે, આ શહેર 4000 વર્ષો જેટલું જૂનું છે, તે કોણે અને કેવી રીતે બાંધ્યું હશે ? ત્યાંના લોકો કેવો ખોરાક ખાતા હશે ! કેવાં કપડાં પહેરતાં હશે ?

### • પ્રવૃત્તિ •

- તમે ભારતના નકશામાં નર્મદા નદી શોધી કાઢો. હજારો વર્ષો પહેલાં નર્મદાના ડિનારે માનવો વસતા હતા.

આપણે ઇતિહાસ કેવી રીતે જાણી શકીએ ?

ઇતિહાસ જાણવા માટે આપણી પાસે જુદા-જુદાં સાધનો છે.

**(I) તાડપત્ર અને ભોજપત્ર :** પ્રાચીન સમયમાં માનવી લખવા માટે તાડપત્ર કે ભોજપત્રનો ઉપયોગ કરતો, જેને આપણે હસ્તપ્રત કરીએ છીએ. તાડપત્રો એટલે તાડ વૃક્ષનાં પર્ણ પર લખાયેલી હસ્તપત્રો અને ભોજપત્ર એટલે હિમાલયમાં થતા ભૂર્જ નામનાં વૃક્ષોની પાતળી આંતરદ્ધાલ ઉપર લખાયેલી હસ્તપત્રો. તાડનાં પર્ણ પર અને ભૂર્જ જેવાં વૃક્ષોની છાલ પર તેઓ હસ્તપત લખતાં તેમાંથી આપણાને તેમની ભાષા અને જીવન જીવવાની પદ્ધતિની જાણકારી મળે છે. આવી અનેક હસ્તપત્રો મળી છે. તાડપત્ર અને ભોજપત્ર પર લખેલી હસ્તપત્રોમાંથી ભારતના પ્રાચીનયુગના માનવી વિશે આપણાને માહિતી મળે છે.

શ્રાવિતપણે નીતિપ્રકાશબુદ્ધિમદ્દગ્યાનાત્મકતાનાદ્વારાનુભૂતિસમગ્રાજીનાનુભૂતિમનુમાણાખ્યાતસે  
 વાર્ષિકતાબન્ધાનારિકાનાસચક્રવર્ત્યાદર્શાદાનાર્થાનુભૂતિમનુભૂતિસે  
 રેણીસચ્છાયિકરણાદ્વારાસાંકોવિશ્વહન્યાદાનિનુભૂતિસારસાગરસાંકોવિશ્વહન્યાદાનિનુભૂતિ  
 હૃદામદ્દમનુભૂતિબાનુભૂતિનામનાસુધાયાનાદ્વારાનિનુભૂતિસારસાગરસાંકોવિશ્વહન્યાદાનિનુભૂતિ  
 સ્વાધીનમનુભૂતિસારસાગરસાંકોવિશ્વહન્યાદાનિનુભૂતિસારસાગરસાંકોવિશ્વહન્યાદાનિનુભૂતિ  
 પ્રાણીનાનુભૂતિસારસાગરસાંકોવિશ્વહન્યાદાનિનુભૂતિસારસાગરસાંકોવિશ્વહન્યાદાનિનુભૂતિ



## 1.1 ભોજપુર અને તાડપત્ર

આવી હસ્તપ્રતો મંદિરો અને મઠોમાં સચ્ચવાયેલી છે. તેમાં સંસ્કૃત, ગ્રાહૂત અને તમિલ ભાષામાં લખાણો મળે છે. કવિતા, નાટકો, વાર્તાઓ અને મહાકાવ્યો પણ તાડપત્ર અને ભોજપત્ર પર મળી આવ્યાં છે. તે પોથીસ્વરૂપે પણ સચ્ચવાયેલી છે. જેમાં ધાર્મિક રીત-રિવાજો, સામાજિક માન્યતાઓ, રાજાઓની જીવનશૈલી, વિજ્ઞાન, શિક્ષણ, દવાઓ, પ્રાણીઓ વિશે મોટા પ્રમાણમાં માહિતી મળે છે.

**(II) અભિલેખો :** ધાતુઓ અને પથ્થરો પર કોતરેલા કે લખેલા લેખ અભિલેખ કહેવાય છે. આપણે અભિલેખોમાંથી પણ ઈતિહાસ જાણી શકીએ. રાજા પોતાના આદેશો શિલાઓ પર કોતરાવી પ્રજા સાથે સંવાદ કરતા હતા. પ્રાચીન ભારતના અનેક રાજાઓ અને રાણીઓએ તેમનાં રાજ્ય, વિજ્ય, ધર્મ અને સંસ્કૃતિની માહિતી આવા અભિલેખો પર અંકિત કરાવી છે. આવા શિલાલેખો અને અભિલેખો પર લખાયેલા લખાણો લાંબા સમય સુધી ટકી રહ્યા છે. અશોકના શિલાલેખો ખૂબ જ જાણીતા છે.



1.2 અશોકનો શિલાલેખ, જૂનાગઢ

**(III) તામ્રપત્રો :** તાંબાના પતરા ઉપર કોતરીને લખવામાં આવતું લખાણ એટલે તામ્રપત્ર. અનેક રાજાઓએ પોતાના વહીવટીતંત્ર અને દાનની માહિતી તામ્રપત્રો ઉપર પણ કોતરાવી છે. ગુજરાતમાં આવાં તામ્રપત્રો મોટી સંખ્યામાં મળી આવ્યાં છે. જેમાંથી રાજના નામ, તેના ધર્મ, વહીવટીતંત્ર અને દાનર્ધમની વિગતો મળે છે. આવાં તામ્રપત્રો શ્રી હેમયંદ્રાચાર્ય જૈનજ્ઞાન મંદિર, પાટણ (ઉત્તર ગુજરાત), એલ.ડી. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ, બો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ, શ્રી મહાવીર જૈન આરાધના કેન્દ્ર, કોબા (ગાંધીનગર)માં સચ્ચવાયેલાં છે.

**સિક્કા :** સિક્કા પણ ઈતિહાસ જાણવાનું અગત્યનું સાધન છે. સિક્કા પર રાજનું નામ, તેના ધર્મ, સંસ્કૃતિ તથા તેના સમય વગેરેની માહિતી મળે છે. ભારતમાં ઈ.પૂ. 5મી સદીના પંચમાર્ક સિક્કા મળી આવ્યા છે જે સૌથી જૂના સિક્કા છે. આ સિવાય ગ્રીક રાજાઓ, મૌર્યકાળ અને ગુપ્તયુગના અનેક સોના-ચાંદી-તાંબાના સિક્કા, જે-તે રાજ્યની સામાજિક, ધાર્મિક, આર્થિક અને રાજકીય માહિતી આપે છે.



1.3 સિક્કાઓ

**પંચમાર્ક સિક્કા :** ધાતુના ટુકડાઓને છાપ ઉપસાવવા બીજામાં મૂકી દ્વારા આપી બનાવતા સિક્કા ‘પંચમાર્ક’ સિક્કા તરીકે ઓળખાય છે.



1.4 પંચમાર્ક સિક્કા

### ઈતિહાસના અભ્યાસીઓ – પુરાતત્ત્વશાસ્ત્રીઓ, ઈતિહાસકારો અને પ્રવાસીઓ

માનવસમાજનો ભૂતકાળ જાણવા આપણાને પુરાતત્ત્વશાસ્ત્રીઓ જેને અંગ્રેજમાં Archaeologist કહેવાય છે તે સંશોધન કરીને માહિતી આપે છે. તેઓ પ્રાચીન સ્થળો પર જઈ ઉત્ખનન કરીને મકાનો, સિક્કા, ઈંટો, પથરો, ઓજારો, ખોરાકના નમૂના, મનુષ્યો અને પ્રાણીઓનાં હાડકાં વગેરે શોધીને તેનો અભ્યાસ કરી તે સમયના માનવોની સંસ્કૃતિથી આપણાને અવગત કરાવે છે.

પ્રાચીનકાળથી મનુષ્ય એક જગ્યાએથી બીજી જગ્યાએ પ્રવાસ કરતો રહ્યો છે. ઘણા પ્રવાસીઓ બીજા દેશોમાં જઈને ત્યાંના જીવનની નોંધ પડા કરતા હતા. આવા પ્રવાસીઓનાં પ્રવાસવર્ણનમાંથી આપણાને જે-તે દેશના ઈતિહાસ અને સંસ્કૃતિની જાણકારી મળે છે. તેમાં મેગેસ્થનીસ, પ્લિની, ફાહિયાન, યુઅન શવાંગ જેવા મુસાફરોનો સમાવેશ થાય છે.

પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને ઈતિહાસકારોનાં સંશોધનોથી આપણાને ઉત્તર-પશ્ચિમ ભારતમાં સિંધુનદીના કિનારે પાંગરેલી મહાન સંભ્રતાનાં દર્શન થાય છે. ભારતમાં આજથી 4500 વર્ષ પહેલાં અનેક શહેરો અસ્તિત્વમાં હતાં. એ જ રીતે ગંગાનદીની આસપાસનાં ક્ષેત્રોમાં આજથી 2500 વર્ષ પહેલાં ઘણાંબધાં શહેરોનો વિકાસ થયો હતો તે પણ જાણી શકાય છે.

આ બધાં સાધનોથી તે સમયના માનવસમાજના રીત-રિવાજો, ખોરાક-પોશાક અને ટેકનોલોજી તથા સંસ્કૃતિની માહિતી મળે છે. ભારતનાં અનેક શહેરો અને ગામડાંઓ શોધી તેમણે આપણાને કપાસ, જવ, ઘઉં ઉપરાંત તે સમયનાં પ્રાણીઓની માહિતી આપી છે.

ઈતિહાસકારો ભૂતકાળનું અધ્યયન કરનારા મહત્વના વિદ્બાનો છે. તેઓ મળી આવેલાં સાધનોનું વર્ગીકરણ કરે છે, સંશોધન કરે છે, હસ્તપતો-દસ્તાવેજો-અભિલેખોમાંથી માહિતી એકત્રિત કરે છે અને પછી યોગ્ય રીતે તેનું આલેખન કરે છે. પુરાતત્ત્વશાસ્ત્રીઓ અને ઈતિહાસકારો ભૂતકાળને આપણી સમક્ષ જીવંત કરે છે.


**ભૂમિનું નામ :** આપણે આપણા દેશને બે નામોથી ઓળખીએ છીએ. ઈન્ડિયા અને ભારત. ઈન્ડિયા શાબુ ઈન્ડસ પરથી ઊતરી આવેલો છે. જેને સંસ્કૃત ભાષામાં સિંધુ કહેવાય છે. પ્રાચીન ઈરાન અને ગ્રીસના લોકો સિંધુ નદીથી પરિચિત હતા. તેઓ આજથી 2500 વર્ષ પહેલાં તે પ્રદેશના સંપર્કમાં આવ્યા હતા. ઈરાનીઓ સિંધુ નદીને હિન્ડોસ અને ગ્રીસના લોકો ઈન્ડસ કહેતા. તેઓ આ નદીના પૂર્વ કિનારાને India-ઈન્ડિયાથી ઓળખતા. ભારત એવું

નામ ઋવેદમાંથી આપણાને જાણવા મળે છે. ભરત નામનો માનવસમૂહ ઉત્તર-પશ્ચિમ ભારતમાં આવીને વસેલો. તેમના નામ પરથી આપણો દેશ ‘ભારત’ તરીકે ઓળખાય છે. આ સમૂહનો ઉલ્લેખ સંસ્કૃતની આરંભિક કૃતિ ઋવેદમાં પણ મળે છે.



E2A8X5

**સાલવારી :** ઈતિહાસમાં સમયનું ખૂબ જ મહત્ત્વ છે. ઘટનાઓ સમય અને સ્થાનની સાથે જ લખી શકાય. આપણે સમયને તારીખ, માસ અને વર્ષ સાથે સંકળીને સમજાએ છીએ. જેમ કે 20 જુલાઈ, 2018 શુક્રવાર. આ પ્રમાણે સમયની ગોઠવણી ઈસુ પ્રિસ્તના જન્મ સાથે સંકળાયેલ છે. પ્રિસ્તી ધર્મના સ્થાપક ઈસુ પ્રિસ્તના જન્મને દુનિયામાં કાળગણાના સાથે જોડવામાં આવ્યો છે. આપણે ‘ઈસવીસન’ એમ કહીએ (અંગ્રેજમાં A.D. Anno Domini) એટલે ઈસુ પ્રિસ્તના જન્મ પછીનાં વર્ષો એમ કહેવાય. દા.ત. ઈ.સ. 2000 એટલે ઈસુ પ્રિસ્તનાં જન્મ પછીનાં 2000 વર્ષ. એ જ રીતે ઈસવીસન પૂર્વ (B. C. - Before Christ) એટલે ઈસુ પ્રિસ્તનાં જન્મ પહેલાં ઉદાહરણ તરીકે, ઈ. સ. પૂર્વ 2000 એટલે ઈસુ પ્રિસ્તના જન્મ પહેલાંનાં 2000 વર્ષ.



ઈતિહાસમાં ઈ.સ.પૂ. અને ઈ.સ.ને સમજાવતી સમયરેખા

ઘણી વાર સાલવારીને AD ને બદલે CE અને BCને બદલે BCE તરીકે પણ લખવામાં આવે છે.

CE એટલે Common Era (સામાન્ય કે સાધારણ યુગ) જ્યારે

BCE એટલે Before Common Era (સામાન્ય કે સાધારણ યુગપૂર્વ)

પ્રિસ્તી ધર્મ વિશ્વના મોટા ભાગનાં રાષ્ટ્રો સાથે સંકળાયેલો હોવાથી અનેક રાષ્ટ્રોની જેમ આપણે ભારતમાં પણ આ જ સાલવારીનો પ્રયોગ કરીએ છીએ.

ઘણી વાર BP એટલે કે Before Present શરૂઆતનો પણ ઉપયોગ થાય છે.

### આટલું જાણો

- BC - Before Christ
- AD - Anno Domini - એનો અને ડેમિની એવા બે શરૂઆત મૂળ ગ્રીક શરૂઆત છે, જેનો અર્થ ‘In The Year Of God’ ભગવાનના સમયનું વર્ષ થાય છે. દા.ત. : AD 2018
- શિલાલેખ : પથ્થર પર કોતરીને લખાયેલો લેખ
- ભોજપત્ર : ભૂર્જ નામનાં વૃક્ષોની પાતળી આંતરણાલ, જેના પર પ્રાચીન સમયમાં ગ્રંથો લખાતા.

ઈતિહાસ જાણવાના અન્ય સોત જેમ કે, અભિલેખો, ઈતિહાસકારો, પ્રવાસીઓની વિશેષ માહિતી તમારા શિક્ષકને પૂછો.



## स्वाध्याय

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :



## 2. ટુંકમાં ઉત્તર આપો :

- (1) B.C.નો અર્થ સમજાવો.
  - (2) A.D.નો અર્થ સમજાવો.
  - (3) ભારતના સૌથી જુના સિક્કા કયા છે ?
  - (4) ઇતિહાસ જાગ્રવાના સોત કયા-કયા છે ?

3. ‘अ’ विभागनी विगतो ‘ब’ विभागनी विगतो साथे योग्य रीते जोड़ी उत्तर आपो :

અ	બુ
(1) અભિલેખ	(a) ઈ.સ. પૂર્વ
(2) ભોજપત્ર	(b) ઈસવીસન
(3) તામ્રપત્ર	(c) ભૂર્જ નામના વૃક્ષની છાલ
(4) B.C.	(d) તાંબાના પતરા ઉપર કોતરેલું લખાણ
(5) A.D.	(e) પથ્થર કે ધાતુ પર કોતરેલું લખાણ



જ્યવીર તેના પરિવાર સાથે ગાંધીનગરથી જામનગર ટ્રેનમાં જઈ રહ્યો હતો. બારી પાસે બેસીને તેણે રસ્તામાં વૃક્ષો, બળદગાડાં, ઊંટલારીઓ, રિક્શા, બસ, ટ્રક, ટ્રેક્ટર જોયાં. તેણે તેના કાકાને પૂછ્યું, આ વાહનવ્યવહાર ક્યારથી શરૂ થયો હશે? તેના કાકાએ તેની પીઠ પર હાથ મૂકી કર્યું કે, આપણે જે રેલવેમાં મુસાફરી કરીએ છીએ તે ભારતમાં આશરે દોઢસો વર્ષથી જ ચાલે છે અને તું જે વાહનો રસ્તા પર જુએ છે તેમાં બળદગાડાં સૌથી જૂનાં છે. તે પહેલાં હજારો વર્ષો પહેલાંના માનવી પાસે આવવા-જવા માટેના કોઈ જ સાધનો ન હતાં. તેઓ એક સ્થળેથી બીજા સ્થળે પગપાળા જ જતા.

### આદિમાનવ – ભટકતું જીવન

આદિમાનવો એટલે ખૂબ જ જૂના સમયના માનવો. આશરે વીસલાખ વર્ષો પહેલાંના આદિમાનવો ભટકતું જીવન જીવતા અને શિકાર કરીને પોતાનો સમય વ્યતિત કરતા. માનવીની આ અવસ્થાને Hunter and Gatherers (શિકાર કરવો અને એકહૃદ કરવું.) કહેવામાં આવે છે. તેઓ હરણ જેવા જંગલનાં પ્રાણીઓ, માછલીઓ અને પક્ષીઓનો શિકાર કરી તેમજ કંદમૂળ અને ફળોને એકત્રિત કરી ખોરાક મેળવતા.

જોકે આ બધું સરળ ન હતું. ક્યારેક જંગલી પ્રાણીઓ આદિમાનવો પર હુમલો કરતાં. વળી, દોડવામાં ખૂબ ઝડપી હોવાથી કેટલાંક પ્રાણીઓ સરળતાથી આદિમાનવોના હાથમાં આવતાં નહિ એટલે ખોરાકની શોધમાં આદિમાનવો એક સ્થળેથી બીજા અને બીજાથી ત્રીજા સ્થળે ભટકતા રહેતા. માનવી આ સમયે કયા ફળ કે કંદમૂળ ખાવાં અને કયાં ન ખાવાં તેનું જ્ઞાન મેળવતો થયો કારણ કે ઘણી વનસ્પતિઓ જેરી હોવાથી માનવનાં મૃત્યુ પડા થતાં.

હરણ, ઘેટાં-બકરાં જેવાં પ્રાણીઓને સરળતાથી મારી શકાતાં હોવાથી આદિમાનવો તેમને શોધવા એક જગાએથી બીજી જગાએ ભટકતા રહેતા. વળી, પાણી જીવનની જરૂરિયાત હોવાથી જ્યાં પાણી મળી રહેતું ત્યાં તેઓ રહેતા.

### ભારતમાં આદિમાનવનાં વસવાટનાં સ્થળો :


પુરાતાત્વશાસ્ત્રીઓ, નૃવંશશાસ્ત્રીઓ અને ઈતિહાસકારોએ મળીને ભારતના આદિમાનવનાં વસવાટનાં અનેક સ્થળો શોધી કાઢ્યાં છે. સાથે-સાથે તેઓ જે ઓજારો વાપરતાં તેની માહિતી પણ શોધી કાઢી છે. તેઓ પથ્થર અને લાકડાનાં હથિયારો અને ઓજારોનો ઉપયોગ કરતાં, ક્યારેક હાડકાંનાં ઓજારોનો પણ ઉપયોગ કરતા. શિકારી અને ભટકતું જીવન જીવતા માનવો પથ્થરની ટેકનોલોજી સાથે સંકળાયેલા હોવાથી આ સમયને પાખાણયુગ કહેવામાં આવે છે.



2.1 પાખાણયુગીન હથિયારો

ચિત્ર 2.1 માં બતાવેલા પથ્થરોનો ઉપયોગ વનસ્પતિ કાપવા અને પ્રાણીઓને ચીરીને તેમની ચામડી કાઢવા થતો. આદિમાનવો વૃક્ષની છાલ અને પ્રાણીઓનાં ચામડાંનો શરીર ઢાંકવા ઉપયોગ કરતા.

ભારતમાં પાષાણકાલીન માનવ-વસાહુતનો નકશો



## 2.2 પુરાતન સ્થળો


તમે નકશામાં દર્શાવેલાં સ્થળો ધ્યાનથી જુઓ.

તમને જાણાશે કે ભારતમાં ઘણીબધી જગાએ આદિમાનવો રહેતા હશે. નકશામાં થોડી જગાએ બતાવી છે પરંતુ ભારતમાં ઘણીબધી જગાઓમાં તેમના વસવાટ હોવાના પૂરાવા મળ્યા છે.

જ્યાં સારા અને મોટા પ્રમાણમાં પથ્થરો, લાકડાં અને પાણી મળી રહે તેવાં સ્થળોએ રહેવાનું તેઓ પસંદ કરતા. વરસાદ અને જંગલી પ્રાણીઓથી પોતાનું રક્ષણ કરવા તેઓ પ્રાકૃતિક ગુફામાં રહેતા. મધ્યભારતમાં વિધ્યપર્વતમાળામાં આવી અનેક જગ્યાઓ મળી આવી છે. નર્મદા નદીની આસપાસના પ્રદેશોમાંથી પણ આવી જગ્યાઓ મળી આવી છે. ભીમબેટકા (મધ્યપદેશ) આદિમાનવોના વસવાટ માટેનું ઉત્તમ સ્થળ મળી આવ્યું છે. તેની ગુફાઓમાં આદિમાનવે દોરેલાં પક્ષીઓ, હરણ, લાકડાના ભાલા, વૃક્ષો, માનવોનાં લગભગ 500 જેટલાં ચિત્રો મળી આવ્યાં છે, જે પ્રાકૃતિક રંગો વડે દોરેલાં છે.



V3T8V6



### 2.3 ભીમબેટકાની ગુફા

#### અજિન અને ચકનો ઉપયોગ અને શોધ :

દક્ષિણ ભારતના કુરનૂલમાં મળી આવેલી આદિમાનવોની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા છે, જે દર્શાવે છે કે તેઓ અજિનથી પરિચિત હશે. આજથી લગભગ 11,000 વર્ષ પહેલાં માનવી અજિનનો ઉપયોગ કરવા લાગ્યો હતો. તેમ ઈતિહાસકારો જણાવે છે. અજિનના ઉપયોગે તેમનાં જીવનમાં કાંતિકારી પરિવર્તન કર્યું. કારણ કે અજિનની મદદથી તેઓ માંસને શેકીને ખાઈ શકતા, અજિનનો ઉપયોગ પ્રકાશ મેળવવા માટે કરતા તેમજ તેના ઉપયોગથી જંગલી પ્રાણીઓથી તેઓ પોતાનું રક્ષણ કરી શકતા.

#### ચર્ચા કરો

- આજના આપણા જીવનમાં પણ આપણને અજિન વિના ચાલે છે ?
- પ્રારંભિક જીવનમાં ચકની શોધે કઈ કઈ કાંતિ કરી હશે?

અજિનના ઉપયોગની જેમ જ તેમનાં જીવનમાં મહત્વનું પરિવર્તન લાવનાર માધ્યમ હતું ચક. ઝડનાં થડ અને જડાં લાકડાંમાંથી તેઓ ચક (પૈંચું) બનાવતા શીખ્યાં.

#### બદલાતું પર્યાવરણ :

આજથી લગભગ 12,000 વર્ષો પહેલાં વિશ્વભરના વાતાવરણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. દુનિયાનાં અનેક ક્ષેત્રોમાં તાપમાન વધતાં વનસ્પતિ અને ધાસનાં ક્ષેત્રો ઊભાં થયાં. તેને પરિણામે ધાસ જાનારાં હરણ, ઘેટાં, બકરાં જેવાં તૃણાહરી પ્રાણીઓની સંખ્યા વધવા લાગી. તેનો લાભ આદિમાનવોને ચોક્કસ મળ્યો. તેઓ આવાં પ્રાણીઓની રીતભાતોનો અભ્યાસ કરવા લાગ્યા અને આમ તેમનો માનસિક વિકાસ પણ થવા લાગ્યો.

વાતાવરણમાં આવેલ પરિવર્તનને કારણો ધાસ, વૃક્ષો, વનસ્પતિની સાથે-સાથે ઘઉં, જવ અને અન્ય ધાન્યોના સંપર્કમાં તેઓ આવ્યા. પથ્થરના ઉપયોગથી સ્ત્રીઓ-પુરુષો અને બાળકો અનાજના દાઢા એકત્રિત કરતા. કુતૂહલવૃત્તિથી થયેલાં આ કાર્યોએ ધીમે-ધીમે ભારતમાં કૃષિની શરૂઆત કરી. લોકો ધાન્ય ઉગાડવા પથરનો ઉપયોગ કરવા લાગ્યા. નદીના કિનારાની આસપાસ ધાન્ય ઉગાડવા લાગ્યા અને ધીમે-ધીમે કૃષિની શરૂઆત થતાં તેમણે ધાન્ય ઊગતું હોય તેની આસપાસ ગારા-માટી-ધાસનાં મકાનોમાં રહેવાનું શરૂ કર્યું અને કમશા: તેમના ભટકતા જીવનનો અંત આવ્યો અને સ્થાયી જીવનની શરૂઆત થઈ. તેમના સ્થાયી જીવનનો પ્રથમ સાથીદાર કે મિત્ર કૂતરો હતો. તે સિવાય તેઓ ઘેટાં-બકરાં અને ગાય-બેંસ, ભૂંડ જેવાં પશુઓથી પણ પરિચિત હતા. ધીમે-ધીમે તેમણે તેમની સાથે પણ સમાયોજન શરૂ કર્યું. આવાં પાલતું પશુઓનું તેઓ જંગલનાં હિંસક પ્રાણીઓથી રક્ષણ કરતા. આમ તેઓ જેતીની સાથે-સાથે પશુપાલન સાથે સંકળાયા. જોકે તેમણે પશુઓનો ઉપયોગ દૂધ માટે ક્યારથી કર્યો તે અંગે સંશોધન થઈ રહ્યું છે.

## સ્થાયી જીવન : ભોજન, રહેઠાણ, પોશાક :

કૃષિની શરૂઆતે અને પશુપાલન પ્રવૃત્તિએ આદિમાનવને ભટકતા જીવનમાંથી સ્થાયી જીવન તરફ પરિવર્તિત કર્યો. આપણે જાણીએ છીએ કે કૃષિ માટેનાં સ્થળોને છોડીને જઈ શકતું નથી કારણ કે પાકને ઉગતાં થોડો સમય લાગે છે, તેને પાણીની જરૂર પડે છે અને પાક તૈયાર થતાં અનાજના છોડને કાપીને તેમાંથી અનાજ કાઢવું પડે છે. આ પ્રક્રિયાએ ભારતમાં સ્થાયી જીવનની શરૂઆત કરી. અનાજનો સંગ્રહ કરવા તેમણે માટીનાં માટલાં-ઘડા વગેરે બનાવવાની પણ શરૂઆત કરી. હવે ભટકતા જીવનનો અંત આવતાં તેમના ખોરાક, પોશાક અને રહેઠાણમાં વ્યાપક પરિવર્તન આવ્યું. તેઓ ઘઉં, જવ અને પશુઓનાં માંસ ઉપરાંત માઇલી અને તેમની વસાહતની આસપાસનાં ફળો ખાતાં. ગારા-માટી અને ધાસનાં મકાનોમાં રહેતાં ખેતી કરતાં, ખેતીનાં ઓજારો પથરોમાંથી બનાવતાં, જેમાં ખૂર્ખી, છીણી, દાતરડાનો સમાવેશ થાય છે. નીચે આપેલા કોષ્ટકમાં ભારતની એવી જગાઓ બતાવવામાં આવી છે જ્યાં અનાજ, રહેઠાણ, ઓજારો અને પ્રાણીઓના અવશેષો મળી આવ્યા છે.

	અનાજ-રહેઠાણ-ઓજાર-પ્રાણીઓ	સ્થળો
(1)	ઘઉં, જવ, ઘેટાં, બકરાં, પથ્થરનાં ઓજારો	મેહરગઢ (હાલ પાકિસ્તાન)
(2)	ચોખા, પ્રાણીઓનાં હાડકાં	કોલિઝવા (ઉત્તરપ્રદેશ)
(3)	ચોખા, ઘેટાં-બકરાં, પથ્થરનાં ઓજારો	મહાગઢ (ઉત્તરપ્રદેશ)
(4)	માનવ-વસાહત, ગંડો	લાંઘણજ (ગુજરાત)
(5)	ઘઉં, મસૂર, કૂતરાં, ખાડાવાળાં મકાન	બુર્જહોમ અને ગુફકાલ (જમ્મુ-કશ્મીર)
(6)	બેંસ, બળદ, ઓજારો	ચિરાંદ (બિહાર)

પુરાતત્વશાસ્ત્રીઓએ શોધેલાં સ્થળોમાં બુર્જહોમ, ગુફકાલ, હુરંગી, મેહરગઢ, લાંઘણજ અને ભીમબેટકામાંથી આપણને માનવ-વસાહત અને તેમનાં પશુપાલનની માહિતી મળે છે. મેહરગઢ (હાલ પાકિસ્તાન) અને ઈનામગામ જેવાં સ્થળોએથી તો તેમનાં ઘર અને ખેતીવાડીની માહિતી પણ મળે છે. તેઓ જવ અને બાજરી જેવાં ધાન્ય ઉગાડતા.

મેહરગઢ અને ઈનામગામ જેવાં સ્થળોએથી પથ્થરનાં તીક્ષ્ણ ઓજારો મળી આવ્યાં છે જે તેમનાં કૃષિકાર્યમાં વપરાતાં હશે.



2.4 મેહરગઢ

પ્રાચીન સમયમાં મેહરગઢ ભારતનું સૌથી પ્રાચીન ગામ ગાણી શકાય. તમે નકશામાં મેહરગઢ જુઓ. અહીંયાં લોકોએ જવ અને ઘઉની ખેતીની શરૂઆત કરી હતી. તેઓ ઘેટાં-બકરાં પાળતાં ખેતી કરતાં, અનાજનો સંગ્રહ કરતાં.

અહીંથી પ્રાણીઓનાં હાડકાં પણ મળી આવ્યાં છે. તેઓ લંબચોરસ ઘરોમાં રહેતાં આ ઘરોમાં અનાજનો સંગ્રહ કરવાનાં નાના-નાના કોઈએ પણ મળી આવ્યાં છે.

મેહરગાઠમાં મળી આવેલા પુરાવા મુજબ તેઓ મૃત્યુ પામનારને માન-સન્માનથી દફનાવતાં હતાં. અહીંથી આવા ઘણા પુરાવા મળી આવ્યા છે. એક જગાએ મનુષ્યની સાથે બકરીને પણ દફનાવવામાં આવી હોવાનો પુરાવો મળ્યો છે. આ બાબત તેમનાં મૃત્યુ પછીનાં જીવનની કલ્પના કે માન્યતા સૂચવે છે.

આવી જ રીતે મહારાષ્ટ્રમાં ઈનામગામ નામનું સ્થળ મળી આવ્યું છે. જ્યાંથી બાળકોનાં મૃતદેહોના અવશેષો મળ્યા છે. તેઓ ગોળ આકારનાં ધરોમાં રહેતાં, પશ્ચપાલન કરતાં અને ખેતીના પાકોમાં બાજરી અને જવ પકવતા હતા.

स्वाध्याय

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :



- (1) આદિમાનવનું જીવન કેવું હતું ?  
(A) ભટકતું જીવન (B) સ્થાયી જીવન  
(C) નગર વસાહતનું જીવન (D) ગ્રામીણ વસાહતનું જીવન

(2) આદિમાનવો શિકાર કરવા માટે કયાં સાધનોનો ઉપયોગ કરતા નહોતા ?  
(A) બંદૂક (B) પથરનાં હથિયારો  
(C) હાડકાંનાં હથિયારો (D) લાકડાંનાં હથિયારો

(3) ભીમબેટકા કયા રાજ્યમાં આવેલું છે ?  
(A) મધ્યપ્રદેશ (B) ગુજરાત (C) બિહાર (D) ઉત્તરપ્રદેશ

(4) સ્થાયી જીવનથી આદિમાનવે કેવી પ્રવૃત્તિઓ શરૂ કરી નહોતી ?  
(A) કૃષિ (B) પશુપાલન (C) અનાજ-સંગ્રહ (D) ઉદ્યોગ

## 2. ટૂંકમાં ઉત્તર આપો :

- (1) સ્થાયી જીવન માટેની જરૂરિયાત શા માટે ઊભી થઈ ?
  - (2) અગ્નિના ઉપયોગથી આદિમાનવનાં જીવનમાં કેવું પરિવર્તન આવ્યું ?
  - (3) આદિમાનવો કેવા પાકો ઉગાડતા હતા ?
  - (4) આદિમાનવો કેવાં પશઓ પાળતા હતા ?

### 3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

- (1) સ્થાયી જીવન શરૂ થતા આદિમાનવે હિંસક પ્રાણીઓ પાળવાનું શરૂ કર્યું.
  - (2) પાખાશયુગમાં પથ્થરના હથિયારોનો ઉપયોગ થતો હતો.
  - (3) ભીમબેટકામાં આદિમાનવે સિંહ અને વાધનાં ચિત્રો દોરેલાં છે.
  - (4) ભીમબેટકાની ગુફાઓમાં પ્રાકૃતિક રંગથી ચિત્રો દોરેલાં છે.




E1L8G4

## 3

## પ્રાચીન નગરો અને ગ્રંથો

આપણો અવારનવાર સંસ્કૃતિ અને સભ્યતા એવા બે શબ્દો સાંભળીએ છીએ. શું તમે તેનો અર્થ જાણો છો? સંસ્કૃતિ એ મનુષ્યની રહેણીકરણીની સાથે સંકળાપેલ બાબત છે. સભ્યતા એ માનવી પોતાની બુદ્ધિશક્તિ, આવડત અને કલા-કૌશલ્યથી જીવનની એક વિશિષ્ટ અવસ્થાનું સર્જન કરે છે. વિશ્વમાં ઈજિપ્ત, મેસોપોટેમિયા, ભારત, ચીન, રોમમાં માનવસમાજની આવી મહાન સભ્યતાનાં દર્શન થાય છે. સદીઓ જૂની આ સભ્યતા આજે પણ માનવજીવનને પ્રેરણા પૂરી પાડે છે. આ સભ્યતાઓ પૈકી આપણે હડ્ધીય સભ્યતાનો અભ્યાસ કરીશું.



### 3.1 હડ્ધીય સભ્યતાનાં સ્થળો

હડ્ધીય સભ્યતાને આપણે સિંહખીણ સભ્યતા તરીકે પણ ઓળખીએ છીએ. ઇ.સ. 1921માં હડ્ધામાંથી આ સભ્યતાના સૌપ્રથમ અવેશણો મળી આવ્યા. ભારતના ઉત્તર પશ્ચિમ ભાગમાં ફેલાયેલી સભ્યતાનાં અનેક સ્થળોમાં હડ્ધા, મોહેં-જો-દો, લોથલ, ધોળાવીરા, કાલીબંગાન, રાખીગઢી વગેરેનો સમાવેશ થાય છે. નકશામાં હડ્ધીય સભ્યતાનાં સ્થળો દર્શાવ્યાં છે તે જુઓ. તેમાંનાં કેટલાંક મુખ્ય નગરોની નગરરચના અને તેમની વિશેષતાઓનો પરિચય મેળવીએ.



L5Q7K2

### ચર્ચા કરો


- હડ્ધીય નગરો અને આજનાં નગરોની તુલના

### નગરરચના

આયોજનબદ્ધ નગરરચના એ હડ્ધીય સભ્યતાની સૌથી મોટી લાક્ષણિકતા હતી. નગરોની રચના એકસમાન થયેલી હતી. તમામ સ્થળોએ પશ્ચિમ તરફ કિલ્લો અને પૂર્વ તરફ સામાન્ય પ્રજાની વસાહત હતી.

બંનેને જુદો પડતો રાજમાર્ગ વચ્ચે આવેલો હતો. પશ્ચિમમાં આવેલા કિલ્લાની ફરતે કોટ હતો. કિલ્લામાં સંભવત: શાસકો રહેતા હોવા જોઈએ. તેમની નગરરચનામાં મોટા ભાગે ઈંટો વપરાતી. હડ્ધીય સભ્યતાનાં નગરોની કેટલીક વિશેષતાઓ જોઈએ.

હડ્ધીય સભ્યતાની મુખ્ય વિશેષતા તેની આયોજનબદ્ધ મકાનવસ્થા હતી. પૂર અને બેજથી બચવા મકાનો ઊચા ઓટલા પર બાંધવામાં આવતાં. અહીંના મકાનોની એક વિશેષતા એ હતી કે, મકાનના દ્વાર મુખ્ય રસ્તા પર પડવાને બદલે અંદરની તરફ પડતાં. અહીં એક અને બે માળનાં મકાનો જોવા મળતા હતાં. અહીંના રસ્તાઓ સુવિધાજનક હતાં. શહેરના મુખ્ય બે રાજમાર્ગો એક ઉત્તરથી દક્ષિણ અને બીજો પૂર્વથી પશ્ચિમ જતો. અહીં મુખ્ય



**3.2 મોહેં-જો-દડો જાહેર સ્નાનાગર**

માર્ગોની સમાંતરે શેરીઓ આવેલી હતી. રસ્તાઓ એકબીજાને કાટખૂણે કાપતા. રસ્તા અને શેરીઓનું આયોજન એ રીતે કરવામાં આવેલું હતું કે, સમગ્ર નગર ચોરસ અને લંબચોરસ વિભાગોમાં વહેંચાઈ જાય. જાહેર રસ્તાઓ પર ચાત્રિપ્રકાશની વ્યવસ્થાના પુરાવા પણ પ્રાપ્ત થયા છે. હડ્ધાકાલીન સભ્યતાના લોકોના વપરાશના પાણીના નિકાલ માટે અત્યંત વિકસિત અને પદ્ધતિસરની વ્યવસ્થા હતી. દરેક મકાનનું પાણી નાની ગટરમાં અને નાની ગટરમાંથી પાણી મોટી ગટરમાં જતું. મોટી ગટરમાંથી પાણી નગરની બહાર જતું. મોહેં-જો-દડોમાં એક જાહેર સ્નાનાગર મળી આવ્યું છે. આ સ્નાનાગારની વચ્ચે સ્નાનકુંડ છે. સ્નાનકુંડમાં ઉત્તરવા માટે બે બાજુએ પગથિયાંની વ્યવસ્થા છે. સ્નાનકુંડની ફરતે વસ્ત્રો બદલવા ઓરડીઓ છે. ઉત્સવ કે ધાર્મિક પ્રસંગોએ આ જાહેર સ્નાનાગરનો ઉપયોગ થતો હશે. આ ઉપરાંત મોહેં-જો-દડોમાંથી મળી આવેલ સ્તંભવાળા મકાનને સભાગૃહની ઓળખ આપવામાં આવી છે. હડ્ધા પંજાબના મૌટગોમરી જિલ્લા(હાલ પાકિસ્તાનમાં)માં આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે. હડ્ધા સિંધુખીણ સભ્યતાનું મુખ્ય નગર હશે. અહીંની મુખ્ય વિશેષતા તેના અન્નભંડારો છે. અહીં રાવી નદીના કિનારે 12 જેટલા અન્નભંડારો મળી આવેલ છે.

લોથલ અમદાવાદ જિલ્લામાં ધોળકા તાલુકામાં ભોગાવો નદીના કિનારે આવેલ છે. લોથલ પ્રાચીન સમયમાં એક વેપારી બંદર અને ઔદ્યોગિક નગર હતું. લોથલમાં ઈંટોનું બનેલું એક માળખું મળી આવ્યું છે. તેને ધક્કો (Dock yard) માનવામાં આવે છે. તે અહીં આવતાં વહાણોને લાંગરીને માલસામાન ચઠાવવા-ઉતારવાના કામ માટે ઉપયોગમાં આવતું હોવાનું માની શકાય. આ ઉપરાંત અહીં વખારો અને મણકા બનાવવાની ફેકટરી મળી આવેલ છે. જેથી કહી શકાય કે લોથલ પ્રાચીન ભારતનું સમૃદ્ધ બંદર હશે અને હડ્ધીય સભ્યતાનો આંતરરાષ્ટ્રીય વેપાર લોથલના બંદર મારફત થતો હશે.



### 3.3 લોથલ બંદરનો ધક્કો (Dock yard)

ધોળાવીરા કચ્છ જિલ્લામાં ભયાઉ તાલુકામાં ખડીરબેટ વિસ્તારમાં આવેલ પુરાતાત્ત્વીય સ્થળ છે. સામાન્ય રીતે હડપીય નગરો બે ભાગમાં (દ્વિસ્તરીય) વહેંચાયેલ છે, જ્યારે ધોળાવીરાનું નગર ત્રણ ભાગમાં (ત્રિસ્તરીય) છે. (1) કિલ્લો-સીટાડલ (2) ઉપલું નગર (3) નીચેલું નગર. ધોળાવીરા નગરની મુખ્ય વિશેષતા વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા અને સ્ટેરિયમ છે.

રાજસ્થાનનું કાલીબંગન નગર હડપીય સભ્યતાની કૃષિકાંતિનું મુખ્ય મથક હતું. અહીં ખેડેલાં ખેતરોના અવશેષો તેની સાબિતી પૂરી પાડે છે. અહીં મળી આવેલા તાંબાના અવશેષો એ પુરવાર કરે છે કે અહીં તાંબાનાં ઓઝારોનું નિર્માણ થતું હશે અને આ ઓઝારો કૃષિક્ષેત્રે ઉપયોગમાં લેવાતાં હશે.

આમ, સિંધુખીણ સભ્યતાનું નગરાયોજન સુવ્યવસ્થિત, સુંદર ઈજનેરીકળા ધરાવતું, આયોજનબદ્ધ અને કૌશલ્યયુક્ત હતું. તેમાં તે વખતના શાસકવર્ગની શાસનશક્તિ, ઈજનેરોની બુદ્ધિમત્તા અને કારીગરોની કલાશક્તિનું અદ્ભુત પ્રતિબિંબ પડે છે.


### હડપીય સભ્યતાનું આર્થિકજીવન

સિંધુખીણ સભ્યતાના લોકો ખેતી, પશુપાલન, વેપાર, હુન્નર ઉદ્યોગ જેવા વ્યવસાયો કરતા હતા. ખેતીમાં ઘઉં, જવ, વટાણા, તલ, સરસવ વગેરે પાકોની ખેતી કરતા. ખેતીમાં જમીન ખેડવા હળનો ઉપયોગ કરતાં. પશુપાલનમાં ગાય, ભેંસ, બકરી, ખૂંધવાળો બળદ પાળતા. તેઓ આંતરિક અને આંતરરાષ્ટ્રીય વેપાર કરતા. અહીંનું સુતરાઉ કાપડ છેક મેસોપોટેમિયા અને તેના માધ્યમથી ઈજિપ્ત સુધી પહોંચતું. એમ ઈતિહાસકારો માને છે. આ ઉપરાંત તેમના અન્ય વ્યવસાયોમાં માટીકામ, ધાતુકામ, મણકા બનાવવાની કલા, શિલ્પકલા વગેરેનો સમાવેશ થતો.

### હડપીય સભ્યતાનું સમાજજીવન :

સિંધુખીણ સભ્યતાના લોકોનો મુખ્ય વ્યવસાય ખેતી અને પશુપાલન હતો અને આ સમયની પ્રજાના ખોરાકમાં ઘઉં, જવ, બાજરી, વટાણા, તલ, ખજૂર વગેરેનો સમાવેશ થતો. પશુપાલનના કારણે તેમના ખોરાકમાં દૂધ, દૂધની બનાવટોનો સમાવેશ થતો. આ સભ્યતાના અવશેષોમાં માછલી પકડવાના હૂક (ગલ) (Hook) મળી આવ્યા છે. તેથી ખોરાકમાં માછલીનો પણ સમાવેશ થતો હશે.

સિંધુખીણ સભ્યતામાંથી મળી આવેલાં શિલ્પોના આધારે એ સમયના લોકોના પોશાક વિશે માહિતી મળે છે. અહીંનાં સ્ત્રી-પુરુષો બે કપડાં પહેરતાં. કમરથી નીચેના ભાગમાં હાલની ધોતી જેવું અને ઉપરના ભાગમાં ડાબા ખબા



3.4 મોહેં-જો-દડોમાંથી મળેલ વસ્ત્રપરિધાન કરેલ પથ્થરની મર્તિ

પરથી જમણા હાથની નીચે આવે એમ ઉપવસ્તુ વીટતાં. મુખ્યત્વે તેઓ સુતરાઉ કાપડનો ઉપયોગ કરતા અને ઊની વસ્ત્રથી પણ પરિચિત હતા. ધાતુ તથા હાથીદાંતની બનેલી, મળેલી સોયના આધારે અનુમાન થાય છે કે તેઓ સીવીને કપડાં પહેરતા હશે, આમ છતાં મોટા ભાગના લોકો સીવાં વિનાનાં કપડાંનો ઉપયોગ કરતા હશે. આ સમયનાં લોકો આભૂષણોમાં કંઠહાર (ગળાનો હાર), હાથમાં વીઠી, કંડામાં કડાં સ્ત્રી અને પુરુષ બંને પહેરતાં. સ્ત્રીઓ બંગડીઓ, કાનમાં કુંડળ, કંદોરો, જંજર વગેરે આભૂષણો પહેરતી. આ આભૂષણો સોના, ચાંદી અને કીમતી પથ્થરોમાંથી બનાવવામાં આવતાં.

સિંધુભીષણ સભ્યતાના લોકો માટીનાં, તાંબાનાં, કંસાનાં વાસણો બનાવતા. જેમાં માટીમાંથી ઘાલા, વાટકી, કુલડી, ગાગર, રકાબી, કથરોટ વગેરે વાસણોનો સમાવેશ થતો. સિંધુભીષણ સભ્યતાના લોકોએ પોતાના બાળકો માટે વિવિધ પ્રકારનાં રમકડાં બનાવ્યાં હતાં. જેમાં પંખી આકારની સિસોટીઓ, ઘૂઘરા, ગાડા, લખોટી, પશુ, પંખી અને સ્ત્રી-પુરુષ આકારનાં રમકડાંનો સમાવેશ થાય છે. એક રીતે જોઈએ તો આ પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગારી એમનાં રમકડાંમાં વ્યક્ત થાય છે. માથું હલાવતા ગ્રાણી અને ઝાડ પર ચઢતા વાનરની કરામત દર્શાવતાં રમકડાં જોવા મળે છે.



3.5 રમકડાં

### ધાર્મિક જીવન અને અંતિમવિધિ :

હાઇનીય સભ્યતાના ધાર્મિક જીવન વિશે આપણને મૂર્તિ અને મુદ્રાઓમાંથી માહિતી મળે છે. મૂર્તિઓમાં માતૃકાદેવીની મૂર્તિઓને ઈતિહાસકારો ધરતીમાતાનું પ્રતીક ગણે છે, એટલે કે હાઇનીય સભ્યતાના લોકો ધરતીપૂજા સવિશેષ કરતા હશે કારણ કે ધરતી અન્ન અને પાણી આપે છે. આ ઉપરાંત તેઓ વૃક્ષપૂજા, પશુપૂજા, નાગદેવતા, સ્વસ્તિકપૂજા કરતા હશે. લોથલ અને કાલીબંગાનમાં અભિપૂજાના અવશેષો પ્રાપ્ત થયા છે.

હાઇનીય સભ્યતાના લોકો મૃત્યુ પામનાર મનુષ્યને દાટતા હશે અને ઘણી જગ્યાએ અભિસંસ્કારના પુરાવાઓ મળ્યા છે. તેઓ મૃતકને દાટતા અને તેની સાથે કેટલીક વસ્તુઓ પણ મૂકતા. જે તેમના મૃત્યુ પદ્ધીના જીવનની તેમની કલ્પના બતાવે છે.

### લિપિ અને ભાષા :

સિંધુભીષણ સભ્યતાના અવશેષોમાંથી મુદ્રાઓ, મુદ્રિકાઓ, તામ્રપત્રિકાઓ મળી આવેલ છે. તેમના ઉપર કોઈ વણઉકેલાયેલી રહસ્યમય ભાષામાં લિપિબદ્ધ લખાણ જોવા મળે છે. જોકે આ લખાણો ટૂંકાં છે, માત્રાવાળા અક્ષરો અને જોડાકરો જોવા મળે છે. આ લિપિ ઉકેલવા ઘણા પ્રયત્નો થયા છે પરંતુ તેમાં હજુ સફળતા મળી નથી.

### ગુજરાતમાં હાઇનીય સભ્યતાનાં સ્થળો :

ગુજરાતમાં અમદાવાદ જિલ્લામાં રંગપુર અને લોથલ, રાજકોટ જિલ્લામાં રોજડી (શ્રીનાથગઢ), કર્ણ જિલ્લામાં દેશલપર, ધોળાવીરા, સુરકોટડા, જામનગર જિલ્લામાં લાખાબાવળ, આમરા, ભરુય જિલ્લામાં કિમનદીના કિનારે ભાગાતળાવ વગેરે ગ્રદેશોમાં હાઇનીય સભ્યતાની નાનીમોટી વસાહતો મળી આવી છે.



J8S7G4

### હાઇનીય સભ્યતાનો અંત :

ઈતિહાસકારો ધરતીકંપ, પૂર, રોગચાળો કે ભાવ્ય આકમણાના કારણે આ સભ્યતાનો અંત આવ્યો હશે તેવું માને છે. જોકે આજે પણ ઈતિહાસકારો માટે તેનો અંત સંશોધનનો વિષય રહ્યો છે.

## આપણાં પ્રાચીન ગ્રંથો

**ऋग्वेद અને તેનું અધ્યયન :** વેદ ચાર છે : ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. ઋગ્વેદ એ આપણો પ્રાચીનતમ ગ્રંથ છે. જેમાં 10 મંડળોમાં 1028 પ્રાર્થનાઓ જેને સૂક્ત કહે છે તેનો સમાવેશ થાય છે. ઋગ્વેદ એ પ્રાચીન જ્ઞાનનો બંડાર છે. તે પ્રાચીન સંસ્કૃત કે વૈદિક સંસ્કૃત ભાષામાં લખાયેલ છે. ઋગ્વેદના માધ્યમથી આર્યોના રાજકીય, સામાજિક, આર્થિક અને ધાર્મિક જીવનનો પરિચય મળે છે. ઈતિહાસકારો, પુરાતત્વવિદો ઈતિહાસ જાણવા માટે પ્રાચીન અવશેષોની સાથે ઋગ્વેદનો અભ્યાસ પણ કરે છે. ઋગ્વેદના કેટલાંક સૂક્તો સંવાદ સ્વરૂપે છે.

ऋગ्वेदमાં પ્રજાકીય જીવનના ઉલ્લેખો જોવા મળે છે. ગાણ, સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓની માહિતી ઋગ्वेदમાં છે. સભા સમિતિની સરખામણીમાં નાની સંસ્થા હતી અને તેમાં રાજ્યના મુખ્ય આગેવાનો બેસતા અને રાજ્યના અગત્યના પ્રશ્નોની ચર્ચા થતી તથા ન્યાય પણ અપાતો. સમિતિ વિસ્તૃત સંસ્થા હતી જે રાજાની ચુંટણી કરતી. રાજાને મદદ કરવા સેનાધ્યક્ષ અને પુરોહિતની નિમણૂક થતી. રાજાનું એક કાર્ય ગવેષણા પણ હતું અને ગવેષણા એટલે યુદ્ધ. ઋગ्वेदમાં રાવી નદીના કિનારે દસ રાજાઓ વચ્ચે થયેલા યુદ્ધનો ઉલ્લેખ પ્રાપ્ત થાય છે.

ऋગ्वेदमાં આર્યોના સામાજિક જીવન વિશે માહિતી મળે છે. સમાજનું એકમ કુટુંબ હતું અને પિતૃપ્રધાન અને સંયુક્ત કુટુંબવ્યવસ્થા હતી. સમાજ વર્ષા અને જ્ઞાતિઓમાં વહેંચાયેલ ન હતો એટલે સમાજમાં સૌ સમાન હતા. કોઈ ઊંચનીયના ભેદભાવ ન હતા. સ્ત્રીઓનું સમાજમાં ઊંચું સ્થાન તથા સ્ત્રીસ્વાતંત્ર્ય હતું અને સ્ત્રીઓને સહર્થમચારિણી ગાળવામાં આવતી અને યજ્ઞમાં તેમની હાજરી આવશ્યક ગણાતી. તે પણ અભ્યાસ કરી શકતી. તેમાં અપાલા, લોપામુદ્રા, ઘોષા જેવી વિદ્યુતી સ્ત્રીઓએ તો ઋગ્વેદની ઋગ્યાઓ પણ રચી છે. કન્યા પુષ્ટ ઉમરની થાય ત્યારે જ લગ્ન થતાં.

ऋ०વेदमાં ઈન્ડ્ર, વરુણ, અર્જિન, સૂર્ય વગેરેના ઉલ્લેખો જોવા મળે છે. સવારની દેવી ઉપા અને સાંજની દેવી અદિતિનો પણ ઉલ્લેખ જોવા મળે છે.

જ્ઞવેદમાં ગાયની, ઘોડાની અને બળદની ચર્ચા ધણી જગ્યાએ થઈ છે. જ્ઞવેદમાં અન્ય પશુઓની સરખામણીમાં ઘોડાનો સૌથી વધુ ઉલ્લેખ આવે છે. જે તેમના જીવનમાં પશુપાલનનું મહત્વ સૂચ્યે છે. પશુઓ માટે યુદ્ધ કરવું એ કબિલાઈ જીવન જીવતા લોકો માટે સામાન્ય હતું. સંપત્તિ મુખ્યત્વે પશુઓની સંખ્યા પર આધાર રાખતી. પશુપાલન સામૃહિક રીતે થતું અને જ્ઞવેદકાલીન અર્થવ્યવસ્થાના પ્રારંભિક ચરણમાં કૃષિ ગૌણ હતી.



## આટલું જાણો

સૂક્તનો અર્થ છે સારી રીતે કહેવાયેલું.

स्वाध्याय

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

## 2. ટૂકમાં ઉત્તર આપો :

- (1) હડ્ડીય સભ્યતાના નગરના રસ્તાઓનો પરિચય આપો.
- (2) ‘હડ્ડીય પ્રજાની સર્જનશક્તિ અને કલાકારીગરી રમકડાંમાં વ્યક્ત થાય છે.’ વિધાન સમજાવો.
- (3) લોથલ વિશે નોંધ લખો.

## 3. ખાલી જગ્યા પૂરો :

- (1) કાલિબંગાન હાલ ..... રાજ્યમાં આવેલ છે.
- (2) હડ્ડીય સભ્યતામાં મળી આવેલ સ્નાનાગૃહ ..... નગરમાં આવેલ છે.
- (3) ધોળાવીરા ..... જિલ્લામાં મળી આવેલ પુરાતત્ત્વીય સ્થળ છે.

## 4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

- (1) હડ્ડીય સભ્યતા મિસર સભ્યતાની સમકાલીન માનવામાં આવે છે.
- (2) ધોળાવીરામાં વરસાદના પાણીના સંગ્રહની વ્યવસ્થા હતી.
- (3) ધોળાવીરાની નગરરચના બે ભાગમાં વહેંચાયેલ છે.
- (4) વેદ મુખ્યત્વે સાત છે.

### • પ્રવૃત્તિ •

- તમારી શાળામાંથી શૈક્ષણિક પ્રવાસ અંતર્ગત લોથલનો પ્રવાસ કરો અને તેના વિષયક માહિતી એકત્ર કરો.
- હડ્ડીય સભ્યતાના માનવજીવન વિશે હસ્તલિખિત અંક બનાવો.





ISBN 2S9

## 4

## ભારતની પ્રારંભિક રાજ્યવ્યવસ્થા

ભારતમાં રાજકીય વ્યવસ્થા અને સંસ્થાઓ વિશે આપણને વેદ, મહાકાવ્યો અને બૌધ્ધ ગ્રંથોમાંથી માહિતી પ્રાપ્ત થાય છે. ઋગવેદકાલીન કે વैદિકાળમાં રાજ્યવ્યવસ્થાનું સ્વરૂપ કબિલાઈ શાસનવ્યવસ્થા જેવું હતું. તેના વડાને રાજન્ય કહેવામાં આવતા જેની ચૂંટણી થતી. સભા અને સમિતિ જેવી રાજકીય સંસ્થાઓ અસ્તિત્વમાં હતી. આ સમુદ્દરને ‘વિશ’ પણ કહેવામાં આવતો. ભારતમાં ત્યાર પછી જુદા-જુદા પ્રકારની રાજ્યવ્યવસ્થા અમલમાં આવી.

### • વિચારો •

વર્તમાન સમયમાં નેતાની પસંદગી કેવી રીતે કરવામાં આવે છે ?

### જનપદ

ઈ.સ. પૂર્વ એક હજારની આસપાસ પંજાਬ અને ગંગા નદીના વિસ્તારમાં જુદા-જુદા સમૂહોનાં પ્રારંભિક રાજ્યોની સ્થાપના થઈ. જેને ‘જનપદ’ કહેવામાં આવતા. ‘જનપદ’ એટલે માણસના વસવાટનું એક ક્ષેત્ર કે સ્થાન. જનપદ શબ્દ રાજ્યના અર્થમાં વપરાતો. જનપદ એ ઋગવેદકાલીન કબિલાઈ સમાજથી બહુ વિશિષ્ટ કહી શકાય તેવી રાજ્યવ્યવસ્થા હતી. કુદુ, પાંચાલ જેવાં જુદા-જુદા સમૂહોનાં રાજ્યોનો તેમાં સમાવેશ થાય છે.

### મહાજનપદ :


ઈ.સ. પૂર્વ ઇન્ડી સદીની આસપાસ ભારતમાં સોળ જેટલાં મહાજનપદો જેવા મળે છે. આ મહાજનપદોનાં કેટલાંક ગણરાજ્યો હતાં તો કેટલાક રાજાશાહી પ્રકારનાં રાજ્યો હતાં. આ મહાજનપદો નીચે આપેલ કોષ્ટકમાં દર્શાવેલ છે :

### સોળ મહાજનપદો :

ક્રમ	મહાજનપદ	રાજ્યાની	વર્તમાન સ્થાન
1.	અંગ	ચંપા	પૂર્વ બિહાર
2.	વજ્ઝિજ	વૈશાલી	ઉત્તર બિહાર
3.	મલ્લ	કુશીનારા	ગોરખપુર આસપાસનો પ્રદેશ (ઉત્તરપ્રદેશ)
4.	કાશી	વારાણસી	વારાણસી (ઉત્તરપ્રદેશ)
5.	મગધ	ગિરિત્રિજ, રાજગૃહ	દક્ષિણ બિહાર
6.	કોસલ	શ્રાવસ્તી, અયોધ્યા	અવધ (ઉત્તરપ્રદેશ)
7.	વત્સ	કૌશાંભી	પ્રયાગરાજ આસપાસનો પ્રદેશ (ઉત્તરપ્રદેશ)
8.	ચેદિ	સુક્ષ્મિત્ર	યમુના અને નર્મદા વચ્ચેનો પ્રદેશ (મધ્ય ભારત)
9.	પાંચાલ	અહિછત, કામ્પિલ્ય	બદાયું, બરેલી આસપાસનો પ્રદેશ (ઉત્તરપ્રદેશ)
10.	સૂરસેન	મથુરા	મથુરા પાસેનો પ્રદેશ (ઉત્તરપ્રદેશ)
11.	કુદુ	ઇન્દ્રપ્રસ્થ	દિલ્હી અને મેરઠ આસપાસનો પ્રદેશ
12.	અરમક	પૌડન્યા	ગોદાવરી નદીના કિનારે

13	અવંતિ	ઉજ્જ્વલિની	માળવાનો પ્રદેશ
14	મત્સ્ય	વિરાટનગર	જયપુર (રાજસ્થાન) પાસેનો પ્રદેશ
15	ગાંધાર	તક્ષશિલા	પેશાવર અને રાવલપીંડી આસપાસનો પ્રદેશ
16	કમ્બોઇઝ	લાઝપુર	નૈત્રક્ત્ય કશ્મીર આસપાસનો પ્રદેશ

પાલિ ભાષામાં લખાયેલ “અંગુતરનિકાય” ગ્રંથ અનુસાર અનુવૈદિકકાળમાં 16 મહાજનપદો હતાં. કેટલાક મહત્વપૂર્ણ જનપદ નકશામાં દર્શાવવામાં આવ્યા છે.



#### 4.1 મહાજનપદ અને નગર

## રાજશાહી રાજ્યવ્યવસ્થા

જે રાજ્યતંત્રમાં રાજ મુખ્ય હતા તે રાજશાહી રાજ્યતંત્ર કહેવાતા. આ સમયનાં મહાજનપદો વચ્ચે સત્તા માટે હરીફાઈ રહેતી. જેમાં મુખ્યત્વે ચાર શક્તિશાળી રાજ્યતંત્રો મળ્યાં, કોસલ, વત્સ, અવંતિ વચ્ચે વિશેષ સ્પર્ધા રહેતી. જેમાં આખરે મગધ શક્તિશાળી રાજ્ય તરીકે પ્રખ્યાત થયું.



### મગધ :

રાજશાહી રાજ્યતંત્રમાં બુદ્ધના સમયમાં મગધ રાજ્ય શક્તિશાળી મહાજનપદ બન્યું હતું. મગધમાં ત્રણ મજબૂત વંશોએ શાસન કર્યું.

**(A) હર્યકવંશ :** આ વંશનો સ્થાપક બિંબિસાર નામનો રાજ હતો. મગધની રાજધાની તરીકે રાજગૃહ (ગિરિવ્રાજ) હતી, જે ગંગા અને શોણ નદીના ડિનારે આવેલું હતું. તેના પછી તેનો પુત્ર અજાતશત્રુ શાસન પર આવ્યો. તેણે પાટલીપુત્ર (પટના)ને રાજધાનીનું સ્થાન બનાવ્યું હતું. તેણે વજિજ સંઘ સાથે યુદ્ધ કરી લિચ્છવીઓને હરાવ્યા અને મગધનો રાજ્યવિસ્તાર કર્યો હતો.

**(B) નાગવંશ :** હર્યકવંશ બાદ નાગવંશ સત્તા પર આવ્યો. જેમાં શિશુનાગ નામના બૌદ્ધધર્મ સાથે સંકળાયેલ રાજનો સમાવેશ થાય છે.

**(C) નંદવંશ :** મહાપદ્ભનંદ દ્વારા સ્થાપિત નંદવંશ સૌથી શક્તિશાળી વંશ હતો. મહાપદ્ભનંદ ભારતનો સૌપ્રથમ સામ્રાજ્ય નિર્માતા ગણાય છે. તેના સમયમાં મગધ ભારતનું સૌથી શક્તિશાળી રાજ્ય બની ચૂક્યું હતું. સિકંદરના ભારત પરના આકમણ સમયે મગધ પર નંદવંશનો ધનનંદ નામનો રાજ શાસન કરતો હતો.

## ગણરાજ્ય

ગણરાજ્ય એટલે લોકો દ્વારા પ્રત્યક્ષ કે પરોક્ષ પદ્ધતિ વડે ચૂંટાયેલા વડા દ્વારા શાસિત રાજ્ય. ગણરાજ્ય પ્રાચીન રાજ્યવ્યવસ્થા તથા શાસનપદ્ધતિનું નોંધપાત્ર લક્ષ્ણ હતું. ‘ગણ’નો સામાન્ય અર્થ ‘સમૂહ’ થાય છે. એક કરતાં વધારે સત્ત્ય સંઘ્યાની મદદથી ચાલતું રાજ્ય એ ગણરાજ્ય કહી શકાય. આ સમયે કેટલાંક એવાં પણ રાજ્યો હતાં કે જેમાં રાજાને જનતા દ્વારા પસંદ કરવામાં આવતો હતો. આવા રાજ્યને ‘ગણરાજ્ય’ કહેવામાં આવતું. જેમાં વैશાલીનાં લિચ્છવીઓ, કપિલવસ્તુના શાક્યો, મિથિલાના વિદેહ, કુશીનારાના મલ્લો વગેરે પ્રજાઓનાં ગણરાજ્યો હતાં. આ પ્રકારની રાજ્યવ્યવસ્થામાં પ્રત્યેક સત્યને ‘રાજ’ જેવો દરજજો આપવામાં આવતો.



### આટલું જાણો

**ગણ :** ગણ શર્દુ ધણા સભ્યોવાળા સમૂહ માટે વપરાતો.

ગણ એટલે જૂથ અથવા સમૂહ.

**સંઘ :** સંઘ એટલે સંગઠન અથવા સભા.

## વैશાલી વજિજ રાજ્ય :

રાજસત્તાક મહારાજ્યો આસપાસના પ્રદેશો તાબે કરીને પોતાની સત્તા વધારવા અને સામ્રાજ્ય સ્થાપવાની મહત્ત્વાકંક્ષા રાખતા. આ જોઈને લિચ્છવી, વજિજ, શાતુક, વિદેહ, શાક્ય, મલ્લ વગેરે આઠ કે નવ જાતિના લોકોએ પોતાનું રક્ષણ કરવા જે સંઘરાજ્ય સ્થાપ્યું એ વજિજસંઘ નામે ઓળખાયું. એ સંઘરાજ્યનું મુખ્ય સ્થાન લિચ્છવીઓનું પાટનગર વैશાલી હતું. આથી તેને વैશાલીના વજિજસંઘનું ગણરાજ્ય કહેવામાં આવતું. ગણરાજ્યના રાજ્ય વહીવટનું

સંચાલન સભા દ્વારા થતું જેના કારણે તેને ગણતંત્ર કહેવામાં આવતું. ગણરાજ્યમાં રાજની બધી સત્તા સત્ત્યો પાસે રહેતી. સભામાં સત્ત્યો બેસતા અને બધાં કામકાજ ગણરાજ્યમાં રજૂ થઈને બહુમત કે સર્વાનુમતે પસાર થતા. જ્યાં સભા ભરાતી તે જગ્યા સંથાગાર (નગરભવન) તરીકે ઓળખાતી.

ગણરાજ્યની સભામાં સત્ત્ય તરીકે વૃદ્ધ તેમજ યુવાનોની પસંદગી થતી. ગણરાજ્યો રાજ્ય-વહીવટ માટે પોતાનો પ્રમુખ પસંદ કરતા હતા; જેની પસંદગી ચૂંટણી કરીને કરવામાં આવતી. ગણરાજ્યમાં પ્રત્યેક સત્ત્યને રાજા ગણવામાં આવતો. ગણરાજ્યોની પોતાની એક સભા હતી. જેમાં વહીવટ, સંરક્ષણ, યુદ્ધ, સંઘ જેવા ઘણા મહત્વના પ્રશ્નો ઉપર ચર્ચા થતી અને પછી નિર્ણય લેવાતો. કોઈપણ સત્ત્ય નિયત થયેલા સમય સુધી જ સત્ત્યપદ ભોગવતો. ગણરાજ્યના પ્રમુખને એક કાર્યવાહક સમિતિ રાજ્ય વહીવટમાં મદદ કરતી.

### •વિચારો •

- પ્રાચીન ભારતનાં ગણરાજ્યોને લોકશાહી રાજ્યો દર્શાવી શકાય ?
- પ્રાચીન ભારતનાં ગણરાજ્યો અને આજની લોકશાહી વચ્ચે શું સામ્ય જોવા મળે છે ?


### ગણરાજ્ય સમયનું સમાજજીવન અને રાજ્યવ્યવસ્થા :

પુરાતાત્ત્વશાસ્ત્રીઓના મતે આ સમયે લોકો સાદાં ઘરોમાં રહેતા હતા. પશુપાલન પ્રવૃત્તિ સાથે સંકળાયેલ હતા. આ સમયે ઘઉં, ચોખા, જવ, શેરડી, તલ, સરસવ, કઠોળ જેવા પાકો થતા હતા. લોકો માટીનાં વાસણોનો ઉપયોગ વિશેષ પ્રમાણમાં કરતા હશે કારણ કે પુરાતાત્ત્વશાસ્ત્રીઓને આવા કેટલાક માટીનાં વાસણો મળી આવ્યાં છે. આ સમયના માટીનાં કેટલાંક વાસણો ઉપર ચિત્રકામ થયેલ જોવા મળે છે. આ વાસણો ભૂખરા રંગનાં ચિત્રિત વાસણો (વ્ઘૂસરપાત્ર) હતાં.



### 4.2 ચિત્રિત ઘૂસરપાત્ર

આ સમયે કોઈ પણ રાજ્યનો શાસક પોતાના રાજ્યના સંરક્ષણ માટે શક્ય બધા જ ઉપાયો કરતો. આ માટે રાજ્યની રાજ્યધાનીની આસપાસ કિલ્લાઓ બાંધવામાં આવતા. આ કિલ્લાઓ મજબૂત અને ઊંચા બાંધવામાં આવતા. તેમાં પુષ્કળ પ્રમાણમાં પથ્થર અને ઈંટનો ઉપયોગ કરવામાં આવતો. કેટલાક રાજાઓ પોતાની શક્તિ અને સમૃદ્ધિનું પ્રદર્શન કરવા માટે પોતાના રાજ્યની ફરતે વિશાળ, ઊંચી અને ભવ્ય દીવાલો તૈયાર કરાવતા. પ્રયાગરાજથી મળેલ ઈંટની દીવાલ આશરે 2500 વર્ષ પહેલાંની ગણાય છે એટલે સંભવત: આ સમયે આવા ઊંચી દીવાલવાળા કિલ્લાઓ બાંધવામાં આવતા હશે.



### 4.3 ઈંટોના કિલ્લાની દીવાલ

#### પ્રયાગરાજ (અલાહાબાદ)

આ સમયનાં તમામ મહાજનપદોને વિશાળ સેના અને સંરક્ષણ માટે મજબૂત કિલ્લાની જરૂરિયાત રહેતી. આ જરૂરિયાતને પૂરી કરવા લોકો પાસેથી કર લેવામાં આવતો. બેતીના પાક પર છઠો ભાગ ખેડૂતો રાજકોષમાં આપતા. કારીગર વર્ગ એક માસમાં એક દિવસ રાજ્યને કામ કરી આપતો. પશુપાલકો કરના ભાગરૂપે પશુઓ આપતા. વેપારીઓ સામાનના ખરીદ-વેચાણ પર કર આપતા હતા.

મહાજનપદોના સમયગાળામાં લોખંડનાં ઓજારોને લીધે બેતીમાં સુધાર થવા લાગ્યો.

આટલું જાણો

- મહાવીર સ્વામી અને ગૌતમ બુદ્ધ બંને આ જનપદો (ગાણરાજ્યો)માં પગપાળા વિચર્યા હતા. જૈન અને બૌધ્ધ ધર્મગ્રંથોમાંથી ગાણરાજ્યો વિશે માહિતી પ્રાપ્ત થાય છે.
  - ગાણરાજ્યના યુગ દરમિયાન મહાત્મા બુદ્ધનો જન્મ થયો તેથી આ યુગને બુદ્ધકાલીન યુગ પણ કહે છે.

## વિશ્વમાં અન્યત્ર

સ્પાર્ટા, એથેન્સ, રોમ, ગ્રીસ વગેરેનાં નગરરાજ્યોનું જે રીતે લોકશાહી રાજ્યો તરીકે વિવરણ કરવામાં આવ્યું છે તે જ રીતે પ્રાચીન ભારતનાં ગણરાજ્યોને પણ લોકશાહી રાજ્યો તરીકે દર્શાવી શકાય.

## प्रवृत्ति

- ‘ભારત એક ખોજ’ ધારાવાહિક જોઈ ગાશરાજ્યોની માહિતી મેળવવી.



स्वाध्याय

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :



## 2. ટુંકમાં ઉત્તર આપો :

- (1) રાજશાહી અને લોકશાહી રાજ્યવ્યવસ્થા વચ્ચેનો તફાવત ટૂકમાં જણાવો.

(2) ગાંધીજીની શાસનવ્યવસ્થાની વિશેષતા જણાવો.

(3) ગાંધીજીનું સમાજજીવન વર્ણિબો.

3. ‘અ’ વિભાગમાં આપેલા રાજ્યનાં નામ સામે ‘બ’ વિભાગમાં આપેલ રાજ્યધાનીઓનાં યોગ્ય નામ જોડી ઉત્તર આપો :

અ	બુ
(1) મગધ	(a) કૌશાંભી
(2) ગાંધાર	(b) ઉજ્જવિની
(3) વત્સ	(c) રાજગૃહ
(4) અવંતિ	(d) તક્ષણિલા

४५

- ગ્રામપંચાયતની ચંટણીની સમગ્ર પ્રક્રિયાની માહિતી મેળવી વર્ગમાં રચ્યા કરો.



ઈ.સ. પૂર્વ છઠી સદીમાં ભારતમાં સામાજિક અને ધાર્મિક-સુધારણાક્ષેત્રે મહત્વપૂર્ણ કાર્યો થયાં. ઈ.સ. પૂર્વની છઠી સદીમાં સામાજિક અને ધાર્મિકક્ષેત્રે પ્રવેશેલા કુરિવાજો, સામાજિક અસમાનતા અને અનૈતિક બાબતો સામે કેટલાક મહાન સુધારકોએ કાર્ય કર્યું. તેમાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામી મુખ્ય છે. આપણે ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીનાં જીવન, એમની સાધના અને તેમણે સ્થાપેલા માનવર્ધનને સમજવાનો પ્રયત્ન કરીશું.

### ગૌતમ બુદ્ધ : પ્રારંભિક જીવન

ગૌતમ બુદ્ધ અને બૌદ્ધધર્મ વિશે જાણવા માટે આપણને જાતકક્થાઓ અને બૌદ્ધ ગ્રંથો ત્રિપિક (સૂત્ર પિણ્ડિક, વિનય પિણ્ડિક અને અભિધભ્રમ પિણ્ડિક)માંથી ઘણી માહિતી સાંપડે છે. 550 જેટલી જાતકક્થાઓ બુદ્ધના પૂર્વજન્મો સાથે સંકળાયેલી છે.

ભારતમાં હિમાલય ક્ષેત્ર તરફ નેપાળની તરાઈમાં કપિલવસ્તુ નામનું રાજ્ય હતું. કપિલવસ્તુના ક્ષત્રિયો શાક્ય કહેવાતા. તે ગાણરાજ્ય હતું. આ ગાણરાજ્યના વડા શુદ્ધોધન હતા. શુદ્ધોધનનાં પત્ની મહાદેવી. ગૌતમ બુદ્ધનો જન્મ ઈ.સ. પૂર્વ 566માં શુદ્ધોધન અને માયાદેવીના ઘરે થયો. તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું. જન્મના થોડા દિવસો બાદ તેમનાં માતા માયાદેવી મૃત્યુ પામ્યાં. તેથી તેમનું પાલનપોષણ ગૌતમી મહાપ્રજાપતિએ કર્યું જે તેમનાં પાલક માતા હતાં.

નાનપણથી જ સિદ્ધાર્થ શિક્ષણ અને જ્ઞાન સાથે સંકળાયેલા હતા. કપિલવસ્તુની બાજુમાં આલારકલામ નામના એક સંતનો આશ્રમ આવેલો હતો. આલારકલામ તેમના ગુરુ હતા. સિદ્ધાર્થ તેમના આશ્રમમાં જતા. અહીં તેઓ ધ્યાન ધરતા હતા. સિદ્ધાર્થ જ્ઞાન અને સમાધિની ચર્ચા કરતા રહેતા હોવાથી તેમના પિતા ચિંતિત થયા. તેમને લાગ્યું કે સિદ્ધાર્થ સંન્યાસી તો નહિ થઈ જાય ને ? સિદ્ધાર્થનાં યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યાં. તેમની પત્નીનું નામ યશોધરા હતું. તેમને એક પુત્ર પણ હતો તેનું નામ રાહુલ હતું.

### ગૃહિત્યાગ અને સાધના :

લગભગ 30 વર્ષની વધે જ્ઞાનપ્રાપ્તિ અને સત્યની શોધ માટે તેમણે પોતાના રાજીવી પરિવાર અને રાજ્યનો ત્યાગ કરી સંન્યાસી બનવાનું નક્કી કર્યું. એક રાત્રે તેમના સારથી છન્ન અને પોતાના પ્રિય ઘોડા કંથકને લઈ રાજ્ય બહાર આવેલ નદીકિનારે ગયા. પોતાના રાજીવી પોશાકનો ત્યાગ કરીને છન્નને પોતાનાં તમામ આભૂષણો આપી કંથકને લઈને રાજમહેલ જવા આજ્ઞા આપી અને પોતે સંન્યાસીનાં ભગવાં કપડાં ધારણ કરી જંગલ તરફ ચાલ્યા.

- ગૃહિત્યાગ બાદ તેઓ રાજગૃહ અને પછી પુરુવેલા નામના સ્થળે ગયા. અહીં પાંચ બ્રાહ્મણો સાથે તપશ્ચર્યા શરૂ કરી. તેમને લાગ્યું કે અન્ન-જળનો ત્યાગ કરી શરીરને કષ આપવાથી જ્ઞાન પ્રાપ્ત થશે નહિ. અધ્યાત્મમાર્ગ અને પોતાની તૃષ્ણાઓ ઉપર વિજય મેળવવો એ જ મનુષ્યનું મોટું કર્તવ્ય છે. તેમણે પાંચ બ્રાહ્મણોનો સાથ છોડીને એકલા જ તપશ્ચર્યા કરવાનો નિર્ણય કર્યો.

બોધિગયા ખાતે એક પીપળાના વૃક્ષ નીચે બેસી તેમણે સત્ય અને જ્ઞાનપ્રાપ્તિ માટે સાધના શરૂ કરી. ઘણા દિવસોની સાધના પછી વૈશાખી પૂર્વિમાના દિવસે તેમને જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત થતાં સિદ્ધાર્થમાંથી તેઓ બુદ્ધ થયા. ‘બુદ્ધ’નો અર્થ જાગ્રત કે જ્ઞાની થાય છે. પાછળથી તેઓ ગૌતમ બુદ્ધ કહેવાયા.

### ઉપદેશ :

જ્ઞાનપ્રાપ્તિ બાદ બુદ્ધ સારનાથ ગયા. જ્યાં તેમને તેમના જૂના બ્રાહ્મણમિત્રો મળ્યા. સૌપ્રથમ વખત તેમણે આ



5.1 ગૌતમ બુદ્ધ

પાંચ બ્રાહ્મણમિત્રોને સારનાથ ખાતે ઉપદેશ આપ્યો. બુદ્ધના આ પ્રથમ ઉપદેશને ‘ધર્મચક્રવર્તન’ કહેવામાં આવે છે. બુદ્ધ સંસારનાં દુઃખોમાંથી મુક્તિ મેળવવા બહુ જ સરળ અને સાદો ઉપદેશ આપ્યો. તેમના મતે ચાર આર્થ સત્ય છે : (1) સંસાર દુઃખમય છે. (2) દુઃખનું કારણ તૃષ્ણા છે. (3) દુઃખનો નાશ તૃષ્ણાનો ત્યાગ છે. (4) અણાંગિક માર્ગ અપનાવવાથી તૃષ્ણાનો ત્યાગ થાય છે. બુદ્ધ સમજાવેલાં આ ચાર આર્થ સત્ય બૌદ્ધર્મના સિદ્ધાંત તરીકે જાણીતાં છે. જેને સમ્યકું દર્શન પણ કહેવામાં આવે છે.

### આટલું જાણો :

- સમ્યક દિષ્ટિ, સમ્યક સંકલ્પ, સમ્યક વાણી, સમ્યક કર્મ, સમ્યક આજીવિકા, સમ્યક વ્યાયામ, સમ્યક સ્મૃતિ, સમ્યક સમાધી. ‘સમ્યક’ સંસ્કૃત શબ્દ છે. તેનો અર્થ ‘સારી રોતે’ એવો થાય છે.

### બુદ્ધ એક મહાન સુધારક તરીકે :

બુદ્ધ મહાન ધાર્મિક અને સામાજિક સુધારક હતા. ધર્મ અને સમાજમાં વ્યાપેલાં દૂષણો દૂર કરવા માટે તેમણે આજીવન કાર્ય કર્યું. તેમના અનેક શિષ્યો હતા. અનેક રાજાઓ અને રાજ્યો તેમના માનવર્ધમથી પ્રોત્સાહિત થયા. તેમણે નીચે મુજબ સુધારકાર્યો કર્યા :



#### (1) ઈશ્વર અને આત્માનો ઈન્કાર : બુદ્ધ ઈશ્વર અને આત્માનો ઈન્કાર કરી કર્મવાદને

મહત્ત્વ આપ્યું હતું. તેમના મતે જો ઈશ્વર હોય તો દુઃખ સંભવે જ નહિ. આત્માના કલ્યાણમાં રત રહેવાને બદલે વર્તમાનકાળમાં સદ્ગ્વિચારયુક્ત જીવન જીવવું જોઈએ.

(2) કર્મકંડનો વિરોધ : હિંદુર્મમાં વ્યાપેલા કર્મકંડનો વિરોધ કરી તેમણે યજ્ઞમાં થતી પશુહિંસાને અટકાવવા તેનો વિરોધ કર્યો. તેમણે કદ્યું કે અહિંસા સર્વાચ્ચ ગુણ છે. તમામ મ્રાણીઓ પ્રત્યે અહિંસાથી વર્તવું તે માનવનું સૌથી મોટું કર્તવ્ય છે.

(3) ઊંચ-નીચના ભેદભાવોનો વિરોધ : આ સમયે હિંદુર્મ બ્રાહ્મણ, ક્ષત્રિય, વैશ્ય અને શૂદ્ર એવા ચાર વર્ણોમાં વહેંચાઈ ગયો હતો. બુદ્ધ આ વર્ણવ્યવસ્થાનો જ વિરોધ કર્યો. તેમણે કદ્યું કે, મનુષ્ય ઉચ્ચ કુટુંબમાં જન્મ લેવાથી મહાન બનતો નથી. તે પોતાનાં કર્માંથી, સદ્ગ્વિચારથી, સત્ય અને અહિંસાના પાલનથી મહાન બને છે. તેમણે સમાજમાં વ્યાપેલાં ઊંચ-નીચના ભેદભાવનો ઉગ્ર વિરોધ કર્યો.

(4) સ્ત્રીઓને મહત્ત્વ : બુદ્ધે પોતાના આ માનવર્ધમમાં પુરુષો જેટલું જ મહત્ત્વ સ્ત્રીઓને આપ્યું. તેમણે કદ્યું નિર્વાણનો માર્ગ માત્ર પુરુષો માટે જ નથી, સ્ત્રીઓ પણ સાધના અને કર્તવ્યથી નિર્વાણ પ્રાપ્ત કરી શકે છે.

### નિર્વાણ :

બુદ્ધને વૈશાખી પૂર્ણિમાએ બોધિવૃક્ષની છાયામાં જ્ઞાન પ્રાપ્ત થયું. જ્ઞાન પ્રાપ્ત કરી બુદ્ધ ભારતમાં સમાજ અને ધર્મમાં સુધારા કરતા રહ્યા. અનેક લોકોને તેમણે સદ્ગ્રાહી વાળ્યા. સત્ય અને અહિંસાનો ઉપદેશ આપી માંસાહાર અને ઊંચ-નીચના ભેદભાવનો વિરોધ કર્યો. 80 વર્ષની વયે કુશીનારામાં તેમનું અવસાન થયું અને તેઓ નિર્વાણ પામ્યા. પરંતુ વિશ્વભરમાં આજે પણ તેમના વિચારો અને ધર્મ જીવંત રહ્યા છે.

### મહાવીર સ્વામી

બૌદ્ધર્મની જેમ જ ભારતીય સમાજજીવનમાં જૈનર્મનું પણ અગત્યનું સ્થાન છે. જૈનર્મમાં કુલ ચોવીસ તીર્થકરો થયા. આગમગ્રંથો જૈનર્મને જાણવાના મહત્વપૂર્ણ ખોતો છે. આ ગ્રંથો પ્રમાણે જૈનર્મના પ્રથમ તીર્થકર ઋખભદેવ અથવા આદિનાથ હતા. ત્રૈવીસમા તીર્થકર પાર્વતીનાથ હતા. પાર્વતીનાથ કાશીના રાજ અશ્વસેનના પુત્ર હતા. તેમણે ત્રૈસ વર્ષની વયે ગૃહત્યાગ કરી સંન્યાસી બની જૈનર્મનો ઉપદેશ આપ્યો. તેમણે વૈદિક ધર્મ અને કર્મકંડ તથા જાતિપ્રથાનો

વિરોધ કર્યો હતો. તેમણે સત્ય, અહિંસા, અસ્તેય અને અપરિગ્રહનો ઉપદેશ આપ્યો હતો. તેમના પછી ચોવીસમા અને છેલ્લા તીર્થકર મહાવીર સ્વામી હતા. તેમના વિશે આપણે જાણીશું.

### મહાવીર સ્વામી : પ્રારંભિક જીવન :

વજિજ સંઘના એક ગણરાજ્ય કુંડગ્રામના જ્ઞાતુક ક્ષત્રિય વંશમાં મહાવીર સ્વામીનો જન્મ થયો હતો. તેમનું બાળપણનું નામ વર્ધમાન હતું. તેમના પિતા સિદ્ધાર્થ ગણરાજ્યના રાજા હતા. મહાવીર સ્વામીનાં માતાનું નામ ત્રિશલાદેવી હતું. તેમના મોટાભાઈનું નામ નંદિવર્ધન હતું. વર્ધમાન પણ ગૌતમ બુદ્ધની જેમ રાજકુમાર હોવાથી તેમણે અનેક કલાનું જ્ઞાન મેળવ્યું હતું. તેમનાં લજ્જા રાજકુમારી યશોદા સાથે થયાં હતાં. વર્ધમાનની પુત્રીનું નામ પ્રિયદર્શિની હતું.



### 5.2 મહાવીર સ્વામી

ત્રીસ વર્ષની વયે સત્ય અને જ્ઞાનની શોધમાં તેમણે ગૃહિત્યાગ કર્યો. બિક્ષુક જીવન ધારણ કરી બાર વર્ષ સુધી કઠોર તપશ્ચર્યા કરી. ઋજુપાલિક નદીના કિનારે તેમને સર્વોચ્ચ જ્ઞાન એટલે કે કેવલજ્ઞાન પ્રાપ્ત થયું. પોતાનાં મન અને ઈન્દ્રિયો પર વિજય પ્રાપ્ત કર્યો હોવાથી તેઓ ‘જિન’ કહેવાયા. આવા મહાન પરાક્રમી વર્ધમાન ‘મહાવીર’ તરીકે જાણીતાં થયા.

#### ઉપદેશ :

બુદ્ધની જેમ જ મહાવીર સ્વામી પણ સંસારને ભય અને દુઃખોથી ભરેલો માને છે. તેઓ ઈશ્વરનો ઈન્કાર કરે છે. તેમના ઉપદેશને ત્રિરત્નના સિદ્ધાંત તરીકે ઓળખવામાં આવે છે. તેમણે નીચે મુજબનાં પાંચ પ્રતોનો ઉપદેશ આપ્યો હતો :



**(1) અહિંસા :** મહાવીર સ્વામી માનતા કે હિંસા એ માનવસમાજનું સૌથી મોટું દૂષણ છે.

કોઈપણ પ્રકારની હિંસા કરવી જોઈએ નહિ. નાનામાં નાના જીવને પણ જીવવાનો પૂરો અધિકાર છે. મનમાં પણ હિંસા કરવી જોઈએ નહિ. પ્રાણી માત્રાની રક્ષા કરવી એ જ મનુષ્યનું સાચું કર્તવ્ય છે.

**(2) સત્ય :** ક્યારેય અસત્યનું ઉચ્ચારણ કરવું જોઈએ નહિ. વિચાર્યા કે સમજ્યા વિના બોલવું પણ જોઈએ નહિ. સત્યના પાલન માટે કોઈનો ત્યાગ કરવો જોઈએ. સત્યનું હંમેશાં દરેક પરિસ્થિતિમાં પાલન કરવું જોઈએ.

**(3) અસ્તેય :** ચોરી એ સૌથી મોટું અનિષ્ટ છે. કોઈની પણ અનુમતિ વગર તેની વસ્તુ ગ્રહણ કરવી જોઈએ નહિ. કોઈની આજ્ઞા વગર કોઈના ધરમાં પ્રવેશ કરવો તે પણ ચોરી છે તેમ સમજવી તે સમયના સમાજને ચોરવૃત્તિથી દૂર કરવાનો તેમણે પ્રયત્ન કર્યો.

**(4) અપરિગ્રહ :** મનુષ્યે પોતાની જરૂરિયાત કરતાં વધારે ચીજવસ્તુઓ, ધન-ધાન્ય, આભૂષણો, વસ્ત્રોનો સંગ્રહ કરવો જોઈએ નહિ. જેટલી જરૂરિયાત હોય તેટલું જ રાખવાથી સંગ્રહવૃત્તિ ઘટે અને પરિણામે ગરીબો સુધી અનાજ જેવી ચીજવસ્તુઓ પહોંચે તેવો મહત્વનો સંદેશ તેમણે આપ્યો.

**(5) બ્રહ્મચર્ય :** તેમણે જૈન સાધુઓ અને સાધ્વીઓને બ્રહ્મચર્યનું પાલન કરવા ખાસ જણાવ્યું હતું.

#### આટલું જાણો :

- ત્રિરત્ન (રત્નત્રયી) સિદ્ધાંત એટલે સમ્યક દર્શન, સમ્યક જ્ઞાન અને સમ્યક આચરણ.

### મહાવીર સ્વામી : એક મહાન સુધારક તરીકે :

મહાવીર સ્વામીએ કર્મકંડ અને યજોનો વિરોધ કર્યો. તેમણે ઈશ્વરનો ઈન્કાર કર્યો. યજમાં થતી પશુહિંસાની નિંદા કરી. સ્ત્રીઓને સમાન અધિકાર આપવાની વાત કરી. બુદ્ધની જેમ જ તેમણે લોકોની ભાષા પ્રાકૃત અને અર્ધમાંધીમાં ઉપદેશ આપ્યો. સાદા અને સરળ ઉપદેશથી તેમણે લોકોનું જીવન બદલી નાખ્યું.

**નિર્વાણ :** 72 વર્ષની વયે પાવાપુરીમાં તેઓ નિર્વાણ પામ્યા.

આવી રીતે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશથી લોકોને નવા વિચારો મળ્યા. એ સમયના ધાર્મિક કિયાકાંડો અને દૃષ્ટિઓ દૂર થયાં. મોટી સંખ્યામાં લોકો તેમના અનુયાયી બન્યા. બંને ઉપદેશકોએ શાંતિ અને સદ્ગ્યારારનો માર્ગ અપનાવવા લોકોને અનુરોધ કર્યો અને આ રીતે તેઓ સમાજના સદ્ગ્યાર-



स्वाध्याय

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :



## 2. ટુંકમાં ઉત્તર આપો :

- (1) ગૌતમ બુદ્ધનો મુખ્ય ઉપદેશ શું હતો ?
  - (2) મહાવીર સ્વામીનો મુખ્ય ઉપદેશ શું હતો ?
  - (3) જૈનધર્મએ ક્ષયાં પાંચ મહાવતો આપ્યાં ?

3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

- (અ) બુદ્ધ અને જૈન બંને ધર્મએ લોકોને શાંતિ અને અહિંસાનો માર્ગ અપનાવવા અનુરોધ કર્યો.  
(બ) બુદ્ધ દ્વારા પ્રથમ ઉપદેશ બોધિગ્યામાં આપવામાં આવેલ.  
(ક) બુદ્ધને સારનાથમાં જ્ઞાન પ્રાપ્ત થયું હતું.

#### 4. યોગ્ય ઉત્તર આપો :

- (1) ગૌતમ બુદ્ધ અને મહાવીર સ્વામીના ઉપદેશમાં શું સમાનતા હતી?  
 (2) ગૌતમ બુદ્ધના સમયમાં ક્યાં અનિષ્ટો જોવા મળતાં હતાં?

— यथा करो

ગૌતમ અદ્ધ તથા મહાવીર સ્વામીએ આપેલા ઉપદેશ આપણાને કેવી રીતે ઉપયોગી છે ?

આવો જાતે કરીએ

- વિવિધ ધર્માની ઉપદેશાત્મક બાબતો શોધો અને તેમાં સરખાપણું શું છે તેની નોંધ કરો.
  - ‘અંગુલિમાલ’ ફિલ્મ નિહાળી બૃદ્ધના જીવનપ્રસંગો નોંધો.

## 6

## મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમાટ અશોક



રવિવાર હોવાથી સોસાયટીનાં સૌ બાળકો મેદાનમાં કિકેટ રમવા ભેગા થયાં. ભવ્ય અને જલ્દે ટીમ પાડી. બોટિંગ કે બોલિંગ નક્કી કરવા માટે સિક્કો ઉછાળ્યો. જલ્દ્ય બોલ્યો : કિંગ. સિક્કો હવામાંથી નીચે જમીન ઉપર પડ્યો. કિંગ પડ્યો એટલે જલ્દે બોટિંગ માંગ્યો. બાજુમાં ઉભેલો હેતાંશ બોલી ઉઠ્યો : સિક્કા પર આપેલી આ સિંહની આકૃતિ ક્યાંથી લીધી હતો ? ભવ્યએ તેને સમજાયો : સિક્કા પર આપેલી સિંહની આકૃતિ એટલે કિંગ. સારનાથના વિશાળ સ્તંભ પર આ સિંહની આકૃતિ સ્થાપિત કરવામાં આવેલી છે. આ સ્તંભને મૌર્યવંશના સમાટ અશોક દ્વારા નિર્માણ કરવામાં આવ્યો હતો. ભારતે તેને રાષ્ટ્રીય પ્રતીક તરીકે સ્વીકારેલ છે.

### મૌર્યવંશ : સ્થાપક અને શાસક

(1) ચંદ્રગુપ્ત મૌર્ય : મૌર્યવંશના સ્થાપક (ઈ.સ. પૂર્વ 321

થી ઈ.સ. પૂર્વ 297) : બાળપણમાં રાજા રાજાની રમત રમતા ચંદ્રગુપ્તનું હીર પારખીને તક્ષશિલાના કૌટિલ્ય ગોત્રના આચાર્ય

વિષ્ણુગુપ્તે (ચાણક્ય) તક્ષશિલા લઈ જઈ તેને શાસ્ત્ર અને શાસ્ત્રોની તાલીમ આપી. ચાણક્યની તાલીમની મદદ અને માર્ગદર્શનથી ચંદ્રગુપ્ત મૌર્યએ ઈ.સ. પૂર્વ 321માં નંદવંશના અંતિમ સમાટ ધનનંદને હરાવીને મગધની ગાદી સંભાળી, મૌર્યવંશની સ્થાપના કરી. ચાણક્યની રાજનીતિ અને વહીવટ અંગેની કુશળતાનો સંપૂર્ણ લાભ ચંદ્રગુપ્તને મળ્યો. ચાણક્ય દ્વારા લખાયેલા “અર્થશાસ્ત્ર” નામના ગ્રંથમાંથી તે સમયની રાજકીય, આર્થિક અને સામાજિક જીવનની માહિતી મળી રહે છે. ચંદ્રગુપ્તની તમામ સિદ્ધિઓમાં ચાણક્યના મુત્સદીગીરીવાળા માર્ગદર્શને ઘણો મહત્વનો ભાગ બજવ્યો હતો.

ગ્રીક રાજ સેલ્યુક્સ નિકેતરને હરાવીને ચંદ્રગુપ્તે ચાર પ્રદેશો (1) કાબુલ (2) કંદહાર (3) હેરાત અને (4) બલુચિસ્તાન જત્યા હતા. ચંદ્રગુપ્તની બહાદુરીથી પ્રભાવિત થઈ સેલ્યુક્સે પોતાની પુત્રી હેલેનાને ચંદ્રગુપ્ત સાથે પરણાવી અને પોતાના રાજ્યદૂત મેગેસ્થનિસને તેના દરબારમાં મોકલ્યો. પાટલીપુત્રમાં રોકાણ દરમિયાન મેગેસ્થનિસે લખેલ પુસ્તક “ઈન્દ્રિકા”માંથી મગધ સામ્રાજ્યના પાટનગર અને એના વહીવટ વિશેની અગત્યની અને આધારભૂત જાણકારી મળે છે.

### રાજ્યવિસ્તાર :

ચંદ્રગુપ્તે પોતાની વીરતા અને ચાણક્યની રાજનૈતિક કુશળતાથી પોતાની સત્તાનો પ્રસાર ભારતના અન્ય પ્રદેશોમાં કરી સમગ્ર ભારત પર એક સાર્વભૌમ સત્તા સ્થાપવાનો પ્રયત્ન કર્યો. ઉત્તરમાં અફધાનિસ્તાન, પેશાવર, કંદહારથી લઈને પૂર્વમાં બંગાળ સુધી તેનું શાસન હતું. પશ્ચિમ ભારત પર પણ એની સત્તા હતી. સૌરાષ્ટ્રમાં પણ તેનું શાસન હોવાનું તથા પુષ્યગુપ્ત નામના વૈશ્ય અમાત્યને ત્યાંના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નીમ્યા હોવાનું આધારોમાં જણાવેલ છે. સૌરાષ્ટ્રમાં આવેલ ગિરિનગર (જૂનાગઢ)ના ગિરનાર પર્વતમાંથી નીકળતી નદીઓ પર બંધ બાંધીને પુષ્યગુપ્તે સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું.


દક્ષિણ ભારતના કોંકણ, કર્ણાટક, મહારાષ્ટ્ર વગેરે પ્રદેશો પણ મગધ સામ્રાજ્યનો એક ભાગ હતા. વાયવ્યમાં છેક



6.1



પશ્ચિમ ગાંધાર (અફઘાનિસ્તાન) સુધીના પ્રદેશો પણ ચંદ્રગુપ્તની સત્તા હેઠળ હતા. આમ, સમગ્ર ભારત પર મૌર્ય સામ્રાજ્યની સાર્વભૌમ સત્તા પ્રવર્તતી હતી.



## 6.2 મૌર્ય સામ્રાજ્યનો વિસ્તાર

જાણવા જેવં

**રાજ્યકુત (એલચી) :** એક રાજ્યનો બીજા રાજ્યમાં મોકલવામાં આવતો પ્રતિનિધિ.

- ભારતમાં આવેલ અન્ય દેશોની એલચી કચેરીઓનાં કાર્ય વિશે તમારા શિક્ષક પાસેથી જાગ્રાતારી મેળવો.

ચંદ્રગુપ્તે તેના જીવનનો અંતિમ સમય જૈન મુનિ ભદ્રબાહુ સાથે મૈસુર (હાલ ક્રાંકાંક)ના શ્રવણ બેલગોડામાં વિતાવ્યો હતો. ઈ.સ. પૂર્વ 297માં તે મૃત્યુ પામ્યો. ચંદ્રગુપ્તે 24 વર્ષ રાજ્ય કર્યાનું અને છેલ્લાં વર્ષોમાં તેણે જૈનધર્મ અપનાવ્યાની વાત જૈન પુરાણોમાંથી મળી આવે છે.

ભારતમાં મૌર્યવંશની સ્થાપના પહેલાંનો ઈતિહાસ આદ્યાતિહાસ તરીકે ઓળખવામાં આવે છે. મૌર્યવંશની સ્થાપનાની ચોક્કસ અને આધારભૂત માહિતી વિવિધ સોતોમાંથી મળી રહે છે. ચંદ્રગુપ્ત મૌર્ય દ્વારા વિષ્ણુગુપ્ત (ચાણક્ય)ની મદદથી સ્થાપવામાં આવેલું મૌર્ય સામ્રાજ્ય ભારતનું પ્રથમ ઐતિહાસિક સામ્રાજ્ય કહેવાય છે.

### મૌર્યવંશની જાણકારી મેળવવાના સોત :

ક્રમ	કૃતિ	લેખક
1.	અર્થશાસ્ત્ર	આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય (કૌટિલ્ય)
2.	ઈન્ડિકા	મેગેસ્થનિસ
3.	દીપવંશ અને મહાવંશ	બૌદ્ધ ગ્રંથો (સિલોન)
4.	મુદ્રારાક્ષસ (નાટક)	વિશાખદત્ત

આ ઉપરાંત, મૌર્ય સમ્રાટોએ કોતરાવેલ શિલાલેખો, સ્તંભલેખો, ગુફાલેખો, સ્તૂપો અને વિહારો વગેરેમાંથી પણ ઐતિહાસિક માહિતી પ્રાપ્ત થાય છે.

#### •વિચારો•

- વર્તમાન સમયમાં તમારે કોઈ વ્યક્તિ, વસ્તુ કે સ્થળ વિશે માહિતી મેળવવી હોય, તો તમે કેવી રીતે મેળવો છો ?

### ગ્રાન્ડ ટ્રેક રોડ (GTR) :

એશિયા ખંડનો સૌથી જૂનો અને લાંબો મુખ્ય રોડ છે. આ રોડનું નિર્માણ સૌપ્રથમ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું. તે તામ્રલિપિ થઈને તક્ષશિલા અને તક્ષશિલાથી મધ્ય એશિયાને જોડતો હતો. તે સમયે ગંગાના મેદાનથી ગંધાર સુધી આ રોડ વિસ્તરેલો હતો. શેરશાહ સૂરીએ પોતાના શાસનકાળમાં આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. અંગ્રેજ શાસનકાળ દરમિયાન તેલહાઉસીએ કોલકાતાથી પેશાવર સુધી આ રોડનું પુનઃનિર્માણ કરાવ્યું હતું. વર્તમાન સમયમાં આ રોડ ટિલ્લીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે.



(2) બિંદુસાર (ઈ.સ. પૂર્વ 297 થી ઈ.સ. પૂર્વ 273) : ચંદ્રગુપ્તના અવસાન બાદ તેનો પુત્ર બિંદુસાર મગધની ગાદીએ આવ્યો. પિતા ચંદ્રગુપ્ત તરફથી વારસામાં મળેલું વિશાળ સામ્રાજ્ય યથાવત ટકાવી રાખી તેની બેટ પુત્ર અશોકને આપી એ જ બિંદુસારની મોટામાં મોટી સિદ્ધિ ગણી શકાય.

બિંદુસારના શાસનકાળમાં રાજકુમાર સુશીમની તક્ષશિલાના અને રાજકુમાર અશોકની અવંતિના રાષ્ટ્રીય (રાજ્યપાલ) તરીકે નિમણૂક થઈ હતી. સુશીમના સમયમાં તક્ષશિલામાં થયેલ બળવાને નિયંત્રિત કરવામાં તે નિષ્ફળ રહ્યો, જ્યારે અશોકે આ કાર્ય સફળતાપૂર્વક પાર પાડી બળવો દ્યાધો.

બિંદુસારે તેના શાસનકાળમાં કોઈ નવો પ્રદેશ જીત્યો ન હતો. પરંતુ ગ્રીક રાજ્યો સાથેના મૈત્રીભર્યા સંબંધો જાળવી રાખ્યા હતા. તેણે મગધની ગાદી પર લગભગ 25 વર્ષ સુધી રાજ્ય કર્યું.

**(3) સમ્રાટ અશોક :** (ઈ.સ. પૂર્વ 273 થી ઈ.સ. પૂર્વ 232) : પિતા બિંદુસારના મૃત્યુ પછી મોટાભાઈ સુશીમ અને બીજા સાવકા ભાઈઓ સાથે થયેલા સંઘર્ષને કારણે ગાદીએ આવ્યાનાં ચાર વર્ષ બાદ રાજ્યાની પાટલીપુત્રમાં અશોકનો રાજ્યાભિષેક થયો હતો.



રાજ્યાભિષેક થયા બાદ અશોકે પિતા તરફથી વારસામાં મળેલ રાજ્યવિસ્તારમાં વધારો કર્યો. તેના શિલાલેખમાં જગ્યાવ્યા મુજબ તેનું સામ્રાજ્ય વાયવ્ય સરહદે આવેલા કંદહાર અને પેશાવરથી ઉત્તર ભારતમાં નેપાળ સુધી, દક્ષિણ મૈસુર (હાલનું કર્ણાટક) સુધી, પશ્ચિમે ગુજરાત-સૌરાષ્ટ્ર સુધી, પૂર્વમાં મગધ (હાલનું બિહાર), કલિંગ (હાલનું ઓଡિશા) સુધી ફેલાયેલું હતું.

### કલિંગનું યુદ્ધ અને અશોકનું હદ્ય-પરિવર્તન :

મગધની પડોશમાં આવેલ કલિંગ (હાલનું ઓડિશા) નંદ રાજાઓના સમયમાં મગધ સામ્રાજ્યનો જ એક ભાગ હતું. પરંતુ મૌર્ય શાસનની સ્થાપના સમયે તે સ્વતંત્ર થઈ ગમેલું. કલિંગને ફરીથી મગધ સામ્રાજ્યનો ભાગ બનાવવાની મહત્વાકાંક્ષા રાખનાર અશોકે રાજ્યાભિષેક પછીના આઠમા વર્ષ (ઈ.સ. પૂર્વ 261) કલિંગના રાજ જ્યંત સામે યુદ્ધ જહેર કર્યું. આ યુદ્ધમાં અશોકનો વિજય થયો.

યુદ્ધમાં વિજય મેળવ્યા બાદ યુદ્ધભૂમિ અને નગરમાં ફરતા અશોકે બધે જ દુઃખ અને શોકનું વાતાવરણ જોયું. યુદ્ધમાં થયેલ ખુલારી અને સ્વીઓ-બાળકોને રડતાં જોઈને કલિંગ પર મેળવેલી જીતનો આનંદ ઓસરી ગયો. અશોકના મનની શાંતિ હજાઈ ગઈ. યુદ્ધમાં થયેલી ખુલારીને કારણે અશોકના હદ્યમાં ભારે સંતાપ અને પશ્ચાત્તાપની લાગણી જન્મી. યુદ્ધની નિરર્થકતા સમજાઈ જવાને કારણે કલિંગનું યુદ્ધ તેના જીવનનું અંતિમ યુદ્ધ બની રહ્યું. બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી તેણે શસ્ત્રોનો ત્યાગ કરી શાસ્ત્રોનું શરણું લીધું. બૌદ્ધર્થમ અંગીકાર કરી અશોક રાજદ્વારી પુરુષમાંથી ધર્માનુરાગી અશોક બની ગયો.

અશોક પહેલો એવો શાસક હતો જેણે શિલાલેખો દ્વારા પોતાનો સંદેશ પ્રજા સુધી પહોંચાડવાનો પ્રયત્ન કર્યો. અશોકના મોટા ભાગના અભિલેખોની ભાષા પ્રાકૃત અને લિપિ બ્રાહ્મી છે.

### બ્રાહ્મી લિપિ :

આધુનિક ભારતની મોટાભાગની લિપિઓ બ્રાહ્મી લિપિમાંથી વિકસી છે. અહીં તમે ‘અ’ અક્ષર જુદી-જુદી લિપિઓમાં જોઈ શકો છો.

ત	અ	ં	િ	ં
પ્રારંભિક	દેવનાગરી	બાંગલા	મલયાલમ	તમિલ
બ્રાહ્મી	(હિન્દી)			

### 6.3 લિપિ

#### કલિંગના યુદ્ધનું વર્ણન કરતો અશોકનો શિલાલેખ

કલિંગના યુદ્ધનું વર્ણન કરતા અશોકે પોતાના કલિંગના શિલાલેખમાં લખાવ્યું છે કે,

રાજા બન્યાનાં આઠ વર્ષ પછી મેં કલિંગ પર વિજય મેળવ્યો.

લગભગ દોઢ લાખ લોકો કેદ કરાયા. એક લાખથી વધુ લોકો માર્યા ગયા. એનાથી મને અપાર દુઃખ થયું છે.

જે લોકો પોતાના સગાંસંબંધીઓ અને મિત્રોને ખૂબ ચાહે છે તથા પોતાના દાસો અને મૃતકો પ્રત્યે દ્યાવાન હોય છે તે પણ યુદ્ધમાં માર્યા જાય છે અથવા પોતાના સ્નેહીજનોને ખોઈ બેસે છે.

તેનાથી મને પશ્ચાતાપ થઈ રહ્યો છે. હવે મેં ધર્મપાલન કરવાનો અને અન્ય લોકોને તેનો ઉપદેશ આપવાનો નિશ્ચય કર્યો છે.

હું માનું છું કે ધર્મના માધ્યમથી લોકોના દિલ જીતવા એ જબરજસ્તીથી વિજય મેળવવા કરતાં વધારે સારું છે. હું આ અભિલોખ ભવિષ્ય માટે એક સંદેશરૂપે કોતરાવી રહ્યો છું કે મારા પછી મારા પુત્રો અને પૌત્રો પણ યુદ્ધ ન કરે. ધર્મનો ફેલાવો કેવી રીતે કરી શકાય તે અંગે તેમણે વિચારવું જોઈએ.

(ધર્મ સંસ્કૃત શબ્દ ધર્મનું પાકૃતરૂપ છે.)

### • વિચારો •

- કલિંગના યુદ્ધ પછી અશોકના વિચારોમાં શું પરિવર્તન આવ્યું ?

ગુજરાતના જૂનાગઢમાં ગિરનાર પર્વત તરફ દામોદર કુંડ જતાં અશોકનો શિલાલેખ મળી આવેલ છે જે માકૃત ભાષામાં લખાયેલ છે. આ શિલાલેખમાં ત્રણ રાજીવીઓના લેખો છે. આ લેખ રાજી મહાક્ષત્રપ રૂક્રદામાનો છે. આ લેખમાં મૌર્ય રાજી ચંદ્રગુપ્તના રાષ્ટ્રીય પુષ્ટિ દ્વારા નિર્માણ કરવામાં આવેલ સુદર્શન તળાવ (જળાશય) અને અશોકના રાષ્ટ્રીય યવનરાજ દ્વારા સિંચાઈ માટે તેમાંથી નહેરો કાઢવાની વિગતો આપવામાં આવેલ છે.

જે સ્થળોએ અશોકના શિલાલેખો મળ્યા છે. તેની વધુ માહિતી માટે નકશા 6.2 નો અભ્યાસ કરવો.

### • વિચારો •

નકશાનો અભ્યાસ કરી તમારા શિક્ષકની મદદથી નીચેના પ્રશ્નોના જવાબ તમારી નોટબુકમાં લખો :

- અશોકના શિલાલેખો ક્યાંથી મળી આવ્યા છે ?
- આ સ્થળો વર્તમાન સમયમાં ક્યાં આવેલાં છે તે શોધો.

### ધર્મપ્રચારક તરીકે અશોક :

અશોકે દેશભરમાં આવેલાં બૌદ્ધ તીર્થધામોની યાત્રા કરી. યાત્રા દરમિયાન બૌદ્ધર્મનો પ્રચાર કર્યો. અશોકે ગૌતમ બુદ્ધના ઉપદેશોમાંથી પ્રેરણા મેળવી પોતાની પ્રજાને ધર્મનો માર્ગ બતાવવા પોતાના સામ્રાજ્યમાં ઠેર-ઠેર શિલાલેખો અને સ્તંભાલેખો કોતરાવ્યા. તે સમયની સમસ્યાઓનો ઉકેલ લાવવા અશોકે રાજ્યમાં ધર્મભાતાની રચના કરી. આ ખાતાના ઊપરી તરીકે નિમાયેલ ધર્મ મહામાત્ર નામના અધિકારીએ પ્રજામાં બૌદ્ધર્મનો પ્રચાર કરી તેમનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું કાર્ય કરવાનું હતું.

અશોકે રાજ્યમાં શિકાર કરવા પર પ્રતિબંધ ફરમાવી પશુઓની હિંસા બંધ કરાવી. તેણે ગૌતમ બુદ્ધના પ્રેમ, દ્યા, કરુણા, અહિંસા, સદાચાર, અનુંંપા જેવા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો. ઉપદેશની સાથે-સાથે કેટલીક લોકોપયોગી વાતો પણ શિલાલેખોમાં કોતરાવી.

## અશોકનો પ્રજાજોગ સંદેશ

- (1) માતાપિતાની આજ્ઞાનું પાલન કરવું.
- (2) વડીલોનો આદર કરવો.
- (3) પણુઓનો વધ ન કરવો.
- (4) બને તેટલો ઓછો ખર્ચ કરવો.
- (5) ગુરુની સેવા કરવી.
- (6) સ્ત્રીઓ અને નોકરો પ્રત્યે માયાળું વર્તન રાખવું.
- (7) બ્રાહ્મણો અને શ્રમણોને દાન આપવું.
- (8) અન્ય ધર્મના મુખ્ય સિદ્ધાંતો સમજવાનો પ્રયત્ન કરી તેનો આદર કરવો.

### પ્રવૃત્તિ

- અશોકના પ્રજાજોગ સંદેશમાં આપવામાં આવેલ વિગતોમાંથી કઈ વિગતો વર્તમાન સમયમાં પ્રાસંગિક છે ?
- સરકાર વિવિધ યોજનાઓ, નિયમો, સુધારા વગેરેની માહિતી લોકોને કયાં-કયાં માધ્યમો દ્વારા આપે છે ?

અશોકે ઈ.સ. પૂર્વ 251માં પાટલીપુત્રમાં મોગલીપુત્ર તિષ્ય (તિસ્સા)ના અધ્યક્ષપદે ત્રીજી બૌદ્ધ પરિષદ બોલાવી. આ પરિષદનો મુખ્ય હેતુ બૌદ્ધધર્મમાં ઉભા થયેલા મતમતાંતરો દૂર કરી ધાર્મિક એકતા સ્થાપવાનો હતો. અશોકે ભારતનાં કશ્મીર, ગાંધાર, ચોલ, પાંડ્ય અને કેરળ રાજ્યોમાં બૌદ્ધધર્મનો પ્રચાર કર્યો હતો. સમ્રાટ અશોક બ્રહ્મદેશ (ભ્યાનમાર), સિલોન (શ્રીલંકા) સિરિયા, ઈજિપ્ટ, મેસેડોનિયા વગેરે દેશોમાં ધર્મપ્રચાર માટે ધર્મપ્રચારક મંડળો મોકલ્યાં. અશોકે પુત્ર મહેન્દ્ર અને પુત્રી સંઘમિત્રાને બૌદ્ધધર્મના પ્રચાર માટે સિલોન મોકલ્યાં હતાં. આમ, અશોકે પોતાના શાસન દરમિયાન બૌદ્ધધર્મને રાજ્યાશ્રય આપ્યો.

અશોકે ધર્મપ્રચાર ઉપરાંત પ્રજાકલ્યાણનાં કાર્યો પણ કર્યો હતાં. અશોકે માનવ અને પણુઓની સારવારની વ્યવસ્થા કરી. કૂવા ખોદાવ્યા, વૃક્ષો રોપાવ્યા, રસ્તા બનાવ્યા અને વિશ્વમગૃહોનું નિર્માણ કરાવ્યું.

અશોકના ગુણો અને તેનાં કાર્યોને લીધે તે ઈતિહાસમાં મહાન રાજ્યી તરીકે સ્થાન ધરાવે છે. ઈ.સ. પૂર્વ 232માં સમ્રાટ અશોકનું અવસાન થયું. તેણે 36 વર્ષ શાસન કર્યું.

### મૌર્યયુગનું વહીવટીતંત્ર :

ચંદ્રગુપ્ત મૌર્યએ વિશાળ સામ્રાજ્યનું નિર્માણ કર્યું. તેનો વિસ્તાર સમ્રાટ અશોકે કર્યો. વિશાળ મૌર્ય સામ્રાજ્યના વિભાગ પાડી તેનો સુવ્યવસ્થિત વહીવટ ચલાવવા માટેનું આયોજન ચંદ્રગુપ્તના મુખ્યમંત્રી અને પ્રખર રાજનીતિશ વિષ્ણુગુપ્ત ચાણક્ય (કૌટિલ્ય) દ્વારા કરવામાં આવ્યું હતું. આ સમયમાં વહીવટીતંત્રના ત્રણ વિભાગો (અંગો) હતાં.



## મૌર્યપુરુણનું વહીવટીતંત્ર

(અ) કેન્દ્રીય

(બ) પ્રાંતીય

(ક) પ્રાદેશિક (સ્થાનિક)

**(અ) કેન્દ્રીય વહીવટીતંત્ર :** સમ્રાટ (રાજા) શાસનવ્યવસ્થામાં કેન્દ્રસ્થાને હતો. તે સામ્રાજ્યનો વહીવટી, લશ્કરી અને ન્યાયતંત્રનો વડો હતો. તેનું પદ વંશપરંપરાગત હતું. પાટલીપુર અને તેની આજુભાજુનો પ્રદેશ સમ્રાટના સીધા અંકુશ હેઠળ હતો. તે મંત્રીઓ અને ઉચ્ચ અધિકારીઓની મદદથી વહીવટ ચલાવતો. ચાણક્ય (કોટિલ્ય)એ કુલ 18 ખાતાઓ દર્શાવ્યાં છે, જેમાંથી મુખ્ય ખાતાઓ અને તેના ઉપરી (વડા) નીચે મુજબ છે :

ક્રમ	ખાતું (વિભાગ)	ઉપરી (વડા)
1.	ખેતી વિભાગ	સીતાધ્યક્ષ
2.	લશ્કર ખાતું	સેનાની
3.	ન્યાય ખાતું	પ્રદેશત્રી (મુખ્ય ન્યાયાધીશ)
4.	વ્યાપાર ખાતું	પણ્યાધ્યક્ષ
5.	દફતર ભંડાર (અક્ષપટલ/રેકર્ડ ખાતું)	મહાઅક્ષપટલ
6.	મુદ્રા (પાસપોર્ટ) ખાતું	મુદ્રાધ્યક્ષ

**(બ) પ્રાંતીય વહીવટીતંત્ર :** વિશાળ મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર પાંચ વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું.

પ્રાંત (મંડળ/વિભાગ)ના વડા તરીકે રાજ્યપાલ (રાજ્યીય) હતો. આ પદ પર મોટે ભાગે રાજકુમારોની નિમણૂક કરવામાં આવતી. રાજ્યપાલનું કાર્ય સમગ્ર પ્રાંતમાં શાંતિ-વ્યવસ્થાની જગ્યાની કરવી, કરવેરા ઉઘરાવવા, રાજના આદેશોનું પાલન કરાવવું અને પ્રાંતમાં બનતા બનાવોથી સમ્રાટ (કેન્દ્ર)ને સતત વાકેફ રાખવાનું હતું.

**(ક) પ્રાદેશિક (સ્થાનિક) વહીવટીતંત્ર :** વહીવટી સરળતા માટે કોઈપણ પ્રાંતને આહાર (જિલ્લા/સ્થાનીય) અને આહારને પ્રદેશ (સંગ્રહણ/તાલુકા)માં વહેંચવામાં આવતો. આહારનો અધિકારી રાજુક (આહારપત્ર/સ્થાનિક) અને પ્રદેશનો અધિકારી પ્રાદેશિક (ગોપ) કહેવાતો. વહીવટીતંત્રનું નાનામાં નાનું એકમ ગ્રામ હતું. તેનો ઉપરી ગ્રામજી કહેવાતો. ગામના ચૂંટાયેલા સભ્યોની સમિતિની મદદથી ગ્રામજી ગ્રામનો વહીવટ ચલાવતો.

### સમ્રાટ અશોકના ઉત્તરાધિકારીઓ તથા મૌર્યવંશનું પતન :

સમ્રાટ અશોકના મૃત્યુ બાદ તેના ઉત્તરાધિકારીઓ વિશે બ્રાહ્મણ, જૈન અને બૌધ્ધ ગ્રંથોમાંથી જુદી-જુદી માહિતી મળે છે. પુરાળોમાં આપેલ માહિતી મુજબ મૌર્યવંશમાં થઈ ગયેલ કુલ 9 કે 10 રાજાઓએ કુલ મળી 137 વર્ષ શાસન કર્યું હતું. મૌર્યવંશના અંતિમ રાજ બૃહદ્રથના નિર્બણ શાસનનો લાભ લઈ તેના સેનાપતિ પુષ્યમિત્ર શુંગે લશ્કરી કવાયત જોવાના બહાને બોલાવી તેની હત્યા કરી. આમ, ઈ.સ. પૂર્વ 185માં પુષ્યમિત્ર શુંગે મગધની ગાઢી પર શુંગવંશની સ્થાપના કરી મૌર્યવંશનો અંત આપ્યો.



स्वाध्याय

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :



## 2. ટુંકમાં ઉત્તર આપો :

- (1) સમાટ અશોકનું વિશાળ સામ્રાજ્ય ક્યાં સુધી કેલાયેલું હતું ?
  - (2) સેવ્યુક્સ નિકેતર સાથેના યુદ્ધ બાદ ક્યાં પરિણામો આવ્યાં ?
  - (3) મૌર્ય સામ્રાજ્યને વહીવટી સરળતા ખાતર કેટલા વિભાગમાં વહેંચવામાં આવ્યું હતું ?
  - (4) અશોકે ગૌતમ બુદ્ધના કયા-કયા સિદ્ધાંતોના પ્રચાર પર ભાર મૂક્યો ?
  - (5) રાષ્ટ્રીય તરીકે નિમાયેલ અધિકારીનાં કાર્યો જણાવો.

3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

- (1) મેગેસ્થનીસ દ્વારા ઈન્ડિકા અને કલહણ દ્વારા મુદ્રારાક્ષસની રચના કરવામાં આવી હતી.
  - (2) ધર્મ મહામાત્રાનું કાર્ય જૈનધર્મનો પ્રચાર કરી પ્રજાનું નૈતિક ધોરણ ઊંચું લાવવાનું હતું.
  - (3) ચંદ્રગુપ્તે પોતાનો અંતિમ સમય શ્રવણબેલગોડામાં વિતાવ્યો હતો.
  - (4) બિંદુસારના સમયમાં મગધ મૌર્ય સામ્રાજ્યમાંથી સ્વતંત્ર થઈ ગયું.
  - (5) અશોકે ઉપગૃહતના ઉપદેશને અનુસરીને બૌદ્ધધર્મ અંગીકાર કર્યો.



P2M3Z4

ઈસુની ત્રીજી સદીમાં મગધમાં પ્રભાવશાળી ગુપ્તવંશની સત્તા સ્થપાઈ. ગુપ્તવંશે ભારતમાં રાજકીય એકતા, શાંતિ અને સુરક્ષા સ્થાપી. તેનાથી અપૂર્વ સમૃદ્ધિ આવી. આથી ગુપ્તયુગને ભારતનો 'સુવર્ણયુગ' કહેવામાં આવે છે. સુવર્ણયુગ એટલે દેશની સમગ્ર પ્રજાની સર્વोત્કૃષ્ણ પ્રગતિ-આબાદી. ગુપ્ત સમ્રાટોએ લોકોને શાંતિ અને સમૃદ્ધિ આપી. જેની પ્રશંસા વિદેશી મુસાફરોએ પણ કરી છે. ગુપ્તયુગનો સુવર્ણયુગ ઘણે અંશે ગુપ્ત સમ્રાટોનું સર્જન હતું.

### ચંદ્રગુપ્ત (પહેલો)

મગધના સામ્રાજ્યમાં શ્રીગુપ્ત ગુપ્ત વંશનો સ્થાપક હતો. તેના પુત્રનું નામ ઘટોટકચ ગુપ્ત હતું. ઘટોટકચ ગુપ્તના અનુગામી રાજા તરીકે ચંદ્રગુપ્ત પ્રથમ (ઈ.સ. 319) પાટલીપુત્રની ગાદીએ આવ્યો. તેણે શક્તિશાળી લિંગવી જાતિની કન્યા કુમારદેવી સાથે લગ્ન કર્યા. લિંગવીઓની સહાયથી તેણે મગધના રાજ્યનો વિસ્તાર કર્યો. તેણે મગધની પાસેના પ્રયાગરાજ (અલાહાબાદ), સાકેત (અયોધ્યા) જીતી લઈ મગધનો વિસ્તાર વધાર્યો. તેણે મહારાજને બદલે 'મહારાજાધિરાજ' જેવું ગૌરવપ્રદ બિરુદ્ધ ધારડા કર્યું હતું. તેણે પોતાની સત્તા અને પ્રતિષ્ઠાની પ્રતીતિ કરાવવા સોનાના સિક્કા બહાર પડાવ્યા હતા. તેનો રાજ્યાભિષેક થયો ત્યારથી તેણે ગુપ્ત સંવત શરૂ કરાવ્યો. સૌરાષ્ટ્રના વલભી રાજ્યના શાસકોએ પણ આ ગુપ્ત સંવતનો સ્વીકાર કર્યો હતો. ગુપ્ત સંવતના આરંભના કારણે હિંદના ઈતિહાસમાં કાળગણના અને કાળકમ અનુસાર ઐતિહાસિક બનાવોની ગોઠવણી શક્ય બની.

### સમ્રાટ સમુદ્રગુપ્ત

ચંદ્રગુપ્ત પ્રથમ પછી તેનો પ્રતાપી પુત્ર સમુદ્રગુપ્ત ગાદીએ આવ્યો. સમુદ્રગુપ્તના સમયની માહિતી પ્રયાગરાજના સ્તંભલેખ (પ્રયાગ-પ્રશસ્તિ) અને તેના સિક્કાઓમાંથી મળે છે. આ પ્રશસ્તિ રાજકવિ હરિષેણે રચી છે. તેમાં સમ્રાટ સમુદ્રગુપ્તના દિવિજયો અને સાંસ્કૃતિક સિદ્ધિઓ વર્ણવી છે. તેણે ખૂબ જ ઓછા સમયમાં ઉત્તર ભારતના મોટા ભાગનાં રાજ્યોથી માંડી અફધાનિસ્તાનના કુશાણ શાસનતંત્ર સુધી તેની વિજયયાત્રા કરી હતી. દક્ષિણમાં લગભગ બાર જેટલા રાજાઓને હરાવ્યા. તેણે આ રાજાઓને હરાવીને તેમનાં રાજ્યો ખાલસા કરવાને બદલે તેઓને ખંડિયા રાજાઓ તરીકે ડહાપણપૂર્વક પુનઃ સ્થાપિત કર્યા. રાજ્યનો વહીવટ ચલાવવા રાજ્યપાલો અને અધિકારીઓની નિમણૂક કરવામાં આવતી.

સમુદ્રગુપ્ત મહાન વિજેતા અને સંસ્કારી સમ્રાટ હતો. તેની સાહિત્યિક સિદ્ધિઓ તથા ચારિત્ર્ય પણ નોંધપાત્ર હતા. તેણે અનેક કાવ્યોની રચના કરી કવિરાજનું બિરુદ્ધ મેળવ્યું હતું. કમનસીબે તેનું આજે એક પણ કાવ્ય મળતું નથી. એક સિક્કામાં સમુદ્રગુપ્તને વીજા વગાડતો દર્શાવવામાં આવ્યો છે જે તેનો સંગીતપ્રેમ દર્શાવે છે.

તેના શાસનકાળ દરમિયાન અનેક મંદિરો, બૌદ્ધ વિહારો અને જૈન ઉપાશ્રયો બંધાયાં હતાં. તેણે અશ્વમેધ યજ્ઞ કર્યો હતો. આ સંદર્ભે તેણે સિક્કા પડાવ્યા હતા. તેણે પોતાના દરબારમાં વિદ્વાનોને એકત્રિત કરી ઉચ્ચ પ્રકારનું સાહિત્ય સર્જન કરાવ્યું હતું. જ્ઞાનીઓ તેની અને તે જ્ઞાનીઓની સોબત ઈચ્છતા હતા. તેણે હિંદુ ધર્મને ઉત્તેજન આપ્યું હતું. તેણે સામાજિક રીત-રિવાજોને સ્વીકાર્ય હતા. પ્રાચીન ભારતના ઈતિહાસમાં સમુદ્રગુપ્તનું સ્થાન વિશિષ્ટ અને નોંધપાત્ર છે. ગુપ્ત સામ્રાજ્યની મહત્તમાનો તે સર્જક હતો.



### 7.1 ગુપ્ત શાસન સમયના સિક્કા

#### સમ્રાટ ચંદ્રગુપ્ત બીજો-વિકમાદિત્ય


સમુદ્રગુપ્તનું અવસાન થયું. તેના સ્થાને ચંદ્રગુપ્ત બીજો ગાડી ઉપર આવ્યો. તેણે પિતાએ વારસામાં આપેલા વિશાળ સામ્રાજ્યને સફળતાપૂર્વક સાચવ્યું, એટલું જ નહિ પણ કેટલાક વિજયો મેળવીને સામ્રાજ્યનો વિસ્તાર વધાર્યો.

ચંદ્રગુપ્ત બીજો ગુપ્તવંશનો સૌથી પ્રતિભાશાળી શાસક હતો. તેના સામ્રાજ્યની સરહદો શક રાજ્ય સુધી વિસ્તરેલી હતી. તેણે ગુજરાત ઉપર હુમલો કરી શક-ક્ષત્રપ વંશના રાજ્યનો અંત આપ્યો. આ વિજયની યાદમાં ‘શકારિ’ બિરુદ્ધ ધારણ કર્યું. તે ‘વિકમાદિત્ય’ પણ કહેવાયો.

તેણે ત્રણસો વર્ષથી પગદ્દો જમાવીને બેઠેલા શક-ક્ષત્રપોને હાંકી કાઢવા માટે શક્તિશાળી રાજ્યો સાથે લગ્નસંબંધો બાંધી તેમની મદદથી પોતાનું સૈન્યબળ વધાર્યું. આ લગ્નસંબંધો તેને પોતાના સામ્રાજ્યના વિસ્તારમાં અને દુઃખનોને મહાત કરવામાં ખૂબ ઉપયોગી થયા. તેણે જાતેલો નવો પ્રદેશ ઘણો જ અગત્યનો હતો. ગુજરાત અને સૌરાષ્ટ્રના સમૃદ્ધ પ્રદેશો, બૃગુકષ્ય (ભરુચ) અને સતંભતીર્થ (ખંભાત)નાં ધીકતાં બંદરો ગુપ્ત સામ્રાજ્યને મળ્યાં. પરિણામે રાજ્યનો દરિયાઈ વેપાર ખૂબ વધ્યો અને ગુપ્ત રાજાઓ અખૂટ સંપત્તિના માલિક બન્યા.



M6D4C7



### 7.2 ગુપ્તશાસિત ભારતનો નકશો

ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલા ચીની યાત્રાણું ફાહિયાને ગુપ્ત રાજ્યવહીવટના અને ગુપ્ત સામ્રાજ્યની સમૃદ્ધિનાં વખાશ કર્યા છે. ચંદ્રગુપ્ત બીજો વૈષ્ણવધર્મી હોવા છતાં અન્ય ધર્મો પ્રત્યે ખૂબ આદરભાવ ધરાવતો હતો. તેનો સેનાપતિ આમ્રકારદેવ બૌદ્ધ ધર્મી અને રાજ્યમંત્રી વરસેન શૈવધર્મી હતો. રાજ્યાની પાટલીપુત્રમાં પણ અનેક બૌદ્ધ મઠો આવેલા હતા.

તેના શાસનકાળ દરમિયાન મેળવેલ સાંસ્કૃતિક સિદ્ધિઓને કારણે જ ગુપ્તયુગ સુવર્ણયુગ બની શક્યો. તે વિદ્વાનો અને કવિઓનો આશ્રયદાતા હતો. સંસ્કૃત ભાષાના મહાન કવિ અને નાટ્યલેખક કાલિદાસ તેના રાજકવિ હતા. ધનવંતરિ તેના રાજવૈદ્ય હતા. વૈજ્ઞાનિક વરાહમિહિર, વैતાલભણ, અમરકોષના રચયિતા અમરસિંહ જેવાં રત્નોથી તેનો રાજદરબાર શોભતો હતો. તેના સમયમાં શિલ્પ, સ્થાપત્ય અને ચિત્રકલાનો સુંદર વિકાસ થયો. અજંતાના ઘણા કલાપમંડપો તેના સમયમાં તૈયાર થયા. તેણે રાજ્યાની પાટલીપુત્રમાં અનેક બૌદ્ધમઠો બંધાવ્યા હતા. દિલ્હી પાસેનો મેહરૌલી લોહસ્તંભ તેના સમયમાં સ્થપાયો. જેને સદીઓ સુધી તાપ અને વરસાદમાં રહેવા છતાં કાટ લાગ્યો નથી.

તેણે પાટલીપુત્ર ઉપરાંત ઉજ્જૈનને બીજી રાજ્યાની બનાવી. તેણે રાજ્યને જુદા-જુદા વહીવટી એકમોમાં વહેંચી સુવ્યવસ્થિત વહીવટ ચલાવ્યો. લગભગ ઈ.સ. 414ના અરસામાં મહાન સમાટ ચંદ્રગુપ્ત-વિકમાદિત્યનું અવસાન થયું.



7.3 મેહરૌલી લોહસ્તંભ

#### ગુપ્ત સામ્રાજ્યનો અંત

ચંદ્રગુપ્ત બીજાના અવસાન પછી તેનો પ્રતાપી પુત્ર કુમારગુપ્ત પહેલો ગાદીએ આવ્યો. તેના સમયમાં નાલંદાની પ્રસિદ્ધ બૌદ્ધ વિદ્યાપીઠ અને અજંતાની કેટલીક ગુફાઓ તેના સમયમાં તૈયાર થઈ.



7.4 નાલંદા વિદ્યાપીઠ



7.5 અજંતાની ગુફાઓ

કુમારગુપ્ત પહેલા પછી તેનો વીરપુત્ર સંદ્રગુપ્ત ગાદી પર બેઠો. સંદ્રગુપ્ત પછીના નિર્બળ શાસકો ઝનૂની અને શક્તિશાળી હૂણોના આકમણાને ખાળી શક્યા નહિ અને ગુપ્ત સામ્રાજ્ય (ઈ.સ. 550માં) છિન્ન-ભેન્ન થઈ ગયું.

#### ગુપ્તયુગની શાસન-વ્યવસ્થા

ગુપ્તયુગનાં શાસનતંત્ર વિશે આપણાને અભિલેખો, સ્મૃતિઓ અને પુરાણોમાંથી માહિતી મળે છે. તે પ્રમાણે

શાસનતંત્ર કેન્દ્રીય, પ્રાંતીય અને સ્થાનિક એમ ગ્રાણ વિભાગોમાં વહેંચાયેલું હતું.

ગુપ્ત શાસનતંત્રમાં સમ્પ્રાટ વહીવટીતંત્રના કેન્દ્રસ્થાને હતા. તેઓ મહારાજાવિરાજ, પરમ ભાગવત જેવાં બિરુદ્ધો ધરાવતા હતાં.

### જેવું

વહીવટીતંત્રમાં મુખ્ય સેનાપતિ ‘મહાબલાધિકૃત’, વિદેશમંત્રી ‘મહાસંધિવિગ્રહક’, મહેલો અને દ્વારોના રક્ષકોના વડા ‘મહાપ્રતિહાર’ કહેવામાં આવતા. ‘મહાઅશ્વપતિ’ એ ઘોડેસવાર સેનાના વડા અને ‘મહાપિલૂપતિ’ એ હાથીની સેનાના વડા હતા. રાજ્યના દસ્તાવેજો સાચવવા માટે પુસ્તપાલની નિમણૂક કરવામાં આવતી.

પ્રાંતના વડા તરીકે મોટેભાગે રાજકુમારને મૂકવામાં આવતા. કુમારામાત્ર અને આયુક્ત પ્રાંતમાં મુખ્ય ભૂમિકા ભજવતા. પ્રાંતને ભુક્તિ કહેવામાં આવતું. જેના વડા પ્રાદેશિક હતા. પ્રાંતને જિલ્લામાં વહેંચવામાં આવતું. જિલ્લાને ‘વિષય’ કહેવામાં આવતો.

ગ્રામકક્ષાએ સમિતિ બનાવવામાં આવતી. જેમાં વડીલો, ગામના મુખી અને અગત્યના વયસ્ક નાગરિકોનો સમાવેશ કરવામાં આવતો.

### ગુપ્તયુગની આર્થિક સ્થિતિ

ગુપ્તયુગ આર્થિક પરિસ્થિતિમાં ભારતનો સુવર્ણયુગ હતો. ઐતી, આંતરિક વેપાર અને આંતરાષ્ટ્રીય વેપાર ખૂબ વિકસ્યો હતો. વિશિષ્ટ જેતપદ્ધતિઓમાં વાર્ષિક, ત્રિ-વાર્ષિક અને પંચવાર્ષિક જેતપદ્ધતિઓ જોવા મળેલ છે. ઉત્તર ભારતમાં ઘઉ, ચોખા, ગાંધારમાં શેરડી, કશ્મીરમાં દ્રાક્ષ અને કેસર તથા કામરૂપમાં નાળિયેર થતાં. બંગાળમાં પુષ્કળ પ્રમાણમાં ચોખા થતા. ગુજરાતમાં અને સિંધમાં કપાસનો પાક અને બંગાળમાં રેશમનું ઉત્પાદન થતું. દક્ષિણ ભારતમાં મરી-મસાલા, રેશમ અને કપાસનો વેપાર વિકસ્યો હતો.



રાજા કુલ ઉત્પાદનનો છઠો ભાગ કર તરીકે લેતા હતા. બ્રાહ્મણો અને મંદિરોને ભૂમિ દાનમાં આપવામાં આવતી હતી. આંતરાષ્ટ્રીય વેપાર એ ગુપ્તયુગની વિશેષતા છે. ભારતથી સ્થળ માર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલા નિકાસ થતા. તો ખંભાત, ભરુચ, સોપારા અને તામ્રલિપિ જેવાં આંતરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઈમારતી લાકડાંની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી.

### ધાર્મિક સ્થિતિ

ગુપ્તયુગમાં હિંદુર્ધર્મ અને સંસ્કૃતિ પૂર્ણ કળાએ ખીલેલા જોવા મળે છે. ગુપ્ત સમ્પ્રાટો વૈષ્ણવ ધર્મને રાજ્ય-ધર્મનો દરજાએ આપતા. પરિણામે વિષણુ, તેમના અવતારો શ્રીરામ અને શ્રીકૃષ્ણ આ સમયમાં મહદંશે પૂજાતા. લક્ષ્મી દેવી તરીકે બહુ જ જ્યાત થયા. આ જ સમયમાં રામાયણ અને મહાભારત તેમ જ પુરાણોનું પુનઃસંકલન થયું. શ્રીમદ્ ભગવદ્ગીતા આ સમયે ખૂબ મહત્વપૂર્ણ ગ્રંથ બન્યો.

વૈષ્ણવ ધર્મની જેમ જ શૈવર્ધર્મ પણ ગુપ્તકાળમાં વિકસ્યો હતો. દક્ષિણ ભારતમાં શૈવ સંતો ‘નયનાર’ કહેવાતા, જ્યારે વૈષ્ણવ સંતો ‘અલ્વાર’ કહેવાતા. મહિષાસુરમર્દિની (દુર્ગા)ની પૂજા પણ પ્રચલિત થઈ હતી. સૂર્ય અને

કાર્તિકેયની પૂજા પણ પ્રચલિત થઈ હતી.

ગુપ્તયુગમાં બૌદ્ધર્મ અને જૈનર્મનો પણ વિકાસ થયો હતો. સમુદ્રગુપ્ત બૌદ્ધર્મનો સંરક્ષક હતો. બૌદ્ધર્મના મહાયાન અને હિન્દુયાન પંથ વિકસ્યા હતા.

### ગુપ્તયુગીન સાંસ્કૃતિક સ્થિતિ

ગુપ્તયુગ સાંસ્કૃતિક રીતે ભારતનો સુવર્ણયુગ હતો. આ યુગમાં અનેક નવી ભાષાઓ ઉત્પન્ન થઈ હતી. કાલિદાસ, સંધુ સ્વામી, હરિસ્વામી અને રાણી વિજયા તથા આર્યસૂર આ સમયના મહત્વના સાહિત્યકારો હતાં. આ સર્વમાં કાલિદાસ સર્વશ્રેષ્ઠ હતા. કાલિદાસને ભારતના શેક્સપિયર કહેવામાં આવે છે. તેમણે ભારતીય મહાકાવ્યોની કથાવસ્તુ લઈ ‘અભિજ્ઞાનશાકુંતલમ્ભ’, ‘રઘુવંશમ્ભ’ અને ‘મેઘદૂતમ્ભ’ જેવાં મહાકાવ્યોની રચના કરી. ગુપ્તયુગ એ મંદિર સ્થાપત્યોની રચનાનો યુગ હતો. ગુજરાતમાં ગોપ, નચના કોઠારનું પાર્વતી મંદિર અને ઝાંસીનું મંદિર એ ભારતનાં સૌ પ્રથમ ઠંટેરી મંદિરો છે. ગુપ્તયુગ આ દિનિએ મંદિર-સ્થાપત્યની શરૂઆત દર્શાવે છે. દુર્ગા, બુદ્ધ, કૃષ્ણ અને શિવની મૂર્તિઓ આ કાળે મોટા પ્રમાણમાં બની.

### ગુપ્તયુગમાં વિજ્ઞાનની સ્થિતિ

મહાન વैજ્ઞાનિકોમાં આર્યભાત અને વરાહમિહિર આ સમયમાં થયા. આર્યભાતે શૂન્ય અને દશાંશપદ્ધતિની શોધ કરી. વરાહમિહિરે ‘બૃહદસંહિતા’ નામનો ખગોળશાસ્ત્રને લગતો મહત્વપૂર્ણ ગ્રંથ લખ્યો. વાગ્ભાતે આયુર્વેદ ક્ષેત્રે “અષ્ટાંગહદ્યસંહિતા” નામનો મહાન ગ્રંથ લખ્યો. આ કાળે મનુષ્યો અને પ્રાણીઓ માટે વૈદકશાસ્ત્ર વિકસ્યું હતું. હાથી-ધોડાની દવાઓ પણ શોધાઈ હતી. રસાયણશાસ્ત્રનો પણ ખાસ્યો વિકાસ થયો હતો. તેનું સર્વશ્રેષ્ઠ ઉદાહરણ દિલ્હી પાસે આવેલો મેહરોલીનો લોહસંંભ છે, જેને હજી સુધી કાટ લાગ્યો નથી.

### સમ્રાટ હર્ષવર્ધન

ગુપ્તયુગ પછી પ્રાચીન ભારતનાં મહત્વપૂર્ણ રાજ્યોમાં હર્ષવર્ધનનું રાજ્ય ગણાય છે. તેઓ થાણેશ્વરના પૂષ્પભૂતિ વંશના હતા. પ્રભાકરવર્ધનના પુત્ર રાજ્યવર્ધન અને હર્ષવર્ધન હતા. જ્યારે તેમની પુત્રી રાજ્યશ્રી હતી. રાજ્યશ્રી કનોજના રાજ ધ્રુવવર્માને પરણી હતી. ગૌડ રાજીવી શશાંક અને માલવરાજે રાજ્યશ્રીનું અપહરણ કરી રાજ્ય પર આકમણ કરતાં મોટી કટોકટી ઊભી થઈ. રાજ્યવર્ધનનું મૃત્યુ રાજ્યશ્રીને બચાવવા જતા થયું.

આવી કટોકટીબરી પરિસ્થિતિમાં ઈ.સ. 606માં સમ્રાટ હર્ષ રાજ્યારોહણ કર્યું. તેમણે રાજ્યશ્રીને બચાવ્યા. એટલું ૪ નહિ રાજ્યશ્રીનું રાજ્ય કનોજ અને થાણેશ્વર એમ બંને રાજ્યો પર પોતાનું યોગ્ય શાસન શરૂ કર્યું.

હર્ષવર્ધન પ્રાચીન ભારતના છેલ્લા મહાન સમ્રાટ હતા. તેમણે મગધ, ઓଡિશા, સારસ્વત, ગૌડ, મિથિલા સુધી પોતાનું સામ્રાજ્ય ફેલાવ્યું હતું. તેનાં સમકાલીન રાજ્યોમાં વલભીના મૈત્રક રાજ ધ્રુવસેન તેના જમાઈ હતા. દખ્ખાણમાં પુલકેશી બીજો સૌથી શક્તિશાળી રાજ હતો. હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે થયેલા નર્મદાના યુદ્ધમાં સમ્રાટ હર્ષનો પરાજ્ય થયો. હર્ષ મોટેભાગે નર્મદાથી ઉત્તરના શક્તિશાળી રાજ ગણાતા હતા.

સમ્રાટ હર્ષનું સાંસ્કૃતિક પ્રદાન બહુ ૪ અગત્યનું હતું. તેના સમયમાં મહાન ચીની યાત્રી યુઅન શવાંગ ભારત આવ્યા હતા. તેમના રાજદરબારમાં રહ્યા હતા. હર્ષ શૈવભક્ત હતા અને પણીથી બૌદ્ધર્મના મહાન અનુયાયી બન્યા. તેમણે કનોજમાં યુઅન શવાંગના અધ્યક્ષપદે એક ધર્મપરિષદનું આયોજન કર્યું. બુદ્ધની પ્રતિમાને હાથીની અંબાડી પર



Y1E5R9

મૂકી તેની પૂજા કરાવી, સ્થાપિત કરી હતી. મહાયાન અને હિન્દુયાન સંપ્રદાયો વિશે આ પરિષદમાં ગોઝી યોજાઈ હતી.

સમ્રાટ હર્ષ સાહિત્ય, કલા અને વિદ્યા પ્રત્યે અનુરૂગ રાખતો હતો. તેના દરબારમાં મહાન કવિ બાણભણ સંકળાયેલા હતા. જેમણે “હર્ષચરિતમ્” અને “કાદંબરી” જેવા સંસ્કૃત સાહિત્યના મહાન ગ્રંથો લખ્યા હતા. મયૂર ભજ અને કવિ જ્યસેન પણ હર્ષના સમયના મહાન કવિઓ હતા. સમ્રાટ હર્ષ પોતે પણ ઉચ્ચ કોટિના સાહિત્યકાર હતા. તેમણે ‘પ્રિયદર્શિકા’ અને ‘રત્નાવલી’ નામનાં બે નાટકોની રચના કરી હતી. સાથે-સાથે ભગવાન બુદ્ધની જાતક કથાઓ ઉપરથી ‘નાગાનંદ’ નામનું વિશિષ્ટ નાટક પણ લખ્યું હતું.

હર્ષ અન્ય દેશો સાથે પણ મૈત્રી સંબંધો બાંધ્યા હતા. તેણે પોતાના દૂત મંડળને ચીનમાં મોકલ્યા હતા. તે જ રીતે ચીનથી ભારતમાં ચીનના દૂતમંડળે મુલાકાત લીધી હતી. આ દિનિએ સમ્રાટ હર્ષ એક ઉચ્ચ કોટિના શાસક, વિજેતા, વહીવટીકર્તા અને સાહિત્યકાર હતા. તેમણે નાલંદા વિદ્યાપીઠને નિભાવવા માટે 100 ગામ ભેટમાં આપ્યાં હતાં.

## પુલકેશી બીજો

સમ્રાટ હર્ષના સમકાળીન રાજાઓમાં સૌથી શક્તિશાળી ચાલુક્યવંશી રાજ પુલકેશી બીજા હતા. તેમણે મહારાષ્ટ્રમાં રાષ્ટ્રકૂટો પાસેથી સત્તા આંચકી રાજ્ય સ્થાપ્યું. પુલકેશી બીજાએ 40 વર્ષ જેટલા લાંબા સમય સુધી શાસન કર્યું હતું. તેણે સમ્રાટ હર્ષને પણ હરાવ્યા હતા. તે મહાન વિજેતા હતા. તેણે દક્ષિણ ભારતના કંદંબો, માહેશ્વરના ગંગો, કોંકણના મૌર્યાને હરાવી ‘દક્ષિણપથના સ્વામી’નું બિરુદ્ધ પ્રામ કર્યું હતું. લાટ, માલવ અને ગુર્જરોને પણ તેણે હરાવ્યા હતા. કર્ણાટક, મહારાષ્ટ્ર અને કોંકણ એ સમગ્ર વિસ્તારનો તે સ્વામી હતો.

હર્ષની જેમ તેણે પણ અન્ય દેશો સાથે સંબંધો વિકસાવ્યા હતા. તેણે દીરાનમાં પોતાના એક રાજદૂતને મોકલ્યો હતો. દીરાના શહેનશાહ ખુશરો બીજા તેના મિત્ર હતા.

## અન્ય રાજ્યો

આ સમયે અન્ય રાજ્યોમાં કાંચીના પલ્લવો, રાજસ્થાનના ગુર્જર પ્રતિદ્ધારો, વલભીના મૈત્રકો, દક્ષિણ ગુજરાતમાં ગુર્જરો, કશ્મીરમાં કર્કાટકો વગેરેનો સમાવેશ થાય છે. જેમાં કાંચીના પલ્લવો સ્થાપત્ય અને કલાને લીધે પ્રાભ્યાત થયા હતા. તેમણે બ્રહ્મા, વિષ્ણુ, મહેશની અનેક મૂર્તિઓ શિલાઓમાં કંડારી મંદિરો બંધાવ્યાં હતાં. મહાબલિપુરમ્ભૂના સમુદ્ર તટે રથમંદિરો બંધાવનારા પલ્લવોએ ભારતની સાંસ્કૃતિક સમૃદ્ધિમાં વધારો કર્યો છે. કાંજીવરમમાં તેમણે બંધાવેલું કૈલાશનાથ મંદિર તે સમયનું સૌથી શ્રેષ્ઠ મંદિર ગણાવી શકાય.



સ્વાધ્યાય

### 1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

- (1) ગુપ્તવંશનો સ્થાપક કોણ હતો ?  
(A) શ્રીગુપ્ત      (B) ચંદ્રગુપ્ત પહેલો      (C) સમુદ્રગુપ્ત      (D) ચંદ્રગુપ્ત બીજો

- (2) સિક્કામાં કયા રાજને વીજા વગાડતો દર્શાવવામાં આવ્યો છે?
- (A) સમુદ્રગુપ્ત                    (B) ચંદ્રગુપ્ત બીજો                    (C) સુંદરગુપ્ત                    (D) કુમારગુપ્ત
- (3) દિલ્હી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું ?
- (A) ચંદ્રગુપ્ત બીજો                    (B) સુંદરગુપ્ત                    (C) સમુદ્રગુપ્ત                    (D) ચંદ્રગુપ્ત પછેલો
- (4) કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી ?
- (A) વલભી                            (B) નાલંદા                            (C) વિક્રમશીલા                    (D) કાશી

## 2. દ્વીકમાં ઉત્તર આપો :

- (1) કયા સમ્રાટના સમયમાં ગુપ્તયુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો ?
- (2) “હર્ષચરિતમ્”ના લેખક કોણ હતા ?

## 3. ‘અ’ વિભાગની વિગતો ‘બ’ વિભાગની વિગતો સાથે યોગ્ય રીતે જોડી ઉત્તર આપો :

- | અ                  | બ                     |
|--------------------|-----------------------|
| (1) મુખ્ય સેનાપતિ  | (a) વિષય              |
| (2) જિલ્લા         | (b) ઉત્પાદનનો છઢો ભાગ |
| (3) કર             | (c) મહાબલાધિકૃત       |
| (4) બાણભંડ         | (d) ખુશરો             |
| (5) ઈરાનના શહેનશાહ | (e) અષ્ટાંગહદ્ય       |





## 8

# ભારતવર્ષની ભવ્યતા

પાણાણકળથી લઈને લગભગ આઈમી સદી સુધીના પ્રાચીન ભારતના ઈતિહાસનું આપણે અધ્યયન કર્યું. વિભિન્ન કળની સંસ્કૃતિ, તેના શાસકો વિશે આપણે માહિતી મેળવી. ભારત એક ઉપખંડ જેટલું મોટું રાષ્ટ્ર છે. પ્રાચીનકળથી અનેક જાતિ, પ્રજાતિઓ, સમૂહો આ દેશની સમૃદ્ધિથી આકર્ષાઈ આ દેશમાં આવતા રહ્યા છે. જેના કારણે ભારતીય સંસ્કૃતિમાં વિવિધતાનો સંગમ રચાયો છે. જવાહરલાલ નેહરુ જેને વિવિધતામાં એકત્ર કહે છે તેવા આ મહાન દેશની કલા અને સ્થાપત્ય તથા સમાજજીવનની આપણે માહિતી મેળવીશું. જેનાથી પ્રાચીન ભારતની પ્રજાના ગૌરવશાળી વારસાની આપણાને માહિતી મળી શકે.

### પ્રાચીન ભારત : ખેતી

આપણા દૈનિક જીવનની મોટાભાગની ખોરાક માટેની તેમજ વપરાશની વસ્તુઓ આપણાને ખેતપેદાશોમાંથી મળે છે.

ખેતીની શરૂઆત પ્રાચીન ભારતમાં થઈ હતી. તે સમયમાં પણ ખેતી માટે વિવિધ ઓઝારો અને સિંચાઈની વ્યવસ્થા હતી.

પ્રાચીન સમયમાં ઘઉં, જવ, ડાંગર, જુવાર, બાજરી, તલ, વરાણા વગેરેની ખેતી થતી હતી.

**ઓઝારો :** હડપા સંસ્કૃતિમાં ખેતઓઝારોમાં હળના અવશેષ મળ્યા નથી. પરંતુ હળ આકારનું રમકડું મળ્યું છે તેથી જાણી શકાય છે કે તેઓ ખેતીમાં હળનો ઉપયોગ કરતા હતા.

આશરે 2500 વર્ષ પહેલાંના સમયથી ખેતી માટે લોખંડાંનાં સાધનોનો ઉપયોગ વધતો જતો હતો. તેમાં જંગલોને સાફ કરવા માટે કુહાડીઓ, હળનાં ફણાં (ફાલ)નો પણ સમાવેશ થાય છે. આ ઉપરાંત દાતરડું, કુહાડાથી તેઓ પરિચિત હતા.

**સિંચાઈ :** સમૃદ્ધ ગામડાંઓ વગર રાજાઓ અને તેમના રાજ્યનું ટકી રહેવું મુશ્કેલ હતું. જે રીતે ખેતીના વિકાસ માટે નવાં સાધનો અને ધરુરોપણ મહત્વપૂર્ણ પગલાં હતાં, તેવી જ રીતે સિંચાઈવ્યવસ્થા પણ ઘણી ઉપયોગી સાબિત થઈ. આ સમયે સિંચાઈ માટે નહેરો, કૂવા, તળાવો તથા કૂત્રિમ જળાશયો બનાવવામાં આવ્યાં.

### પ્રાચીન ભારત : ગ્રામીણ જીવન

ઉત્તર ભારત અને દક્ષિણ ભારતમાં ગ્રામીણ જીવન આ પ્રમાણે હતું. ભારતના ઉત્તરભાગના ગામનો વડો ગ્રામબોજક કહેવાતો. સામાન્ય રીતે એક જ પરિવારના લોકો આ પદ પર પેઢીઓ સુધી રહેતા. આ પદ વંશપરંપરાગત હતું. ગ્રામબોજક મોટાભાગે ગામનો સૌથી મોટો જમીનમાલિક હતો. આ જમીનમાલિક ભાડૂતી માણસો રાખી ખેતી કરાવતો હતો. રાજા પણ ગામડાંના કરવેરા ઉધરાવવાનું કાર્ય તેમને સોંપત્તા. તે કાયદા અને વ્યવસ્થાની સ્થિતિ પણ સંભાળતા.

દક્ષિણ ભારતમાં ત્રણ પ્રકારના લોકો રહેતા હતા : મોટા જમીનદારો, નાના ખેડૂતો અને જમીનવિહોણા મજૂર (દાસ).

**નગરજીવન :** મોટાભાગનાં શહેરો 2500 વર્ષ પહેલાં મહાજનપદોની રાજ્યાની હતાં. આ શહેરો કિલ્લાબંધીથી સુરક્ષિત હતાં. ઘણાં શહેરોમાંથી વલયકૂપ પ્રાપ્ત થયા છે, જે કૂવા તરીકે ઓળખાતા. આ વલયકૂપ શૌચાલય, નીક અથવા કચરાપેટી માટે ઉપયોગમાં લેવાતા હતા.

ગ્રામીણ અને નગરના લોકો ખોરાકમાં ઘઉં, જવ, ચોખા, દૂધ, દહી, ઘી, ફળફળાદિ તથા માંસ-માછલીનો ઉપયોગ કરતાં.

પુરુષો અને સ્ત્રીઓ સામાન્ય રીતે બે વખ્તો પહેરતાં. શરીરના નીચેના ભાગનું વખ્ત ‘નિવિ’ અને ઉપરના ભાગનું વખ્ત ‘વાસ’ કહેવાતું. ક્યારેક ઉપરના વખ્ત ઉપર દુપણ જેવું ‘અવિવાસ’ લપેટતા.

## પ્રાચીન ભારતમાં કલા

ઈતિહાસવિદો કલાને બે ભાગમાં વહેંચે છે : (1) લલિતકલા અને (2) નિર્દર્શનકલા. લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલા વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે નિર્દર્શનકલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે. આપણે આ બાબતોને વિગતે જોઈશું.

## ભારતમાં સાહિત્યનો વારસો

ભારતીય સાહિત્ય ધાર્મિક, ધર્મતર અને વિદેશી મુસાફરોના વર્ણનો એમ ત્રણ ભાગમાં વહેંચાયેલું છે.



R9V7N7

**(A) ધાર્મિક સાહિત્ય :** ભારતના સૌથી પ્રાચીન ધાર્મિક સાહિત્યમાં વેદોનો સમાવેશ થાય છે. તેમની સંખ્યા ચાર છે : ઋગવેદ, યજુર્વેદ, સામવેદ અને અર્થવેદ. વેદોને સમજાવવા માટે બ્રાહ્મણ ગ્રંથો અને આરાધકોની રચના કરવામાં આવી. જેમાં શતપથ બ્રાહ્મણ, ગોપથ બ્રાહ્મણ અને બૃહદ્દારણ્યક સૌથી અગત્યના ગણાવી શકાય.

આ સિવાય રામાયણ અને મહાભારત એ બંને મહાકાવ્યો પ્રાચીન ભારતીય સમાજ, સંસ્કૃતિ અને ધર્મનો ત્રિવેણી સંગમ છે. વેદવ્યાસરચિત ‘મહાભારત’ પ્રારંભમાં ‘જ્ય સંહિતા’થી ઓળખાતું. જે વિકસતું જતા એક લાખ શ્લોકનું મહાભારત થયું. તે જ રીતે વાલ્મીકિ રચિત રામાયણમાં ભગવાન શ્રીરામની કથાની સાથે આદર્શ સમાજજીવન અને નૈતિક ધોરણોનું ચિત્રણ થયેલું છે.

108 જેટલાં ઉપનિષદ્દો ભારતીય ચિંતનના મહામૂલા ગ્રંથો છે. કઠ, કેન, પ્રશ્ન, મુંડક, માંડુક્ય, ઈશાવાસ્યમ્, અને છાંદોગ્ય ઉપનિષદ્દો ભારતના તત્ત્વજ્ઞાનના મહાન ગ્રંથો છે. પુરાણોની સંખ્યા 18 જેટલી છે. જેમાં વિષ્ણુપુરાણ, ગરુડપુરાણ, વાયુપુરાણ અને મત્સ્યપુરાણ તેમજ ભાગવત વિશિષ્ટ ગ્રંથો તરીકે જ્યાત થયા છે.

બૌધ્ધ અને જૈનધર્મના મહાન ગ્રંથોમાથી આપણાને સમાજજીવન અને ધર્મની માહિતી મળે છે. બૌધ્ધર્મના મૂળ ગ્રંથોને ‘ત્રિપિછ્છક’ કહેવાય છે. તેમાં ‘સૂત્ર (સૂત્ર) પિછ્છક’, ‘વિનયપિછ્છક’ અને ‘અતિધમપિછ્છક’નો સમાવેશ થાય છે. આ સિવાય જાતક કથાઓ, ‘દિવનિકાય’, ‘અંગુત્તરનિકાય’ અને ‘મજિજમનિકાય’ અગત્યના ગ્રંથો છે. નાગસેનનું મિલિન્દ પાન્ડો (પ્રશ્નો) અને આર્યમંજુષ્ઠી શ્રીમૂળકલ્પ અગત્યના બૌધ્ધ ગ્રંથો છે. તિષ્ણત ભાષામાં બૌધ્ધગ્રંથની ‘કઝાર’ અને ‘તંજર’ બે સંહિતા પ્રસિદ્ધ છે. જાતક કથાઓ, દિવનિકાય, મજિજમનિકાય પણ બૌધ્ધ ગ્રંથો છે. આ ઉપરાંત ‘બૃહદ્કથા’, ‘હરિવંશપુરાણ’, ‘વાસુદેવહિતી’, ‘સિદ્ધહેમશબ્દાનુશાસન’, ‘દ્વયાશ્રય’ અને ‘કીર્તિકૈમુદી’ મુખ્ય છે.

જૈનગ્રંથોને આગમ ગ્રંથો કહેવામાં આવે છે. આવા આગમ ગ્રંથોની સંખ્યા 12 છે. જૈનધર્મનું પ્રાચીન સાહિત્ય 14 પર્વ અને 12 અંગમાં વહેંચાયેલું છે. મુખ્ય ગ્રંથોમાં ‘આગમો’, ‘આચારઅંગ’ અને ‘વૈતાલિક દશાવૈતાલિક સૂત્ર’ અગત્યના છે.

**(B) ધર્મતર સાહિત્ય :** જેમની વિષયવસ્તુ ધર્મની બહાર છે તેવા સાહિત્યિક ગ્રંથો ધર્મતર સાહિત્ય તરીકે ઓળખાય છે. તેમાં મોટેભાગો કાવ્યો, નાટકો, પ્રશસ્તિઓ, વ્યાકરણ ગ્રંથો અને સ્મૃતિઓનો સમાવેશ થાય છે. આ સ્મૃતિઓ એ ભારતના કાયદાગ્રંથો છે. જેમાં મનુસ્મૃતિ, યાજ્ઞવળ્યસ્મૃતિ અને નારદસ્મૃતિનો સમાવેશ થાય છે. કૌટિલ્યનું અર્થશાસ્ત્ર પણ કાયદાગ્રંથ છે.

પ્રાચીન ભારતમાં મોટા પ્રમાણમાં નાટકો અને કાવ્યોની રચના થઈ છે. જેમાં મહાકવિ ભાસ, કાલિદાસ, શુદ્રક, ભારવિ જેવા મહાન સાહિત્યકારોનો સમાવેશ થાય છે. આવાં અગત્યનાં મહાકાવ્યો અને નાટકોમાં અભિજ્ઞાન શાકુંતલમ્બ, રઘુવંશમ્બ, મેઘદૂતમ્બ, કિરતાર્જુનીયમ, સ્વખવાસવદ્ધતમ્બ અને મૃચ્છકટિકમ્બ વગેરેનો સમાવેશ થાય છે.

દક્ષિણ ભારતમાં એક વિશિષ્ટ સાહિત્ય જેને ‘સંગમ સાહિત્ય’ કહેવામાં આવે છે તેની રચના ઈ.સ.ની પ્રથમ ત્રણ સદીઓમાં થઈ હતી. મદુરાઈમાં ત્રણ સંગમ (સભા)માં 1600 જેટલા લોકકવિઓએ વીરકાવ્યોની રચના કરી. આ સાહિત્યમાં શિલપ્પદિકારમ્બ, મણિમેખલાઈ ખૂબ જ અગત્યનાં છે.

સંસ્કૃત ભાષામાં સર્વશ્રેષ્ઠ વ્યાકરણગ્રંથ પાણિનિનું ‘અષાધ્યાયી’ છે. જે ઈ.સ. પૂર્વ પાંચમી સદીમાં રચાયું હતું. અશોકના શિલાલેખો પણ પ્રાચીન ભારતના ઈતિહાસ મૌર્ય સામ્રાજ્યનાં વહીવટીતંત્રો તથા બૌદ્ધર્મના નૈતિક નિયમો વિશે માહિતી આપે છે.

ગુપ્તકાળમાં પ્રશસ્તિ કાવ્યો અને ગ્રંથોનો ઘણો વિકાસ થયો. સમુદ્રગુપ્તની ‘પ્રયાગ પ્રશસ્તિ’ના લેખક હરિષેણ હતા. તો ઉદ્યગિરિની ચંદ્રગુપ્ત દ્વિતીયની પ્રશસ્તિના લેખક વીરસેન સાબા હતા. બાણે ‘હર્ષચરિતમ્બ’માં હર્ષની પ્રશસ્તિ કરી છે.

**(C) વિદેશી મુસાફરોનાં વર્ણનો :** ભારતમાં સદીઓથી અનેક વિદેશી પ્રવાસીઓ આવતા રહ્યા છે. જેમાણે પોતાના ભારત પ્રવાસનાં વર્ણનો લાખ્યાં છે. તેમની આ પ્રવાસનોંથોમાંથી ભારતીય સંસ્કૃતિ અને પ્રજાજીવનની માહિતી મળે છે. આવા મુસાફરોમાં ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં રહેલા ગ્રીક એલચી મેગેસ્થનિસ ખૂબ જ અગત્યના છે. તેમણે “ઈન્ડિકા” નામનો એક ઉત્કૃષ્ટ ગ્રંથ લખ્યો છે. જેમાં મૌર્યયુગ વિશે આપણાને માહિતી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે ગ્રીક નાવિક ટોલેમીએ ભૂગોળ વિશે લખેલા ગ્રંથમાં ભારતનાં બંદરો વિશેની માહિતી મળે છે. ચંદ્રગુપ્ત દ્વિતીયના સમયમાં આવેલ ચીનના મુસાફર ફાહિયાને અને સમ્રાટ હર્ષવર્ધનના સમયમાં આવેલ ચીની મુસાફર યુઅન શવાંગે તત્કાલિન ભારતીય સમાજજીવન, શાસકો અને સંસ્કૃતિનું અદ્ભુત ચિત્રાણ કરેલું છે.

### વેપારીઓ – નવા માર્ગો

પ્રાચીન સમયમાં ભારત વિવિધ ચીજવસ્તુઓ તેમજ વિદેશો સાથે વેપાર–વાણિજ્યમાં મોખરે હતું. વેપારના કારણે ભારતની આર્થિક સમૃદ્ધિ શિખરે હતી.

દેશ-વિદેશ સાથેનો વેપાર જમીનમાર્ગ અને સમુદ્રમાર્ગ થતો હતો. લોથલ હડપીય સંસ્કૃતિનું મોટું બંદર હતું. લોથલમાં બંદરની ગોદી-ડોકયાર્ડ-વહાણા ધક્કા અને વખારના અવશેષો મળ્યા છે, જે દરિયાઈ વાહન-વ્યવહારની માહિતી આપે છે.

લોથલના લોકો માટીકામના વિવિધ ઘાટનાં વાસણો અને વિવિધ પ્રકારના દરદાગીના બનાવતા. સેલખડી, ધીપ અને હાથીદાંતમાંથી બનાવેલ મણકાઓનો વેપાર થતો. ભારતના મરીમસાલા અને કીમતી પથ્થરોની વિશેષ માંગ રહેતી.

ભારતથી સ્થળમાર્ગ મધ્ય એશિયા થઈને યુરોપ સુધી સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને મસાલાની નિકાસ થતી. ખંભાત, ભરૂચ, સોપારા અને તામ્રલિપિ જેવાં આંતરરાષ્ટ્રીય બંદરોના માધ્યમથી વિશ્વના પૂર્વ અને પશ્ચિમ ભાગમાં સુતરાઉ કાપડ, રેશમી કાપડ, મસાલા, તેજાના, ઈમારતી લાકડાની નિકાસ થતી. જ્યારે સોનું, ચાંદી અને અન્ય ચીજોની આયાત થતી.

ચીનથી વેપાર અર્થે કેટલાક લોકો દૂરના વિસ્તારોમાં પગપાળા કે ઘોડા ઉપર જતા હતા. તેઓ સાથે રેશમ કાપડ પણ લઈ જતા હતા. તેઓ જે માર્ગ મુસાફરી કરતા હતા તે માર્ગ રેશમમાર્ગ (silk route) તરીકે જાણીતો બન્યો હતો. મુખ્યત્વે ચીન, ભારત, ઈરાન, અરબસ્તાન, ગ્રીક અને રોમના વેપારીઓ આ વેપારમાર્ગ સાથે સંકળાયેલા હતા.

દક્ષિણ ભારતનાં બંદરો કાળા મરી અને અન્ય તેજાનાની નિકાસ માટે જાણીતાં મુખ્ય કેન્દ્રો હતાં.

### પ્રાચીન ભારતમાં ચિત્રકલા

ચિત્ર મનુષ્યના મનોભાવને પ્રગટ કરતું વિશિષ્ટ માધ્યમ છે. સાથે-સાથે તે જે-તે સમયની વાસ્તવિક પરિસ્થિતિનું પણ ચિત્રણ કરે છે. ભારતમાં સૌથી જૂનાં ચિત્રો પાણાણયુગના મળી આવે છે. મધ્યપ્રદેશમાં ભીમબેટકા નામના સ્થળોથી પાણાણયુગના સમયની આદિમ જનજાતિએ દોરેલાં 500 કરતાં પણ વધારે ચિત્રો મળી આવેલ છે, જે આજે પણ એટલાં જ જીવંત છે.

આ સિવાય અજંતા, ઈલોરા અને બાધની ગુફાઓમાં તથા અમરાવતીમાં ભારતીય સંસ્કૃતિ સાથે સંકળાયેલાં ચિત્રો મોટાપ્રમાણમાં મળી આવે છે. અજંતા-ઈલોરાનાં ચિત્રો વિશ્વવિભ્યાત છે. જેમાં બુદ્ધની જાતક કથાઓને અને બુદ્ધની સાધનાને ચિત્રોમાં વ્યક્ત કરવામાં આવ્યા છે. પદ્મપાણિનું વિશ્વવિભ્યાત ચિત્ર ભારતીય સંસ્કૃતિનું ઘરેણું છે, તો ઈલોરાનું શિવ મંદિર એક જ શિલામાંથી કોતરેલું મહાન શિલ્પ છે.

### પ્રાચીન ભારતમાં શિલ્પ અને સ્થાપત્ય

હડ્ધીય સર્વત્તામાં જોવા મળતું નગરાયોજન એ ભારતીય સ્થાપત્યના વિશ્વપ્રસિદ્ધ નમૂના છે. એક સમાન નગરરચના, સ્નાનાગાર, અનાજના કોઠાર, ઔદ્ઘોગિક એકમો અને વરસાદી પાણીના પ્રબંધ સાથે સંકળાયેલાં અનેક સ્થાપત્યો હડ્ધીય સર્વત્તા સાથે સંકળાયેલા છે. જે પ્રાચીન ભારતનો ઈજનેરી કળાનો ઉત્તમ નમૂનો ગણાય છે. આ સ્થાપત્યોમાં ગુફા-સ્થાપત્ય, મંદિર-સ્થાપત્ય અને મહેલોનાં સ્થાપત્યોનો સમાવેશ થાય છે. ગુફા-સ્થાપત્યોમાં બારાબારની પહાડીઓ, નાસિકનાં ગુફાશિલ્પો, અજંતા-ઈલોરા અને અમરાવતીનાં ગુફાશિલ્પોનો સમાવેશ થાય છે.

શિલ્પકલામાં મૂર્તિકલાનો ભારતમાં પૂર્ણપણે વિકાસ થયો હતો. મૂર્તિકલામાં બે કલા શૈલીઓ પ્રાચીન ભારતમાં પ્રચલિત હતી : (1) ગાંધારકલા : જે ગ્રીક અને ભારતીય કલાશૈલીનો સંગમ હતી. ઉત્તર-પશ્ચિમ ભારતમાં અફધાનિસ્તાનમાં આવેલા તક્ષશિલા અને ગાંધારમાં આ કલાશૈલીના અનેક નમૂના મળ્યા છે. તેમાં બુદ્ધની મૂર્તિઓ મોટાપ્રમાણમાં બની હતી. બુદ્ધની વિશાળ પ્રતિમાઓ આ કલાશૈલીમાં બામિયાન અને ચારસડામાં જોવા મળે છે. (2) અન્ય કલાશૈલી સંપૂર્ણ ભારતીય છે, જે મથુરાકલા તરીકે ઓળખાય છે. તેમાં પણ સૌપ્રથમ બુદ્ધની મૂર્તિઓ બની. ત્યારબાદ મથુરા કલાશૈલીમાં હિન્દુ દેવી-દેવતાઓની મૂર્તિઓ બનવા લાગી. અમરાવતી, અજંતા, નાસિક, સારનાથમાં પણ મૂર્તિકલાના નમૂના પ્રાપ્ત થયા છે.

### સ્તૂપો અને વિહારો

બૌદ્ધર્મના સ્થાપત્યમાં સ્તૂપ, ચૈત્ય અને વિહારોનો સમાવેશ થાય છે. ગૌતમ બુદ્ધના નિર્વાણ બાદ તેમના જીવનની યાદગીરીરૂપે સ્તૂપનિર્માણ શરૂ થયું. સૌપ્રથમ વજ્જિસંધમાં આ સ્તૂપોનું નિર્માણ થયું. સ્તૂપ એટલે નાના ગુંબજ આકારનું (અંડાકાર) સ્થાપત્ય. જેમાં મધ્યમાં બુદ્ધના અવશેષોને દાબડામાં રાખવામાં આવતા અને બૌદ્ધ ધર્માઓ ત્યાં થાન ધરતાં. પછીથી સ્તૂપો ભારતમાં મોટાપ્રમાણમાં બનવા લાગ્યા. જેમાં અશોકનો સાંચીનો સ્તૂપ, લુખીનીનો સ્તૂપ, સારનાથનો સ્તૂપ ખૂબ જ અગત્યનો છે. અશોક પછીના સમ્રાટોએ પણ સ્તૂપ-નિર્માણની પરંપરાને જાળવી રાખી. સાંચીના સ્તૂપ ફરતે કાઢનિર્માણ કરવાનું કાર્ય શુંગવંશના રાજાઓએ કર્યું. કનિષ્ઠે પુરુષપુર (પેશાવર)ના એક વિશાળ



P3B4G5

સૂપ જેને ‘શાહજી કી ડેરી’ કહેવામાં આવે છે, તેનું નિર્માણ કરાયું. સૂપની આસપાસ પ્રદક્ષિણાપથ હોય છે. ચૈત્યો પણ પછીથી બૌદ્ધ કલાનું બહુ જ મોટું કેન્દ્ર બન્યા. ચૈત્યો ગુજરાની જેમ પર્વત કોતરીને બનાવવામાં આવતા. ચૈત્યોમાં ગુજરામાં જ હારબંધ સંભો, દરવાજા, વિશાળ પ્રાર્થનામંડપ વગેરે કોતરીને તેને મંદિરનો આકાર આપવામાં આવતો તથા પ્રાર્થનાગૃહ તરીકે તેનો ઉપયોગ થતો. સંભો ઉપર બારીક કોતરકામ કરવામાં આવતું. અમરાવતી, ભજ અને કાર્વીના ચૈત્યો વિશ્વવિભ્યાત થયા છે. બૌદ્ધ અને જૈન સાધુઓને રહેવા માટે પર્વત કોતરીને ગુજરાઓ બનાવવામાં આવતી અને તે સ્થળો વિહાર તરીકે ઓળખાતા. જૈન અને બૌદ્ધ સાધુઓ આ વિહારોમાં રહીને અધ્યયન કરતાં. યુઅનશવાંગે ઉત્તર ભારતમાં અને ગુજરાતમાં સો જેટલાં વિહારો હોવાનું નોંધ્યું છે. જૈન સ્થાપત્યકલા સાથે પણ મૂર્તિઓ અને વિહારો જોડાયેલાં છે. શ્રવણ બેલગોડામાં આવેલી ગોમતેશ્વરની જૈન મૂર્તિ વિશ્વવિભ્યાત છે. જૈનધર્મના સાધુઓ અને બૌદ્ધ ભિક્ષુઓના નિવાસ માટે પહાડોમાં સંખ્યાબંધ ગુજરાઓ બનાવવામાં આવી હતી. આવી ઘણી ગુજરાઓ ગુજરાતમાં આવેલી છે. જેની માહિતી તમારા શિક્ષક પાસેથી મેળવો.

## શિક્ષણનો વારસો

હડ્યુય સભ્યતાનો વિસ્તાર અને તેની વિકસિત નગરવ્યવસ્થા જોતાં એમ કહી શકાય કે, ભારતમાં ઉચ્ચ શિક્ષણ અને ટેક્નિકલ શિક્ષણ ચાર હજાર વર્ષથી અપાઈ રહ્યું છે. મોહેન્-જો-દોમાંથી શિક્ષણ સંસ્થાના અવશેષ પ્રાપ્ત થયા છે. આ સભ્યતા કાંસ્યસભ્યતા તરીકે પણ ઓળખાતી, એટલે કે તેઓ કાંસું બનાવવાની ટેક્નોલોજી જાણતા. આમ કહી શકાય છે કે રસાયણશાસ્ત્રનો વિકાસ થયો હશે. કિલ્લા, મકાનો, સ્નાનાગાર, રસ્તા સિવિલ ઇજનેરીટિંગનો વિકાસ દર્શાવે છે. કાપડવજાટ અને વહાણવટાનો વિકાસ દર્શાવે છે કે, યાંત્રિક ઇજનેરીટિંગ હડ્યુય સંસ્કૃતિના સમયથી જ ભારતમાં પાંગરતું રહ્યું છે.



પ્રાચીન ભારતમાં શિક્ષણ આપતી પાંચ વિદ્યાપીઠો જેને આપણે યુનિવર્સિટી કહી શકીએ તેના અવશેષો મળી આવ્યા છે. ઉત્તર પશ્ચિમ ભારતના ગાંધાર ક્ષેત્ર પાસે તક્ષશિલા મહાન શૈક્ષણિક તીર્થસ્થાન હતું. અહીં નીતિશાસ્ત્ર, સંસ્કૃત વ્યાકરણ, ખગોળ અને જ્યોતિષ, હિંદુ ધર્મ અને દર્શનનું શિક્ષણ અપાતું. પાણિનિ, ચાણકય, ચંદ્રગુપ્ત, જીવક જેવા મહાન દાર્શનિકો અને શાસકો આ જ શિક્ષણ સંસ્થામાંથી જ્યાતિ પામ્યા હતા.

બિહારમાં આવી જ એક શિક્ષણસંસ્થા નાલંદા વિદ્યાપીઠ તરીકે જ્યાત હતી. યુઅનશવાંગે પણ તેની મુલાકાત લીધી હતી. અહીંથી પણ હિંદુ અને બૌદ્ધ દર્શનશાસ્ત્રનું શિક્ષણ આપવામાં આવતું હતું. નાલંદા વિશ્વ વિદ્યાપીઠના આચાર્ય નાગાર્જુન મહાન રસાયણશાસ્ત્રી હતા. તેમણે પારાની ભસ્મ બનાવીને ઔષધિ તરીકે વાપરવાની શરૂઆત કરી.

ગુજરાતમાં છઢી-સાતમી સદીમાં વલભીમાં મહાન વિદ્યાપીઠ હોવાના પુરાવા પ્રાપ્ત થયા છે. તેના વિશે પણ યુઅન શવાંગે ખાસું લખાણ કર્યું છે. અહીંથા દૂર દેશાવરથી અનેક વિદ્યાર્થીઓ વિદ્યા પ્રાપ્ત કરવા આવતા. પ્રવેશ માટે વિદ્યાર્થીઓએ ‘પ્રવેશિકા’(પરીક્ષા) આપવી પડતી. ત્યારબાદ આચાર્યો લેખિત પરીક્ષા લઈ રૂબરૂ મુલાકાત સમાલાપ માટે આગળ મોકલતા. આવી આધુનિક કક્ષાની શિક્ષણપ્રક્રિયા તે સમયે ભારતમાં પ્રવર્તમાન હતી. અહીં હિંદુ, બૌદ્ધ અને જૈન એમ ત્રણેય ધર્મ, ચિંતન, જ્યોતિષ, ખગોળનું જ્ઞાન આપવામાં આવતું.

બંગાળમાં વિકમશિલા અને ઓદન્તપુરી નામની બે વિદ્યાપીઠો (યુનિવર્સિટી) અસ્થિત્વમાં હતી. જ્યાં બૌદ્ધધર્મ સાથે સંકળાયેલાં ત્રણ માળનાં વિશાળ પુસ્તકાલયો બનાવવામાં આવ્યાં હતાં.

## સિક્કા

ભારતનો ઈતિહાસ જાણવાનું એક અગત્યનું સાધન અને સમૃદ્ધિનું પ્રતીક સિક્કા છે. ભારતમાં સૌથી જૂના સિક્કા ઈ.સ. પૂર્વ પાંચમી સદીના ‘પંચમાર્ક કોઈન’ તરીકે ઓળખાય છે. ત્યારબાદ ઈન્ડોગ્રેન્ન રાજાઓએ, વિશિષ્ટ પ્રકારના સુવર્ણ સિક્કા શરૂ કર્યા. જેની ઉપર રાજાનું ચિહ્ન તેની આકૃતિ (ફોટો) અને તેનો સમય ઉલ્લેખિત થયો હતો.

તેનાથી આપણને તે સમયનો ઈતિહાસ જાણવા મળે છે. સૌથી શ્રેષ્ઠ સિક્કા ગુપ્તકાળના જોવા મળે છે. સમુદ્રગુપ્તના વીજાવાદન કરતા અને વ્યાપ્ત પરાક્રમ, ચંદ્રગુપ્ત પ્રથમનાં રાજારાજીના અને ગરુડના, ચંદ્રગુપ્ત દ્વિતીયના (વિકમાદિત્ય) અને સિંહવિકમના તથા ગરુડધ્વજના સિક્કા મોટાપ્રમાણમાં મળી આવેલા છે. આ સિક્કા મોટેભાગે સુવર્ણના છે, જેનાથી તે સમયની ભારતની અપાર સમૃદ્ધિની માહિતી મળે છે. ભારતનો સર્વાંગી વિકાસ સદીઓથી થતો રહ્યો છે. જ્ઞાનની લગભગ તમામ શાખાઓ આપણા દેશમાં ફૂલીફાલી અને વિકસી છે. ભારતનો મહાન સાંસ્કૃતિક વારસો સમગ્ર વિશ્વમાં અદ્વિતીય છે.

### સ્વાધ્યાય

#### 1. નીચેની ખાલી જગ્યામાં યોગ્ય શબ્દ મૂકી વાક્ય પૂર્ણ કરો :

- (1) નિર્દર્શન કલામાં ..... અને ..... નો સમાવેશ થાય છે.
- (2) દક્ષિણ ભારતનું વિશિષ્ટ સાહિત્ય ..... છે.
- (3) ચંદ્રગુપ્ત મૌર્યના દરબારમાં ..... ગ્રીક અલચી હતો.
- (4) મધ્યપ્રદેશમાં ..... સ્થળેથી પાખાણયુગનાં ચિત્રો મળી આવેલ છે.
- (5) ઈ.સ. પૂર્વે પાંચમી સદીના સિક્કાને ..... તરીકે ઓળખવામાં આવે છે.



#### 2. ટૂંકમાં ઉત્તર આપો :

- (1) વैદિક સાહિત્ય વિશે ટૂંકમાં જણાવો.
- (2) પ્રાચીન ભારતમાં કયા-ક્યા વિદેશી મુસાફરો/પ્રવાસીઓ આવ્યા હતા ?
- (3) સ્તૂપ અને ચૈત્યનો અર્થ જણાવો.
- (4) તક્ષશિલામાં કયા-ક્યા વિષયોનું શિક્ષણ આપવામાં આવતું હતું?
- (5) ગુપ્તવંશના કયા-ક્યા રાજવીઓના સિક્કાઓ મળી આવ્યા છે ?

#### 3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

- (1) ઉપનિષદોમાં માંક્ય, મત્સ્ય અને મુંડક ઉપનિષદોનો સમાવેશ થાય છે.
- (2) ગ્રીક નાવિક ટોલેમીએ લખેલા ‘ઈન્ડિકા’ નામના ગ્રંથમાંથી ભારતનાં બંદરો વિશેની માહિતી મળે છે.
- (3) ઈલોરાની ગુફામાં મળી આવેલા બુદ્ધની જાતકકથાઓનાં ચિત્રો જગવિષ્યાત છે.
- (4) ગાંધારશૈલીમાં ગ્રીક અને ભારતીય મૂર્તિકલાનો સંગમ જોવા મળતો હતો.
- (5) પ્રાચીન ભારતમાં ગાંધાર પ્રદેશમાં આવેલ નાલંદા વિદ્યાપીઠ જગવિષ્યાત હતી.

#### 4. ટૂંક નોંધ લખો :

- |                         |                               |
|-------------------------|-------------------------------|
| (1) ધર્મતર સાહિત્ય      | (2) પ્રાચીન ભારતનાં સ્થાપત્યો |
| (3) પ્રાચીન ભારતની જેતી | (4) ગ્રામીણ અને નગરજીવન       |





9

## આપણું ઘર : પૃથ્વી

આપણે જ્યાં રહીએ છીએ એ આપણું ગામ અને ઘર. આ બધું શાની ઉપર છે ? આવો મુજબ આપણાને સૌને થાય. જવાબ બહુ સાદો છે કે મારું ઘર અને ગામ પૃથ્વી પર આવેલું છે. એટલે પૃથ્વી આપણું વિશાળ ઘર કહેવાય. જે કેટલું વિશાળ છે, નહિ ?

તો ચાલો આપણા આ વિશાળ ઘર વિશે થોડુંક જાણીએ. તમને એ જાણવાનું મન થાય એ સ્વાભાવિક છે. તમને ખબર છે આપણી પૃથ્વી એ સૌરપરિવારનો એક સત્ત્ય છે. વળી પાછું આ સૌર પરિવાર એટલે શું ? ચાલો હું તમને સૌરપરિવારની સમજ આપું.

### સૌરપરિવાર (Solar System)

આપણો સૂર્ય મંદાકિની તારામંડળનો એક સ્વયંપ્રકાશિત તારો છે. આ તારાની આસપાસ નાના-મોટા સત્ત્યો ગોળારૂપે છે. આપણી પૃથ્વી એમાંનો એક ગોળો છે. આ તમામને આપણે ગ્રહો તરીકે ઓળખીએ છીએ. સૂર્યના ગુરુત્વાકર્ષણ અને જે-તે ગ્રહના ગુરુત્વાકર્ષણ બળના લીધે આ બધા ગ્રહો સૂર્યની આસપાસ વર્તુળાકાર સ્વરૂપે ફરે છે. આ ગ્રહોને પોતાનો કોઈ પ્રકાશ નથી, સૂર્ય પાસેથી મળતા પ્રકાશથી તે પ્રકાશે છે. સૌરપરિવારના આ ગ્રહો વિવિધ કંદ અને સ્વરૂપ ધરાવે છે. આ બધા ગ્રહો મળીને બને છે આપણું સૌરપરિવાર કે સૌરમંડળ.



M7Q5A9

આમ ગ્રહો, ઉપગ્રહો, લધુગ્રહો, ધૂમકેતુઓ અને ઉલ્કાઓનો આપણા સૌરમંડળમાં સમાવેશ થાય છે. તો ચાલો આપણા આ સૌરમંડળનો પરિચય મેળવીએ. સૌપ્રથમ સૌરમંડળના મુખ્ય સત્ત્ય તરીકે સૂર્યને ઓળખીએ.

### સૂર્ય (Sun) :

સૂર્યથી આપણે પરિચિત છીએ. આપણા રોજના કાર્યની શરૂઆત જ સૂર્યોદયથી થાય છે ને ! સૂર્ય સત્ત્યાનિત તારો છે. તે પૃથ્વી પરના જીવનનો દાતા ગણાય છે. સૂર્ય પૃથ્વી કરતાં લગભગ 13 લાખ ગણો મોટો છે. તેની ફરતે જો એક ચક્કર લગાવવું હોય તો 1000 કિમીના વેગથી ચાલતા વિમાનમાં બેસીને ફરીએ તો 107 વર્ષ નીકળી જાય. સૂર્યનું ગુરુત્વાકર્ષણ બળ પૃથ્વી કરતાં 28 ગણું વધારે છે. આથી જે પદાર્થનું વજન પૃથ્વી પર 1 કિગ્રા થાય તેનું વજન સૂર્યની સપાટી પર 28 કિગ્રા થાય. આ ગુરુત્વાકર્ષણશક્તિને લીધે જ ગ્રહો પોતાના ચોક્કસ માર્ગમાં રહેલા છે અને તેની આસપાસ ફરે છે. પૃથ્વી તેનાથી 15 કરોડ કિમી દૂર છે. સૂર્યના પ્રકાશને ધરતી પર પહોંચતા સવા આઠ મિનિટનો સમય લાગે છે.

સૂર્યની સપાટી હંમેશાં અસ્થિર રહે છે. તેમાં અનેક કિમી લાંબી પ્રજવલિત થતી અનિજવાળાઓનો સમાવેશ થાય છે. સૂર્યનું મુખ્ય આવરણ હાઇડ્રોજન વાયુનું બનેલું છે. તેમાં હાઇડ્રોજન અને હિલિયમ વાયુની પ્રક્રિયાથી પ્રકાશ અને ગરમી ઉત્પન્ન થાય છે, જેને આપણે 'ઉર્જા' કહીએ છીએ. જેથી સૂર્યસપાટી ખૂબ જ ગરમ છે. સૂર્યની ઉર્જાથી પૃથ્વી પર જીવસૃષ્ટિ વિકાસ પામી છે તેથી સૂર્યને 'સજીવોના પાલક' તરીકે પણ ઓળખવામાં આવે છે.

હવે આપણે ગ્રહોનો ટૂંકમાં પરિચય મેળવીએ. સૌરપરિવારમાં કુલ આઠ ગ્રહો છે. જેમાં બુધ, શુક્ર, પૃથ્વી, મંગળ આંતરિક ગ્રહો અને ગુરુ, શનિ, યુરેનસ, નેપ્ટૂન બાબ્ય ગ્રહો તરીકે ઓળખવાય છે. સૌરપરિવારના મંગળ, બુધ, ગુરુ, શુક્ર અને શનિ એ ગ્રહો નશી આંખે જોઈ શકાય છે.

- (1) બુધ (Mercury) :** આ ગ્રહ સૂર્યની સૌથી નજીક છે. તે પીળાશપડતા રંગનો છે. બુધને વાતાવરણ અને ઉપગ્રહ નથી. પૃથ્વી પરથી આપણાને બુધ ગ્રહ સૂર્યાદ્ય પહેલાં અને સૂર્યાસ્ત બાદ થોડો સમય આકાશમાં દેખાય છે.
- (2) શુક (Venus) :** સૌરપરિવારનો સૌથી ચમકતો ગ્રહ છે. તે કદ અને વજનમાં પૃથ્વી જેવો જ છે. જાણે પૃથ્વીનો જોડિયો ભાઈ ! તે ચણકાટમાં ચંદ્રને મળતો આવે છે. તેને એક પણ ઉપગ્રહ નથી. તેની આસપાસ વાયુઓ અને વાદળોનાં ઘણું આવરણોને કારણે તેનો અભ્યાસ બહુ થઈ શક્યો નથી.
- (3) પૃથ્વી (Earth) :** શુક અને મંગળની વચ્ચે પૃથ્વીનું સ્થાન છે. પૃથ્વી પોતાની ધરી પર 24 કલાકમાં એક આંટો પૂરો કરે છે. જ્યારે સૂર્યની ફરતે લગભગ 365 દિવસમાં એક આંટો પૂરો કરે છે. પૃથ્વી પર દિવસ-રાત અને ઋતુઓ જેવી ઘટનાઓ ફક્ત અહીં જોવા મળે છે. પૃથ્વીને એક ઉપગ્રહ ચંદ્ર છે.
- ચંદ્ર (Moon) :** પૃથ્વીનો એક માત્ર ઉપગ્રહ છે. તેને પૃથ્વીની ફરતો એક આંટો પૂરો કરતાં તથા પોતાની ધરી ઉપર પણ એક આંટો પૂરો કરતાં આશરે 29.5 દિવસ લાગે છે. ચંદ્ર પર વાતાવરણ નથી. ચંદ્ર ઉપર પાણી અને વાતાવરણ ન હોવાથી તેના ઉપર જીવન નથી. ચંદ્ર પરમકાશિત છે. ચંદ્રને સૂર્ય પ્રકાશિત કરે છે. ચંદ્રની સપાઠી ઉપર ઉલ્કાપાત થતા હોવાથી તેની ઉપર ખૂબ (વિશાળ) મોટા ખાડાઓ પડી ગયા છે. અહીં મૃતજીવાળામુખી આવેલા છે.
- (4) મંગળ (Mars) :** લાલ રંગનો સુંદર ચમકતો ગ્રહ છે. મંગળને આછું વાતાવરણ છે. મંગળ ઉપર ઋતુઓ પ્રમાણે પૃથ્વી કરતાં વધુ ઠંડી અને ગરમી પડે છે. તેને બે ઉપગ્રહો છે. વૈજ્ઞાનિકો મંગળ પર જીવસૂચિ વિકસાવવાના પ્રયત્નો કરી રહ્યા છે.
- (5) ગુરુ (Jupiter) :** ગુરુ આછો પીળાશપડતો સફેદ ગ્રહની છે. ગુરુની આસપાસ વાયુઓનું વાતાવરણ છે. આ ગ્રહ ખૂબ ઠંડો હશે એવું મનાય છે. તે સૌરમંડળનો સૌથી મોટો ગ્રહ છે. ગુરુને 79 ઉપગ્રહો છે. જેમાં પણ વૈજ્ઞાનિકોમાં મતમતાંતર જોવા મળે છે. આ મોટા ભીમકાય ગ્રહને દૂરભીનથી જોતાં ટપકાવાળી સપાઠી મનોહર લાગે છે.
- (6) શનિ (Saturn) :** સૌરપરિવારમાં ગુરુ અને યુરેનસની વચ્ચે આવેલો છે. ગુરુ પછીનો મોટો ગ્રહ છે. નીલા રંગના તેજસ્વી વલયોથી સુંદર લાગે છે. વલયોના કારણે તે જુદો તરી આવે છે. આ વલયો માથામાં પહેરેલી પાદડી જેવા લાગતા હોઈ શનિને પાદડિયો ગ્રહ પણ કહેવાય છે. શનિને 62 કરતાં વધારે ઉપગ્રહો છે. સૂર્યથી દૂર હોવાના કારણે તેની સપાઠીનું તાપમાન ઓછું છે.
- (7) યુરેનસ (Uranus) :** પૃથ્વીથી એટલો દૂર છે કે તે સામાન્ય દૂરભીનથી દેખાતો નથી. ત્યાં સૂર્યનું તેજ પણ આછી ચાંદની જેવું લાગે છે. વિલિયમ હર્ષલ નામના ખગોળજીશીએ 1781માં આ ગ્રહ શોધી કાઢ્યો હતો. આ ગ્રહ ખૂબ જ ઠંડો છે.



9.1 સૌરપરિવાર

**(8) નોંધ્યુન (Neptune) :** આ ગ્રહ લીલા રંગનો છે. તેના વાતાવરણમાં મિથેન નામનો ઝેરી વાયુ છે. આ ગ્રહ પર પણ પૃથ્વીની જેમ ઋતુપરિવર્તન થતું જોવા મળે છે.

શું તમારે ગ્રહોના નામ સૂર્યથી તેના સ્થાન મુજબ યાદ રાખવા છે? તો આટલું જ બોલો.

**My Very Excellent Mother Just Served Us Noodles**

Mercury, Venus, Earth, Mars, Jupiter, Saturn, Uranus, Neptune

**ઉલ્કા (Meteors) :** કોઈવાર તમને રાત્રે આકાશમાં તારા ખરતા હોય તેવું દેખાય છે ને! હકીકતમાં તારા ખરતા જ નથી. અવકાશમાં ફરતા પથ્થરના નાના ટુકડા અથવા ગ્રહોના નાના ભાગો જે 'ઉલ્કા' તરીકે ઓળખાય છે. આવા ટુકડા પૃથ્વીની નજીક આવતા ગુરુત્વાકર્ષણ બળના લીધે પૃથ્વી તરફ ખૂબ જરૂરી ખેંચાઈ આવે છે. વાતાવરણમાં પ્રવેશતા ઘર્ષણના લીધે તે સળગી ઉઠે છે. આ વખતે આકાશમાં તેજ લિસોટો દેખાય છે તેને આપણે તારો ખર્યો એમ કહીએ છીએ. કેટલીક પૂરેપૂરી ન સળગેલી ઉલ્કાઓ પૃથ્વી પર પડી મોટા ખાડા પાડી દે છે. મહારાષ્ટ્રનું કોયના સરોવર આવી ઉલ્કા પડવાથી જ બનેલું હોવાનું મનાય છે. સૌરાષ્ટ્રમાં ધજણા પાસે આવી ઉલ્કા ખરી હતી જેનું વજન 40 કિગ્રા જેટલું હતું.

**નક્ષત્રો (Constellations) :** વિશાળ અર્થમાં કોઈપણ તારાઓનો સમૂહ અથવા એકલો તારો પણ 'નક્ષત્ર' કહેવાય. કેટલાક તારાઓના સમૂહને કારણે તેનો ચોક્કસ આકાર તૈયાર થયો છે. તે ક્યારેક હંસ જેવો તો ક્યારેક ગરૂડ જેવો દેખાય છે. અચિની, રેવતી, વિશાખા, પુનર્વસુ, મૃગશીર્ષ, રોહિણી, પુષ્ય, આર્ડ્રા સ્વાતિ જેવાં કુલ 27 નક્ષત્રો આવેલાં છે. આકાશમાં ચંદ્રની આસપાસ બે-ત્રણ નક્ષત્રો ઓળખવા ચંદ્રને જોતા રહેવું પડે. નક્ષત્રોને યાદ રાખવા મુશ્કેલ છે પરંતુ વારંવાર જોવા અને સમજવાથી તે સહેલાઈથી યાદ રાખી શકાય છે. કેટલાંક નામ તો શુભકાર્યો સાથે યાદ રહી જાય છે જેમ કે પૃથ્વનક્ષત્રમાં સોના-ચાંદીની ખરીદી કરવામાં આવે છે.

આ વાત થઈ આપણા સૌરપરિવાર એટલે કે સૌરમંડળની. તમારે હજ આપણા ઘર એટલે કે પૃથ્વી વિશે વધુ જાણવું છે ને? તો ચાલો...

### ● પ્રવૃત્તિ ●

- તમારી નોટબુકમાં તમને ગમે તે તરફ સૂર્ય દોરો. ત્યાંથી શરૂ કરી સૂર્યમંડળ બનાવો અને સૂર્યમંડળ વિશે લખો.

### પૃથ્વીનું સ્થાન અને આકાર

આપણે સૂર્ય અને ચંદ્રને આથમતા જોઈએ છીએ. કેવા સરસ મજાના તેજસ્વી દેખાય છે! આપણી પૃથ્વી પણ આવો જ એક ગોળો છે. તેનો આકાર ગોળ છે. તે બંને ધ્રુવોથી થોડી ચપટી છે. કેટલાક અવકાશયાત્રીઓ ચંદ્ર ઉપર જઈ આવ્યા છે. તેમણે પૃથ્વીના ફોટા પણ લીધા છે. ચંદ્ર પરથી પૃથ્વી આકાશમાં મોટા ગોળા જેવી દેખાય છે.

આપણે એક નાનકડા ગામ કે શહેરમાં રહીએ છીએ. વળી, આપણે જે ભાગને જોઈ શકીએ છીએ તે પૃથ્વીનો ખૂબ નાનકડો ભાગ હોય છે. આ કારણે પૃથ્વી ગોળ છે તેવો ઘ્યાલ આવી શકતો નથી. તમે ક્યારેય તૂટી ગયેલું માટલું જોયું છે? તેનો એક નાનકડો ટુકડો હાથમાં લઈએ તો આખેઆખું માટલું ગોળ હશે એવો ઘ્યાલ આવી શકતો નથી. આમ પૃથ્વીના નાનકડા ભાગ ઉપર ઊભા રહીને જોવાથી આપણાને આખી પૃથ્વી ગોળ જણાતી નથી. પરંતુ હવે અવકાશ અને ચંદ્ર પરથી લીધેલા ફોટોગ્રાફ ઉપરથી આપણે કહી શકીએ કે, પૃથ્વીના ગોળ હોવા વિશે કોઈ શંકા રહી નથી.

પૃથ્વી દરા જેવી ગોળ નથી પણ તે નારંગી જેવી છે. પૃથ્વી ધ્રુવમદેશો આગળથી જરા ચયપટી અને વિષુવવૃત્ત આગળથી થોડી ફૂલેલી છે. ધ્રુવવૃત્ત કરતાં પૃથ્વીનો મધ્યભાગ મોટો છે. આપણો તો હવે પૃથ્વીનું ઘનફળ અને વજન પણ જાણી શક્યા છીએ. પૃથ્વીનો અભ્યાસ કરવા માટે પૃથ્વીના ગોળાનો સાધન તરીકે ઉપયોગ કરવામાં આવે છે. તેની ઉપર દુનિયાનો નકશો દોરેલો હોય છે. તેમાં ભૂમિઅંડો, મહાસાગરો તથા મહત્વનાં વૃત્તોનાં નામ લખેલાં હોય છે. પૃથ્વીનો ગોળો એ પૃથ્વીની નાની ‘પ્રતિકૃતિ’ છે. પૃથ્વીના ગોળા પર તમે ઉત્તરધ્રુવ અને દક્ષિણધ્રુવ બતાવી શકશો. પૃથ્વીના ગોળા પરથી પૃથ્વી એક તરફ નમેલી છે તે જાણી શકશો.




9.2 ઉપગૃહથી પૃથ્વીની તસવીર

**ધ્રુવનો તારો (Pole Star) :** આકાશમાં એક તારો એવો છે કે જે હંમેશાં આકાશમાં એક જ દિશામાં એક જ સ્થળે દેખાય છે. તો પછી એ તારાને શોધવો-ઓળખવો કઈ રીતે ? આ ધ્રુવના તારાને સપ્તર્ધિના જૂમબાની મદદથી સરળતાથી શોધી શકાય છે. સપ્તર્ધિના આગળના બે તારાને જોડતી કલ્પિત રેખાની દિશામાં આગળ વધતાં એક તેજસ્વી તારો તમને દેખાશે. બસ, એ જ ધ્રુવનો તારો છે. દરિયાઈ સફર કરનારા કે રણમાં મુસાફરી કરનારા લોકો ધ્રુવનો તારો સહેલાઈથી શોધી કાઢે છે. એ તારો જે દિશામાં દેખાય તે દિશા ઉત્તર દિશા છે. આ તારો પૃથ્વીના ઉત્તર ગોળાર્ધમાં જ દેખાય છે. તેની સ્થિરતા અને પૃથ્વીના લગભગ ગોળ આકારને લીધે દક્ષિણ ગોળાર્ધમાંથી જોઈ શકતો નથી.



9.3 પૃથ્વીનો ગોળો



9.4 અક્ષાંશ-રેખાંશ

### અક્ષાંશ-રેખાંશ (Latitude-Longitude) :

પૃથ્વીના ગોળા ઉપર આડી અને ઊભી કાલ્યનિક રેખાઓ છે. પરંતુ આ કલ્પિત રેખાઓ દ્વારા પૃથ્વીના કોઈપણ સ્થળનું ચોક્કસ સ્થાન અને સમય જાણી શકાય છે. જમીન પર આ રેખાઓ હોતી નથી. આ રેખાઓ માત્ર નકશામાં જ જોઈ શકાય છે.


**અક્ષાંશ :** પૃથ્વીના ગોળા પર દોરેલી આડી કાલ્યનિક રેખાઓને અક્ષાંશ કહેવામાં આવે છે. પૃથ્વીની સપાટી પરના કોઈપણ સ્થળને જો સીધી રેખાથી પૃથ્વીના કેન્દ્ર સાથે જોડવામાં આવે, તો તે રેખાથી વિષુવવૃત્તીય કાલ્યનિક સપાટી સાથે કેન્દ્ર આગળ જેટલા અંશનો ખૂણો થાય તેટલો તે સ્થળનો અક્ષાંશ બને છે. અક્ષાંશવૃત્તોની કુલ સંખ્યા 180 છે.




### જાણવા જેવું

- એ અક્ષાંશવૃત્તો વચ્ચે વાસ્તવિક જમીનસપાટી પર આશરે 111 કિમીનું અંતર હોય છે.

**અક્ષવૃત :** પૃથ્વી ઉપર ઉત્તર અથવા દક્ષિણ ગોળાઈમાં વિષુવવૃત્તથી સરખા કોણીય અંતરે મળેલાં સ્થળોને જોડનારું પૂર્વ-પશ્ચિમ સંંગ વર્તુળને અક્ષવૃત કહેવાય.



**રેખાંશ :** પૃથ્વીના ગોળા ઉપર દોરેલી ઊભી કટિપિત રેખાઓને રેખાંશ કહેવામાં આવે છે. રેખાંશ ધ્રુવ પાસે એકબીજાને મળે છે. ધ્રુવ તરફ જતા આ રેખાઓ એકબીજાની નજીક આવતી જાય છે. કુલ રેખાંશવૃત્તની સંખ્યા 360 છે, જેમાં  $0^{\circ}$  રેખાંશ અને  $180^{\circ}$  રેખાંશ મહત્વના છે.




**9.5 વર્તુળ અને ખૂણાઓ**

**રેખાવૃત :** પૃથ્વીની ધરીથી મૂળ રેખાવૃતની કાલ્યનિક સપાટી સાથે પૃથ્વીસપાટીએ સરખા કોણાત્મક અંતરે આવેલાં સ્થળોને જોડનારી ઉત્તર-દક્ષિણ સંંગ રેખાને રેખાવૃત (અર્ધવર્તુળ) કહે છે.

#### • પ્રવૃત્તિ •

- તમારી નોટબુકમાં એક વર્તુળ દોરી તેમાં  $23.5^{\circ}$  ઉ.આ., દ.આ. નામનિર્દેશ સાથે બતાવો. સાથે  $0^{\circ}$  અક્ષાંશનું નામનિર્દેશ કરી બતાવો.


પૃથ્વીની સપાટી પર મધ્યમાં એક આડી રેખા દોરેલી છે તે જુઓ. એ રેખા વિષુવવૃત્ત છે. વિષુવવૃત્તથી પૃથ્વીના બે સરખા ભાગ કરે છે. વિષુવવૃત્તથી ઉપરનો એક ભાગ એ ઉત્તર ગોળાઈ અને દક્ષિણ તરફનો ભાગ દક્ષિણ ગોળાઈ. આમ, ઉત્તર તરફના ઉત્તર અક્ષાંશ અને દક્ષિણ તરફની રેખાઓ દક્ષિણ અક્ષાંશ કહેવાય છે. વિષુવવૃત્તથી ઉત્તરે  $23.5^{\circ}$  કર્કવૃત અને વિષુવવૃત્તથી દક્ષિણે  $23.5^{\circ}$  દક્ષિણ અક્ષાંશરેખાને મકરવૃત્ત કહે છે. આ જ પ્રમાણે વિષુવવૃત્તથી ઉત્તરે  $66.5^{\circ}$  ઉત્તર અક્ષાંશરેખાને ઉત્તર ધ્રુવવૃત્ત (Arctic circle) અને વિષુવવૃત્તની દક્ષિણે  $66.5^{\circ}$  દક્ષિણ અક્ષાંશરેખાને દક્ષિણ ધ્રુવવૃત્ત (Antarctic circle) કહે છે. વિષુવવૃત્તની ઉત્તરમાં કર્કવૃત સુધી તેમજ દક્ષિણમાં મકરવૃત્ત સુધી દેખાતી સૂર્યની ગતિને અયન કહેવાય છે. તેથી આની વચ્ચેના વૃત્તોને અયનવૃત્તો કહેવાય છે. સૂર્યની આ ગતિને છ મહિના જેટલો સમય લાગે છે. પૃથ્વી  $66.5^{\circ}$ ના ખૂણો નમેલી છે. આથી સૂર્યનાં કિરણો કર્કવૃત અને મકરવૃત્ત વચ્ચે લગભગ ‘સીધાં’ પડે છે.



#### 9.7 મુખ્ય અક્ષાંશવૃત્તો

#### • જાળવા જેવું •

- $23.5^{\circ}$  ને 23 દિગ્રી અને 0.5 મિનિટ તરીકે વંચાય છે.



9.8 અયનવૃત્ત

### પ્રવૃત્તિ

- $23.5^\circ$  ઉત્તર અક્ષાંશવૃત્ત દોરો. તે જ પ્રમાણે  $23.5^\circ$  દક્ષિણ અક્ષાંશવૃત્ત દોરો. હવે પૃથ્વીના ગોળાની મદદથી આ બંને અક્ષાંશવૃત્ત કયા-કયા દેશોમાંથી પસાર થાય છે તે લખો.


## GPS (ગ્લોબલ પોર્જિશનિંગ સિસ્ટમ)

ગ્લોબલ પોર્જિશનિંગ સિસ્ટમ દ્વારા મોબાઇલ ફોન અને ગુગલ અર્થ મારફતે આપણાને કોઈપણ સ્થળના અક્ષાંશ અને રેખાંશ જાણવા મળે છે. ઇન્ટરનેટની સુવિધાવાળા મોબાઇલ વડે જે-તે સ્થળના અક્ષાંશ અને રેખાંશ મળી જાય છે. આજે તો આ સિસ્ટમ દ્વારા અક્ષાંશ-રેખાંશ ખૂબ સહેલાઈથી જાણી શકાય છે.

### મુખ્ય રેખાંશવૃત્તો

(1) ગ્રનિચ (Greenwich Mean Time-GMT) રેખા : દુંગલેન્ડના ગ્રનિચ શહેર પરથી પસાર થતી  $0^\circ$  રેખાંશવૃત્તને 'ગ્રનિચ રેખા' કહે છે. ગ્રનિચ રેખાથી પૃથ્વીના પૂર્વ અને પશ્ચિમ એમ બે ભાગ પડે છે. જે પૂર્વ ગોળાઈં અને પશ્ચિમ ગોળાઈં તરીકે ઓળખાય છે. ગ્રનિચ રેખાની  $180^\circ$  પૂર્વમાં પૂર્વ રેખાંશ અને  $180^\circ$  થી પશ્ચિમમાં પશ્ચિમ રેખાંશ ગણવામાં આવે છે.

(2) આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા (International Date Line) : રેખાંશવૃત્તને 'આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા' કહે છે. આ રેખાંશવૃત્ત માત્ર એક જ છે. આ રેખા ઓળંગતા તારીખ અને વાર બદલાય છે. તે પેસિફિક મહાસાગરમાંથી પસાર થાય છે. તે કેટલાંક સ્થળોએ બરાબર  $180^\circ$  પર નથી, વાંકિયૂંકી છે. તેનું કારણ એ છે કે જો તેને સીધી દોરવામાં આવે તો એક જ દેશના કેટલાક ટાપુ ઉપર એક જ દિવસે બે વાર અને બે તારીખ બેગી થઈ જાય. કેટલીક જગ્યાએ એક ટાપુ પર બીજી તરફ જતાં તારીખ બદલાઈ જાય અને સમય તથા તારીખનો ગોટાળો થાય. આ નિવારવા આ રેખાના માર્ગમાં




9.9 આંતરરાષ્ટ્રીય દિનાંતર રેખા

આવતી જમીન બાજુ પર રાખીને તેને સમુદ્ર તરફ ફેરવી છે એટલે કે તે વાંકીનૂંકી છે.



### કટિબંધો (Zone)

બાજુની આકૃતિ પરથી સમજાય છે કે તાપમાન, પ્રકાશ, ગરમી અને ઠંડીના આધારે પૃથ્વી રીતે જુદા-જુદા વિભાગોમાં વહેંચાઈ જાય છે, જેને 'કટિબંધો' કહે છે. વધારે તેમજ ઓછા પ્રકાશ અને ગરમી મેળવતા ભાગોને નીચે મુજબ ત્રણ વિભાગમાં વહેંચવામાં આવેલા છે :



કટિબંધ		
ઉષ્ણ કટિબંધ (Tropical Zone)	સમશીતોષ્ણ કટિબંધ (Temperate Zone)	શીત કટિબંધ (Polar Zone)
અતિશય ગરમી	સપ્રમાણ ગરમી-ઠંડી	સખત ઠંડી

**પૃથ્વીની ગતિના પ્રકાર :** બધા ગ્રહોની જેમ પૃથ્વીની પણ ફરવાની બે પ્રકારની ગતિ છે.


**(1) પરિભ્રમણ (Rotation) :** ભમરડો પોતાની ધરી પર ફરે છે, તેમ પૃથ્વી પોતાની ધરી પર પથિંમથી પૂર્વ દિશામાં ફરે છે. પૃથ્વીની આ ગોળ ચક્કર લગાવવાની ગતિ દૈનિક ગતિ કહેવાય છે. તેને પરિભ્રમણ પણ કહે છે. પૃથ્વી વિષુવવૃત્ત પર કલાકના 1670 કિલોમીટરની ઝડપે એક ચક પૂર્ણ કરે છે. આ ચક પૂર્ણ કરતાં ચોવીસ કલાક થાય છે. પૃથ્વીનો નારંગો જેવો ગોળ આકાર બનાવવામાં આ ગતિએ મહત્વનો ભાગ ભજવ્યો છે.

**(2) પરિક્રમણ (Revolution) :** પૃથ્વી પોતાની ધરી પર ચક્કર લગાવવાની સાથે સાથે સૂર્યની આસપાસ પરિક્રમા કરે છે. જેને પરિક્રમણ કહેવાય છે આ પરિક્રમા પૂરી કરતાં પૃથ્વીને લગભગ 365 દિવસ લાગે છે. આ સમયગાળાને આપણે એક વર્ષ કહીએ છીએ. અવકાશમાં પૃથ્વીને સૂર્યની આસપાસ ચક્કર લગાવવાનો એક કાલ્યનિક માર્ગ નક્કી થયેલો છે, જે કક્ષા (orbit) તરીકે ઓળખાય છે. આ સાથે પૃથ્વી વર્તુળાકાર નહિ પરંતુ લંબગોળાકાર કક્ષામાં ફરે છે. વર્ષભર પૃથ્વી અને સૂર્ય વચ્ચેનું અંતર સરખું હોતું નથી. પૃથ્વી પોતાની ધરી પર 23.5° અને કક્ષા સાથે 66.5°નો ખૂણો બનાવીને ફરે છે. પૃથ્વીના આ ધરીનમનના કારણો ઋતુઓ થાય છે અને રાત-દિવસ લાંબા ટૂંકા થાય છે.

**દિવસ-રાત :** પૃથ્વીની દૈનિક ગતિના લીધે જ દિવસ અને રાત થાય છે. પૃથ્વી પોતાની ધરી પર નમેલી અને ગોળ હોવાથી તેના અર્ધાભાગ પર જ સૂર્યનો પ્રકાશ પડે છે અને અર્ધાભાગ પર અંધારું રહે છે. પૃથ્વી ફરતી ન હોત તો એક તરફ અજવાણું અને બીજી તરફ અંધારું જ રહેત. પણ તેમ બનતું નથી. આમ પૃથ્વીનું દરેક સ્થળ 24 કલાકમાં




અજવાળામાંથી અંધારામાં અને અંધારામાંથી પાછું અજવાળામાં આવે છે. તેનાથી પૃથ્વીના દરેક સ્થળે સવાર, બપોર અને સાંજ થાય છે. પૃથ્વીના ધરી નમનના લીધે દિવસ-રાતની લંબાઈમાં ફેરફાર થાય છે.



9.11 દિવસ-રાત

21મી જૂને કર્કવૃત્ત અને 22 મી ડિસેમ્બરે મકરવૃત્ત પર સૂર્યનાં કિરણો બરાબર સીધાં પડે છે. જ્યાં સૂર્યનાં કિરણો સીધાં પડે છે ત્યાં અને તેની નાલ વિસ્તારોમાં દિવસ લાંબા અને રાત ટૂંકી રહે છે. જ્યાં સૂર્યનાં કિરણો ગાંસાં પડે છે ત્યાં દિવસ ટૂંકો અને રાત લાંબી રહે છે. જ્યારે 21 માર્ચ અને 23 સપ્ટેમ્બર માસમાં રાત અને દિવસ સરખાં રહે છે.



### • પ્રવૃત્તિ •

- આજૂતિ 9.12 નું અવલોકન કરી જવાબ આપો :
  - (1) 22મી ડિસેમ્બરે દિવસ અને રાતની લંબાઈની સ્થિતિ શું હશે ?
  - (2) 21મી માર્ચ અને 23મી સપ્ટેમ્બરની વિશેષતા શું છે ?

**જ્યુનિયન કિરણો :** પૃથ્વી ધરી પર નમેલી હોવાથી ઉત્તર ધ્રુવ અને દક્ષિણ ધ્રુવ વારાફરથી સૂર્યનાં સામે આવે છે. સૂર્યનાં કિરણો વિષુવવૃત્તની ઉત્તરે કે દક્ષિણ સીધાં પડે છે. આમ થવાથી દિવસ-રાતમાં તફાવત પડે છે. આથી વધારે સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં ઉનાળો અને ઓછો સમય સૂર્યપ્રકાશ મેળવતા વિસ્તારોમાં શિયાળો અનુભવાય છે. તે જ સમયે દક્ષિણ ગોળાઈધમાં શિયાળામાં જ્યુનિયન અનુભવાય છે જે માનવજીવનને સીધી અસર કરે છે.

### • પ્રવૃત્તિ •

- પૃથ્વીના ગોળાની મદદથી ભારતમાં ઉનાળો હોય તો નીચે આપેલા દેશોમાં કઈ જ્યુનિયન હશે તે શોધો :
  - (1) અમેરિકા - \_\_\_\_\_
  - (2) ઓસ્ટ્રેલિયા - \_\_\_\_\_
  - (3) શ્રીલંકા - \_\_\_\_\_
  - (4) ઇંગ્લેન્ડ - \_\_\_\_\_
  - (5) ભૂતાન - \_\_\_\_\_
  - (6) બ્રાઝિલ - \_\_\_\_\_

**ઉત્તરાયણ :** 22મી ડિસેમ્બરથી સૂર્યનાં સીધાં કિરણો ઉત્તર તરફ એટલે કે વિષુવવૃત્ત તરફ પડવાના શરૂ થાય છે. આમ, ઉત્તરાયણ 22મી ડિસેમ્બરે થાય છે. 14મી જાન્યુઆરીએ સૂર્ય મકરરાશિમાં પ્રવેશ કરે છે. માટે ‘મકરસંકાંતિ’ કહેવાય છે.

**દક્ષિણાયન :** 22મી જૂનથી સૂર્યનાં સીધાં કિરણો કર્કવૃતથી ખસીને દક્ષિણ તરફ વિષુવવૃત્ત તરફ પડવાનું શરૂ થાય છે જેને ‘દક્ષિણાયન’ કહે છે.

**સંપાત (Equinox) :** સૂર્યનો કાંતિવૃત્ત અને વિષવવૃત્ત વર્ષમાં બે વખત એકબીજાને છેદે છે. આ છેદનબિંદુને સંપાત દિવસ કહેવામાં આવે છે. સંપાત દરમિયાન સૂર્ય ઉત્તર તરફ ખસતાં જતાં ઉત્તર ગોળાઈધમાં ‘22 મી માર્ચ’ થી દિવસની લંબાઈ વધતી અને રાત ટૂંકી થતી જાય છે. ઉત્તર ગોળાઈધમાં ‘21મી જૂન’ વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. સૂર્ય દક્ષિણ તરફ ખસતાં જતાં દક્ષિણ ગોળાઈધમાં 24 મી સપ્ટેમ્બરથી દિવસની લંબાઈ વધતી જાય અને રાત ટૂંકી થતી જાય છે. દક્ષિણ ગોળાઈધમાં 22મી ડિસેમ્બર વર્ષનો લાંબામાં લાંબો દિવસ અને ટૂંકામાં ટૂંકી રાત હોય છે. વર્ષ દરમિયાન ‘21 મી માર્ચ’ અને ‘23મી સપ્ટેમ્બરે’ સૂર્યનાં કિરણો વિષુવવૃત્ત ઉપર સીધાં પડતાં હોઈ રાત અને દિવસ સરખાં થાય છે જે વિષુવદિન તરીકે ઓળખાય છે.

**લીપવર્ષ (Leap Year) :** પૃથ્વીનું 1 વર્ષ એટલે 365 દિવસ અને છ. કલાક પણ ચોથા ભાગના દિવસની ગણતરી કરવાનું અગવડભરેલું હોવાથી 365 દિવસે વર્ષ પૂરું કરીએ છીએ. બાકી બચેલા છ કલાક દર ચાર વર્ષ ફેબ્રુઆરી મહિનામાં એક દિવસ વધારીને એટલે કે 28 દિવસને બદલે 29 દિવસ કરી સરભર કરીએ છીએ. તે વર્ષને લીપવર્ષ કહીએ છીએ.

### • પ્રવૃત્તિ •

- આપના શિક્ષકની મદદથી લીપવર્ષની ગણતરી કેવી રીતે થાય છે તે અંગે જાણો.


## ગ્રહણ (Eclipse)

આપણને સૂર્ય અને ચંદ્ર તરફથી પ્રકાશ મળે છે. સૂર્ય સ્વયંપ્રકાશિત છે અને ધગધગતો ગોળો છે. ચંદ્ર પરમ્પરકાશિત છે તે સૂર્યના પ્રકાશથી પ્રકાશિત છે. જુદા-જુદા દિવસે પૃથ્વી તરફ પ્રકાશિત ભાગ દેખાય છે. કોઈ કારણથી સૂર્યનો અમુક ભાગ દેખાતો બંધ થાય તેમજ પૂર્ણ ચંદ્રનો અમુક ભાગ ન દેખાય કે, ક્યારેક આખેઆખો ચંદ્ર દેખાતો બંધ થાય ત્યારે ગ્રહણ થયું એમ કહેવાય.



## સૂર્યગ્રહણ (Solar Eclipse)


ચંદ્ર પૃથ્વીની વધુ નજીક છે તે પૃથ્વીની આસપાસ ફરે છે. ક્યારેક તે ફરતી વખતે સૂર્ય અને પૃથ્વીની વચ્ચે આવી જાય છે. આ વખતે ચંદ્રના અંતરાયથી સૂર્ય દેખાતો બંધ થાય છે. આ ઘટનાને આપણે ‘સૂર્યગ્રહણ’ કહીએ છીએ. ચંદ્ર સૂર્ય કરતાં નાનો હોવાથી તે સૂર્યને સંપૂર્ણ ઢાંકી શકતો નથી. આ કારણે આખી દુનિયામાં ‘સૂર્યગ્રહણ’ એક સાથે જોઈ શકાતું નથી. સૂર્યગ્રહણ અમાસે થાય છે, પરંતુ દર અમાસે આ ઘટના બનતી નથી.



9.13 સૂર્યગ્રહણ

## ચંદ્રગ્રહણ (Lunar Eclipse)

ચંદ્રને સૂર્ય તરફથી પ્રકાશ મળે છે. તેથી ચંદ્ર તરફ જતાં સૂર્યનાં કિરણોની વચ્ચે પૃથ્વીનો અવરોધ આવે એટલે ચંદ્રના એટલા ભાગમાં અંધકાર રહે. ટૂંકમાં પૃથ્વીના એટલા ભાગનો પડણાયો ચંદ્ર પર પડે છે, ચંદ્રનો આ ભાગ આપણને દેખાય નહિ જેને ચંદ્રગ્રહણ કહેવાય છે. આવી ઘટના પૂનમની રાતે જ થાય છે, પરંતુ દર પૂનમે આવી ઘટના બનતી નથી.



9.14 ચંદ્રગ્રહણ

જાણવા જેવં

- સૂર્યગ્રહણ અમાસના દિવસે થાય છે પરંતુ તે દરેક અમાસે થતું નથી.
  - ચંદ્રગ્રહણ પૂનમની રાત્રે ૭ થાય છે પરંતુ તે દરેક પૂનમે થતું નથી. આ બંને બાબતો વિશે તમારા શિક્ષકની મદદથી વધુ વિગત જાણો.



स्वाध्याय

1. નીચે આપેલા પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર લખો :

- (1) હું સૂર્યથી સૌથી નજીકનો ગ્રહ છું.  
 (A) પૃથ્વી (B) બુધ (C) શુક (D) નેષ્ટ્યુન

(2)  $0^\circ$  અક્ષાંશવૃત્ત ક્યા નામે ઓળખાય છે ?  
 (A) ગ્રિનિય (B) કર્કવૃત્ત (C) વિષ્ણુવવૃત્ત (D) મકરવૃત્ત

(3)  $23.5^\circ$  ઉ.અ. અને  $66.5^\circ$  ઉ.અ. વચ્ચે ક્યો કટિબંધ આવેલો છે ?  
 (A) શીત (B) સમશીતોષ્ણ (C) ઉષ્ણ (D) તમામ

(4) હું મારી ધરી પર  $23.5^\circ$  નો ખૂણો બનાવું છું ?  
 (A) સૂર્ય (B) ચંદ્ર (C) પૃથ્વી (D) શુક

(5) સૂર્યનો કાંતિવૃત્ત વિષ્ણુવવૃત્તને વર્ષમાં કેટલી વાર છેદે છે ?  
 (A) એક (B) બે (C) ત્રણ (D) ચાર

(6) કોના અંતરાયથી પૃથ્વી પર ‘સૂર્યગ્રહણ’ જોવા મળે છે ?  
 (A) ચંદ્ર (B) સર્ય (C) પૃથ્વી (D) એક પણ નહિ

## 2. મને ઓળખો :

- (1) મને ભીમકાય ગ્રહ પણ કહે છે. \_\_\_\_\_

(2) મને ઓળંગતા તારીખ બદલવી પડે. \_\_\_\_\_

(3) હું  $90^{\circ}$  દક્ષિણ અક્ષાંશ હું. \_\_\_\_\_

(4) હું પૃથ્વીની આસપાસ ફરું હું. \_\_\_\_\_

(5) હું ન હોઉં તો જીવસુષ્ટિ નાશ પામે. \_\_\_\_\_

3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

- (1) ચંદ્ર સ્વયં પ્રકાશિત છે.
  - (2) નેપ્યુન નીલા રૂગનો વ્રહ્ણ છે.

(3) પૃથ્વી પર દોરેલી કાલ્યનિક આડી રેખાઓને અક્ષાંશ કહે છે.

(4) 21મી જૂને કર્કવૃત્ત પર શિયાળો હોય છે.

(5) વિષુવવૃત્ત પર ખૂબ જ ઠંડી પડે છે.

(6)  $90^{\circ}$  ઉત્તર અક્ષાંશ ઉત્તર ધ્રુવ કહેવાય છે.

#### 4. એક વાક્યમાં ઉત્તર આપો :

(1) પૃથ્વીની ગતિઓ કેટલી છે ?

(2) ધ્રુવનો તારો કઈ દિશામાં જોવા મળે છે ?

(3) સૂર્યમંડળનો સૌથી ચમકતો ગ્રહ ક્યો છે ?

(4)  $180^{\circ}$  રેખાંશવૃત્ત ક્યા નામે ઓળખાય છે ?

#### 5. નણો-ચાર વાક્યમાં ઉત્તર આપો :

(1) પૃથ્વી પોતાની ધરી પર ન ફરે તો શું થાય ?

(2) અક્ષાંશવૃત્ત અને રેખાંશવૃત્ત એટલે શું ?

(3) ફેબ્રૂઆરી માસમાં ક્યારેક 29 દિવસ હોય છે - વિધાન સમજાવો.

(4) ક્યા ગ્રહો આંતરિક ગ્રહો તરીકે ઓળખાય છે ?

(5) ઉત્તરાયણ એટલે શું ?

#### 6. ટૂંક નોંધ લખો :

(1) ચંદ્રગ્રહણ

(2) સૂર્યમંડળ

(3) કટિબંધો

(4) સંપાત





10

## પૃથ્વીનાં આવરણો

સૌરપરિવારમાં આપણી પૃથ્વી અજોડ છે; પૃથ્વી એક માત્ર ગ્રહ છે કે જેને અનુકૂળ તાપમાન, પાણી, હવા અને જીવન મળ્યું છે. જે પૃથ્વીને મળેલ અમૂલ્ય બેટ છે. બીજા ગ્રહો પર હજુ પાણી અને ઓક્સિજન પૂરતા પ્રમાણમાં હોવાના પૂરાવા મળ્યા નથી.

સામાન્ય રીતે આપણે જાણીએ છીએ કે, પૃથ્વી તેના ઉદ્ભબ સમયે અગનગોળાના સ્વરૂપે હતી. આ અગન-ગોળો ધીરે-ધીરે ઠંડો પડતાં કેટલાંક તત્ત્વોનું કમશઃ પ્રવાહી અને ઘન સ્વરૂપમાં રૂપાંતર થયું. આમ, પૃથ્વીની આસપાસ વાયુઓનું તથા પૃથ્વીની સપાટી પર ખડકો અને માટીનું આવરણ અસ્તિત્વમાં આવ્યું. આ આવરણના વિશાળ ખાડાઓમાં પાણી ભરતાં મહાસાગરો બન્યા. આમ, પૃથ્વીનું ચોક્કસ સ્વરૂપ રચાયું.

### પૃથ્વીનાં આવરણો

પૃથ્વીના ચાર મુખ્ય આવરણો છે (1) મૃદાવરણ (2) જલાવરણ (3) વાતાવરણ (4) જીવાવરણ.



G2B8X1

**(1) મૃદાવરણ (Lithosphere)** : પૃથ્વી ઉપરનો પોપડો સામાન્ય રીતે માટી અને ઘન પદાર્થોનો બનેલો છે. ‘મૃદા’ શબ્દનો અર્થ માટી થાય છે તેથી પોપડાના ઉપલા ભાગને ‘મૃદાવરણ’ કહે છે. આ આવરણ ખડકો અને ઘન પદાર્થનું બનેલું હોવાથી તેને ‘ખડકાવરણ’ કે ‘ઘનાવરણ’ તરીકે પણ ઓળખવામાં આવે છે.

**વિસ્તાર અને બંધાવરણ** : પૃથ્વીનો ઉપરનો પોપડો લગભગ 64 કિલોમીટરથી 100 કિલોમીટર જેટલો જાડો છે. તેમાં મુખ્યત્વે ઓલ્યુમિનિયમ અને સિલિકા જેવાં હલકાં તત્ત્વો રહેલાં છે. ઊંડા સમુક્રોમાં આ પોપડો પાતળો હોય છે. પૃથ્વીસપાટીનો આશરે 29 % ભાગ મૃદાવરણ રોકેલો છે. આ ભાગ પર પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો વગેરે આવેલાં છે. મૃદાવરણની સપાટીથી જેમ-જેમ ઉંડ જઈએ તેમ-તેમ તાપમાનમાં વધારો થતો જાય છે.

સામાન્ય રીતે દર 1 કિમીની ઉંડાઈએ જતાં આશરે  $30^{\circ}$  સેલ્સિયસ તાપમાનનો વધારો થાય છે. આમ અહીં વધારે ગરમીને કારણે અંદરના ખડકો પણ પીગળી જઈ અર્ધપ્રવાહી ઘણું સ્વરૂપમાં ફેરવાઈ જાય છે. આ ખડકોના પીગળેલા દ્રવ્યને ‘મેંમા’ કહે છે. જેમાં કેટલાક વાયુઓની હાજરી હોય છે. અહીં ઉપરના ખડકોનું દબાણ ખૂબ જ વધારે હોય છે.

આમ, દબાણ અને ગરમી જેવાં પરસ્પર વિરોધી બળો વચ્ચે સમતુલા જળવાય છે, એટલે જ પૃથ્વીનો પોપડો ફાટી જતો નથી.

મૃદાવરણનો જીવાવરણ અને વનસ્પતિજીવન સાથે ગાડ સંબંધ છે. આપણાં ધર, પાણી, બેતી, ઉદ્યોગો બધું જ આ મૃદાવરણ સાથે સંબંધ ધરાવે છે. મૃદાવરણમાંથી ખનીજો અને ખનીજ તેલ મળે છે. બેતી કરી વિવિધ પાકોનું ઉત્પાદન મેળવીએ છીએ. મેદાનપ્રદેશોમાં વિવિધ ઉદ્યોગ-ધંધા અને બીજી આર્થિક પ્રવૃત્તિઓ કરીએ છીએ. પર્વત-પ્રદેશોમાં આવેલાં જંગલો પણ મૃદાવરણને આભારી છે. ટુંકમાં એમ કહી શકાય કે, આહારથી માંડીને આવાસ અને આપણા અસ્તિત્વનો પાયો એટલે જ મૃદાવરણ.

**(2) જલાવરણ (Hydrosphere)** : પૃથ્વીસપાટી પર ભૂમિપ્રદેશ કરતાં પાણીના વિસ્તારનું પ્રમાણ વધારે છે. પૃથ્વીસપાટીનો જે વિસ્તાર પાણીથી ઘેરાયેલો છે તેને ‘જલાવરણ’ તરીકે ઓળખવામાં આવે છે.


પૃથ્વીસપાટીનો લગભગ 71 % જેટલો વિસ્તાર જલાવરણથી ઘેરાયેલ છે. પૃથ્વીસપાટીનો આ વિસ્તાર એટલો વિશાળ છે કે એમાં ભૂમિખંડો પણ ટાપુ જેવા લાગે છે. પૃથ્વી પરના વિશાળ જળરાશિ ધરાવતા ભાગોને ‘મહાસાગરો’ તરીકે ઓળખવામાં આવે છે. જે ક્રમશા: પેસેફિક, એટલેન્ટિક, હિંદ અને આર્ક્ટિક મહાસાગર તરીકે જાણીતા છે. પૃથ્વી પરના મહાસાગરો ખૂબ વિશાળ અને ઉંડા છે. તેના તણિયે 10 થી 11 કિમી જેટલી વિશાળ અને ઉંડી ખાઈઓ છે. મહાસાગરોના તણિયે પણ પૃથ્વીસપાટી જેવાં ભૂમિસ્વરૂપો આવેલાં છે. પૃથ્વી પર જે પાણી છે તેમાંથી 97 % સમુદ્રમાં રહેલું ખારું પાણી છે. બાકીના પાણીનો આશરે પોણો ભાગ ધ્રુવો પર તથા હિમાલય જેવા બીજા ઉંચા પર્વતો પર બરફ રૂપે છે. જે પાણી પૃથ્વીના પેટાળમાં છે, સરોવરમાં અને નદીઓ રૂપે વહે છે તેનું પ્રમાણ ખૂબ જ ઓછું છે.

પૃથ્વી પર રહેતા જીવો અને વનસ્પતિને પાણી વિના ચાલતું નથી; પાણી ખોરાક સાથે મળે કે હવામાંથી બેજરૂપે મળે. જલાવરણનું અસ્તિત્વ એટલે જ સજ્જવસૃષ્ટિનું અસ્તિત્વ. પૃથ્વી પરના વરસાદ માટેનો મોટાભાગનો બેજ સમુદ્રમાંથી આવે છે. સમુદ્રના તણિયે કીમતી ખનીજોનો મોટો જથ્થો આવેલો છે. પાણીમાંથી મીઠું મેળવીએ છીએ અને તેના તણિયે મેંગેનીઝ, લોખંડ, કલાઈ વગેરે ખનીજો આવેલાં છે. સમુદ્ર પ્રોટીનયુક્ત આહારનો ભંડાર પણ છે. સમુદ્રો કે મહાસાગરોનાં મોઝાં, પ્રવાહો અને ભરતીમાં પ્રચંડ શક્તિ રહેલી છે. તેને નાથીને વિદ્યુતશક્તિ મેળવી શકાય છે. મહાસાગરો જળપરિવહનના માર્ગો બન્યા છે. વિવિધ દેશોના વેપારમાં પણ જળમાર્ગો વધારે અનુકૂળ રહ્યા છે.

**(3) વાતાવરણ (Atmosphere) :** પૃથ્વીની ચારેબાજુ વીટળાઈને આવેલા લગભગ 800 થી 1000 કિલોમીટરની ઉંચાઈ સુધીના વિવિધ વાયુના આવરણને ‘વાતાવરણ’ કહે છે.

વાતાવરણને નરી આંખે જોઈ શકતું નથી. વાતાવરણમાં વિવિધ વાયુઓ, પાણીની વરાળ, ધૂળના રજકણો, ઉલ્કાકણા, ક્ષારકણ તથા સૂક્ષ્મજીવ-જંતુઓ ભણેલા હોય છે.


વાતાવરણ રંગ, ગંધ અને સ્વાદરહિત હોય છે તેમજ પારદર્શક હોય છે. વાતાવરણમાં વાયુ, પ્રવાહી અને ધન તત્વોનો સમાવેશ થાય છે. તેમાં આવેલા વિવિધ વાયુઓમાં નાઈટ્રોજન, ઓક્સિજન, ઓર્ગેનિક, કાર્બન ડાયોક્સાઇડ, ઓઝોન વગેરે મુખ્ય છે. પૃથ્વીની સપાટી નજીકનું વાતાવરણ ઘણું છે. જ્યારે પૃથ્વીની સપાટીથી ઊંચે જતા વાયુઓનું પ્રમાણ ઘટતાં હવા પાતળી થતી જાય છે.



10.1 વાતાવરણમાં વાયુઓનું પ્રમાણ

પૃથ્વીની સપાટીથી જેમ ઊંચે જઈએ તેમ વાતાવરણના મોટાભાગના વાયુઓનું પ્રમાણ ઘટતું જાય છે.

કાર્ਬન ડાયોક્સાઇડ વાયુ ભારે હોવાથી હવાના નીચલા સ્તરમાં તે વધારે પ્રમાણમાં હોય છે અને ઉપર જતાં ઓછો થઈ જાય છે. કાર્બન ડાયોક્સાઇડ આશરે 20 કિમીની ઊંચાઈ પછી, ઓક્સિજન આશરે 110 કિમીની ઊંચાઈ પછી અને નાઈટ્રોજન આશરે 130 કિમીની ઊંચાઈ પછી ઓછો થતો જાય છે. ખૂબ ઊંચાઈએ જતાં માત્ર હાઇડ્રોજન અને લિલિયમ જેવા હલકા વાયુઓ હોય છે.



10.2 વાતાવરણમાં ઊંચાઈ અનુસાર વાયુઓની પ્રમાણ

વાતાવરણમાં ઓઝોન વાયુનું પ્રમાણ ખૂબ ઓછું હોય છે. આ વાયુ સૂર્યના જલદ પારજાંબલી કિરણોનું શોષણ કરી પૃથ્વીને સૂર્યની પ્રચંડ ગરમીથી બચાવે છે. આ વાયુ મુખ્યત્વે વહેલી સવારે ખુલ્લા મેદાનમાં અને સમુદ્રકિનારાની હવામાં વધારે પ્રમાણમાં હોય છે. વળી, ઓઝોન વાયુ સ્વાસ્થ્યવર્ધક હોવાથી લોકો આવા સ્થળે વહેલી સવારમાં ચાલવા માટે જાય છે.

**વિચારો :** પર્વતારોહકો પર્વત ચઢતી વખતે સાથે ઓક્સિજનના બાટલા શા માટે રાખે છે.

વાતાવરણમાં રહેલા વિવિધ રજકણોને લીધે પૃથ્વી પર સૂર્યપ્રકાશ રેલાતો જોવા મળે છે. તેનાથી એકાએક અંધારું કે અજવાણું થતું નથી. સૂર્યોદય પહેલાં ઉધાકાળ અને સૂર્યાસ્ત પછી સંધ્યાના આકાશી રંગો આ રજકણોને આભારી છે. રજકણો દ્વારા પ્રકાશનાં કિરણોનું પરાવર્તન થાય છે અને આપણાને સૂર્યપ્રકાશ મળે છે.

વાતાવરણના માધ્યમથી અવાજ સાંભળી શકાય છે. અવાજ અને પ્રકાશનાં મોઝાં વાતાવરણમાં પરાવર્તન પામી પૃથ્વીસપાટી પર પાછા ફરે છે તેથી જ રેઝિયો અને દૂર્દર્શનનાં પ્રસારણ શક્ય બને છે. વાતાવરણ સાથેના ઘર્ષણથી ઉલ્કા જેવા અવકાશી પદાર્થો સળગી ઉઠી નાશ પામે છે. આમ, વાતાવરણ પૃથ્વી માટે ‘કુદરતી ઢાલ’ની ગરજ સારે છે.

**(4) જીવાવરણ (Biosphere) :** મૃદ્ગાવરણ, વાતાવરણ અને જલાવરણના જે ભાગમાં જીવસૃષ્ટિ વ્યાપેલ છે તેને ‘જીવાવરણ’ કહે છે. સૌર પરિવારમાં પૃથ્વી એક જ એવો ગ્રહ છે જેને ‘જીવાવરણ’ મળ્યું છે.

જીવાવરણમાં વિવિધ પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે. આ જીવસૃષ્ટિમાં માનવ તેમજ વનસ્પતિ અને પ્રાણીઓનો સમાવેશ થાય છે. પૃથ્વી પરના સજીવો ખોરાક જીવાવરણમાંથી મેળવે છે. જીવાવરણના સજીવો માનવજગતને વૈવિધ્યપૂર્ણ ખોરાક અને કાચો માલ પૂરો પાડે છે. આમ, માનવજીવનના અસ્તિત્વ અને નિર્વાહનો આધાર જીવાવરણ છે.

## માનવ-પ્રવૃત્તિઓની અસર :

જવાવરણ મોટે ભાગે સંતુલિત સ્થિતિમાં છે. પરંતુ માનવીય વિક્ષેપ જ્યારે સંતુલિત તંત્રમાં ખલેલ પહોંચાડે છે; ત્યારે ઘણી મુશ્કેલીઓ ઊભી થાય છે. પર્યાવરણનું શોષણ કરી કરતાં વિકાસને પરિણામે ફુદરતી પોષણકરી જોખમાય છે. આવી સ્થિતિ માનવ અને પર્યાવરણ માટે હાનિકારક છે.

### સ્વાધ્યાય



H7C5J3

#### 1. નીચેના પ્રશ્નોના એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

- (1) પૃથ્વી પરનાં મુખ્ય આવરણો કેટલાં છે ?
- (2) મૃદાવરણ એટલે શું ?
- (3) જલાવરણ શેનું બનેલું છે ?
- (4) વાતાવરણના મુખ્ય વાયુઓ કયા-કયા છે ?
- (5) જીવસૃષ્ટિમાં કોનો સમાવેશ થાય છે ?

#### 2. નીચેની ખાલી જગ્યા પૂરો :

- (1) પર્વતો, ઉચ્ચપ્રદેશો, મૈદાનો ..... આવરણમાં આવેલાં છે.
- (2) પૃથ્વીસપાટીથી આશરે ..... કિમી સુધી વાતાવરણ વિસ્તરેલું છે.
- (3) વાતાવરણમાં ..... વાયુનું પ્રમાણ સૌથી વધુ હોય છે.

#### 3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

- (1) વાતાવરણમાં ઓક્સિજન 150 કિમીની ઊંચાઈ સુધી હોય છે.
- (2) મહાસાગરો આપણા જળમાર્ગો બન્યા છે.
- (3) જવાવરણમાં અનેક પ્રકારની જીવસૃષ્ટિનો સમાવેશ થાય છે.
- (4) પૃથ્વીની સપાટી પર પાણી અને હવાને કારણે સજીવસૃષ્ટિ વિકાસ પામે છે.
- (5) ઓર્ઝેન વાયુ સૂર્યનાં પારજાંબલી કિરણોથી પૃથ્વી પરના સજીવોને બચાવે છે.

#### 4. ટૂંક નોંધ લખો :

- (1) વાતાવરણ (2) જલાવરણનું મહત્વ (3) મૃદાવરણનું મહત્વ

### • પ્રવૃત્તિ •

- પર્યાવરણના જતન માટે આપણે શું કરી શકીએ તેની ચર્ચા ચાર આવરણોના સંદર્ભે કરો.



11


## ભૂમિસ્વરૂપો

પૃથ્વીના પોપડાની અંદર સમયાંતરે હળનચલન થતું હોય છે. તે જમીનનાં સ્વરૂપો રચે છે અને બદલે છે. આવો અનુભવ પણ આપણને ભૂકુંપના આંચકાઓ દ્વારા તો ક્યાંક જવાળામુખી કે ત્સુનામી જેવી ઘટનાઓ દ્વારા થાય છે. આ હળનચલનથી ક્યાંક પર્વત, ઉચ્ચપ્રદેશ અને ફાટખીણાની રચના થાય છે. તે ઉપરાંત નદી, હિમનદી, પવન, સમુદ્રનાં મોઢાં જેવાં કુદરતી બળોના લીધે ધોવાણ અને નિક્ષેપણ કિયા દ્વારા કંપનાં મેદાનો, ખીણો અને કોતરોની રચના થાય છે.

પૃથ્વીસપાટીનો અમુક ભાગ ચોક્કસ ઊંચાઈ, ઠોળાવ અને આકાર પ્રાપ્ત કરે ત્યારે તેને ભૂમિસ્વરૂપ કહેવામાં આવે છે.

### ભૂમિસ્વરૂપના મુખ્ય પ્રકાર

પ્રદેશની ઊંચાઈ પ્રમાણે જમીન ભાગોને પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન વગેરે નામથી ઓળખવામાં આવે છે.



### 11.1 મુખ્ય ભૂમિસ્વરૂપો

**(1) પર્વત (Mountain) :** સમુદ્રસપાટીથી લગભગ 900 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તેમજ ઓછા કે તીવ્ર, ઠોળાવ અને સાંકડાં શિખરો ધરાવતાં વિસ્તારને 'પર્વત' કહે છે.

પૃથ્વીના પેટાળમાં ભૂકુંપ અને જવાળામુખી જેવાં કુદરતી ભौતિક બળોની કિયા, પ્રતિકિયા અને આંતરકિયાથી પર્વતો બને છે. પર્વતોના ઉદ્ભવ અને વિકાસમાં એકથી વધુ કિયાઓ અને બળોની અસર જોવા મળે છે. તેથી પર્વતો તેનાં વિવિધ પાસાઓના સંદર્ભમાં એકબીજાથી અલગ જોવા મળે છે.


**પર્વતોનું વર્ગીકરણ :** નિર્માણકિયાના આધારે પર્વતોને ચાર વિભાગમાં વહેંચવામાં આવે છે : (1) ગેડ પર્વત (2) ઝંડ પર્વત (3) જવાળામુખી પર્વત (4) અવશિષ્ટ પર્વત.

**(1) ગેડ પર્વત (Fold Mountain) :** મોટે ભાગે સમુદ્ર તળિયાના પ્રદેશો કે જળાશયોના તળિયે એકત્ર




E6Q9R5

થયેલા નિક્ષેપમાં બંને બાજુએથી દબાણ આવતાં કરચલીઓ કે ગેડ પડે છે. તેના ઉર્ધ્વવળાંકને આપણો શિખર તરીકે અને અધોવળાંકને ખીણ કે તળેટી સ્વરૂપે જોઈ શકાય છે.




એશિયામાં હિમાલય, યુરોપમાં આલ્પ્સ, ઉત્તર અમેરિકામાં રોકિઝ અને દક્ષિણ અમેરિકામાં એન્ટિઝ દુનિયાના મુખ્ય ગેડ પર્વત છે.




11.3 ખંડ પર્વત

#### (2) ખંડ પર્વત (Block Mountain) :

ભૂગર્ભિક બળોને લીધે બે ભૂમિસ્તરો પર બેંચાણબળ લાગે છે ત્યારે તેમાં તિરાઠ કે ફાટ પડે છે. આથી આજુબાજુનો ભાગ બેસી જાય, વચ્ચેનો ભાગ સ્થિર રહે તો તે ખંડપર્વત અને નીચે બેસી જતાં ભાગમાં ફાટખીણ રચાય છે. જર્મનીનો હોસ્ટ પર્વત તેનું શ્રેષ્ઠ ઉદાહરણ હોવાથી ખંડ પર્વતને હોસ્ટ પર્વત પણ કહેવામાં આવે છે. ભારતમાં આવેલા નિલગીરી, સાતપુડા, વિંધ્યાચલ પર્વત ખંડ પર્વતનાં ઉદાહરણો છે.



11.4 જવાળામુખી પર્વત



11.5 અવશિષ્ટ પર્વત

#### (4) અવશિષ્ટ પર્વત (Residual Mountain) :

ઘસારાનાં કુદરતી બળો સામે ટકી રહેતા શેષ ભાગોમાંથી અવશિષ્ટ પર્વત બને છે. હજારો વર્ષથી પોચા ખડકો ઘસાઈને વહી જાય છે તથા નક્કર ખડકમાંથી બનેલ ભૂમિ ભાગ ઊંચા ભૂમિખંડ તરીકે ટકી રહે છે તેને જ અવશિષ્ટ પર્વત કહે છે. ભારતમાં અરવલ્લી, નીલગીરી, પારસનાથ, રાજમહલ તથા પૂર્વધાટ અવશિષ્ટ પર્વતનાં ઉદાહરણો છે.

#### પર્વતોનું મહત્વ :

પર્વતો દેશ કે પ્રદેશની સીમા-સરહદ અને કુદરતી દીવાલ સમાન છે અને ઠંડા પવનથી રક્ષા કરે છે, તો

ભેજવાળા પવનો રોકીને વધારે વરસાદ આપે છે. પર્વતો નદીઓનાં ઉદ્ગમસ્થાન છે. તેમાંથી નીકળતી નદીઓ દ્વારા ફળદુષ મેદાનોનું નિર્માણ થાય છે. વધુ વરસાદવાળા, ઊંચા હિમાયથાદિત પ્રદેશમાંથી બારેમાસ વહેતી નદીઓ જળભંડારનું કામ કરે છે. જળવિધૂત ઉત્પન્ન કરવા માટે તે જરૂરી છે. ઉપરાંત પર્વતો, જંગલસંપત્તિ, ખનિજસંપત્તિ અને પ્રાણીસંપત્તિના બંદાર છે. પ્રવાસન ઉદ્ઘોગ, ચલચિત્ર ઉદ્ઘોગ તથા પર્વતારોહકો માટે પર્વતો આશીર્વાદરૂપ છે. વિશ્વની કુલ વસ્તીના દશમા ભાગની વસ્તી માટે રહેઠાણનું સ્થાન છે, તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે મેક્સિકો અને બગોટા.


આટલું જાણો			
ક્રમ	વિકસિત શહેર	દેશ	ઉંચાઈ
1.	મેક્સિકો	મેક્સિકો	2300 મીટર
2.	ક્રિટો	ઇક્વેડોર	2386 મીટર
3.	બગોટા	કોલંબિયા	2625 મીટર
4.	લેહ	ભારત	3500 મીટર
5.	હાસા	તિબેટ (ચીન)	3520 મીટર
6.	લાપાઝ	ઓલિવિયા	3640 મીટર

### ઉચ્ચપ્રદેશ (Plateau)


સમુદ્રસપાટીથી આશરે 180 મીટરથી વધુ ઊંચાઈ ધરાવતા તથા ટોચ ઉપરથી પ્રમાણમાં પહોળા અને સપાટ ભૂમિ ભાગને ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે.



**ઉચ્ચપ્રદેશોનું વર્ગીકરણ :** ભૌગોલિક સ્થાન અને સંરચનાના આધારે ઉચ્ચપ્રદેશોને ગ્રાન્ય ભાગમાં વહેંચી શકાય છે : (1) આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ (2) પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ (3) ખંડીય ઉચ્ચપ્રદેશ.



**(1) આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ (Intermontane Plateau) :** ચારેબાજુથી ઊંચી પર્વતમાળાઓથી પૂર્ણ રીતે કે આંશિક રીતે ઘેરાયેલ ભૂમિ ભાગને આંતરપર્વતીય ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે. તિબેટનો ઉચ્ચપ્રદેશ અને મોંગોલિયાનો ઉચ્ચપ્રદેશ તેનાં ઉદાહરણો છે.




11.7 પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ

**(2) પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ (Piedmont Plateau) :** પર્વતોની તળેટીમાં એક તરફ સીધો ઢોળાવ ધરાવતા પ્રદેશને પર્વતપ્રાંતીય ઉચ્ચપ્રદેશ કહેવામાં આવે છે. પેન્ટાગોનિયા (દ. અમેરિકા) પીડમોન્ટ (યુ.એસ.) ભારતમાં માળવાનો ઉચ્ચપ્રદેશ તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.

### (3) ખંડીય ઉચ્ચપ્રદેશ (Continental Plateau)

**Plateau**) : ભૂગર્ભિક હલનયલનથી ઉચ્કાયેલા ભૂમિ ભાગને કે મોટા ભૂમિ ભાગ પર લાવાના સ્તરો ખૂબ ઊંચાઈ સુધી ઠરવાથી ખંડીય ઉચ્ચપ્રદેશનું નિર્માણ થાય છે. ભારતમાં મહારાષ્ટ્રનો લાવાનો ઉચ્ચપ્રદેશ, બ્રાજિલનો ઉચ્ચપ્રદેશ, અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ, સ્પેન, ગ્રીનલેન્ડ, ઓન્ટાર્કટિકનો અરબસ્તાનનો ઉચ્ચપ્રદેશ તેનાં ઉદાહરણો છે.



11.8 ખંડીય ઉચ્ચપ્રદેશ

**ઉચ્ચપ્રદેશનું મહત્વ :** ઉચ્ચપ્રદેશની લાવાની ફળકૃપ જમીન હોય તો કપાસની ખેતી માટે અનુકૂળ બને છે. પ્રાચીન નક્કર ખડકના ઉચ્ચપ્રદેશમાંથી લોખંડ, મેંગેનીજ, સોનું જેવી કીમતી ખનિઓ મળે છે. જેમ કે ભારતનો છોટાનાગપુરનો ઉચ્ચપ્રદેશ. આ ઉચ્ચપ્રદેશના ઢોળાવો પશુપાલન માટે ખૂબ જ મહત્વના છે. પ્રવાસન અને ફિલ્મ શૂટિંગ માટે ઉપયોગી છે.

#### આણવા જેવું

- ગુજરાતના સૌરાષ્ટ્રની લગભગ મધ્યમાં ઉચ્ચપ્રદેશની રૂચના થયેલી છે.

#### મેદાન

સમુદ્રસપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈએ આવેલા સમતલ કે સપાટ ભૂમિ ભાગને મેદાન તરીકે ઓળખવામાં આવે છે. દુનિયાના મોટાભાગના મેદાન નદીઓ દ્વારા ઠલવાયેલ માટીમાંથી નિર્માણ પામ્યાં છે. નદીઓ સિવાય કેટલાંક મેદાનોનું નિર્માણ પવન, જવાળામુખી અને હિમનદીઓ દ્વારા પણ થાય છે.



M2L3Z8

**મેદાનોનું વર્ગીકરણ :** નિર્માણના આધારે મેદાનોનું વર્ગીકરણ આ પ્રમાણે કરી શકાય : (1) કિનારાનાં મેદાન (સંરચનાત્મક મેદાન) (2) ઘસારણનાં મેદાન (3) નિક્ષેપણનાં મેદાન.

**(1) કિનારાનાં મેદાન (Costal Plain/Constructive Plain) :** આ મેદાનનું નિર્માણ મુખ્યત્વે સમુદ્રકિનારા એટલે કે પૃથ્વીની ભૂગર્ભિક હિલયાલને કારણે સમુદ્રકિનારા નજીકનો ખંડીય છાજલીનો ભૂમિભાગ ઊંચાય ત્યારે બનતા મેદાનને સંરચનાત્મક મેદાન કહે છે. આવા મેદાન મોટેભાગે ભૂમિખંડના કિનારે જેવા મળે છે. મેક્સિકોના અભાતના કિનારે ફેલાયેલ સંયુક્ત રાજ્ય અમેરિકાના દક્ષિણ-પૂર્વ આવેલ મેદાન તેનું ઉદાહરણ છે. જમીનના તળિયા ઘસાવાના કારણે પણ આવા મેદાનનું નિર્માણ થાય છે. ઓસ્ટ્રેલિયાનું મધ્યનું મેદાન આ પ્રકારે નિર્માણ પામ્યું છે.

**(2) ઘસારણનાં મેદાન (Erosional Plain) :** પૃથ્વીની સપાટી પર સતત ઘસારણની પ્રક્રિયા ચાલતી રહે છે, જેનાથી લાંબે ગાળે પર્વતો તથા ઉચ્ચપ્રદેશો નદી, પવન અને હિમનદી જેવાં પરિબળો દ્વારા ઘસાઈને મેદાન બને છે. આવા મેદાન સંપૂર્ણપણે સપાટ બનતા નથી. નક્કર ખડકોની ટેકરીઓ વચ્ચે-વચ્ચે જેવા મળે છે. ઉત્તર કેનેડા અને પશ્ચિમ સાઈબીરિયાના મેદાન ઘસારણથી નિર્માણ પામ્યા છે. ઘસારણ દ્વારા બનેલ મેદાનોને ‘પેની પ્લેઇન’ પણ કહે છે.

**(3) નિક્ષેપણનાં મેદાન (Depositional Plain) :** નદી, હિમનદી, પવન વગેરે પરિબળો દ્વારા પથરાયેલ કંપના નિક્ષેપણથી સરોવર કે સમુદ્ર જેવા કોતરો ભરાવાથી આવા મેદાનનું નિર્માણ થાય છે. તેથી તેને નદીકૂત કે કંપના મેદાન પણ કહેવામાં આવે છે. ભારતમાં ગંગા-યમુનાના મેદાન, ઉત્તર ચીનમાં હવાંગહોનું મેદાન, ઈટાલીમાં

પોનદી દ્વારા બનેલ લોમ્બાઈનું મેદાન કંપના મેદાનનાં વિશિષ્ટ દણાંત છે. જ્યારે મેદાનોનું નિર્માણ સરોવરમાં કંપના નિક્ષેપણથી થાય છે ત્યારે તેને ‘સરોવરના મેદાન’ કહે છે. કશ્મીરની ખીણો ભારતમાં સરોવરના મેદાનનું ઉદાહરણ છે.

**મેદાનોનું મહત્વ :** માનવવસાહતો અને વાપાર-વાણિજ્યનાં સ્થાનો ફળદ્વારા મેદાનોમાં સ્થપાય છે. સપાટ મેદાન સડકમાર્ગ અને રેલમાર્ગ માટે ઉપયોગી પુરવાર થયા છે. ગીયવસતી ધરાવતાં શહેરો મેદાનોમાં આવેલાં છે. ફળદ્વારા જમીન ખેત-ઉત્પાદન માટે વધુ ઉપયોગી છે. ખેતપેદાશો ઉદ્યોગો માટે કાચો માલ પૂરો પાડે છે.

## ઉપસાગર (Bay)

સામાન્ય રીતે મહાસાગરના જળભાગનો આંશિકભાગ એટલે ઉપસાગર. જે ફરતેની જમીનથી ખુલ્લા વિશાળ સરોવર જેવો આકાર ધારણ કરે છે. ઉપસાગરો વિશાળ અને નાના કદના હોઈ શકે છે. ભારતમાં બંગાળનો ઉપસાગર તેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે.



## અખાત (Gulf)

જ્યારે કોઈ જળવિસ્તાર ત્રણ બાજુથી ભૂમિથી ઘેરાયેલ હોય તેને અખાત કહેવાય છે. ઉદાહરણ તરીકે ખંભાતનો અખાત અને કચ્છનો અખાત.

## ભૂશિર (Cape)

ભૂશિર એટલે ભૂમિનો લંબાત્મક છેડો જે જળભાગમાં ફેલાયેલ હોય છે, જેને સમુક્રદેખા તરીકેની સંજ્ઞા પણ આપી શકાય. દા.ત. કન્યાકુમારી (ભારત) અને કુપ ઓફ ગુડ હોપ (આફિકા)

## ટાપુ (Island)

જે ભૂમિભાગ ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ હોય તેને ટાપુ તરીકે ઓળખવામાં આવે છે. ઉદાહરણ તરીકે લક્ષ્ણદીપ, અંદમાન-નિકોબાર શંખોદ્વાર (બેટ દ્વારકા), પિરોટન, નરાબેટ, પિરમબેટ, શિયાળ બેટ વગેરે.

## ખીણ (Valley)

પર્વતોની હારમાળા વચ્ચે આવેલો નીચાણવાળો ભાગ. ગેડ પર્વતો અને ખંડ પર્વતોના નિર્માણ વખતે તથા નદી, હિમનદીના ધસારણ કાર્યના પરિણામે ખીણોની રચના થાય છે. દા.ત., કશ્મીર ખીણ.

## સામુક્રદ્ધુની (Strait)

બે જળ વિસ્તારોને જોડતી સાંકડી જળપણીને સામુક્રદ્ધુની કહે છે. ઉદાહરણ : ભારત અને શ્રીલંકા વચ્ચે આવેલી પાલકની સામુક્રદ્ધુની.

## સંયોગીભૂમિ (Isthmus)

બે જળ વિસ્તારોને અલગ કરતી સાંકડી ભૂમિપણીને સંયોગીભૂમિ કહે છે. ઉદાહરણ : પનામા (ઉત્તર અને દક્ષિણ અમેરિકા ખંડ વચ્ચે)

## દ્વીપકલ્પ (Peninsula)

જે ભૂમિભાગની ત્રણ બાજુ સમુક્ર અને એક બાજુ જમીન વિસ્તારથી જોડાયેલ હોય તેને દ્વીપકલ્પ કહે છે. દા.ત. દક્ષિણ ભારત, સૌરાષ્ટ્ર.

स्वाध्याय



## 1. નીચેના પ્રશ્નોના ઉત્તર લખો :

- (1) ભૂમિસ્વરૂપ કોને કહેવાય ?
  - (2) પર્વત એટલે શું ? તેના મુખ્ય પ્રકારો ક્યા છે ?
  - (3) ઉચ્ચપ્રદેશ અને મેદાન વચ્ચેનો તફાવત જણાવો.

## 2. યોગ્ય વિકલ્પ વડે ખાલી જગ્યા પૂરો :



### 3. મને ઓળખી કાઢો :

- (1) હું જમીનથી ત્રણ બાજુથી ઘેરાયેલો છું.....

(2) મારો છેડો જળભાગમાં અમૃક વિસ્તાર સુધી ફેલાયેલો રહે છે.....

(3) હું ચારેબાજુથી જળવિસ્તારથી ઘેરાયેલ છું.....

(4) હું બે જળવિસ્તારોને જોડું છું.....

(5) મારી ત્રણ બાજુ સમૃક્ર અને એક બાજુ જમીન છે.....

#### 4. ટૂંક નોંધ લખો :



D7L2K2

12

## નક્શો સમજીએ

પ્રવાસીઓ ગુજરાતનાં જુદાં-જુદાં પ્રવાસનસ્થળો જેવા કે સોમનાથ, દ્વારકા, તરણોત્તર, અંબાજી, ધોરડો, સાપુત્રારા વગેરે સ્થળોની મુલાકાત લે છે. તેઓ આ પ્રવાસનસ્થળોના ભૌગોલિક વિસ્તારથી અજાણ હોવા છતાં પોતે નિશ્ચિત કરેલ સ્થળો સુધી ખૂબ જ સરળતાથી પહોંચી જાય છે, તેનું કારણ શું? કારણ માત્ર એટલું જ કે તેમની પાસે પ્રવાસનસ્થળો દર્શાવતો નક્શો હોય છે. તેઓ નકશાવાચન દ્વારા પોતાના પ્રવાસનસ્થળ અંગેની માહિતી પ્રાપ્ત કરી શકે છે.

વર્તમાન સમયમાં પ્રવાસ ઉપરાંત બીજા અનેક પ્રકારના હેતુઓ માટે નક્શા ખૂબ જ ઉપયોગી બની ગયા છે. આજે તો વિજ્ઞાન અને ટેક્નોલોજીના યુગમાં GPS (Global Position System)ની મદદથી તમે વિશ્વના કોઈપણ સ્થળે સ્વયં પહોંચી શકો છો. આપણે આ પ્રકરણમાં નક્શા વિશે સમજ મેળવીએ.

પૃથ્વીનો ગોળો પૃથ્વીનો અભ્યાસ કરવા માટે ઉપયોગી છે પણ પૃથ્વીના કોઈ એક ખંડ, દેશ, રાજ્ય, જિલ્લા, તાલુકા, શહેર કે ગામનો અભ્યાસ કરવા માટે નક્શો વધારે ઉપયોગી છે.

નક્શા શરૂઆતનો અંગ્રેજ પર્યાય ‘Map’ છે. મૂળ લેટિન ભાષાનો શરૂ ‘Mappa Mundi’ (મેપા મુન્ડી) ઉપરથી અપભ્રંશ થઈને ‘Map’ બન્યો છે. તેનો અર્થ ‘હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો’ એવો થાય છે. સામાન્ય અર્થમાં નક્શો પૃથ્વીની સપાઠી અથવા તેના કોઈ એક ભાગના સપાઠ કાગળ પરના આલેખનને નક્શો કહેવાય છે. મોટો વિસ્તાર ધરાવતા પ્રદેશની ઘણીબધી વિગતોને નકશામાં સમાવેશ કરી શકાય છે.

### નકશાપોથીના નક્શા (Atlas Map)

પૃથ્વી અથવા તેના વિશાળ ભાગની બહુવિધ વિગતો દર્શાવતા નકશાના સમૂહને નકશાપોથી કહે છે. તેમાં રાજ્યકીય, વહીવટી, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવેલ હોય છે. નકશાની મદદથી જે-તે પ્રદેશની સંપૂર્ણ વિગતો જાણી શકાય છે. નક્શા વિવિધ પ્રદેશની મહત્વની વિગતો જેવી કે પ્રાકૃતિક (પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન, નદી, સરોવર વગેરે) અને સાંસ્કૃતિક (પરિવહન, ઉદ્યોગો, ખેતી, સિંચાઈ વગેરે) દર્શાવે છે.

### નકશાના પ્રકાર

નકશાના મુખ્ય બે પ્રકાર છે : હેતુ આધારિત નક્શા અને માપ પ્રમાણે નક્શા.

**(1) હેતુઓ આધારિત નક્શા (Thematic Map) :** આ પ્રકારના નક્શા જરૂરિયાત પ્રમાણેની વિગતોના આધારે તૈયાર કરવામાં આવે છે. હેતુ આધારે તૈયાર થતા નકશાને તેમાં દર્શાવતી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોના આધારે મુખ્ય બે વિભાગમાં વર્ગીકૃત કરવામાં આવે છે : (A) પ્રાકૃતિક નક્શા (B) સાંસ્કૃતિક નક્શા.



Y9J5Y5

**(A) પ્રાકૃતિક નક્શા (Physical Map) :** કુદરત નિર્ભિત વિગતોનું આલેખન કરતા નકશાઓને પ્રાકૃતિક નક્શા કહે છે. પ્રાકૃતિક નકશામાં પૃથ્વીના પ્રાકૃતિક ભૂમિસ્વરૂપો જેમ કે પર્વત, ઉચ્ચપ્રદેશ, મેદાન, નદીઓ, મહાસાગરો વગેરે દર્શાવવામાં આવે છે. વન્ય પ્રાણીઓ, વનસ્પતિ-જંગલો, ખનીજ વગેરેનું વિવરણ દર્શાવતા નકશાઓ પ્રાકૃતિક નકશાના ભાગ છે.

- (i) ભૂપૃષ્ઠના નકશા : આ નકશામાં પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનો, જળપરિવાહ વગેરે દર્શાવેલ હોય છે.
- (ii) હવામાન/આબોહવાના નકશા : સ્થળ કે પ્રદેશના હવામાન આબોહવાના તત્ત્વો-તાપમાન, વરસાદ, પવનો વગેરેની માહિતી દર્શાવે છે.

- (iii) ખગોળીય નકશા : ગ્રહો, ઉપગ્રહો, આકાશગંગા, નક્ષત્રો વગેરે અવકાશી પદાર્થોની માહિતી આપતા નકશા ખગોળીય નકશા કહે છે.

**(B) સાંસ્કૃતિક નકશા :** માનવસર્જિત વિગતોનું આલેખન કરતા નકશાને સાંસ્કૃતિક નકશા કહે છે. આ નકશામાં માનવીની વિવિધ પ્રવૃત્તિઓનો નિર્દેશ કરેલ હોય છે. રાજકીય નકશો, ખેતી, વસતી, પરિવહનના નકશા સાંસ્કૃતિક નકશાનાં ઉદાહરણ છે.

- (i) રાજકીય નકશા : ખંડ, દેશ, સ્થાનિક વહીવટીતંત્ર તથા તેની સરહદોની માહિતી આપતા નકશાને રાજકીય નકશા કહે છે.

- (ii) ઔદ્યોગિક નકશા : ઔદ્યોગિક ક્ષેત્રો, ઉદ્યોગોનો તબક્કાવાર ઈતિહાસ, ઉત્પાદન વગેરેની માહિતી ઔદ્યોગિક નકશાઓમાં આપવામાં આવે છે.

- (iii) ઐતિહાસિક નકશા : પ્રાદેશિક કે રાષ્ટ્રીય વહીવટી તંત્રનો ઈતિહાસ દર્શાવતા નકશા ઐતિહાસિક નકશા કહે છે.

આ સિવાય માપ પ્રમાણે પણ બે પ્રકાર છે :

**(2) માપ આધારે નકશાના પ્રકાર :** સામાન્ય રીતે એક નકશાનું પ્રમાણમાપ 1 સેન્ટિમીટર : 50 કિલોમીટર કરતાં ઓછું હોય તો તેને મોટા માપના નકશા કહે છે. અહીં નકશામાં એક સેન્ટિમીટર બરાબર 50 કિલોમીટર પૃથ્વી પર વાસ્તવિક અંતર દર્શાવે છે. મોટા માપના નકશામાં વિગતો વધારે દર્શાવેલ હોય છે. જેમ કે તાલુકા, શહેર કે ગામના નકશા મોટા માપના નકશાના ઉદાહરણ છે. નાના માપના નકશામાં પૃથ્વીસપાઈનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. જેમ કે જુદા-જુદા ખંડ કે દેશના નકશાને નાના માપના નકશા કહે છે. વિશ્વનો નકશો, દેશના નકશા, નકશાપોથીના નકશા નાના માપના નકશાના ચાર પ્રકાર છે : (1) ઓટલાસ (2) કેટેસ્ક્રૂલ (3) સ્થળવર્ઝન (4) ભીતનકશા.

નીચે આપેલ કોષ્ટકમાં તમારી શાળામાં ઉપલબ્ધ નકશાઓની યાદી તૈયાર કરો. નકશાઓમાં કઈ વિગત દર્શાવેલી છે તેની નોંધ કરો :


કોષ્ટક

ક્રમ	નકશાનું નામ	નકશાની વિગત
1.		
2.		
3.		
4.		
5		


નીચે આપેલ નકશાઓનું અવલોકન કરી તેના પ્રકારની નોંધ કરો.



12.1 ગુજરાત



12.2 ભારત



12.3 भारत



12.4 दुनिया


## આટલું જાણો :

ભારતમાં નકશાઓ બનાવતી મુખ્ય ત્રાણ સંસ્થાઓ છે.

- NATMO (નેશનલ એટલાસ થિમેટિક મેપ ઓર્ગનાઇઝેશન) આ સંસ્થા કોલકાતામાં આવેલી છે. તે વિતરણ દર્શાવતા નકશાઓનું નિર્માણ કરે છે.
- NRSA (નેશનલ રિમોટ સેન્સિંગ એજન્સી) આ સંસ્થા હૈદરાબાદમાં આવેલી છે. તે ઈસરો દ્વારા અવકાશમાં સ્થાપિત ઉપગ્રહ દ્વારા લેવાયેલ તસવીરથી નકશાઓ તૈયાર કરે છે.
- સર્વે ઓફ ઇન્ડિયા - આ સંસ્થા દેહરાદૂન ખાતે આવેલી છે. આ સંસ્થા નકશાનિર્માણ અને તેના ઉપયોગ માટેની મંજૂરી આપે છે. આપણા પાઈચ્યુપ્સ્ટકના નકશા આ સંસ્થા દ્વારા પ્રમાણિત કરેલ છે.


**નકશાનાં અંગો :** નકશાનાં મુખ્ય ત્રાણ અંગો છે : આ ત્રાણ અંગ દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ છે.

**દિશા (Direction) :** સામાન્ય રીતે તમે નકશામાં અવલોકન કરો છો ત્યારે તમે ચિહ્ન  જુઓ છો. આ તીરનું નિશાન ઉત્તર દિશાનો સંકેત કરે છે. જ્યારે તમને ઉત્તર દિશાનું જ્ઞાન હોય તો અન્ય બીજી દિશાઓ પણ નક્કી કરી શકો છો. તમે ઊગતા સૂર્ય સામે મુખ રાખીને ઊભા રહો તો તમારો ડાબો હાથ ઉત્તર દિશા બાજુ અને જમણો હાથ દક્ષિણ દિશા બાજુ આવશે. તમે ઊગતા સૂર્ય સામે ઊભા છો તે તમારી પૂર્વ દિશા છે અને પીઠ બાજુની પથ્થિમ દિશા છે.



12.5 દિશા-ખૂણા

ઉપર્યુક્ત આંકૃતિ 12.5માં ચાર મુખ્ય દિશાઓ દર્શાવેલ છે. જ્યારે અન્ય ચાર ખૂણાઓ (મધ્યવર્તી દિશાઓ) છે. ઉત્તર-પૂર્વને ઈશાન, દક્ષિણ-પૂર્વને અજીન, દક્ષિણ-પથ્થિમને નૈત્રાત્મય અને ઉત્તર-પથ્થિમને વાયવ્ય દિશા કહે છે. દિશાઓ અને ખૂણાઓ (મધ્યવર્તી દિશાઓ)ની મદદથી નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે.



આકृતिनા આધારે નીચેના પ્રશ્નોના જવાબ લખો :

- (1) મંદિરની દિશા .....
- (2) પોસ્ટઓફિસથી કૂવાની દિશા .....
- (3) તળાવથી પાણીની ટાંકીની દિશા .....
- (4) ખેતરથી પોસ્ટઓફિસની દિશા .....

### 12.6 ગમનું રેખાંકન

#### • આટલું જાણો •

#### ● હોકાયંત્ર

ચુંબકના ગુણવર્ભને આધારે વિકસાવવામાં આવેલ સાધનને હોકાયંત્ર કહે છે. હોકાયંત્ર કાચથી ઢંકાયેલું બોક્સની અંદર એક ચુંબકીય સોય ધરી પર રાખેલી હોય છે જે મુક્ત રીતે ફરી શકે છે. સોય ઉપર N અને S દર્શાવેલ હોય છે. હોકાયંત્રનો ઉપયોગ વહાણા, સ્ટીમર, સબમરિન, વિમાન વગેરેમાં દિશાનિર્ધારણ માટે થાય છે.



12.7 હોકાયંત્ર

#### • વિચારો •

- હોકાયંત્રની સોય હંમેશાં ઉત્તર-દક્ષિણ દિશા તરફ જ શા માટે હોય છે ?

#### પ્રમાણમાપ (Scale)

પૃથ્વી ઉપરના કોઈ પણ બે સ્થળ વચ્ચેનું અંતર અને તે બંને સ્થળોના નકશા ઉપરના અંતર વચ્ચેના ગુણોત્તરને પ્રમાણમાપ કહે છે. પ્રમાણમાપ 1 સેમી : 100 કિમી હોય એટલે કે નકશામાં દર્શાવેલ એક સેન્ટિમીટર વાસ્તવિક પૃથ્વી પરનું અંતર 100 કિલોમીટર છે. અંતર દોરી કે માપપદ્ધીની મદદથી શોધી શકાય છે.

## રૂઢ સંજ્ઞાઓ (Conventional Signs)

વિદ્યાર્થીભિત્રો, તમે ધરેથી શાળાએ આવો છો ત્યારે કેટલાંક વિશિષ્ટ ચિહ્નો કે પ્રતીકોનું અવલોકન કર્યું હશે. નીચે આપેલ કોષ્ટકમાં તમે જોયેલાં ચિહ્નો દોરો અને તેની વર્ગાંડમાં ચર્ચા કરો.



### 12.8 સંકેતને ઓળખો

નકશામાં જુદી-જુદી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવવા કેટલાંક વિશિષ્ટ ચિહ્નોનો ઉપયોગ થાય છે તેને રૂઢ સંજ્ઞાઓ કહે છે. નકશામાં રૂઢ સંજ્ઞાઓ દર્શાવવા માટે નિશ્ચિત અક્ષરો, ધ્યાય-પ્રકાશ, રંગો, ચિત્રો અને રેખાઓનો ઉપયોગ કરવામાં આવે છે. આ રૂઢ સંજ્ઞાઓની મદદથી પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો સરળતાથી દર્શાવી શકાય છે. નકશાની રૂઢ સંજ્ઞાઓની ભાષા/ચિહ્નો સરળ અને સર્વમાન્ય ભાષા છે. આ ચિહ્નો સંદર્ભે આંતરરાષ્ટ્રીય સમજૂતી હોવાથી નકશાઓમાં રૂઢ સંજ્ઞાઓનો ઉપયોગ થાય છે. નીચે આપેલ કોષ્ટકમાં રૂઢ સંજ્ઞાઓનું અવલોકન કરો અને તમારા શિક્ષકની મદદથી સમજો :

બાબત	રૂઢ સંજ્ઞા	બાબત	રૂઢ સંજ્ઞા
પર્વત		નકશાની ઉત્તર દિશા	
ટેકરી		જિલ્લાની સીમા	— — —
શિખર		રાજ્યની સીમા	• • • •
ધાર		આંતરરાષ્ટ્રીય સરહદ	— — — —
નદી		પ્રમાણમાપ	
નદીઓનો સંગમ		દેશની રાજ્યાની	
નદી પરનો બંધ		રાજ્યનું પાટનગર	
પાકો માર્ગ		જિલ્લાનું મથક	
રેલમાર્ગ		શહેર	
દીવાદંડી		જંગલો	
પોસ્ટઓફિસ	PO	પોલીસ-સ્ટેશન	PS
સર્કિટહાઉસ	CH	પોસ્ટ અને તારઓફિસ	PTO

### 12.9 રૂઢ સંજ્ઞાઓ

ચિક્કો ઉપરાંત નકશામાં જુદા-જુદા રંગ અને રંગસ્તરથી વિભિન્ન પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતો દર્શાવી શકાય છે. નીચે આપેલ કોષ્ટકમાં પ્રાકૃતિક અને સાંસ્કૃતિક વિગતોને રંગ વડે દર્શાવેલ છે :

વિગત	રંગ	રંગ
ભૂમિ-સ્વરૂપ	કથણી/બદામી	[Color Box]
જળ-સ્વરૂપ	વાદળી	[Color Box]
વનસ્પતિ પ્રદેશ	લીલો	[Color Box]
રેલમાર્ગ	કાળો	[Color Box]
જમીનમાર્ગ	લાલ	[Color Box]
ખેતી	પીળો	[Color Box]


### 12.10 રંગસ્તર સંકેત

#### ભારતનું સ્થાન

ભારત એક વિશાળ ભૂમિભાગ છે. ભારત દેશ પૃથ્વી પર ઉત્તર-પૂર્વ ગોળાઈંમાં આવેલ છે. ભારત એશિયા ખંડમાં દક્ષિણ ભાગમાં આવેલો છે. ભારતની ઉત્તરે હિમાલય પર્વતમાળા આવેલી છે. પૂર્વ દિશાએ બંગાળનો ઉપસાગર અને પશ્ચિમ દિશાએ અરબસાગર આવેલો છે. ભારતનો મુખ્ય ભૂમિખંડનો વિસ્તાર  $8^{\circ} 4'$  થી  $37^{\circ} 6'$  ઉત્તર અક્ષાંશ અને  $68^{\circ} 7'$  થી  $97^{\circ} 25'$  પૂર્વ રેખાંશવુત વચ્ચે આવેલો છે. ભારતના લગભગ મધ્યમાંથી કર્કવૃત પસાર થાય છે.

વર્તમાન સમયમાં ભારતને વહીવટી સરળતા માટે 28 રાજ્યો, 7 કેન્દ્રશાસિત પ્રદેશ અને 1 રાજ્યીય રાજ્યાની પ્રદેશમાં વહેંચવામાં આવેલ છે.

(નોંધ : આ માહિતી વર્ષ: 2019ના પ્રારંભ સુધીની છે.)



## 12.11 ભારત રાજકીય

## સ્વાધ્યાય

### 1. ખાલી જગ્યાઓ પૂરો :

- (1) મેપા મુન્ડી ..... ભાષાનો શબ્દ છે.
- (2) નકશાનાં મુખ્ય ..... અંગો છે.
- (3) સાંસ્કૃતિક નકશામાં ..... વિગતો દર્શાવેલ હોય છે.



### 2. નીચે 'અ' વિભાગની વિગતો સામે 'બ' વિભાગની વિગતોને જોડો :

અ	બ
(1)	(a) પોસ્ટઑફિસ
(2) PO 6	(b) આંતરરાષ્ટ્રીય સીમા
(3)	(c) નદી
(4)	(d) પ્રમાણમાપ
(5)	(e) ઉત્તર દિશા
	(f) પોલીસ-સ્ટેશન

### 3. નીચેનાં વિધાનો પૈકી ખરાની સામે (✓)ની અને ખોટા સામે (✗)ની નિશાન કરો :

- (1) મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલ હોય છે.
- (2) નકશામાં વનસ્પતિના પ્રદેશ લીલા રંગથી દર્શાવેલ હોય છે.
- (3) ભારત પૃથ્વી પર ઉત્તર-પશ્ચિમ ગોળાઈમાં આવેલ છે.
- (4) જુદા-જુદા ખંડ દર્શાવતો નકશો મોટા માપનો નકશો છે.

### 4. એક-બે વાક્યમાં ઉત્તર આપો :

- (1) હેતુ આધારિત નકશાના પ્રકાર લખો.
- (2) રૂઢ સંજ્ઞા એટલે શું ?
- (3) કેન્દ્રશાસિત પ્રદેશ કોને કહેવાય ?

### 5. ટૂંકમાં ઉત્તર આપો :

- (1) પ્રાકૃતિક અને સાંસ્કૃતિક નકશા વચ્ચેના તફાવત જણાવો.
- (2) માપના આધારે નકશાના પ્રકાર જણાવી નાના માપના નકશાનાં બે ઉદાહરણો લખો.
- (3) નકશાના મુખ્ય અંગ જણાવી પ્રમાણમાપ વિશે લખો.
- (4) નકશાના આધારે ભારતના સ્થાન વિશે ટૂંકમાં જણાવો.

## 6. નીચે આપેલ નકશાનું અવલોકન કરી ઉત્તર આપો :



12.12 ભારત રાજકીય

- (1) હિમાયલ પ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલ છે ?
- (2) મધ્યપ્રદેશ રાજ્ય ગુજરાતની કઈ દિશાએ આવેલ છે ?
- (3) અરુણાચલપ્રદેશ રાજ્ય ભારતમાં કઈ દિશાએ આવેલું છે ?
- (4) કેરલ રાજ્યની ઉત્તર દિશાએ ક્યું રાજ્ય આવેલું છે ?
- (5) ગુજરાતની દક્ષિણ દિશાએ ક્યો કેન્દ્રશાસિત પ્રદેશ આવેલો છે ?

### ● વધુ વિગતો જાગ્રવા નીચેની વેબસાઇટની મુલાકાત લો :

[www.surveyofindia.gov.in/](http://www.surveyofindia.gov.in/)

<http://www.natmo.gov.in>

<https://nrsa.gov.in/>



ભારત વિશાળ ભૌગોલિક વિસ્તારવાળો દેશ છે. વળી તે ભૌગોલિક વિવિધતા ધરાવે છે. આ વૈવિધ્ય આપણને વિસ્મય પમાડે છે. ઉત્તરમાં હિમાલયની પર્વતમાળા જેનાં ઊંચાં શિખરો બારેમાસ બરફથી ઢંકાયેલાં રહે છે. પૂર્વમાં બંગાળનો ઉપસાગર, પશ્ચિમે અરબસાગર અને દક્ષિણમાં હેંદ મહાસાગર આવેલા છે.

ભારત લગભગ 32.8 લાખ ચોરસ કિમી ક્ષેત્રફળ ધરાવે છે. તેનો અંદાજિત વ્યાપ ઉત્તરમાં કાશ્મીરથી લઈને દક્ષિણમાં કન્યાકુમારી સુધી 3214 કિમી અને પૂર્વના અરુણાચલથી પશ્ચિમમાં ગુજરાતના કર્ણ સુધી 2933 કિમીમાં વિસ્તરેલો છે. લાંબા સમુદ્રકિનારા, ઊંચી-ઊંચી પર્વતમાળાઓ, દૂર-દૂર સુધી ફેલાયેલાં નદી-મેદાનો ઊભડ-ખાબડ ઉચ્ચપ્રદેશ અને કિનારાથી દૂર આવેલા ટાપુઓ જેવાં વિવિધ ભૂમિસ્વરૂપો અહીં જોવા મળે છે. આબોહવા અને વનસ્પતિ સાથે સંસ્કૃતિ અને ભાષાની વિવિધતા પણ આપણને ઊરીને આંખે વળગે છે. આપણા રિવાજો અને પરંપરાઓમાં ભિન્નતાઓ જોવા મળે છે અને આ વિવિધતા અને એક રાષ્ટ્રની ભાવના આપણને વિશ્વમાં એક વિશિષ્ટ ઓળખ અપાવે છે.

## ભારતના પ્રાકૃતિક વિભાગો (Physical Division of India)




ભારતના ભૂપૃષ્ઠની આધારે તેના પ્રાકૃતિક વિભાગો પાડવામાં આવ્યા છે. ઉત્તરમાં આવેલો મહાંદશે હિમાલય સીમારક્ષકનું કાર્ય કરે છે. તેની ઉત્તર-દક્ષિણ ફેલાયેલી સમાંતર પર્વતમાળાને ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. તેની છેક ઉત્તરમાં મહાહિમાલય કે હિમાદ્રી પર્વતમાળામાં વિશ્વનું સૌથી ઊંચું શિખર માઉન્ટ એવરેસ્ટ આવેલું છે. ત્યારબાદ તેની દક્ષિણે મધ્ય હિમાલય કે હિમાચલ નામથી ઓળખાતી પર્વતમાળા આવેલી છે જ્યાં દર્શનીય સ્થળો અને યાત્રાધામો આવેલાં છે. તેની દક્ષિણે શિવાલિક કે લઘુહિમાલય નામે ઓળખાતી પર્વતમાળા આવેલી છે.

હિમાલયની દક્ષિણે ગંગા, સતતુજ, યમુના, બ્રહ્મપુત્ર અને તેની શાખા નદીઓએ ઠાલવેલા કાંપથી બનાવેલ વિશાળ મેદાન આવેલું છે. આ નદીઓથી બનેલાં મેદાન સમતલ અને ખેતી માટે ફળદૂપ ઉપજાઉ જમીન ધરાવે છે, ત્યાં વધુ ખેત-ઉત્પાદન થતું હોવાથી મેદાનોમાં ગીયવસ્તી જોવા મળે છે.

ભારતના પશ્ચિમ ભાગમાં ભારતીય મહામરૂસ્થલ આવેલું છે. ત્યાં ગરમી વધારે તથા વરસાદનું પ્રમાણ નહિવતૂ હોય છે. ક્યારેક તો સણંગ ત્રણ-ચાર વર્ષ સુધી વરસાદ થતો નથી. આ ક્ષેત્રમાં વનસ્પતિનું પ્રમાણ ખૂબ ઓછું જોવા મળે છે.


ઉત્તરનાં મેદાનોની દક્ષિણે ઊંધા ત્રિકોણાકારે દખ્ખણાનો ઉચ્ચપ્રદેશ આવેલો છે. તેનું ભૂપૃષ્ઠ સમતલ નથી તેના કેટલાક ભાગો ઊંચા તો કેટલાક ઓછી ઊંચાઈ ધરાવે છે. અહીં ધણી પર્વતમાળાઓ અને પહાડી વિસ્તારો આવેલા છે. જેમાં દુનિયાની સૌથી પ્રાચીન પર્વતમાળા અરવલ્લી જે આ ક્ષેત્રની ઉત્તર-પશ્ચિમે આવેલી છે. તેની દક્ષિણ-પૂર્વમાં વિંધ્યાચલ અને સાતપૂડાની પર્વતમાળાઓ આવેલી છે. પૂર્વથી પશ્ચિમ તરફ વહીને અરબસાગરને મળતી નર્મદા અને તાપી વિંધ્યાચલ અને સાતપૂડાની પર્વતશ્રેણીમાંથી વહે છે. દક્ષિણાના ઉચ્ચપ્રદેશની પૂર્વ દિશામાં પૂર્વવધાર અને પશ્ચિમ દિશામાં પશ્ચિમવધાર આવેલો છે. જે પૈકી પશ્ચિમવધાર સણંગ જ્યારે પૂર્વવધાર તૂટક-તૂટક છે. આ ઉચ્ચપ્રદેશો જવાળામુખીથી બનેલા હોવાથી તે ક્ષેત્રોમાં ખનીજો વિપુલ પ્રમાણમાં મળી આવે છે.



### 13.1 ભારત પ્રાકૃતિક

પૂર્વધારની પૂર્વમાં અને પશ્ચિમધારની પશ્ચિમે કિનારાના મેદાન આવેલાં છે. આ મેદાનોમાં પૂર્વ કિનારાના મેદાનની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકડું છે. ગોદાવરી, મહાનદી, કાવરી અને કૃષ્ણા પૂર્વ તરફ વહીને ફળદુપ મુખત્રિકોણપ્રદેશ બનાવી બંગાળાના ઉપસાગરને મળે છે બ્રહ્મપુર અને ગંગા નદીએ બંગાળાના ઉપસાગરમાં સુંદરવન નામના વિશાળ મુખત્રિકોણ પ્રદેશની રચના કરી છે.

ભારતમાં બે ટાપુસમૂહ આવેલા છે. બંગાળના ઉપસાગરમાં દક્ષિણ પૂર્વ આવેલા અંદમાન અને નિકોબાર તથા અરબસાગરમાં કેરલના ડિનારાથી પશ્ચિમે પરવાળાથી બનેલા લક્ષ્યદ્વિપ ટાપુઓ છે. ભારતની છેક દક્ષિણે હિંદ મહાસાગર આવેલો છે.



13.2 ભારતનો રેખાંકિત નકશો

### • પ્રવૃત્તિ •

- ભારતના રેખાંકિત નકશામાં નીચેની વિગતોની નકશાપૂર્તિ કરો :

  1. ભારતીય મહામરુસ્થલ
  2. ગંગાનું મેદાન
  3. હિમાલય
  4. પૂર્વધાર
  5. પશ્ચિમધાર
  6. પૂર્વ ડિનારાનું મેદાન
  7. પશ્ચિમ ડિનારાનું મેદાન
  8. અંદમાન-નિકોબાર ટાપુઓ
  9. અંદમાન-નિકોબાર ટાપુઓ
  10. લક્ષ્યદ્વિપ
  11. અરબસાગર
  12. બંગાળનો ઉપસાગર
  13. હિંદ મહાસાગર

## ભારતની આબોહવા

વાતાવરણમાં થતા રોજિંદા ફેરફારને હવામાન કહે છે અને ક્રોઈપણ સ્થળમાં હવામાનનાં તત્ત્વોની આશરે 30 વર્ષની સરેરાશ પરિસ્થિતિને આબોહવા કહે છે. તમે અનુભવ્યું હશે કે, ક્યારેક ગરમીનું પ્રમાણ વધે તો ક્યારેક ઠંડીનું તો વળી ક્યારેક આકાશ વાદળાયું બની જાય છે અને સૂર્ય વાદળો પાછળ ઢંકાઈ જાય, પવન વગેરેની વિગતો તમે રેઝિયો કે ટીવી દ્વારા જાણી હશે. ભારતમાં નીચે મુજબની ઋતુઓ અનુભવાય છે :



ક્રમ	ઋતુ	માસ
1.	શિયાળો	દિસેમ્બરથી ફેબ્રુઆરી (ઠંડી ઋતુ)
2.	ઉનાળો	માર્ચથી મે (ગરમ ઋતુ)
3.	ચોમાસું	જૂનથી સપ્ટેમ્બર (વર્ષા ઋતુ)
4.	પાછા ફરતા મોસમી પવનોની ઋતુ	ઓક્ટોબરથી નવેમ્બર (શરદ ઋતુ - નિર્વત્તન ઋતુ)

**શિયાળો (Winter) :** શિયાળો ઠંડીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યનાં ડિરણો ત્રાંસાં પડતાં હોવાથી અને ક્યારેક છિમવર્ષ થવાથી ઉત્તરના મેદાનમાં અને હિમાલયના પર્વતીય પ્રદેશોમાં તાપમાન નીચું જાય છે. ગુજરાતના ઉત્તર ભાગમાં આવેલ વિસ્તારોમાં રાજ્યના બીજા વિસ્તારો કરતાં વધુ ઠંડી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો ટૂંકા હોય છે.

**ઉનાળો (Summer) :** ઉનાળો અકળાવનારી ગરમીની ઋતુ છે. આ દિવસોમાં સૂર્યનાં ડિરણો લગભગ સીધાં પડતાં હોવાથી તાપમાન ઊંચું જાય છે. જોકે સમુદ્રકિનારાના પ્રદેશોમાં ગરમીનું પ્રમાણ દેશના ખંડીય ભાગો કરતાં ઓછું રહે છે. બપોરે ગરમ સૂકા પવનો ફૂંકાય છે, જેને 'લૂ' કહે છે. આ ઋતુ દરમિયાન ગુજરાતના ઉત્તરભાગ અને રાજ્યસ્થાનના પાશ્ચિમભાગમાં વધુ ગરમી અનુભવાય છે. આ ઋતુમાં દિવસો શિયાળાની તુલનામાં લાંબા હોય છે.

**ચોમાસું (Monsoon) :** ચોમાસું વરસાદની ઋતુ છે. દક્ષિણ-પશ્ચિમ (નૈર્ઝર્ટ્ય) દિશામાંથી વાતા પવનો સમુદ્ર પરથી ફૂંકાતા હોવાથી તે ભેજવાળા હોય છે. આ પવનો વરસાદ લાવે છે. આ પવનોનો એક ફાંટો અરબસાગર પરથી આગળ વધી કેરલ, મહારાષ્ટ્ર, ગુજરાત અને મધ્ય ભારત સુધી પહોંચે છે. જ્યારે બીજો ફાંટો બંગાળના ઉપસાગર, અંદમાન દીપસમૂહો, પૂર્વ ભારત થઈ ગંગાના મેદાનોમાં આગળ વધે છે. આ બંને ફાંટા આગળ જતાં એકબીજાને મળી પશ્ચિમ ઉત્તરપ્રદેશ, હરિયાણા, પંજાબ અને પૂર્વ રાજ્યથાન સુધી પહોંચી વરસાદ આપે છે. વરસાદના આગમનથી ખેડૂતવર્ગ ખેતીકામમાં પ્રવૃત્ત થઈ જાય છે. આ પવનોના માર્ગમાં પર્વતો આવે ત્યારે ત્યાં વધુ વરસાદ આપે છે.

ગુજરાતમાં વરસાદની શરૂઆત જૂન મહિનાના બીજા કે ત્રીજા સપ્તાહથી શરૂ થઈ જુલાઈના પહેલા સપ્તાહ સુધીમાં તો આખા ગુજરાતમાં વર્ષાઋતુનું આગમન થઈ જાય છે. ગુજરાતમાં આ પવનોના માર્ગમાં મોટા પર્વતો ન હોવાથી વરસાદનું પ્રમાણ ઓછું હોય છે. ભારતમાં મોટાભાગની ખેતી વરસાદ આધારિત હોવાથી સારા ચોમાસાનો અર્થ ખેતીમાં મબલખ પાક એવો કરાય છે. આ ઋતુ ખેતી માટે ખૂબ અગત્યની ગણાય છે.

## પ્રવૃત્તિ

- નીચે આપેલા કોષ્ટકમાં તે ઝતુ અને તહેવારોની ખાલી જગ્યામાંથી યોગ્ય વિકલ્પોમાંથી શોધી લખો :

(ઉત્તરાયણ, દશોરા, ધૂળેટી, જન્માષ્મી, નાતાલ, શરદપૂનમ, ચેટીચંદ, રક્ષાબંધન)

ક્રમ	ઝતુ	તહેવાર
1.	શિયાળો	
2.	ઉનાળો	
3.	ચોમાસું	
4.	પાછા ફરતા મોસમી પવનોની ઝતુ	

**પાછા ફરતા મોસમી પવનોની ઝતુ :** આ ઝતુમાં પવનો જમીન પરથી સમુદ્ર તરફ વાય છે. આ પરિસ્થિતિ ચોમાસાથી તદ્દન વિપરીત જોવા મળે છે. ઉત્તર-પૂર્વ (ઇશાન) દિશામાંથી જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. તેથી વરસાદ આપત્તા નથી. આ દિવસોમાં આકાશ વાદળો વિનાનું સ્વચ્છ જોવા મળે છે. તાપમાન ઠીક-ઠીક પ્રમાણમાં વધે છે અને તેની લોકોના આરોગ્ય પર વિપરીત અસર પડે છે. ઓક્ટોબર પૂરો થતાં તાપમાન ઘટવા માટે છે અને નવેમ્બરથી રહેલી સવારે હંડી અનુભવાય છે.

આ પવનો બંગાળના ઉપસાગર પરથી પસાર થતાં બેજવાળા બને છે અને ભારતના પૂર્વ કિનારે આવેલ તમિલનાડુ અને આંધ્રપ્રદેશમાં તે આ દિવસોમાં વરસાદ આપે છે.

ભારતની આબોહવામાં સ્પષ્ટ ઝતુભેદ અનુભવાય છે. તેની ખાસિયતને કારણે સામાન્ય રીતે મોસમી આબોહવા કહેવાય છે.

## વિચારીને કહો

- જો બારેમાસ એકસરખી ઝતુ હોય તો આપણા જીવન પર કેવી અસરો પડે તે નીચેની મુદ્દા ધ્યાન રાખી કહો :

● ખોરાક

● પોશાક

● ઝેતી

## વનસ્પતિ : જંગલોના પ્રકાર (Vegetation : Types of Forest)

આપની ચોતરફ વિવિધ પ્રકારના ઝડ-છોડવા અને ઘાસ જોવા મળે છે. કેટલીક વનસ્પતિ સુંદર મજાનાં ફૂલોવાળી તો કેટલીક કંટાળી હોય છે. અમુક વૃક્ષો વેઘૂર-ઘટાદાર તો અમુક નીચાં અને પાંખાં હોય છે. વનસ્પતિ એક પ્રદેશ કરતાં બીજા પ્રદેશમાં અલગ-અલગ હોય છે. આ વિવિધતાનું કારણ આબોહવામાં રહેલી ભિન્નતા છે. આ આબોહવાને આધારે જ વનસ્પતિના પ્રકાર પાડવામાં આવે છે. વરસાદનું પ્રમાણ વનસ્પતિની આ વિવિધતા સર્જન માટેનો મુખ્ય આધાર છે. જંગલોના પ્રકારો આ મુજબ છે :


**ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો (Tropical Rainy Forest) :** જ્યાં વરસાદનું પ્રમાણ વધારે હોય છે ત્યાં ઉષ્ણ કટિબંધીય વરસાદી જંગલો આવેલાં હોય છે. આ જંગલોનાં વૃક્ષો વેઘૂર અને ઘટાદાર હોવાથી સૂર્યનાં કિરણો જમીન સુધી પહોંચી શકતાં નથી. અનેક જાતનાં વૃક્ષો, વેલાઓ અને છોડવા (Ferns) ત્યાં જોવા મળે છે. વળી, બધી જાતનાં



વृक्षोમां एकसाथे पानभर आवती नथी पाण वर्षभर अलग समये आवती होवाथी ते હમेशां લીલांદ્ઘમ દેખાય છે. આ પ્રકારનાં જંગલો પશ્ચિમ ધારના કિનારાના તરફના ઢોળાવોમાં પછીરૂપે અને અંદમાન-નિકોબાર ટાપુઓમાં તથા ઉત્તર-પૂર્વ ભારતના કેટલાક ભાગોમાં આવેલાં છે. મહોગની, રોજવુડ, નેતર વગેરે વૃક્ષો અહીં જોવા મળે છે.

**ઉષ્ણ કટિબંધીય પાનભર જંગલો (Tropical Deciduous Forest) :** આ પ્રકારનાં જંગલો ભારતમાં ધણા મોટાભાગ પર આવેલાં છે. આ જંગલો ઓછાં ઘટાદાર હોય છે. તેમાં પાનભર ઋતુ દરમિયાન વૃક્ષો પાંડાં બેરવે છે. આથી તેને ખરાઉ મોસમી જંગલો એવા નામે પણ ઓળખવામાં આવે છે. સાગ, સાલ, વાંસ, મહુડો, લીમડો વગેરે વૃક્ષો આ પ્રકારનાં જંગલોમાં જોવા મળે છે.

**સૂકાં જાંખરાંવાળાં જંગલો (Dry and Scrub Forest) :** આ પ્રકારનાં જંગલો ઓછા વરસાદના પ્રદેશોમાં જોવા મળે છે. અહીં થતાં વૃક્ષો કાંઠાળા હોય છે. થોર, ખેર, ખીજડો, બાવળ, બોરડી વગેરે મુખ્ય છે. રાજસ્થાન, હરિયાણા, પશ્ચિમધારના પૂર્વિયથળ પર અને ગુજરાતમાં જોવા મળે છે.



13.3 ભારત કુદરતી વનસ્પતિ

**પર્વતીય જંગલો (Montane Forest) :** આ પ્રકારનાં જંગલો તેના નામ પ્રમાણે પર્વતીય વિસ્તારમાં જોવા મળે છે. પર્વતોમાં જુદી જુદી ઊંચાઈએ વિવિધ પ્રકારની અને આકાર વૈવિધ્ય ધરાવતી વનસ્પતિ હિંગે છે. સમુદ્રસપાટીથી 1500 મી થી 2500 મી સુધી ઊગતી વનસ્પતિ શંકુ આકારની અને સોયાકાર પાંડાં ધરાવતી હોય છે. તેના આકાર પરથી આ વનસ્પતિ શંકુદ્રૂમ વનસ્પતિ તરીકે ઓળખાય છે. ચીડ, દેવદાર, પાઈન વગેરે આ પ્રકારની વનસ્પતિ ગણાય છે.

**મેન્ગ્રોવ જંગલો (Mangrove Forest) :** આ પ્રકારનાં જંગલો સમુદ્રની ભરતીના ખારા પાઇમાં વિકસે છે. આ પ્રકારનાં જંગલો પદ્ધિમ બંગાળ, ગુજરાત અને અંદમાન-નિકોબારના ટાપુઓના સમુદ્રકિનારે આવેલાં છે. ગંગાના મુખત્રિકોષ પ્રદેશમાં આવેલ સુંદરવન આ પ્રકારનું જંગલ છે, ત્યાં થતાં સુંદરી નામનાં વૃક્ષો પરથી એ નામ પડ્યું છે. ગુજરાતના સમુદ્રકિનારે આ પ્રકારનાં જંગલોમાં ચેરનાં વૃક્ષો જોવા મળે છે. જેનો ઉપયોગ સ્થાનિક લોકો બળતણ તરીકે કરે છે.

### • પ્રવૃત્તિ

- પાઠની વિગતોને આધારે નીચેના કોષ્ટકમાં માણ્યા મુજબની વિગતો ભરો :

જંગલના પ્રકાર સામે તે જંગલોમાં જોવા મળતાં વૃક્ષોની યાદી બનાવો :

- |                                 |       |       |       |
|---------------------------------|-------|-------|-------|
| (1) ઉષા કટિબંધીય વરસાદી જંગલો   | _____ | _____ | _____ |
| (2) ઉષા કટિબંધીય પાનખરનાં જંગલો | _____ | _____ | _____ |
| (3) સૂક્ષ્મ જાંખરાંવાળાં જંગલો  | _____ | _____ | _____ |
| (4) પર્વતીય જંગલો               | _____ | _____ | _____ |
| (5) મેન્ગ્રોવ જંગલો             | _____ | _____ | _____ |

**જંગલોનું મહત્વ :** જંગલો આપણી ઘણી જરૂરિયાતો પૂરી પાડે છે. તેનાથી થનારા મુખ્ય ફાયદા કોષ્ટકની મદદથી જાણીએ.

### જંગલોના ફાયદા

પર્યાવરણીય ફાયદા	આર્થિક ફાયદા
<ul style="list-style-type: none"> <li>● વાતાવરણ શુદ્ધ રાખે</li> <li>● વરસાદ લાવે</li> <li>● ધોવાણ અટકાવે</li> <li>● વન્યજીવોને કુદરતી આવાસ</li> <li>● ભૂમિગત જળ-સંરક્ષણ</li> </ul>	<ul style="list-style-type: none"> <li>● બળતણ અને ઈમારતી લાક્કું</li> <li>● ઔષધિઓ</li> <li>● ઉદ્યોગો માટે કાચો માલ</li> <li>● ધાસચારો</li> <li>● લાખ-રાળ-ગુંદર જેવી જંગલ-પેદાશો</li> </ul>

### • પ્રવૃત્તિ

- તમારી આજુબાજુ ઊગતાં વૃક્ષોનાં ઔષધીય ઉપયોગ વિશે શિક્ષકની કે વડીલોની મદદથી જાણો.
- શાળાની કઈ ચીજે જંગલમાંથી મળતા કાચા માલમાંથી બનેલી છે. તેની યાદી મિત્રોની સાથે ચર્ચા કરીને બનાવો.
- ‘જંગલ વિનાશ નહિ રોકાય તો આવનાર પરિસ્થિતિ અને તેની અસરો’ વિશે વક્તુત્વ-સ્પર્ધાનું આયોજન અનુકૂળતાએ ગોઈવો.

આપણા દેશનાં જંગલોમાં વિવિધ જાતના વન્યજીવો વસે છે. જેમાં સસ્તન વર્ગનાં પ્રાણીઓ, પક્ષીઓ, જળચરો ઉભયજીવીઓ, ક્રીટકો, સરિસુપો, કીડાઓનો સમાવેશ થાય છે. વાધ આપણા દેશના વિવિધ ભાગોમાં જોવા મળે છે. અને તે આપણનું રાષ્ટ્રીય પ્રાણી છે. જંગલી બકરીઓ હિમાલય અને નીલગિરિના પર્વતોમાં, હાથી અને એકશિંગી ભારતીય ગેડા અસમનાં જંગલોમાં મુક્ત રીતે વિહરતા જોઈ શકાય છે. કેરલ અને કાર્ણાટક રાજ્યનાં જંગલો હાથીઓ માટે જાણીતાં છે. કચ્છ, સુરેન્દ્રનગર અને પાટણનાં સૂકાં ક્ષેત્રોમાં ઘૃણાર જોવા મળે છે. એશિયાઈ સિંહો સમગ્ર વિશ્વમાં માત્ર ગુજરાતમાં ગીરનાં જંગલોમાં જોવા મળે છે.


### જાણવું ગમશે



### સિંહ

સિંહ ભારતમાં માત્ર ગીરના જંગલમાં જ જોવા મળે છે અને તે ગુજરાતનું રાજ્ય-પ્રાણી છે. સંરક્ષણના પ્રયાસોથી તેની સંખ્યામાં વધારો થયો છે. વનવિભાગ દ્વારા પ્રવાસીઓ માટે સિંહદર્શનના કાર્યક્રમનું આયોજન કરાય છે.

ભારતમાં પક્ષીની અનેક પ્રજાતિઓ જેવી કે સારસ, બતક, કોયલ, પોપટ, ધોરાડ, ચીબરી, કાબર, સમડી, ગીધ, ગરુડ, ધૂવડ વગેરે વસે છે. મોર આપણનું રાષ્ટ્રીય પક્ષી છે. આ ઉપરાંત ભારતમાં ગુજરાત, ઓડિશા વગેરે રાજ્યોના સમુદ્રકિનારે સમુદ્રના કાચબાઓ ઈંડાં મૂકવા આવે છે. આપણે ત્યાં સાપની ઘણી પ્રજાતિઓ જોવા મળે છે તે પૈકીની મોટા ભાગની પ્રજાતિઓ બિનઝેરી છે.



### 13.4 ભારતના વન્યજીવો

આપણા દેશનાં જળાશયો અને જળખાવિત વિસ્તારોમાં દૂર-દૂર આવેલા ઠંડા પ્રદેશોમાંથી પક્ષીઓ શિયાળામાં બચ્ચાં ઉછેરવા આવે છે. ગુજરાતનું નળસરોવર, ખીજદિયા, થોળ, ધારીઢંઢ (કચ્છ) વગેરે જગ્યાએ શિયાળા દરમિયાન હજારો વિદેશી પક્ષીઓ આવે છે અને શિયાળો પૂરો થતાં તે પોતાના વતનમાં પરત જાય છે. આવાં પક્ષીઓ પ્રવાસી કે યાયાવર પક્ષીઓ નામે ઓળખાય છે.

## જાણવા જેવું



### સુરખાબ (Flamingo)

સુરખાબ નળ સરોવર, કચ્છના રણમાં તથા કાદવવાળા કે પાણીવાળાં ક્ષેત્રોમાં જોવા મળે છે. તે લાંબા પગ અને સફેદ-ગુલાબી જાંયવાળું શરીર ધરાવે છે. ભારતમાં માત્ર કચ્છમાં જ તે માળા કરે છે. જમીન પર કીચડવાળી કારીય માટીમાં નાનો ગોળ ટીંબો બનાવી તેના મથાળે ખાડો કરી તેમાં ઢૂંઢૂ મૂકે છે.

## અભયારણ્યો, રાષ્ટ્રીય ઉદ્યાનો અને જૈવ આરક્ષિત ક્ષેત્રો (Sanctuary, National Parks, Bio Reserve Zone)

વન્ય જીવોના સંરક્ષણના હેતુથી કેટલાક વિસ્તારોને ખાસ કાયદાકીય જોગવાઈથી નીચે મુજબનાં વિસ્તારો કે ક્ષેત્રો જાહેર કરવામાં આવે છે, જેની મુખ્ય વિગતોની માહિતી મેળવીએ.

	અભયારણ્ય	રાષ્ટ્રીય ઉદ્યાન	જૈવ આરક્ષિત ક્ષેત્ર
રચના	રાજ્ય સરકાર દ્વારા	રાજ્ય અને કેન્દ્ર સરકારના સંકલનથી	આંતરરાષ્ટ્રીય માપદંડો મુજબ
અન્ય વિગતો	પાલતુ પશુઓને મંજૂરી બાદ ચરાવવાની છૂટ	પાલતુ પશુઓને ચરાવવા પર સંપૂર્ણ પ્રતિબંધ	તમામ બહારની માનવીય પ્રવૃત્તિઓ પર સંપૂર્ણ પ્રતિબંધિત
ઉદાહરણ	<ul style="list-style-type: none"> <li>બાલારામ અભયારણ્ય</li> <li>નળ સરોવર પક્ષી-અભયારણ્ય</li> </ul>	<ul style="list-style-type: none"> <li>ગીર રાષ્ટ્રીય ઉદ્યાન</li> <li>વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન</li> </ul>	<ul style="list-style-type: none"> <li>કચ્છ રણનું આંશિક ક્ષેત્ર</li> <li>નીલગિરિનું ક્ષેત્ર (દક્ષિણ ભારત)</li> </ul>

જંગલો અને વન્ય જીવોની સુરક્ષા આપણા સહુની જવાબદારી છે. તેના સરકાર દ્વારા ઘડવામાં આવતા કાયદા અને મૂકવામાં આવતા પ્રતિબંધોનો અમલ કરવા આપણે સહુએ કટિબદ્ધ થવું પડશે.

## પ્રવૃત્તિ

- શાળામાં વનવિભાગના અધિકારીને વક્તાવ્ય માટે બોલાવી તમારા વિસ્તારની વનસ્પતિ અને વન્ય જીવોની માહિતી જાણો.



## સ્વાધ્યાય

### 1. જોડકાં જોડો :

અ

- (1) એકશિંગી ભારતીય ગેડા
- (2) સમુદ્રના કાચબા
- (3) યાયાવર પક્ષીઓ

બ

- (a) ઓડિશાનો સમુદ્રકિનારો
- (b) જળપ્લાવિત ક્ષેત્ર
- (c) અસમ
- (d) કર્ચ્છ, સુરેન્દ્રનગર અને પાટણનાં સૂકાં ક્ષેત્રો

### 2. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

- (1) સિંહ ગીર ઉપરાંત નજ સરોવરમાં જોવા મળે છે.
- (2) પૂર્વ કિનારાની તુલનામાં પશ્ચિમ કિનારાનું મેદાન સાંકું છે.
- (3) કાવેરી નદીએ સુંદરવન નામનો મુખનિકોણ પ્રદેશ બનાવ્યો છે.

### 3. એક-બે વાક્યમાં ઉત્તર આપો :

- (1) હિમાલયની દક્ષિણે આવેલ મેદાન કઈ કઈ નદીઓએ બનાવ્યું છે?
- (2) ગુજરાતમાં યાયાવર પક્ષીઓ ક્યાં ક્યાં આવે છે ?

### 4. નણ-ચાર વાક્યમાં ઉત્તર આપો :

- (1) મેન્ઘ્રૂવ જંગલો વિશે તમે શું જાણો છો?
- (2) પર્વતીય જંગલ વિશે માહિતી આપો.

### 5. શબ્દ-સમજૂતી આપો :

- (1) યાયાવર પક્ષીઓ
- (2) પાનખર ઋતુ

### 6. ટૂંક નોંધ લખો :

- (1) જંગલોના પ્રકાર
- (2) ભારતની આબોહવા અને ઋતુઓ

### ● વધુ વિગતો જાણવા નીચેની વેબસાઈટની મુલાકાત લો :

- www.wti.org.in/
- www.oocities.org/
- www.downtoearth.org.in/
- www.nationalgeographic.org/



### વિવિધતાની સમજ

ધર્મ, ભાષા, જાતિ અને આર્થિક અસમાનતા સાથે વિવિધતા ધરાવતો આપણો દેશ વિશ્વમાં અનોખી ઓળખ ધરાવે છે.

ખોરાક, તહેવાર, રીત-રિવાજ અને પોશાક ઉપરાંત સમાજજીવનમાં બિન્નતા જોવા મળે છે. આપણા દેશમાં એકતા અને સમાનતા માટે આપણે શું કરી શકીએ એ અંગે જોઈએ.

#### • વિચારો •

- તમે તમારા વર્ગનાં બાળકોથી કઈ કઈ બાબતોમાં જુદા પડો છો ? તમારા વર્ગના વિદ્યાર્થીઓ તમારાથી ઘણી બાબતોમાં બિન્ન હોવા છતાં તેઓ તમારા મિત્રો કેમ બન્યા છે ?

ભારતના લોકોમાં જેટલી વિવિધતા છે. આવી વિવિધતા દુનિયાના બીજા દેશોમાં ભાગ્યે જ હશે. વિવિધતાઓના કારણે જ ભારત એક ઉપભંડ બની ગયો છે. આપણા દેશમાં કશ્મીરથી કન્યાકુમારી સુધી અને ગુજરાતથી અરુણાચલ પ્રદેશ સુધી દેશવાસીઓના રૂપ-રંગ, પોશાક, ધર્મ, ભાષા, ખાન-પાન વગેરેમાં બિન્નતાઓ છે.

#### ધર્મ

આપણા દેશમાં વિવિધ ધર્મમાં આસ્થા ધરાવતા લોકો રહે છે. હિન્દુ, ઈસ્લામ, ખ્રિસ્તી, શીખ, બૌધ્ધ, જરથોસ્તી(પારસ્સી) અને યહૂદી ધર્મ પાળતા લોકો અહીં હળીમળીને રહે છે. ધર્મમાં બિન્નતા હોવા છતાં સૌ સમાન રીતે ધર્મનું આચરણ કરી શકે તેવા શુભ આશય માટે આપણા દેશમાં બધા જ ધર્મોને સરખું મહત્વ આપવામાં આવે છે.

#### ભાષા

આપણા દેશમાં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, બંગાળી, મરાઠી, પંજાਬી, તમિલ, તેલુગુ, કન્ડ, મલયાલમ, ઉર્ડૂ, કોકણી વગેરે ભાષા બોલાય છે. ભાષામાં બિન્નતા હોવા છતાં આપણા દેશમાં એકતા અને દેશની એકતાને જાળવી રાખવા આ વિવિધ ભાષાઓ મહત્વ ધરાવે છે.

#### સાંસ્કૃતિક

આપણા દેશમાં ધર્મ અને ભાષામાં બિન્નતા હોવાથી સાંસ્કૃતિક વિવિધતા બહોળા પ્રમાણમાં જોવા મળે છે. વિવિધ પ્રદેશ કે રાજ્યમાં સાંસ્કૃતિક વિવિધતા સરળતાથી જોઈ શકાય છે.

દિવાળી, મકરસંકાંતિ, હોળી, દશેરા, શિવરાત્રી, ગાંશેશવતુર્થી, ઈદ, નાતાલ, અષાઢી બીજ, મહોરમ, બુદ્ધજયંતી, મહાવીરજયંતી, ઓંષારમ, પતેતી, વૈશાખી વગેરે તહેવારો દેશના જુદા-જુદા ભાગોમાં વસતા લોકો સાથે મળીને ઊજવે છે.

#### • જાણવા જેવું •

- દેશના જુદા-જુદા ભાગોમાં વસતા લોકો અલગ-અલગ પ્રકારનાં નૃત્યમાં કુશળતા ધરાવે છે. ઉદાહરણ તરીકે ચાસ-ગરબા (ગુજરાત), બાંગડા (પંજાબ), કથક (ઉત્તરપ્રદેશ), કુચીપુરી (અંધ્રપ્રદેશ), કથકલી (કરલ), ભરતનાટ્યમ્ (તમિલનાડુ), બિહુ (অসম), ઓଡિસી (ଓଡ଼ିଶા), ધુમર (રાજસ્થાન) છે.

વિવિધતાઓ સાથે પ્રજાનાં ખાન-પાન, પોશાક, રહેઠાણ, માન્યતાઓ, રીત-રિવાજ વગેરેમાં પણ અનેક પ્રકારની વિવિધતાઓ રહેલી છે. સ્થળની આબોહવા, ભૂપૃષ્ઠ, ખેતી, જંગલો વગેરે ભૌગોલિક બાબતોના કારણો દેશ વિવિધતાવાળો બન્યો છે.

### • પ્રવૃત્તિ •

- ભારતનો નકશો જુઓ. અસમ અને કેરલ રાજ્યનું સ્થાન શોધી કાઢો. આ બંને પ્રદેશોની ભૌગોલિક પરિસ્થિતિઓ ત્યાંના નિવાસીઓનાં બોજન, પોશાક, ખેતી, વ્યવસાય વગેરે પર કેવી અસર કરે છે? શિક્ષકની મદદથી તેની યાદી બનાવો.
- કેલેન્ડરની મદદથી તહેવારોની યાદી બનાવો.
- નીચે કેટલાક તહેવારોનાં નામ મૂક્યાં છે. તેની સામેના ખાનામાં  તે તહેવાર ક્યા ધર્મના લોકો ઉજવે છે તે લખો :
 

1. પતેતી	<input type="text"/>	2. ઈદ	<input type="text"/>	3. શિવરાત્રી	<input type="text"/>
4. વૈશાખી	<input type="text"/>	5. નાતાલ	<input type="text"/>	6. મહાવીરજયંતી	<input type="text"/>
- નીચે કેટલાંક નૃત્યનાં નામ આપેલાં છે. તે નૃત્યમાં ક્યા રાજ્યનાં છે તે આપેલી ખાલી જગ્યામાં લખો :
 

1. કથકલી	_____	2. ધૂમર	_____
3. રાસ-ગરબા	_____	4. ભાંગડા	_____

### વિવિધતામાં એકતા

ભારતીય સંસ્કૃતિ વિશ્વની પ્રાચીનતમ સંસ્કૃતિઓમાંની એક છે. આપણા દેશની પ્રજા પોશાક, ખોરાક, રહેઠાણ, ધર્મ, ભાષા, રીત-રિવાજ, તહેવારો વગેરે અનેક બાબતોમાં એકબીજાથી બિન્ન છે. છતાં, દેશવાસીઓમાં ભાવાત્મક એકતા જોવા મળે છે. વિવિધતામાં એકતા એ આપણી સંસ્કૃતિની આગવી વિશિષ્ટતા છે.



જુદા-જુદા ધર્મો, ભાષાઓ તથા જાતિઓના લોકો પોતાના રાષ્ટ્ર માટે પ્રેમ, સન્માન, દેશ માટે ત્યાગની ભાવના તથા તાદાત્યની લાગણીઓ એક સમાનભાવે અનુભવે તેને રાષ્ટ્રીય એકતા કહે છે.

રાષ્ટ્રીય એકતાથી રાષ્ટ્રનો આર્થિક, સામાજિક, ઔદ્યોગિક વગેરે ક્ષેત્રોમાં વિકાસ થાય છે. વિવિધતાઓની વચ્ચે પણ લોકો શાંતિ, સલામતી અને સમૃદ્ધિ પ્રાપ્ત કરે છે. તેથી જ ડૉ. રાધાકૃષ્ણને કહ્યું છે કે, “જો આપણે એક રાષ્ટ્રના રૂપમાં જીવિત રહેવું હશે તો આપણે સૌઅં રાષ્ટ્રીય એકતાની આવશ્યકતા સ્વીકારવી જ પડશે.” આજાદીની લડતમાં દેશવાસીઓએ રાષ્ટ્રપ્રેમ અને સર્મર્ઝની ભાવના થકી રાષ્ટ્રીય એકતાનાં દર્શન કરાવ્યાં હતાં. વિવિધતામાં એકતા આપણા દેશની વિશેષતા છે.

### • વિચારો •

- રવીન્દ્રનાથ ટાગોર રચિત આપણા રાષ્ટ્રગીતમાં પણ ભારતીય એકતાની અભિવ્યક્તિ છે. રાષ્ટ્રગીત એકતા વિશે શું સમજાવે છે તેનું વર્ણન કરો.

વિવિધ જ્ઞાતિઓ, ધર્મો, રીત-રિવાજો, સંસ્કૃતિઓ, ભાષાઓ વગેરેનો સમન્વય ભારતમાં થયો છે. ભારત વૈવિધ્ય ધરાવતો દેશ હોવાથી ભાતીગળ સંસ્કૃતિનું સર્જન કરી શક્યો છે. ભારતે વસુધૈવ કુટુંબકમ્ (સમગ્ર વિશ્વ એક કુટુંબ છે.)ની ભાવનાને વિશ્વમાં સાકાર કરી છે. ભારતે ધાર્મિક સહિષ્ણુતા અને સર્વધર્મ સમભાવનો પ્રસાર વિશ્વમાં કર્યો છે. ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિવિધતામાં એકતા એ ભારતીય સંસ્કૃતિનું મહત્વપૂર્ણ લક્ષણ છે. આપણા દેશમાં ધર્મો-સંપ્રદાયો, જ્ઞાતિઓ, ભાષાઓ અને ઉત્સવોનું સંમિશ્રણ જોવા મળે છે. ભારતના લોકો સહઅસ્તિત્વની ભાવનાથી પોતાનું જીવન જીવે છે. ભારતીય પ્રજાએ આપણી વિવિધતાનું સંવર્ધન અને જતન કર્યું છે, જે અદ્વિતીય છે.

### **વિવિધતા અને સમાનતાના પ્રયાસો**

આપણા દેશમાં અનેક પ્રકારની વિવિધતા જોવા મળે છે. આ કારણે ક્યારેક વિવિધતાને લીધે ભેદભાવ જોવા મળે છે. દેશમાં અમીર-ગરીબ, છોકરા-છોકરી, સાક્ષર-નિરક્ષર, શહેરી-ગ્રામીણ અને જ્ઞાતિ આધારિત ભેદભાવ જોવા મળે છે. પ્રારંભિક સમાજરચનામાં વ્યવસાય આધારિત વર્ણવ્યવસ્થા હતી. કેટલાક સમુદ્ધાયો આ કારણે આર્થિક-સામાજિક રીતે પછાત રહી જવા પામ્યા હતા. આથી જ્ઞાતિ આધારિત ભેદભાવ ઉદ્ભબ્યા હતા. ઘણું કરીને સાક્ષર લોકો વધુ આવક પ્રાપ્ત કરે છે. જેથી ભાણેલા લોકોનું જીવનધોરણ ઊંચું જોવા મળે છે. સમાજમાં તેઓ મોભાનું સ્થાન ધરાવે છે. સાક્ષર અને નિરક્ષર વ્યક્તિના ભેદભાવ ઊભા થાય છે. આપણા દેશમાં ગામડાની અને ગ્રામીણ લોકોની સંખ્યા વધુ છે. શહેરી લોકોનું પ્રમાણ તુલનામાં ઓછું છે. ગ્રામીણ અને શહેરી લોકોના જીવનધોરણમાં મોટો તફાવત હોવાના કારણે ભેદભાવ ઊભા થાય છે. દેશની આજાદી પછી દેશના બંધારણમાં સમાનતાના અધિકારને સ્થાન મળતાં અસ્પૃષ્યતા નાબૂદ કરી દેવામાં આવી છે. સમાનતાના અધિકારથી સૌને રાષ્ટ્રમાં સમાન તક, ન્યાય અને દરજાઓ પ્રાપ્ત થાય છે. મફત અને ફરજિયાત શિક્ષણના અધિકારનો કાયદો અમલમાં મુકાયો છે. જેથી સૌને સમાન રીતે પ્રાથમિક શિક્ષણની તકો મળવા લાગી છે. લોકોના સામૂહિક વિકાસ માટે ગ્રામીણ સરકાર, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રો, વીજળી, પીવાના પાણીની સુવિધાઓ વગેરે પાયાની સુવિધાઓ સરકારે વધારી છે અને સીને સમાજમાં માન સંન્માન મળે તે માટે સરકારશી બંધારણીય જોગવાઈ અનુસાર સીએને સમાન તક આપે છે.

લોકો પોતાના ધર્મનું પાલન કરે, પોતાની ભાષા બોલી શકે અને પોતાના તહેવારો ઊજવી શકે, એ પ્રકારની સ્વતંત્રતાઓ મળવાના કારણે આજાદી પછીનાં વર્ષોમાં ભેદભાવો નામશેષ થઈ રહ્યા છે. ચોક્કસ જ્ઞાતિના લોકો માટે ગ્રામપંચાયતથી સંસદ સુધીની ચુંટણીમાં કેટલીક બેઠક અનામત રાખવામાં આવી છે. નોકરીઓમાં પણ આ બાબત ધ્યાનમાં રાખવામાં આવી છે. વિદ્યાર્થીઓ માટે છાત્રાલય, શિષ્યવૃન્તિઓ અને આર્થિક સહાયની યોજનાઓ અમલમાં આવી જેથી સામાજિક, આર્થિક અને રાજકીય તથા સાંસ્કૃતિક ક્ષેત્રો સૌને આગળ વધવાની તકો પ્રાપ્ત થઈ રહી છે.

### **છોકરા-છોકરી અંગેના ભેદભાવ**

ભારત જ નહિ પણ વિશ્વના કોઈ પણ રાષ્ટ્રની પ્રગતિ અને વિકાસમાં માનવસંસાધન તરીકે સીએનેની ભૂમિકા ખૂબ જ મહત્વની છે. સ્વી-પુરુષની જૈવિક બિન્નતાની સાથે સામાજિક અને સાંસ્કૃતિક દિઝિકોણથી છોકરીઓના ઉછેરમાં ભેદભાવ હોવાથી બંનેનો વિકાસ પણ અલગ રીતે થાય છે. આજે પણ મોટાભાગનાં કુટુંબોમાં મહિલા ઘરકામ કરે, રસોડામાં રસોડી બનાવે અને બાળઉછેરનું કામ કરે છે. સ્વીઓને કુટુંબવિષયક કોઈ નિર્ણય લેવાની સત્તા નથી. આરોગ્યની અપૂર્તી દેખભાગ, શિક્ષણ અને આર્થિક અધિકારોથી દીકરીઓને વંચિત રાખવામાં આવે છે. કપડામાં, રમતોમાં, અભ્યાસની તકોમાં, હરવા-ફરવા, વિચાર અને વ્યવહાર વગેરેમાં છોકરીઓ સાથે ભેદભાવ રાખવામાં આવે છે. છોકરીઓમાં સાક્ષરતાનું પ્રમાણ નીચું હોવાથી છોકરીઓ બાળલગ્ન, પડદાપ્રથા, દહેજપ્રથા તથા અન્ય કુરિવાજોનો ભોગ બને છે. સમાજમાં પુત્ર જન્મને પ્રાધાન્ય હોવાથી સ્વી ભ્રૂંણ હત્યાનો ભોગ બને છે. વિવિધ ક્ષેત્રોમાં મહિલાઓનું અલ્ય પ્રમાણ સ્વી-પુરુષના ભેદભાવ સ્પષ્ટ કરે છે. જોકે સમાજમાં જગ્યાતિ અને શિક્ષણનો વ્યાપ વધવા સાથે આ ભેદભાવો ભૂસાતા જાય છે.

## • જાણવા જેવું •

### ● સ્ત્રીઓ પ્રત્યેના બેદભાવ દૂર થાય તે માટેના પ્રયાસો

- 1992માં રાષ્ટ્રીય મહિલા આયોગની રચના કરવામાં આવી છે.
- ગરીબ મહિલાઓ સહેલાઈથી ન્યાય મેળવી શકે તે માટે નારી અદાલતોની સ્થાપના કરવામાં આવી છે.
- મહિલાઓની સમસ્યાઓના નિવારણ માટે મહિલા કલ્યાણ કેન્દ્રોની રચના થઈ છે.
- દેશમાં કન્યા-કેળવણીનું પ્રમાણ વધે તે માટે સમાજ અને સરકાર સહિયારા પ્રયત્ન કરે છે.
- કુટુંબની માલ-મિલકતમાં સમાન હિસ્સો મળે તે માટે કાયદાઓ બનાવવામાં આવ્યા છે.
- બાળલગ્ન, દહેજપ્રથા અને ખીબ્રૂણ હત્યા અટકાવવા માટે કડક કાયદાઓ ઘડવામાં આવ્યા છે.
- દેશમાં મહિલાઓને સમાન દરજ્જો, શિક્ષણ અને સલામતી પ્રાપ્ત થાય તે માટે 1980થી અનેક કાર્યક્રમો અમલમાં મુકાયા છે.



સ્વાધ્યાય

#### 1. નીચેના પ્રશ્નોના ટૂંકમાં ઉત્તર લખો :

- (1) દેશમાં કઈ-કઈ ભાષાઓ બોલાય છે?
- (2) આપણા દેશના લોકો કયા-કયા ધર્મો પાણે છે ?
- (3) આપણો દેશ ક્યા કારણો વિવિધતાવાળો દેશ બન્યો છે ?
- (4) રાષ્ટ્રીય એકતા કોને કહેવાય?

#### 2. ટૂંકમાં ઉત્તર આપો :

- (1) લોકોમાં જોવા મળતી વિવિધતામાં એકતા
- (2) વિવિધતા અને સમાનતાના પ્રયાસો

#### 3. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જગ્યાવો :

- (1) આજાદી પછીનાં વર્ષોમાં બેદભાવો નામશેષ થઈ રહ્યા છે.
- (2) આપણો દેશ શહેરોનો બનેલો છે.
- (3) ચૂંટણીમાં કેટલીક બેઠકો અનામત રાખવામાં આવતી નથી.

#### 4. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

- (1) છોકરા-છોકરીના બેદભાવ વિશે ટૂંકમાં જગ્યાવો.
- (2) ભારત બિનસાંપ્રદાયિક દેશ છે. વિધાન સમજાવો.

#### 5. ખાલી જગ્યા પૂરો :

- (1) મહારાષ્ટ્રના લોકો મુખ્યત્વે ..... ભાષા બોલે છે.
- (2) પંજાબના લોકો ..... નૃત્ય માટે જાણીતા છે.
- (3) મહાવીરજ્યંતીનો ઉત્સવ ..... ધર્મ સાથે સંકળાયેલો છે.
- (4) ભારતમાં ..... રાજ્યના રાસ-ગરબા જાણીતા છે.



આપણો દેશ ભારત. દુનિયામાં સૌથી મોટી લોકશાહી ધરાવતો આપણો દેશ. ઘરનો વહીવટ અને સંચાલન વડીલો કરે છે. બસ ! આ જ રીતે દેશનું સંચાલન સરકાર કરે છે. આપણો દૈનિકપત્રો, ટેલિવિઝન કે વાતચીતમાં ‘સરકાર’ શબ્દ સાંભળતા હોઈએ છીએ. દેશના સંચાલન માટે કે નિર્ણયો લેવા સરકારની જરૂર પડે છે. દેશના વિકાસ માટે સરકાર આયોજનપૂર્વક કાર્ય કરે છે. બંધારણને કેન્દ્રમાં રાખી કાયદા બનાવવા, કાયદામાં સુધારા કરવા અને તેનો અમલ કરવાનું કાર્ય સરકાર દ્વારા કરવામાં આવે છે. આપણા દેશની સરકારને મતદાન દ્વારા ચુંટવામાં આવે છે.



### 15.1 સમાચારપત્રનાં કટિંગ

ઉપરના ચિત્રમાં આપણો સરકારનાં વિવિધ કાર્યો, નિર્ણયો કે જાહેરાતો અંગે જાણી શકીએ છીએ. આપણી આસપાસ ઉપલબ્ધ દૈનિકપત્રો અને મેગેજિનનું વાચન કરી આપણો વિવિધ કાર્યો અંગેની જાણકારી મેળવી શકીએ છીએ. લોકોથી, લોકો વડે અને લોકો માટે ચાલતી શાસનવ્યવસ્થાને લોકશાહી શાસનવ્યવસ્થા કહેવામાં આવે છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં ‘સરકાર’ મહત્વનું અને આગવું સ્થાન ધરાવે છે.

#### પ્રવૃત્તિ

- દૈનિકપત્રો અને અન્ય સાહિત્યમાંથી ‘સરકાર’ના સંદર્ભ છપાયેલ વિગતો એકઢી કરી ‘સરકારનાં કાર્યો’ અંગે સંગ્રહપોથીનું નિર્માણ કરો.
- સરકારનાં કાર્યો અને જીવનમાં સુવિધા અંગે ચર્ચા કરી વિવિધ સુવિધાઓની યાદી કરો.

#### આપણો દેશ : આપણી સરકાર

આપણો દેશ વિવિધતા ધરાવતો દેશ છે. દુનિયામાં સૌથી મોટી લોકશાહી અને વિશ્વમાં સૌથી વધુ મતદારો ધરાવતો આપણો દેશ છે. દેશની વિશાળતા અને અનેક પ્રકારની બિન્નતા હોઈ એક જ સ્થળેથી વહીવટ કે સંચાલનમાં અગવડ પડે. આવી સમસ્યાઓ અને અગવડના સામે સુચારું વહીવટ માટે સરકાર વિવિધ સ્તરે કાર્ય કરે છે. લોકશાહી વ્યવસ્થામાં સ્થાનિક સરકાર, રાજ્ય સરકાર અને રાષ્ટ્રીય સરકાર કાર્ય કરે છે.

## • જુઓ અને સમજો •

સ્થાનિક સરકાર	ગામ કે શહેરનો કાર્યભાર સંભાળે છે.
રાજ્ય સરકાર	સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે.
રાષ્ટ્રીય સરકાર	સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે.

વિવિધ સ્તરે સરકાર જરૂરી છે. નિયમો બનાવવા અને તેને લાગુ કરવા આ સ્તરો ખૂબ જ ઉપયોગી છે. દેશના નિભાવ, વિકાસ અને કાયદા-વ્યવસ્થાની જાળવણી માટે સરકાર અને તેના વિવિધ સ્તરો વિશે આપણે જાણ્યું. આપણા દેશમાં લોકશાહી વ્યવસ્થાનો સ્વીકાર કરવામાં આવ્યો છે. દુનિયામાં સરકારના સંદર્ભે સરકાર અને તેની રચનાને આધારે સરકાર કે શાસનવ્યવસ્થામાં વિવિધતા જોવા મળે છે.

### સરકારના પ્રકાર

આપણો દેશ લોકશાહી-વ્યવસ્થા ધરાવે છે. દુનિયાના બધા જ દેશમાં લોકશાહી શાસનવ્યવસ્થા નથી. દુનિયાના દેશોમાં કાર્યરત વિવિધ વ્યવસ્થામાં જોવા મળતા ‘સરકાર’ના પ્રકાર અંગે જોઈએ.



### લોકશાહી સરકાર :

આ પ્રકારના શાસનમાં લોકો મતદાન દ્વારા પોતાનો પ્રતિનિધિ ચૂંટે છે. ચૂંટણીમાં વિજેતા ઉમેદવારો દ્વારા સરકારનું નિર્માણ થાય છે. લોકશાહી શાસનવ્યવસ્થામાં લોકોને કેન્દ્રમાં રાખી સરકાર કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટણી દ્વારા સ્થાનિક, રાજ્ય કે રાષ્ટ્રીય સરકારનું નિર્માણ કરવામાં આવે છે. કેટલાક દેશમાં લોકશાહી થકી ચૂંટાયેલ પ્રતિનિધિ દ્વારા મુખ્યમંત્રી કે વડાપ્રધાનની પસંદગી થાય છે. દુનિયાના કેટલાક દેશમાં પ્રમુખશાહી પદ્ધતિની લોકશાહી વ્યવસ્થા જોવા મળે છે. ભારતમાં સંસદીય લોકશાહી છે.

લોકશાહી સરકાર માટે કહેવાય કે ‘સરકાર’નું સંચાલન લોકો દ્વારા સીધા મતદાન થકી આડકતરી રીતે લોકો જ કરે છે. માનવ અધિકારોના સંરક્ષણ અને સંવર્ધન માટે લોકશાહી સરકારનો વિકલ્પ શક્ય નથી. આમ લોકોના સર્વાંગી વિકાસ અને અધિકારો માટે લોકશાહી સરકાર ખૂબ જ મહત્વ ધરાવે છે. લોકશાહી સરકારમાં લોકો જ સરકાર છે. સરકાર પણ લોકો માટે કાર્ય કરે છે. આપણા દેશમાં ચૂંટાયેલી સરકારની મુદ્દત સામાન્ય રીતે પાંચ વર્ષની હોય છે.

### સાભ્યવાદી સરકાર :

આ પ્રકારના શાસનમાં બધાને સાભ્યતા કે સરખાપણાને વિશેષ મહત્વ આપવામાં આવે છે. સાભ્યવાદને આધારે કાર્યરત સરકાર સાભ્યતા અને સમાનતાના ધોરણે શાસનવ્યવસ્થાનું સંચાલન કરે છે. વિશ્વના અનેક દેશોમાં સાભ્યવાદી વિચારધારાને આધારે કાર્યરત સરકાર જોવા મળે છે. વિશ્વના અમુક દેશોમાં ચૂંટણી દ્વારા સાભ્યવાદી સરકારોનું નિર્માણ થાય છે. કેટલાક શાસકો સાભ્યવાદી વિચારધારાને આધારે સરકારનું નિર્માણ કરી લાંબા ગાળે એકહથું શાસક બન્યાનાં અનેક ઉદાહરણ જોવા મળે છે. શ્રમિકો, મજૂરો કે શોભિત લોકોને આર્થિક, બૌદ્ધિક કે વૈચારિક રીતે સમાનતા કે સાભ્યતાના આધારે જોડીને સરકારનું સંચાલન કે શાસન ચલાવાય છે. વ્યક્તિગત કે બળજબરીથી શાસન ચલાવનાર કેટલાક શાસકો આજે સાભ્યવાદી દૂર જઈ રાજશાહી કે વ્યક્તિકેન્દ્રી શાસન કરે છે. વિશ્વમાં સાભ્યવાદી વિચારધારાને ‘ડાબેરી વિચારધારા’ તરીકે ઓળખવામાં આવે છે.

## રાજશાહી સરકાર :

આ પ્રકારના શાસનમાં શાસક તરીકે કોઈ એક વ્યક્તિ શાસન કરે છે. મોટેભાગે રાજશાહી વ્યવસ્થામાં શાસક એટલે કે રાજાનું પદ વારસામાં મળે છે. આ પ્રકારના શાસનમાં લોકોને પોતાનો શાસક ચૂંટવાનો અવિકાર હોતો નથી. આજે દુનિયાના કેટલાક દેશોમાં રાજશાહી જોવા મળે છે. ક્યાંક રાજશાહીમાં લોકોને ચૂંટણી દ્વારા નામ પૂરતા જોડવામાં આવે છે.

રાજશાહી સરકાર માટે કહેવાય કે અહીં વ્યક્તિકેન્દ્રી શાસન હોય છે. એક વ્યક્તિ દ્વારા લેવાતા નિર્ણયો અહીં આખરી માનવામાં આવે છે. લોકોની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને બદલે શાસકની સુખાકારી, સુવિધા કે વ્યવસ્થાને જ મહત્વ આપવામાં આવે છે.

### •પ્રવૃત્તિ •

- શિક્ષકશી સાથે ચર્ચા કરી વિવિધ શાસનવ્યવસ્થા ધરાવતા દેશો નકશામાંથી શોધો.
- વિવિધ દેશના શાસકો અંગેની વિગતો એકઠી કરો અને ‘શાસકઅંક’નું નિર્માણ કરો.

## લોકશાહીનાં મૂલ્યો

આપણે જોયું કે સ્થાનિક કક્ષાએ, રાજ્ય કક્ષાએ અને રાજ્યીય કક્ષાએ શાસન થાય છે. લોકોના જીવનધોરણને ઊંચું લાવવા અને તેમની સુખાકારી માટે લોકશાહી શાસન-વ્યવસ્થા કાર્ય કરે છે. લોકોને કેન્દ્રમાં રાખી જરૂરિયાત અને ભાવિ આયોજનો કરતી વખતે ધ્યાનમાં રાખવામાં આવે છે. લોકો પોતાની તરફે મતદાન કરે તે માટે લોકશાહી શાસકો સરકારનું સંચાલન કરે છે. લોકોની સુખાકારી, સુવિધા અને વિકાસને મહત્વ આપી બંધારણને આધારે લોકશાહીનાં મૂલ્યોનું જતન કરવામાં આવે છે. સૌને સમાનતા, સુરક્ષા અને સુવિધા માટે લોકશાહીનાં મૂલ્યોને ધ્યાનમાં રાખી આયોજનો અને યોજનાઓ અમલી કરી લોકશાહીનાં મૂલ્યોનું જતન થાય તે માટે કાર્ય થાય તે જરૂરી છે.



15.2 મતદારનું ચિત્ર

## સરકાર અને કાયદા

સરકારનું કામ કાયદા બનાવવાનું છે. આ કાયદા સૌંદર્ય રાખવા પડે. સરકારને કામ કરવા માટે વિવિધ કાયદા મહત્વાનું સ્થાન ધરાવે છે. સરકાર જોડે કાયદાના અમલ સાથે તેમાં સુધારો કરવાની પણ સત્તા હોય છે. સરકારના કાયદાને લોકો પડકારી પણ શકે છે. પોતાના અવિકારો અને થયેલ અન્યાય સામે લોકો અદાલતોનો સહયોગ મેળવી શકાય છે. સરકારના કાયદા કે કાર્યવાહી સંદર્ભ લોકોને લાગે કે તેનું યોગ્ય રીતે અમલીકરણ થતું નથી ત્યારે તેઓ પોતાનો અવાજ અદાલતમાં રજૂ કરે છે. જરૂર જણાય ત્યાં અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે.



15.3 ન્યાયની દેવી

### • પ્રવૃત્તિ •

- શિક્ષકશ્રી પાસેથી અદાલતનાં કાર્યો વિશે જાણકારી મેળવી ચર્ચા કરો.
- દૈનિકપત્રો કે સામયિકોમાંથી સરકારને અદાલતે આપેલાં સૂચન કે આદેશને લગતા સમાચાર શોધી એકઠા કરો.



સ્વાધ્યાય

### 1. નીચેના પ્રશ્નોના ઉત્તર આપો :

- (1) સરકારની જરૂર શા માટે છે ?
- (2) સરકારના મુખ્ય પ્રકાર કેટલા અને કયા-કયા છે ?
- (3) દુનિયામાં સરકારના મુખ્યત્વે કેટલા પ્રકાર જોવા મળે છે ?
- (4) આપણા દેશમાં કયા પ્રકારની શાસનવ્યવસ્થા જોવા મળે છે ?

### 2. યોગ્ય જોડકાં જોડો :

અ

- (1) રાજ્ય સરકાર
- (2) સ્થાનિક સરકાર
- (3) રાષ્ટ્રીય સરકાર
- (4) રાજશાહી સરકાર

બ

- (a) એક જ વ્યક્તિ શાસન કરે છે.
- (b) સમગ્ર દેશમાં કાર્યભાર સંભાળે છે.
- (c) ગામ કે શહેર માટે કાર્યભાર સંભાળે છે.
- (d) સમગ્ર રાજ્યમાં કાર્યભાર સંભાળે છે.

### 3. યોગ્ય કારણ આપો :

- (1) લોકશાહીમાં લોકોને કેન્દ્રસ્થાને મનાય છે.
- (2) લોકોના અવિકારો રાજશાહીમાં જળવાતા નથી.
- (3) સરકાર કાયદામાં ફેરફાર કરે છે.

### 4. નીચેનાં વિધાનો ખરાં છે કે ખોટાં તે જણાવો :

- (1) લોકશાહીમાં લોકોના હાથમાં સત્તા છે.
- (2) રાજશાહી શાસક ચૂંટણી વગર પસંદ થાય છે.
- (3) અદાલત સરકારને વિવિધ મુદ્દાઓ માટે સૂચન કે આદેશ કરી શકે છે.

# 16

## સ્થાનિક સરકાર




આપણો સરકાર, સરકારના પ્રકાર અને સરકારના સ્તર વિશે તમે જાણો છો. હવે આપણે આપણા વિસ્તારની સ્થાનિક સરકાર વિશે અભ્યાસ કરીએ. વિદ્યાર્થી મિત્રો, અહીં આપને નીચે એક ફકરો આપેલ છે. જેમાં તમારા વિસ્તાર પ્રમાણે જે બાબત લાગુ ન પડતી હોય તેના પર લીટી દોરીને તે મુજબ આપેલ ખાલી જગ્યામાં સાચી વિગત લખો.

હું ..... ગામ/શહેરમાં રહું છું. મારા ગામ/શહેરમાં ગ્રામપંચાયત/નગરપાલિકા/મહાનગરપાલિકા આવેલી છે. જેના વડા સરપંચ/પ્રમુખ/મેયરનું નામ ..... છે.

તમે આ વિગતો ભરી તેના પરથી ઘ્યાલ આવી ગયો કે, તમે કોઈ ગામ/શહેરમાં રહો છો. તમે તમારા વિસ્તારના સ્થાનિક વહીવટીતંત્રથી માહિતગાર છો. સ્થાનિક વહીવટીતંત્ર કેવી રીતે કાર્ય કરે છે તેના વિશે વિશેષ અભ્યાસ કરીએ.

### સ્થાનિક સરકાર (પંચાયતીરાજ)




### પંચાયતીરાજ

આપણે પંચાયતીરાજનું ગ્રામ સ્તરનું માળખું સ્વીકારેલ છે :

- (1) ગામ કક્ષાએ ગ્રામપંચાયત
- (2) તાલુકા કક્ષાએ તાલુકા પંચાયત
- (3) જિલ્લા કક્ષાએ જિલ્લા પંચાયત

સ્થાનિક કક્ષાએ લોકો મત આપીને પોતાના પ્રતિનિધિઓ ચૂંટે છે અને તેમના દ્વારા જ વહીવટ થાય તેને સ્થાનિક સ્વરાજ્ય કરે છે. આ સંસ્થાઓને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ કહેવામાં આવે છે. ગ્રામપંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત એ ગ્રામીણ સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે. નગરપાલિકા અને મહાનગરપાલિકા એ શહેરી સ્થાનિક સ્વરાજ્યની સરકાર છે.



### 16.1 સ્થાનિક સરકાર

#### જ્ઞાનવા જેવું

- ભારતમાં પંચાયતીરાજની શરૂઆત રાજસ્થાનના નાગોર જિલ્લાના બગાદરા ગામથી 2 ઓક્ટોબર, 1959થી થઈ. ગુજરાતમાં 1 એપ્રિલ, 1963થી પંચાયતીરાજનો અમલ શરૂ થયો.

વિદ્યાર્થીમિત્રો, ચિત્ર 16.2માં તમે જોઈ શકો છો કે, ગ્રામપંચાયતના પાયા પર આપણી બધી જ સરકારો ટકેલી છે. ગ્રામપંચાયતથી ઉપર તાલુકા પંચાયત અને તેનાથી ઉપર જિલ્લા પંચાયત આવેલ છે. ત્યાર પછી રાજ્યની સરકાર જે રાજ્યનો વહીવટ સંભાળે છે. ગુજરાત રાજ્યનો વહીવટ ગુજરાત સરકાર સંભાળે છે. આપણા દેશનો વહીવટ કેન્દ્ર સરકાર ચલાવે છે. આમ, આ બધાના મૂળમાં તો ગ્રામપંચાયત જ છે. પંચાયતીરાજ્યમાં સૌથી મહત્વનું એકમ ગ્રામપંચાયત છે.

### ગ્રામીણ પ્રશાસન

#### ગ્રામપંચાયત :



P7R5A5

કેન્દ્ર સરકાર

રાજ્ય સરકાર

જિલ્લા પંચાયત

તાલુકા પંચાયત

ગ્રામપંચાયત

### 16.2 સરકારનું વિકાસ માળખું

**રચના :** સ્થાનિક સ્વરાજ્યની સંસ્થામાં સૌથી પાયાનું એકમ ગ્રામપંચાયત છે. 500 થી 25,000 સુધીની વસતી ધરાવતાં ગામમાં ગ્રામપંચાયતની રચના કરવામાં આવે છે. ગ્રામપંચાયતમાં ઓછામાં ઓછા 8 અને વસતીના આધારે વધુમાં વધુ 16 ચૂંટાયેલા સભ્યો હોય છે. ગ્રામપંચાયતના વડાને સરપંચ કહે છે. દર પાંચ વર્ષ ગ્રામપંચાયતના સભ્યો અને સરપંચની ચૂંટણી થાય છે. ગામના મતદારો પ્રત્યક્ષ રીતે મત આપીને સરપંચને ચૂંટે છે. વોર્ડના સત્યને જે તે વોર્ડના મતદારો ચૂંટે છે. ગ્રામપંચાયતની ચૂંટણી કોઈપણ રાજકીય પક્ષ દ્વારા કે કોઈ રાજકીય પક્ષના પ્રતીક પર લડાતી નથી.

#### વહીવટ :

ગ્રામપંચાયતના સરપંચ અને સભ્યો મળિને ગામના વિકાસનાં કામો અંગે ઠરાવો કરીને ગામના વિકાસનાં કામો નક્કી કરે છે. સરકાર તરફથી તલાટી-કમ-મંત્રીની નિમણૂક કરવામાં આવે છે. તે વહીવટીકાર્ય સંભાળે છે. કરવેરાની વસૂલાત કરે છે.

ગ્રામપંચાયતના અહેવાલ, પત્રકો અને અંદાજપત્ર તૈયાર કરી તેના હિસાબો રાખવાનું કામ કરે છે. ગ્રામપંચાયતના કાર્યાલયને ‘ગ્રામ સચિવાલય’ પણ કહેવામાં આવે છે.



### 16.3 ગ્રામપંચાયત

#### ગ્રામપંચાયતની આવકનાં સાધનો :

- પાણીવેરો, સફાઈવેરો, મિલકતવેરો, દુકાનવેરો
- રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર તરફથી મળતું અનુદાન

## કાર્યો :

- ધર નંબર આપવા.
- ધરવપરાશ અને પીવાના પાણીની વ્યવસ્થા
- ગામના રોડ-રસ્તા બનાવવા
- ગામના રસ્તાની સફાઈ અને ગંદા પાણીનો નિકાલ
- જહેર મિલકતની જાળવણી
- ગામમાં આરોગ્યવિષયક જાળવણી
- ગામમાં દીવાબત્તી (લાઈટ)ની વ્યવસ્થા
- ગામમાં પ્રાથમિક શિક્ષણ સહિત શિક્ષણ સુવિધા, જાગ્રત્ત અને ફેલાવો
- ગ્રામવિકાસનું આયોજન
- ગામના ખેતરોના પાકની સંભાળ અને ગૌચરની જાળવણી
- જમીન દફ્તરની જાળવણી
- જન્મ-મરણનું રજિસ્ટર નિભાવવું.

## ગ્રામસભા

સામાન્ય ભાષામાં કહીએ તો ગ્રામસભા એટલે ગામના લોકોને ભેગા કરવા. ગ્રામસભા એ ગામની ધારાસભા જેવી છે. ગામમાં રહેતા પુખ્ત વયના બધા જ સભ્યો ગ્રામસભાના સભ્ય ગણાય છે. તેને ગ્રામસભામાં હાજર રહેવાનો, મત આપવાનો કે કોઈપણ દરખાસ્ત કરવાનો અવિકાર છે.

ગ્રામપંચાયતે વર્ષમાં ઓછામાં ઓછું બે વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે. ગ્રામસભાના અધ્યક્ષ સરપંચ હોય છે. અગાઉથી જાણ કરીને ગ્રામસભાની બેઠક બોલાવવામાં આવે છે. જેમાં તાલુકા અને



16.4 ગ્રામસભા

જિલ્લા કક્ષાએથી અધિકારીઓ હાજર રહે છે તેમજ ગામમાં ફરજ બજાવતા સરકારી કર્મચારીઓ પણ હાજર રહે છે.

ગ્રામપંચાયતે કરવાના વિકાસનાં કામોનો અગ્રતાકમ નક્કી કરવામાં આવે છે. ગામના પ્રશ્નો જેવા કે ગામના રસ્તાઓ, પીવાના પાણીની સમસ્યા, ગ્રામસફાઈ, લાઈટની સુવિધા, શિક્ષણ અને આરોગ્યની સુવિધા વગેરેની ચર્ચા થાય છે.

ગ્રામસભાના દરેક સભ્યે જાગ્રત રહીને ગ્રામસભામાં અવશ્ય હાજરી આપવી જોઈએ. ગામના પ્રશ્નો અને વિકાસનાં કામોની ચર્ચા થવી જોઈએ તો જ ગામને પારદર્શક વહીવટ મળશે અને ગ્રામસભાનો ઉદ્દેશ સફળ થશે.

### • પ્રવૃત્તિ •

સરપંચ અને તલાટી-કમ-મંત્રીની મુલાકાત લો અને નીચે મુજબની માહિતી એકઠી કરો :

- તમારા ગામની વસતી અને ગામનાં શ્રી-પુરુષ મતદારોની સંખ્યા
- તમારા ગામમાં કુલ કેટલા વોડ છે ? કેટલા સભ્યો છે ? મહિલા સભ્યોની યાદી બનાવો.
- તમારા ગામની ગ્રામપંચાયત દ્વારા કરેલાં વિકાસનાં કાર્યોની યાદી તૈયાર કરો.

### • જાણવા જેવું •

#### સમરસ ગ્રામપંચાયત

ગ્રામપંચાયતની રચના ચૂંટણી વિના સર્વસંમતિથી વિના વિરોધે થાય તેવી ગ્રામપંચાયતને સમરસ ગ્રામપંચાયત કહે છે. ગામમાં સંપ, સહકાર, સુમેળ અને સંવાદિતા જળવાઈ રહે તે રીતે સ્થાનિક પ્રજા વિકાસમાં ભાગ લે તે હેતુથી ગુજરાત રાજ્યમાં ઓક્ટોબર, 2001માં પંચાયત ગ્રામ, ગૃહનિર્માણ અને ગ્રામવિકાસ વિભાગ દ્વારા આ યોજના અમલમાં મૂકવામાં આવી.

ગ્રામપંચાયતની ચૂંટણી બિનહરીઝ થાય તો સરકાર દ્વારા ગામના વિકાસ માટે ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. આ અનુદાનનો ઉપયોગ ગ્રામસભા નક્કી કરે તે મુજબના વિકાસનાં કામો માટે કરવામાં આવે છે. જો ગ્રામપંચાયત મહિલા સમરસ બને એટલે કે સરપંચ સહિત તમામ સભ્યો મહિલાઓ બિનહરીઝ ચૂંટાય તો ખાસ અનુદાન ફાળવવામાં આવે છે. પ્રથમ વખત, બીજી વખત, ત્રીજી વખત અને સતત ચોથી વખત સમરસ ગ્રામપંચાયત થાય તો વિકાસનાં કામો માટે વિશેષ અનુદાન સરકાર ફાળવે છે. ગ્રામપંચાયતની ચૂંટણીઓના કારણે ગામમાં મનહુંબ ન થાય, વેરઝેર ન સર્જાય તે માટે સરકાર દ્વારા આ યોજના જાહેર કરેલ છે.

### તાલુકા પંચાયત

સ્થાનિક સરકારમાં ગ્રામપંચાયત પદીનું બીજું સ્તર તાલુકા પંચાયત છે.

**રચના :** તાલુકા પંચાયતની બેઠકો તાલુકાની વસતીના પ્રમાણો નક્કી થાય છે. તાલુકા પંચાયતમાં ઓછામાં ઓછા 16 અને વધુમાં વધુ 32 સભ્યો ચૂંટાયેલા હોય છે. જેમાં મહિલાઓ માટે 50 % બેઠકો અનામત રાખવામાં આવે છે. આ બેઠકના મતદારો તાલુકા પંચાયતના સભ્યોને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યોમાંથી બહુમતીથી તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની વરણી થાય છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી જ કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે.

**વહીવટ :** તાલુકા પંચાયતના વહીવટી વડાને તાલુકા વિકાસ અધિકારી (T.D.O. - Taluka Development Officer) કહે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. તે તાલુકા પંચાયતના ઠરાવોનો અમલ કરાવે છે. તાલુકા પંચાયતના તમામ કર્મચારીઓ પર દેખરેખ રાખે છે. તાલુકા પંચાયતનું વાર્ષિક અંદાજપત્ર (Budget) પણ તેઓ તૈયાર કરે છે.

### કાર્યો :

- તાલુકામાં સ્વાસ્થ્ય અને આરોગ્યવિધયક સેવાઓ પૂરી પાડવી.
- રોગચાળા નિયંત્રણની કામગીરી કરવી.
- ગ્રામ્ય માર્ગો બનાવવા તથા જળવણી કરવી.
- ગ્રાથમિક શાળાઓની સ્થાપના અને સંચાલન કરવું.
- તાલુકા કક્ષાએ ખેતીવાડી સુધ્ધારણા અને આયોજન કરવું.
- શ્રી કલ્યાણ, યુવક પ્રવૃત્તિઓ, સામાજિક વિકાસ અને સહાય પૂરી પાડવી.
- પૂર, આગ, અક્સમાત વગેરે આકસ્મિક સંજોગોમાં મદદ

### • જાળવા જેવું •

#### તીર્થગ્રામ યોજના :

ગુજરાતમાં તીર્થગ્રામ યોજનાની શરૂઆત 21 જુલાઈ, 2004-05થી અમલમાં આવી. આ યોજનામાં પસંદ થયેલ ગામને અનુદાન રાજ્ય સરકાર ફાળવે છે. જે માટે....

- છેલ્લાં પાંચ વર્ષમાં ગામમાં કોઈ પણ પ્રકારનો ગુનો નોંધાયેલ ન હોવો જોઈએ.
- માદક કે કેફી દ્રવ્યોનું ઉત્પાદન, વેચાણ કે સેવન થતું ન હોવું જોઈએ.
- ગામમાં સ્વચ્છતા જળવાવી જોઈએ.
- કન્યા-કેળવણીનો ઊંચો દર અને અપવ્યયનો નીચો દર હોવો જોઈએ.
- આ ઉપરાંત અન્ય માપદંડોના આધારે તીર્થગ્રામ પસંદ કરવામાં આવે છે. જેનો ઉદ્દેશ ગ્રામ્ય વિસ્તારમાં રહેતા લોકો વચ્ચે પરસ્પર સદ્ભાવના વધે, એકત્ર જળવાય અને ભાઈચારાની ભાવના વધે તે છે.

#### પાવનગ્રામ યોજના :

તીર્થગ્રામ યોજનાની જેમ જ છેલ્લાં ત્રણ વર્ષમાં ગામમાં કોઈ ગુનો નોંધાયેલ ન હોય તેવા ગામને પાવન ગામ તરીકે પસંદ કરીને રૂપિયા એક લાખ સુધીનું અનુદાન સરકાર દ્વારા ફાળવવામાં આવે છે. શું તમારું ગામ પણ આ યોજનામાં પસંદ થાય તો તમને ગમે ? અને એ માટે ગામલોકોએ શું કરવું પડે ?

### • પ્રવૃત્તિ •

- તમારા તાલુકાની તાલુકા પંચાયત કચેરીની મુલાકાત લેવી.
- તમારા તાલુકાના તાલુકા પંચાયતના પ્રમુખ અને તાલુકા વિકાસ અધિકારી (T.D.O.)નાં નામ લખો.
- તમારા વિસ્તારના તાલુકા પંચાયતના સભ્ય સાથે તાલુકા પંચાયતની રચના અને કામગીરી અંગે ચર્ચા કરો.

## જિલ્લા પંચાયત

સ્થાનિક સરકારનું ગ્રીજું સ્તર જિલ્લા પંચાયત છે. ત્રિ-સ્તરીય પંચાયતીરાજમાં સૌથી ઉપરનું સ્તર છે.

**રચના :** જિલ્લા પંચાયતની સભ્યસંખ્યા ઓછામાં ઓછી 32 અને વધુમાં વધુ 52 હોય છે. જિલ્લાની વસ્તીના આધારે જિલ્લા પંચાયતની બેઠક નક્કી થાય છે. જેમાં 50 % બેઠકો મહિલાઓ માટે અનામત રાજવામાં આવે છે. જે-તે બેઠક વિસ્તારના મતદારો પોતાના સભ્યને ચૂંટે છે. આ ચૂંટાયેલા સભ્યો બહુમતીથી પ્રમુખ અને ઉપપ્રમુખને ચૂંટે છે. તેમજ આ ચૂંટાયેલા સભ્યોમાંથી કારોબારી સમિતિ, સામાજિક ન્યાય સમિતિ, શિક્ષણ સમિતિ, બાંધકામ સમિતિ, આરોગ્ય સમિતિ વગેરે સમિતિઓની રચના કરવામાં આવે છે. જિલ્લા પંચાયતની મુદ્દત પાંચ વર્ષની હોય છે.

**વહીવટ :** જિલ્લા પંચાયતના વહીવટી વડાને જિલ્લા વિકાસ અધિકારી (D.D.O. - District Development Officer) કહે છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે. રાજ્ય સરકારની યોજનાઓનું સંકલન અને અમલ જિલ્લા પંચાયત કરે છે.

### કાર્યો :


- જિલ્લા પંચાયત, ગ્રામપંચાયત અને તાલુકા પંચાયતની પ્રવૃત્તિઓનું નિયંત્રણ અને સહાયનું કાર્ય કરે છે.
- રાજ્ય સરકારની મહેસૂલ, શિક્ષણ, સહકાર, સિંચાઈ, પશુ સંવર્ધન, કૃષિ વગેરે પ્રવૃત્તિઓનું જિલ્લા કક્ષાએ સંચાલન અને નિયંત્રણ કરે છે.

જિલ્લા આરોગ્ય અધિકારી, જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી, જિલ્લા ખેતીવાડી અધિકારી, જિલ્લા સમાજ કલ્યાણ અધિકારી, નાયબ કાર્યપાલક ઈજનેર વગેરે અધિકારીઓ જિલ્લા પંચાયતનાં કાર્યો સંભાળે છે.

### • પ્રવૃત્તિ •

- તમારા જિલ્લાની જિલ્લા પંચાયત કચેરીની મુલાકાત લેવી.
- તમારા જિલ્લાના જિલ્લા પંચાયતના પ્રમુખ અને જિલ્લા વિકાસ અધિકારી (D.D.O.)નાં નામ લખો.
- તમારા વિસ્તારના જિલ્લા પંચાયતના સભ્યનું નામ લખો.

## સામાજિક ન્યાય સમિતિ



16.5 સામાજિક ન્યાય સમિતિ

સમાજના નબળા વર્ગને શિક્ષણ, સ્વાસ્થ્ય અને સામાજિક-આર્થિક સગવડ મળી રહે તેવી યોજનાઓ ઘડવી અને તેનો અમલ કરવાનું કામ સામાજિક ન્યાય સમિતિનું છે. તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત કક્ષાએ આ સમિતિ પાંચ સભ્યોની બનેલી હોય છે. પંચાયતીરાજમાં ગ્રાણેય સ્તરોએ સામાજિક ન્યાય સમિતિની રચના કરવી ફરજિયાત છે. આ સમિતિનું કાર્ય નબળા વર્ગને ન્યાય આપવાનું છે.

### શહેરી પ્રશાસન

આપણા દેશનાં એક લાખ કે તેથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં નગરપાલિકા તથા પાંચ લાખ કે તેથી વધુ વસતી ધરાવતાં શહેરોમાં મહાનગરપાલિકા એ સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓ છે. વસતીના આધારે આ વિસ્તારો નક્કી કરવામાં આવે છે. જેમાં સામાન્ય રીતે દર પાંચ વર્ષ ચૂંટણીઓ કરવામાં આવે છે. શહેરના મતાધિકાર ધરાવતાં તમામ મતદારો ચૂંટણીમાં ભાગ લઈ શકે છે.



### નગરપાલિકા

સામાન્ય રીતે પચીસ હજારથી વધુ વસતીવાળાં શહેરોમાં નગરપાલિકા હોય છે. નગરપાલિકાની સભ્ય ઓછામાં ઓછી 28 હોય છે.

**રચના :** નગરપાલિકા વિસ્તારને વસતીના આધારે વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. એક વોર્ડમાં 4 સભ્યો હોય છે. જેમાંથી 50 % મહિલા અનામત સભ્યો હોય છે. જેમાંથી ચૂંટાયેલા સત્યોમાંથી પ્રમુખ, ઉપપ્રમુખની વરણી કરવામાં આવે છે. પ્રમુખ એ ચૂંટાયેલા વડા છે. તેમનો કાર્યકાળ અઢી વર્ષનો હોય છે. તેઓ નગરપાલિકાનું અધ્યક્ષ પદ સંભાળે છે.

**વહીવટ :** ચૂંટાયેલા સત્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. જેમાં કારોબારી સમિતિ, નાણાં સમિતિ, આરોગ્ય અને સફાઈ સમિતિ, બાંધકામ સમિતિ વગેરે ઉપરાંત જરૂર મુજબની અન્ય સમિતિઓ રચવામાં આવે છે. નગરપાલિકાના વહીવટી વડા ચીફ ઓફિસર ગણાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે.

**કાર્યો :** નગરપાલિકા દ્વારા નગરજનોની સુવિધા માટે નીચે મુજબનાં કાર્યો હાથ ધરવામાં આવે છે :

- પાણીપુરવણાની વ્યવસ્થા
- રસ્તા, ગંડા પાણીનો નિકાલ, સફાઈની વ્યવસ્થા
- જન્મમરણ અને લગ્નની નોંધણીની કામગીરી
- નગરનિયોજન અને શિક્ષણની વ્યવસ્થા
- અભિનશમન, અખાદ્યપદાર્થોના વેચાણ સામે કાર્યવાહી
- બગીચા, પુસ્તકાલયો વગેરે સુવિધાઓ આપવાનું
- સાંસ્કૃતિક ભવનો કે સભાગૃહનું નિર્માણ અને સારસંભાળ

### પ્રવૃત્તિ

- શહેરી વિસ્તારમાં આવેલી નગરપાલિકાની કચેરીની મુલાકાત લો.
- નગરપાલિકાના પ્રમુખે કઈ કામગીરી કરવાની હોય તેની માહિતી મેળવો.
- તમે નગરપાલિકા વિસ્તારમાં રહેતા હોય તો તમારા વોર્ડના સભ્યોનાં નામ લખો.

## મહાનગરપાલિકા

મહાનગરપાલિકામાં સત્ત્યસંખ્યા વસ્તીના આધારે નક્કી કરવામાં આવે છે. મહાનગરપાલિકાના સત્ત્યને કોર્પોરેટર (કાઉન્સિલર) તરીકે ઓળખવામાં આવે છે. મહાનગરપાલિકાના વડાને મેયર કહેવામાં આવે છે. ગુજરાતમાં આઠ મહાનગરપાલિકાઓ છે.

**રચના :** મહાનગરપાલિકાને વિવિધ વોર્ડમાં વહેંચવામાં આવે છે. 75,000ની વસ્તીએ એક વોર્ડ બનાવવામાં આવે છે. જેમાં 4 સત્ત્યો હોય છે, તેમાંથી 50 % મહિલા અનામત સત્ત્યો હોય છે. શહેરના મતાધિકાર ધરાવતા તમામ મતદારો ચૂંટણીમાં મતદાન કરી શકે છે અને પોતાના વિસ્તારના કોર્પોરેટરને ચૂંટે છે. વિવિધ વોર્ડમાંથી ચૂંટાયેલા સત્ત્યો બહુમતીથી પોતાનામાંથી મેયર ચૂંટી કાઢે છે. મેયર પોતાના હોદા પર અઢી વર્ષ માટે રહે છે.

**વહીવટ :** ચૂંટાયેલા સત્ત્યોમાંથી વિવિધ સમિતિઓ બનાવવામાં આવે છે. જેમાં કારોબારી સમિતિ (સ્ટેન્ડિંગ કમિટી) સૌથી વધારે મહત્વની છે. મહાનગરપાલિકાના વહીવટી વડા અનુનિસિપલ કમિશનર ગણાય છે. તેમની નિમણૂક રાજ્ય સરકાર કરે છે.

**કાર્યો :** શહેરી વિસ્તારમાં વસ્તી વધારે હોય છે. આથી નાગરિકોની સુખાકારી અને શહેરના વિકાસ માટે વધુ જવાબદારીપૂર્વક કામગીરી કરવાની હોય છે.

- જહેર સ્વચ્છતા અને આરોગ્યની જાળવણી
- પીવાના ચોખ્ખા પાણીની વ્યવસ્થા અને વિતરણ
- ગાટરવ્યવસ્થા, સાફસફાઈ અને ગંદા કચરાનો નિકાલ
- રસ્તાઓ બનાવવા અને જાળવણી કરવી
- રસ્તા પર લાઈટની વ્યવસ્થા કરવી
- પ્રાથમિક શિક્ષણની વ્યવસ્થા
- પુસ્તકાલય, કીડાંગણો અને બાગબગીચા બનાવવા
- ખાદ્યસામગ્રીમાં થતી ભેણસેળ અટકાવવી
- જન્મમરણ અને લગ્નની નોંધણી કરવી.

### • પ્રવૃત્તિ •

- ગુજરાત રાજ્યમાં આવેલ મહાનગરપાલિકાઓની યાદી તૈયાર કરો.
- તમારા વિસ્તારની કે નજીકની મહાનગરપાલિકાની વેબસાઈટની મુલાકાત લો. તેમાં નાગરિકોની સુવિધા માટે કદ્દિક કામગીરી ઓનલાઈન થાય છે તેની માહિતી મેળવો.

## કલેક્ટર

કલેક્ટર જિલ્લાના વહીવટી વડા છે. તેઓ કલેક્ટર ઉપરાંત જિલ્લા ન્યાયાધીશ (District Magistrate) અને જિલ્લા ચૂંટણી અધિકારી તરીકેની કામગીરી પણ કરે છે. તેઓની પસંદગી કેન્દ્રીય જહેર સેવા આયોગ (U.P.S.C. - Union Public Service Commission) દ્વારા કે બધીથી થાય છે. તેમને રાજ્ય સરકાર નિમણૂક આપે છે. તેઓ

જિલ્લામાં વહીવટી વ્યવસ્થા જાળવવાનું કાર્ય કરે છે. જિલ્લામાં જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓની અદ્ધત ન સર્જય તે નિશ્ચિત કરવાનું કાર્ય કલેક્ટરનું હોય છે.

### પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા મહત્વની છે.

- જિલ્લા સ્તરે તમામ વિભાગોનાં કામોનું સંકલન અને સંચાલન કરે છે.
- સમગ્ર જિલ્લાના વિકાસ માટે બનેલી જિલ્લા આયોજન સમિતિના સચિવ કલેક્ટર હોય છે.
- તેઓ ગ્રામપંચાયતની સભ્ય સંખ્યા નક્કી કરે છે. ગ્રામપંચાયતમાં અનામત બેઠકોની ફાળવણી કરે છે.
- અનુસૂચિત જાતિ, અનુસૂચિત જનજાતિ, સામાજિક અને શૈક્ષણિક રીતે પદ્ધત વર્ગના લોકો તથા મહિલાઓ માટે સરપંચનો હોદ્દો અનામત રાખવાનો નિર્ણય કરે છે.

### • શિક્ષક-પ્રવૃત્તિ •

- કેન્દ્રીય જાહેર સેવા આયોગ (U.P.S.C.) દ્વારા લેવાતી પરીક્ષા અંગે વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવું. IAS, IPS, IFS અંગે માહિતી આપવી. જિલ્લા કક્ષાએ ફરજ બજાવતા આઈ.એ.એસ. કક્ષાના અને આઈ.પી.એસ. કક્ષાના અધિકારીઓનાં નામ જણાવવા. ગુજરાત જાહેર સેવા આયોગ (G.P.S.C.) દ્વારા લેવાતી જાહેર પરીક્ષા અંગે માહિતી આપવી.

### મામલતદાર

મામલતદાર એ તાલુકા કક્ષાના વહીવટી અધિકારી છે. તેઓની પસંદગી રાજ્ય જાહેર સેવા આયોગ (ગુજરાતમાં જી.પી.એસ.સી.) દ્વારા લેવાતી પરીક્ષા દ્વારા કે બઢતીથી થાય છે. મામલતદાર સરેરાશ 50 કે તેથી વધુ ગામોના સમૂહના બનેલા તાલુકાના મહેસૂલી વડા છે. તાલુકા ન્યાયાધીશ (Executive Magistrate) તરીકે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ માટે કલેક્ટરને સીધી રીતે જવાબદાર છે.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાર યાદી તૈયાર કરાવવી, ચૂંટણીઓ યોજવી, વિવિધ પ્રકારના દાખલા અને પ્રમાણપત્રો આપવા, મધ્યાહ્નભોજન યોજનાનું સંચાલન તથા નિયંત્રણનું કાર્ય, ફુદરતી આપત્તિઓ સમયે રાહત-બચાવની કામગીરી વગેરે કાર્યો કરે છે.

### લોકઅદાલત

ગરીબ અને સામાજિક રીતે પદ્ધત વર્ગના લોકો, ફુદરતી આપત્તિનો ભોગ બનનાર વ્યક્તિ, ઓછી આવક ધરાવનાર વ્યક્તિ કોઈપણ કારણોથી ન્યાય મેળવવામાં વંચિત ન રહે તે માટે લોકઅદાલતો સ્થાપવામાં આવે છે. બંને પક્ષો સંમત હોય તેમને લોકઅદાલતમાં બોલાવવામાં આવે છે. લોકઅદાલત એ તકરાર નિવારણનો શ્રેષ્ઠ વિકલ્પ છે. ‘કોઈની ન હાર કોઈની ન જીત’ એ રીતે લાંબા સમયથી મુદ્દતો પડતી હોય એવા કેસોનો નિકાલ થાય છે. તેમાં કેસ મૂકવા માટે પક્ષકારોને કોઈ બર્ચ કરવાનો રહેતો નથી. કેટં કચેરીમાં લાંબા સમયથી પડતર રહેલા કેસોનો બંને પક્ષોને સંતોષકારક અને સમાધાનકારી રીતે ન્યાય મળે છે. વારંવાર મુદ્દતે-મુદ્દતે ઘક્કા ખાતા પક્ષકારો, સાક્ષીઓ વગેરેને પડતી મુશ્કેલીઓમાંથી લોકઅદાલત મુક્ત કરે છે.

સમાધાન સમજૂતી શક્ય ન બને તો લોકઅદાલત દ્વારા કેસો હાથ પર લઈને નિર્ણય આપે છે જે તમામ પક્ષકારોને માન્ય રહે છે. લોકઅદાલતનો હુકમ અંતિમ રહે છે. લોકઅદાલતથી વિવાદનો અંત આવે છે. બંને પક્ષોને

ન્યાય મળે છે અને પરસ્પર ઝડપતા માણસો વચ્ચે સમાધાન થાય છે. નાણાં અને સમયનો બચાવ થાય છે. ગુજરાત કાનૂનીસેવા સત્તામંડળ, ગુજરાત હાઈકોર્ટ, અમદાવાદ દ્વારા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાં કાયમી લોકઅદાલતની સ્થાપના કરવામાં આવેલ છે. કાયમી લોકઅદાલતમાં કેસ દાખલ કરવા માટે અથવા કોઈ કાર્યવાહી કરવા માટે કોર્ટ ફી ભરવાની રહેતી નથી.



I7Z2B8

## સ્વાધ્યાય

### 1. ખાતી જગ્યા પૂરો :

- (1) આપણે પંચાયતીરાજ્યનું ..... સ્તરનું માળખું સ્વીકારેલ છે.
- (2) ગ્રામપંચાયતનો વહીવટ કરવા સરકાર તરફથી ..... ની નિમણૂક કરવામાં આવે છે.
- (3) તાલુકાના વહીવટી વડાને ..... કહે છે.
- (4) સ્થાનિક સરકારનું ત્રીજું સ્તર ..... પંચાયત છે.
- (5) ગ્રામપંચાયત વિસ્તારમાં વર્ષમાં ઓછામાં ઓછું ..... વખત ગ્રામસભાનું આયોજન કરવું ફરજિયાત છે.

### 2. ટૂંકમાં ઉત્તર લખો :

- (1) મામલતદાર કઈ કક્ષાના વહીવટી અધિકારી છે ?
- (2) જિલ્લાના વહીવટી વડા કોણ હોય છે ?
- (3) મહાનગરપાલિકાના વહીવટી વડા કોને ગણવામાં આવે છે ?
- (4) મહાનગરપાલિકામાં કેટલા ટકા મહિલા અનામત સભ્યો હોય છે.
- (5) મેયર પોતાના હોદ્દા પર કેટલી મુદ્દત માટે રહી શકે છે ?

### 3. ત્રણ-ચાર વાક્યોમાં ઉત્તર આપો :

- (1) ગ્રામપંચાયતનાં કાર્યો જણાવો.
- (2) સ્થાનિક સરકાર એટલે શું ? સમજાવો.
- (3) તલાટી કમ-મંત્રી કયાં-કયાં કાર્યો કરે છે ?

### 4. ટૂંક નોંધ લખો :

- (1) મહાનગરપાલિકાનાં કાર્યો વિગતે લખો.
- (2) સામાજિક ન્યાય સમિતિ
- (3) પંચાયતીરાજમાં જિલ્લા કલેક્ટરની ભૂમિકા



વ્યક્તિના જીવન ઉપર આસપાસની બાબતો અસર કરે છે. આપણી આસપાસ અનેક પ્રકારની ભિન્નતા જોવા મળે છે. ગ્રામીણ જીવનની સૌથી મહત્વની બાબત કોઈ હોય તો એ છે કે, તેઓ ઓછામાં ઓછી સુવિધાઓનો ઉપયોગ કરે છે. ગામડાના લોકો વિવિધ રીતે આર્થિક-વ્યવસ્થા સાથે જોડાયેલ હોય છે. મોટેભાગે લોકો જેતીનાં કામ સાથે જોડાયેલ હોય છે. ગ્રામીણ જીવનમાં સ્થાનિક વ્યવસ્થા અને સ્થાનિક પર્યાવરણની વસ્તુઓ જીવનમાં સીધી અસર કરે છે. પર્યાવરણ સાથે જીવનનિર્વાહની વ્યવસ્થા એટલે ગામડાનું જીવન. ગામડાની વ્યક્તિઓના જીવન ઉપરાંત તેમની સુવિધાઓ અને સમસ્યા અંગે આપણે ચર્ચા કરીશું.

આપણો દેશ ભારત અનેક વિવિધતા વચ્ચે અનોખી એકતા ધરાવે છે. આપણો દેશ ધર્મ, ભાષા, પ્રદેશ કે આર્થિક ભિન્નતા વચ્ચે અનોખી ઓળખ ધરાવે છે. આપણા દેશમાં 5000 કરતાં વધારે શહેર અને 27,000 જેટલાં નાનાં-મોટાં નગર છે. આસપાસનાં ગામમાં રહેતા લોકો રોજગારી મેળવવા માટે શહેરમાં આવે છે. કેટલાંક નગર કે શહેરમાં બીજા રાજ્યથી પણ લોકો આવે છે. આપણા દેશના નાગરિકોને દેશમાં કોઈ પણ રાજ્યમાં જઈ શાંતિથી રહેવાનો અને વિકસવાનો બંધારણમાં અધિકાર અપાયો છે. શહેરમાં રહેનાર લોકો વિવિધ વ્યવસાય સાથે જોડાયેલ હોય છે. કેટલાક એક કરતાં વધારે વ્યવસાય સાથે જોડાયેલ હોય છે. આપણી આસપાસ અનેક લોકો આપણાને જોવા મળે છે. દરેકને જીવનનિર્વાહ કરવા માટે આવકની જરૂર પડે છે. ઘરમાં પણ નોકરી, ધંધો કે મજૂરી-કામ કરી પૈસા આવે એમાંથી પરિવાર જીવનનિર્વાહ કરે છે.



17.1 જેતરમાં કાર્ય કરતાં શ્રમિકો

## ગામડાનું જીવન

બનાસકાંઠા જિલ્લાનું એક શહેર ડીસા. અહીંથી થોડું દૂર એક ગામ. ગામનું નામ રાણપુર. અહીં મોટેભાગે સૌ ખેતીકામ સાથે જોડાયેલા. અહીં કોઈ ખેતી કરે. વળી કોઈ પશુપાલન કરે. પોતાના ખેતરમાં કામ કરતાં કરતાં વધારાના સમયે કોઈ ઓજાર બનાવે કે કપડાં સીવવાનું પણ કામ કરે. એક તો વળી ટ્રેક્ટર ચલાવે. જે બોલાવે એના ખેતરમાં ખેડ કરવા જાય. ગામ નાનું પણ અહીં વાળ કપાવવા કે દાઢી કરાવવા શહેરમાં ન જવું પડે. અહીં નાનીમોટી કેટલીક દુકાનો. આ દુકાનોમાં ચંપલ મળે અને કપડાં પણ મળે. જરૂર પડે ત્યારે તાવ-શરદીની દવા ગામની દુકાનમાંથી મળી જાય. આ ગામ અને આસપાસનાં ગામમાં સૌ બટાટા અને બાજરીની જ ખેતી કરે.

ગામમાં દરજી મળે, સુથાર પણ મળે. હજામ અને લુહાર પણ આ ગામમાં જોવા મળે છે. આ બધા જ એમના વ્યવસાય સાથે ખેતી કે ખેતમજૂરી સાથે જોડાયેલ છે. ગામમાં એક યુવાને થોડા સમય પહેલાં ચા-નાસ્તા માટે એક દુકાન બનાવી છે. ગામના લોકો કરતાં અહીંથી પસાર થનાર વધારે સંખ્યામાં અહીં ચા-નાસ્તો કરવા ઉભા રહે છે. કેટલાક ખેડૂતો અહીં બારેમાસ શાકભાજીની ખેતી કરે છે. કેટલાક ખેડૂતો દાડમની કે બીજા ફળની વાડી બનાવે છે. ફળ, ફૂલ અને શાકભાજીની ખેતી કરનાર પણ આ ગામમાં જોવા મળે છે.



17.2 ગ્રામીણ જીવન


### ગામડામાં શ્રમકાર્ય અને જીવન :

એમને સૌ મધુબા કહે. માલપુર ગામમાં તે રહે. આ જ ગામમાં એમનાં લગ્ન થયાં. ગામના મોટા ખેડૂતના ખેતરમાં તે એમના પતિ જોડે મજૂરી કરે. આખો દિવસ મજૂરી કરે. સવારે આઠ વાગે ધરનું નાનુંમોટું કામ પતાવી બંને મજૂરીએ જાય. તેમને બે દીકરીઓ છે. બંને ગામની જ સરકારી શાળામાં ભણે છે. મોટા ખેડૂતનું નામ મોંઘજીભાઈ. તેમને વીસ એકર જમીનનું ખેતર. મધુબા અહીં કામ કરે અને પોતાનું ગુજરાન ચલાવે. સવારે આઠ વાગ્યાથી સાંજના ચાર વાગ્યા સુધી તે ખેતરમાં મજૂરી કરે. ખેતરમાં તે વાવેતર કરે. નિંદામણ કરે અને બીજું કામ પણ કરે. આખો દિવસ મધુબા મજૂરી કરે ત્યારે સાંજે એમને વેતન મળે. રોજ કાંઈ ખેતરનું કે મજૂરીનું કામ ન મળે. એક વખત એમને દિવસો સુધી કામ મળ્યું ન હતું. તેથી લવજીભાઈ પાસેથી એમણે પૈસા ઉછીના લીધા હતા. નાની દીકરી બીમાર પડી હોઈ તેમને પૈસાની ખાસ જરૂર હતી. આ પૈસા પરત ચૂકવવા જરૂરી હતા પણ એ સમયે કામ મળતું પણ ન હતું. આ કારણે લવજીભાઈને પૈસા પાછા આપવા માટે એમણે

પગમાં પહેરવાનાં ઝાંઝર વેચી દીધાં હતાં. આવું કેટલીય વખત બનતું. ખેતરમાં મજૂરીનું કામ ન હોય ત્યારે તે બીજાના ખેતરમાં કે પથ્થરની ખાણમાં મજૂરીકામ કરતાં. હવે એમની ઉંમર થઈ જોઈ તેમનાથી વધારે મજૂરી થતી નથી. તે ખૂબ થાકી જાય છે. તેથી મધુબાના પતિ પણ એમને ઘરકામમાં મદદ કરે છે. તેઓ સાંજે ઘરે આવે અને ઘરનું કામ કરે. ભોજન તૈયાર કરે અને જમે.

આ ગામમાં બીજા પણ કેટલાય લોકો છે જેમની જોડે પોતાની જમીન નથી. કેટલાક જોડે થોડીક જ જમીન છે. જેની પાસે જમીન ઓછી છે તે વરસાદને આધારે જ ખેતી કરે છે. આ કારણે વરસાદ ન હોય ત્યારે કેટલાક લોકો આ ગામ છોડી મજૂરી કરવા બીજે જતાં રહે છે.

### •જુઓ અને સમજો •



મધુબાનાં કામ અંગે અહીં ચાર્ટ આપેલ છે. આ ચાર્ટને જોઈ નીચેના પ્રશ્નો આધારે ચર્ચા કરો :

- (1) તેમને ક્યારે વધારે કામ મળતું હશે ?
- (2) કયાં-કયાં મહિનામાં તેમને કામ મળતું નહિ હોય ?
- (3) કેટલા મહિના સુધી એમને કામ શોધવું પડતું હશે ?

### •ચર્ચા કરો •

- (1) મધુબા એમના ઘરમાં કયાં કામ રોજ કરતાં હશે ?
- (2) મધુબાને ઘરમાં એમના પતિ કેવી રીતે મદદ કરતા હશે ?

### ખેતી, પશુપાલન અને જીવનનિર્વાહ :

નાનું ગામ પાંડરવાડા. અહીં સલમાન રહે. સલમાન પાસે પોતાનું ખેતર છે. સલમાન પાસે દસ એકર જમીન છે. આ જમીનમાં તે જાતે ખેતી કરે છે. જ્યાં જરૂર જળાય ત્યાં તે કોઈની મદદ મેળવી ખેતી કરે છે. આ મદદ માટે તે મજૂરીના પૈસા આપે છે. તે બિયારણ અને ખાતર બજારમાંથી વેપારી પાસેથી લાવે છે. વેપારી તેમને ઉધારમાં બિયારણ

અને ખાતર આપે છે. પાક ઉત્તરે એટલે એને વેચીને સલમાન વેપારીને પૈસા પરત આપે છે. બાકીના પૈસા ચૂકવતા તે ખેતરની આવકમાંથી સાત કે આઠ મહિના સુધી જીવન જીવી શકે છે. બાકીના સમયમાં જીવન જીવવા માટે તે પશુપાલન કરી આવક મેળવે છે. સલમાન જોડે એક ગાય અને બે બેંસ છે. તેમનું દૂધ સલમાનને જરૂરી નાણાં મેળવી આપે છે. સલમાન દૂધ સહકારી મંડળીમાં વેચે છે. તેમાંથી જે આવક થાય એમાંથી તે બાકીના ચાર મહિના જીવન જીવી શકે. કેટલીક વખત પાસેના શહેરની ઔદ્યોગિક વસાહતમાં સલમાન છૂટક કામ મેળવી જીવનનિર્વાહ માટે ખર્ચ ભેગું કરવા મજૂરી કરે છે.

### • વિચારો અને કહો •

- સલમાનને ક્યારે મજૂરી કરવી પડતી હશે ?
- સલમાનની આવક ક્યા સમયે સૌથી વધારે હશે ?
- સલમાન પાસે ગાય કે બેંસ ન હોય તો તેને શું મુશ્કેલી પડે ?
- ઔદ્યોગિક વસાહતમાં સલમાનને કેવું કામ કરવું પડતું હશે ?

### ગામનું શહેર સાથે જોડાણા :

નાનું ગામ રામનગર. અહીં એક વેપારી. એમનું નામ જગાભાઈ. તેમને નાની દુકાન. આ દુકાનમાં શાકભાજ મળે. કરિયાણું મળે અને સાથોસાથ જીવનજરૂરી કેટલીક વસ્તુઓ પણ મળે. સાબુ, મીઠું કે નાનીમોટી દવાઓ આ દુકાનમાં મળે. રામનગરમાં મોટે ભાગે સૌ ચોખાની ખેતી કરે. ગામલોકોને જગાભાઈની દુકાનમાં કોઈ વસ્તુ જોઈતી હોય તો તે ચોખા લઈને જાય. જગાભાઈ આ ચોખાને બદલે તેમને જોઈતી વસ્તુ આપે. ગામલોકો પાસેથી ખરીદેલા ચોખા ભેગા કરી શહેરની મોટી દુકાનમાં આપી આવે. ઓછા પૈસે ચોખા ખરીદી જગાભાઈ શહેરમાં થોડા વધારે પૈસામાં આ સામાન વેચીને નાણાં કમાય છે.

મધુબા જેવાં ખેતમજૂર અંગે આપણે જોયું. જમીનદાર જેવા મોટા ખેડૂત ઉપરાંત સલમાન જેવા નાના ખેડૂત અને સાથોસાથ જગાભાઈ જેવા નાના વેપારીઓ અંગે આપણે વિગત જોઈ. તેમની પાસે નાની દુકાન કે આવક માટે અન્ય રસ્તા છે. પશુપાલન અને છૂટક મજૂરી ઉપરાંત ઔદ્યોગિક વસાહતમાં છૂટક કામ કરી ગુજરાન ચલાવનાર અંગે પણ આપણે વિગતવાર જોયું.

### અન્ય રીતે જીવનનિર્વાહ :

નાનું ગામ સંચારડા. દરિયાકિનારે આવેલું આ ગામ. અહીં રૂડીબહેન અને લખીમા રહે. તેમની પાસે ખેતી કરવા માટે જમીન નથી. ન તેઓ છૂટક મજૂરી કરે છે કે ન કોઈ જગ્યાએ કાયમી કામ કરી પૈસા કમાય છે. રૂડીબહેન અને લખીમા બંને માછલી પકડવાનું કામ કરે છે. માછીમાર ખાદ્યઉત્પાદક કહેવાય છે. માછલી એ દરિયાઈ જીવ છે. રૂડીબહેનને ઘરકામમાં તેમના પતિ સહયોગ કરે છે. લખીમા ઘરડા છે. તેમના પતિનું અવસાન થયું છે. રૂડીબહેન અને લખીમાની ભાગમાં એક નાની હોડી છે. તે દરિયાકિનારે જ મૂકી રાખે છે. તેમની જોડે ઘરમાં માછલી પકડવા માટે નાની જાળ અને એ માટેનાં કેટલાંક સાધનો છે. તેઓ માછલાં પકડવા દરિયામાં જાય છે. દરિયામાં માછલાં મેળવવા દૂર સુધી જવું પડે છે. વર્ષમાં આઠ મહિના સુધી તે માછલાં પકડીને જીવનનિર્વાહ કરે છે.

ચોમાસાના દિવસોમાં દરિયો ખેડવો એ જોખમકારક છે. આ કારણે રૂડીબહેન અને લખીમા ચોમાસાના દિવસો દરમિયાન માછલી પકડવા જતાં નથી. વરસાદ, વાવાજોડું કે આવી કુદરતી આપત્તિઓ સામે રૂડીબહેન અને લખીમા જેવાં માછીમારી કરનારાં લાચાર છે. જ્યારે આવી કુદરતી સ્થિતિ આવે ત્યારે તેમને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જ્યારે તે માછલી પકડી શકતા નથી ત્યારે તેમની જોડે આવકનું બીજું કોઈ સાધન રહેતું નથી. આવા સમયે કામ મેળવવા માટે ખૂબ મુશ્કેલી પડે છે. આ સમયે જીવનનિર્વાહ માટે તેમણે પૈસા ઉછીના લેવા પડે છે. ઉછીના પૈસા તેઓ ત્યારે જ પરત કરી શકે છે જ્યારે એ માછલી પકડીને વેચી શકે. તેમને માછલી પકડવામાં પણ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. આજકાલ બધે જ પ્રદૂષણ વધતું જોવા મળે છે. દરિયામાં પ્રદૂષણ વધવાને લીધે માછલી પકડવા તેમણે દરિયામાં ખૂબ દૂર જવું પડે છે. પ્લાસ્ટિક અને ઉદ્યોગોનું પાણી નદી-ગાટર મારફતે દરિયામાં જાય છે. આ કારણે અહીં પ્રદૂષણ વધતું જાય છે. પ્રદૂષણને લીધે અહીં માછલીઓ પણ ઓછી થતી જાય છે. આ પરિસ્થિતિ પણ રૂડીબહેન અને લખીમાને ચિંતામાં મૂકે છે. દરિયામાં તોફાન આવે ત્યારે તે માછલી પકડવા જઈ શકતાં નથી. ત્સુનામી વખતે આવેલ દરિયાના તોફાનમાં તેમને આર્થિક નુકસાન થયું હતું. તે સમયે તેમની હોડીને પણ નુકસાન થયું હતું. આ વખતે તે લાંબાસમય સુધી માછલી પકડવા જઈ શક્યાં ન હતાં. સરકારે તેમને નવી હોડી લાવવા માટે આર્થિક સહાય કરી હતી.

આ જ રીતે ગામડાંના કેટલાય લોકો દૂધ, શાકભાજુ કે અન્ય સામગ્રી ગામડામાંથી પાસેના શહેરમાં જઈ તેનું વેચાણ કરી જીવનનિર્વાહ કરે છે.

### • વિચારો અને કહો •

- આપણી આસપાસ લોકો કેવી રીતે કમાય છે ?
- માછીમારને રોજ કેટલા કલાક કામ કરવું પડતું હશે ?
- દરિયાને ચોખ્યો રાખવા માટે તમે શું કરી શકો એમ છો ?
- માછલીની જેમ અન્ય શું વેચીને નાણાં કમાઈ શકાય ?
- કેવી કુદરતી આફત વખતે માછલી પકડવા જઈ શકતું નથી હોતું ? શા માટે ?

### યાદ કરો, પૂછો અને લખો :

ક્રમ	વ્યવસાય	વ્યવસાયકારનું નામ	વ્યવસાયની વિગત
1.			
2.			
3.			
4.			

### શહેરનું જીવન

આપણે અત્યારે ગ્રામીણ જીવન અને જીવનનિર્વાહની વાત કરી. આ જ રીતે શહેરમાં પણ વ્યવસાય અને રોજગારી માટે જાણકારી મેળવવી જરૂરી છે. શહેરમાં રોજગારી મેળવવી ખૂબ જ કપરું કામ છે. શહેરમાં વસતા લોકો અને તેમની રોજગારી અંગે વિગતો જોઈશું.



### 17.3 શહેરનું જીવન

આપણી આસપાસ અનેક લોકો હોય છે. દરેક કોઈ ને કોઈ કામ સાથે જોડાયેલ હોય છે. શહેરમાં વિવિધ પ્રકારના વ્યવસાય જોવા મળે છે. આ વ્યવસાય ઉપર અનેક લોકો નિર્ભર હોય છે. કોઈને દુકાન હોય તો કોઈને દુકાનમાં નોકરી. કોઈ ઓફિસમાં જાય. કોઈ રોડ ઉપર બેસીને ધંધો કરે. કેટલાક લોકો તો હરતાં ફરતાં કામ કરે. કોઈ શાળામાં કે કોલેજમાં ભણાવવા જાય તો કોઈ નાનીમોટી મજૂરી કે કૌશલ્ય આધારે કામ મેળવી રોજગારી દ્વારા જીવનનિર્વાહ કરે છે.

#### • વિચારો અને કહો •

- ચિત્રમાં કયા-કયા વ્યવસાય જોઈ શકાય છે.
- ચિત્રમાં ન હોય તેવા અન્ય વ્યવસાય કયા છે ?
- કયા કૌશલ્યને આધારે રોજગારી મળે છે ?
- તમે કયો વ્યવસાય કરી રોજગાર મેળવવા વિચારો છો ?

#### રેખાની વાત :

રેખાનું ગામ નાનું. બાજુના શહેરમાં અનાં માસી રહે. રેખા માસીના ઘરે આવી હતી. તેણે જોયું તો અહીં કેટલાય લોકો રોડ ઉપરથી જ રોજગારી મેળવે છે. કોઈ શાકભાજની નાની દુકાન ચલાવે છે. એક માણ લારી ઉપર શાકભાજ વેચે છે. ફૂલની દુકાન હોય કે સાઈકલના પંક્ચરની અને કોઈ મરામતની દુકાન ચલાવે છે. રોડના ઉપર એક ખૂણામાં બૂટપોલિશની દુકાન બનાવી એક ભાઈ રોજગાર મેળવે છે. સોડા-શરબતની દુકાન કે કરિયાણાની દુકાન પણ અહીં જાડો રોડ ઉપર છે. રોડ ઉપર ઊભા હોઈએ અને થોડી જ વારમાં ગાડીનો કાચ સાફ કરી પૈસા ભેગા કરનાર પણ રેખાએ જોયા. એક ભાઈ સાઈકલ ઉપર સફાઈનાં સાધનો વેચે છે, બીજો ભાઈ રસ્તા ઉપર પીવાના પાણીનો ધંધો કરે છે. તેજ રસ્તા ઉપર ફેરીયો, રમકડાં વેચે છે. રેખાએ એક હેરકટિંગ સલૂન જોયું અને કહ્યું ‘આ બધુ મારા ગામમાં



### 17.4 સ્વરોજગાર મેળવતા કારીગરો

ત્રાણ કે ચાર દુકાનોમાં હોય છે. રેખાના ગામમાં જે બધું દુકાનમાં મળે છે એવી કેટલીક વસ્તુ અંગે અહીં પાથરણામાં વેચાતી જોઈ. રોડ ઉપરની દુકાન કે રોડની આસપાસ કામ કરનારને કારણે અનેક વખત સમસ્યા જોવા મળે. ક્યારેક ટ્રાફિક-સમસ્યા વધી જાય છે. નાનામોટા અક્સમાત થાય છે. આવું રોડ ઉપર કે રોડની આસપાસ કેટલાક લોકો વ્યવસાય કરી રોજગારી મેળવે છે. શહેરમાં એક વ્યક્તિ એક કરતાં વધારે વ્યવસાય કે કૌશલ્ય આધારે વિવિધ પ્રકારનાં કામ સાથે જોડાયેલ હોઈ શકે. રેખાઓ જોયું કે ટાયર પંક્ચરની દુકાનમાં કામ કરતો હતો એ જ છોકરો રાતે ભજનમાં ઢોલક વગાડતો હતો.

### • જાણવા જેવું

- એક અંદાજ મુજબ શહેરમાં રોજગારી મેળવતા કુલ વ્યક્તિ પૈકી 12 % લોકો શહેરમાં રસ્તા ઉપરથી રોજગારી મેળવે છે. કેટલાક શહેરમાં પાથરણા બજાર કે લારીગલ્વા બજાર માટે ખાસ વ્યવસ્થા કરવામાં આવે છે. જેથી કરીને ટ્રાફિકની સમસ્યા નિવારી શકાય છે.

### કરશનભાઈનું કામ

બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકામાં માવસરી ગામ. એક બાજુ રાજ્યસ્થાન અને એક બાજુ પાકિસ્તાનની સરહદ ધરાવતું આ ગામ. ગામમાં કરશનભાઈ રહે. તે ગામમાં સુધારીકામ કરતા હતા. કરશનભાઈ પાંચ વર્ષથી બાજુના નગર થરાદમાં રહે છે. કરશનભાઈ શહેરમાં રિક્ષા ચલાવવાનું કામ કરે છે. તેમની રિક્ષામાં શાળાનાં બાળકોને શાળા સુધી પહોંચાડે છે. આજે કરશનભાઈ પાસે બે રિક્ષા છે. આજે કરશનભાઈ શહેરમાં રિક્ષા ચલાવી રોજગારી મેળવે છે.

### • વિચારો અને કહો

- કરશનભાઈ શહેરમાં કેમ આવ્યા હશે ?
- શહેરમાં પરિવારને કઈ અગવડ પડતી હશે ?
- તમે બીજા કોઈ શહેર કે ગામમાં જાવ તો રોજગારી મેળવવા શું કરો ?
- ગામદેથી શહેરમાં આવેલ કોઈ એક વ્યવસાયકાર અંગે ચર્ચા કરો.

### સામૂહિક શહેરી જીવનનિર્વાહ :

નિલમના મામા એક ફેક્ટરીમાં કામ કરે છે. ફેક્ટરી મોટા સંકુલમાં છે. અહીં પ્રવેશતાં જ વિવિધ વિભાગ જોવા મળ્યા. અહીં શર્ટ અને પેન્ટ બનાવવાની ફેક્ટરી છે. અહીં કાપડનો વિભાગ અને ટેક્નિકલ વિભાગ વધારે સક્રિય જોવા મળ્યો. ઉપરના માળમાં પચાસ કરતાં વધારે મશીન હતાં. ઓછી મહેનતે વધારે કામ અને સિલાઈ થઈ શકે એવા સિલાઈ માટેનાં મશીન હતાં. સિલાઈ કરવા અને બટન લગાવવા માટે ખાસ પ્રકારનાં મશીન હતાં. આ કારણે ઓછી મહેનતે વધુ કામ થતું હતું. નિલમના મામા અહીં મેનેજર તરીકે કામ કરતા હતા. તેમણે નિલમને કપડું આવે ત્યાંથી શર્ટ કે પેન્ટ તૈયાર થઈને પેક્ઝિંગ થાય ત્યાં સુધીની કામગીરી જોવાની તક આપી. તે ફેક્ટરી જોઈને આવી. અહીં તેના મામા વેપારીઓ સાથે વાત કરતા હતા. સામેના વેપારીને કામ જરૂરથી જોઈતું હતું. એમણે એક હજાર શર્ટ જોઈતા હતા. તેઓ કહેતા હતા કે, ઓવરટાઈમ કરાવી આ ઓર્ડર પૂરો કરાવી આપો. નિલમના મામાએ તેમને ઓવરટાઈમ અને તેમાં થતાં વધારાના ખર્ચ અંગે વાત કરી.



### 17.5 કપડાં સીવવાની ફેક્ટરી

#### જાણવા જેવું

- ચોવીસ કલાક કામ કરતાં એકમમાં ત્રણ પાળીમાં કામ થાય છે. એક જ જગ્યામાં 24 કલાક દરમિયાન 3 વ્યક્તિ કામ કરે છે. આઠ કલાક કરતાં વધારે કામ કરવાનું થાય, તો દરેક કલાકના કામ માટે વધારાનાં નાણાં ચૂકવવામાં આવે છે.

#### છૂટક જીવનનિર્વાહ :

જ્યસિંહ રાજસ્થાનથી નવસારી આવ્યા છે. અહીં તે ચોકલેટ બનાવવાનું કામ કરે છે. અનેક પ્રકારની ચોકલેટ બનાવે છે. તેઓ આ માલ બનાવી બજારના વેપારી સુધી પહોંચાડવાનું કામ કરે છે. આ માટે કાચી સામગ્રી એક્ટી કરવાથી લઈ ચોકલેટનું ઉત્પાદન કરવાનું અને તેનું વેચાણ કરવાના કામ ઉપર તેઓ સીધી દેખરેખ રાખે છે. સેલ્સમેન અને વેપારી સુધી માલ પહોંચે તો જ વેચાણ સરળ બને. આ માટે તેમને વેપારીઓ સાથે ખાસ સંપર્ક રાખવા પડે છે. જ્યસિંહની ચોકલેટને કારણે આજે 100 કરતાં વધુ લોકો સીધી કે આડકતરી રીતે રોજગારી મેળવે છે. આપણી આસપાસ અનેક વ્યવસાયકાર જોવા મળે છે. આધુનિક સમયમાં કૌશલ્યને આધારે કામ મળી જ રહે છે. રોજગારી મેળવવા માટે કૌશલ્ય ખૂબ જ મહત્વ ધરાવે છે.

#### • યાદ કરો અને લખો •

- આપણી આસપાસ અનેક લોકો વિવિધ કામ સાથે જોડાયેલ છે. આ કામને આધારે તેઓ રોજગારી મેળવે છે. અહીં એક ઉદાહરણ આપેલ છે. જ્યસિંહ ચોકલેટ બનાવવાનું કારખાનું ચલાવે છે. આ માટે એને સહયોગની જરૂર પડશે. તમે પણ આ માટે વિવિધ રીતે રોજગારી મેળવનાર અંગે અને તેમની સાથે જોડાયેલ અન્ય વિગતો તૈયાર કરો.

ક્રમ	રોજગારીનું માધ્યમ	ક્યાંથી આવે છે	કઈ રીતે પહોંચે છે	કોણ ઉપયોગ કરે છે	વિશેષ નોંધ
1.	પેપરનો ફેરિયો	શહેરના પ્રેસમાંથી	વાહન દ્વારા આવે છે.	અનેક માણસો ઉપયોગ કરે છે.	અનેક માહિતી આપણને મળી શકે છે.
2.	શાકભાજી વેચનાર	બેતરમાંથી			તંદુરસ્તી માટે સારું

### સ્વાધ્યાય

#### 1. ખાલી જગ્યા પૂરો :

- (1) ગામડામાં મોટે ભાગે સૌ ..... કામ સાથે જોડાયેલ હોય છે.  
(2) ઔદ્યોગિક રોજગારી ..... માં વધુ મળી રહે છે.



#### 2. નીચેના આપેલ પ્રશ્નોના વિકલ્પોમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી ઉત્તર આપો :

- (1) ગામડામાં લોકો નીચે પૈકી કયું કામ વધારે કરતાં જોવા મળે છે ?  
(A) સરકારી નોકરી      (B) ખેતી      (C) ઉદ્યોગ      (D) બધું જ સાચું
- (2) શહેરમાં રોજગારી મેળવવા માટે લોકો ક્યાંથી આવે છે ?  
(A) પાસેના ગામથી      (B) અન્ય રાજ્યથી      (C) અન્ય શહેરથી      (D) બધું જ સાચું

#### 3. એક-બે વાક્યોમાં ઉત્તર આપો :

- (1) ખેતી કે ખેતમજૂરી કરતાં લોકો મોટે ભાગે ક્યાં જોવા મળે છે ?  
(2) રોડ ઉપર કયા કયા રોજગાર કરતાં વ્યક્તિ જોવા મળે છે ?  
(3) કેવી વ્યક્તિને રોજગારી મેળવવામાં સરળતા રહે છે ?

#### 4. ટૂંક નોંધ લખો :

- (1) ગ્રામીણ જીવનનિર્વાહ      (2) શહેરી જીવનનિર્વાહ  
(3) શહેરમાં છૂટક રોજગારી      (4) પશુપાલન અને ખેતમજૂરી

#### 5. જોડકાં જોડો :

- | અ                    | બ                                   |
|----------------------|-------------------------------------|
| (1) ખેતમજૂરી         | (a) કાયમી કામ મળી રહે છે.           |
| (2) કૌશલ્ય આધારે કામ | (b) એક કરતાં વધુ રીતે કમાઈ શકાય છે. |
| (3) ઔદ્યોગિક રોજગારી | (c) બારેમાસ કામ ન પણ મળે.           |



# ચાલો, સમજ ચકાસીએ

## 1. ચાલો, ઈતિહાસ જાણીએ

### • નીચેના આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

- (1) તાપ્રાપત્રો ગુજરાતમાં કઈ જગ્યાએ જોવા મળતાં નથી ?  
(A) શ્રી હેમચંદ્રાચાર્ય જૈન જ્ઞાનમંદિર, પાટણ  
(B) એલ. ડી. ઈન્સ્ટિટ્યુટ ઓફ ઇન્ડોલોજી, નવરંગપુરા, અમદાવાદ  
(C) ભો. જે. અધ્યયન અને સંશોધન વિદ્યાભવન, અમદાવાદ  
(D) ગુજરાત વિદ્યાપીઠ લાઇબ્રેરી, અમદાવાદ
- (2) ઇ.સ. 2019માં ઈસુ પ્રિસ્તના જન્મનાં કેટલાં વર્ષ થયાં હશે ?  
(A) 2000 (B) 2019 (C) 2319 (D) 1019
- (3) નીચેનામાંથી કયો પ્રવાસી ભારત આવ્યો ન હતો ?  
(A) મેગેસ્થનિસ (B) ફાહિયાન (C) યુઅન-શવાંગ (D) કોલંબસ

## 2. આદિમાનવથી સ્થાયી જીવનની સકર

### • નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

- (1) નીચે પૈકી કયું સ્થળ પાણાણકારીન માનવ-વસાહતનું નથી ?  
(A) ભીમબેટકા (B) ઊજીઝેન (C) ઈનામગામ (D) મહાગઢા
- (2) ભારતમાંથી મળી આવેલ પ્રાચીન ગુફાઓ સંબંધિત નીચે પૈકી કયું વિધાન યોગ્ય નથી ?  
(A) ગુફા એ આદિમાનવના રહેઠાણ માટેનું સ્થળ હતું.  
(B) આદિમાનવોએ ગુફાઓમાં ભીતચિત્રો દોર્યાં હતાં.  
(C) આદિમાનવ ગુફાઓમાં રહી લોખંડનાં ઓજારો બજાવતો હતો.  
(D) કુરનૂલની ગુફામાંથી રાખના અવશેષો મળ્યા હતા.
- (3) નીચે આપેલ કઈ જોડ સાચી છે ?  
(A) મહાગઢા - ચોખા (B) બુર્જહોમ - મસૂર (C) મેહરગઢ - ઘરં (D) આપેલ ત્રણેય

## 3. પ્રાચીન નગરો અને ગ્રંથો

### • નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

- (1) નીચે આપેલ જોડ પૈકી કઈ જોડ ગુજરાતનાં પ્રાચીન નગરોની છે ?  
(A) હડ્યા, મોહેં-જો-દરો, મહેરગઢ, રહેમાન ગઢી  
(B) લોથલ, રંગપુર, રોજડી, ધોળાવીરા  
(C) કાલીબંગાન, ભગવાનપુર, રાપડ, બનાવલી  
(D) રંગપુર, કાલીબંગાન, મોહેં-જો-દરો, મહેરગઢ

#### 4. भारतनी प्रारंभिक राज्यव्यवस्था

- નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(3) ગાંધારાજ્યોની રાજ્યવ્યવસ્થા પૈકી નીચેનામાંથી ક્યું વાક્ય ખોટું છે ?

- (A) વૈશાલી વજિજસંધનું ગાંધારાજ્ય કહેવામાં આવતું.  
(B) ગાંધારાજ્યમાં જ્યાં સભા ભરાતી હતી તે સ્થળ સંથાગાર કહેવાતું.

- (C) રાજ્યની બધી જ સત્તા સભ્યો પાસે રહેતી.  
(D) ગાંધારાજ્યમાં પ્રત્યેક સભ્યને રાજા ગાંધારામાં આવતો ન હતો.

(4) આપણા દેશનાં લોકો પોતાના શાસકોની પસંદગી કઈ રીતે કરે છે ?

- (A) વંશ પરંપરાગત (B) ધ્વનિમતથી  
(C) મતદાનથી (D) એકેય નહિ.

(5) નીચેનામાંથી ક્યા ગ્રંથ અનુવૈદિક કાળમાં 16 મહાજન પદો હતાં ?

- (A) અંગુતરનિકાય (B) નિપિષ્ટક  
(C) મહાભારત (D) એક પણ નહિ.

## 5. શાંતિની શોધમાં : બુદ્ધ અને મહાવીર

• નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(1) નીચેનામાંથી ક્યું વિધાન ગૌતમ બુદ્ધ વિશે સાચું નથી ?

- (A) તેમનું બાળપણનું નામ સિદ્ધાર્થ હતું.  
(B) ગૌતમ બુદ્ધના યુવાવસ્થામાં જ લગ્ન કરાવવામાં આવ્યા હતાં.  
(C) તેમનું અવસાન કુંડગ્રામમાં થયું હતું.  
(D) ગૌતમ બુદ્ધનાં પત્નીનું નામ યશોધરા હતું.

(2) નીચેનામાંથી કઈ બાબત મહાવીર સ્વામી સાથે બંધબેસતી નથી ?

- (A) જૈનર્ધમ (B) કુંડગ્રામ  
(C) યશોધા (D) કપિલવસ્તુ

(3) ગૌતમ બુદ્ધને નીચેનામાંથી ક્યા દિવસે જ્ઞાનપ્રાપ્તિ થઈ હતી ?

- (A) શરદપૂર્ણિમા (B) વૈશાખી પૂર્ણિમા  
(C) ગુરુપૂર્ણિમા (D) ઉપરમાંથી એક પણ નહિ.

## 6. મૌર્યયુગ : ચંદ્રગુપ્ત અને સમ્રાટ અશોક

• નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(1) બૌદ્ધ ધર્મના પ્રચાર માટે સમ્રાટ અશોકે પોતાના પુત્ર અને પુત્રીને ક્યાં મોકલ્યાં હતાં ?

- (A) ભારતમાં (B) ચીન  
(C) સિલોન(શ્રીલંકા) (D) પાકિસ્તાન

- (2) મૌર્ય સામ્રાજ્યના પ્રમુખ નગરમાં કોનો સમાવેશ થતો નથી ?  
 (A) તકશીલા (B) પાટલીપુત્ર  
 (C) ઉજ્જૈન (D) સાંચી
- (3) ગ્રાન્ડ ટ્રેડ સંદર્ભ નીચેનામાંથી કઈ બાબત સાચી છે ?  
 (A) રોડનું નિર્માણ ચંદ્રગુપ્ત મૌર્યના સમયમાં થયું હતું.  
 (B) તામ્રલિપિ થઈને તકશીલાને જોડતો હતો.  
 (C) વર્તમાન સમયમાં દિલ્હીથી કોલકાતા સુધીના રાષ્ટ્રીય ધોરીમાર્ગથી ઓળખાય છે.  
 (D) ઉપર્યુક્ત તમામ
- (4) સૌરાષ્ટ્રમાં ગિરનાર પર્વત પર નીચેનામાંથી કોણો સુદર્શન તળાવનું નિર્માણ કરાવ્યું હતું ?  
 (A) પુષ્પગુપ્ત (B) સ્કંદગુપ્ત  
 (C) સમુદ્રગુપ્ત (D) અશોક
- (5) સમાટ અશોકના સંદર્ભમાં નીચેનામાંથી કઈ જોડ સાચી નથી ?  
 (A) રાજધાની પાટલીપુત્રમાં રાજ્યાભિષેક  
 (B) બૌદ્ધ સાધુ ઉપગુપ્તના ઉપદેશથી શાસ્ત્રોનો ત્યાગ કર્યો.  
 (C) પાટલીપુત્રમાં ત્રીજ બૌદ્ધ પરિષદ બોલાવી હતી.  
 (D) અશોકના અભિલેખોની ભાષા સંસ્કૃત અને લિપિ ખરોખી છે.
- (6) મૌર્યયુગનાં વહીવટીતંત્રમાં રાજકુમારોની નિમણૂંક નીચેનામાંથી ક્યા પદ પર કરવામાં આવતી ?  
 (A) લોકપાલ (B) સામંત  
 (C) રાજ્યપાલ (D) રાષ્ટ્રપતિ

## 7. ગુપ્તયુગ અને અન્ય શાસકો

- નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

- (1) ગુપ્તયુગની રાજધાની ઉજ્જૈન હાલ ક્યા રાજ્યમાં આવેલ છે ?  
 (A) ગુજરાત (B) ઉત્તરપ્રદેશ  
 (C) મધ્યપ્રદેશ (D) બિહાર
- (2) નાલંદા વિદ્યાપીઠ હાલના ક્યા રાજ્યમાં આવેલી હતી ?  
 (A) અસમ (B) બિહાર  
 (C) ઉત્તરપ્રદેશ (D) હરિયાલી

- (3) હર્ષવર્ધન અને પુલકેશી વચ્ચે કઈ નદીના કિનારે યુદ્ધ થયું હતું.
- (A) ગંગા (B) ગોદાવરી
- (C) ચંબલ (D) નર્મદા
- (4) ગુપ્તયુગના શાસકોને પ્રથમથી કર્મમાં ગોઈવો :
- (A) ચંદ્રગુપ્ત પ્રથમ, સમુદ્રગુપ્ત, ચંદ્રગુપ્ત બીજો, સ્કંદગુપ્ત
- (B) સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો, સમુદ્રગુપ્ત
- (C) સમુદ્રગુપ્ત, સ્કંદગુપ્ત, ચંદ્રગુપ્ત પ્રથમ, ચંદ્રગુપ્ત બીજો
- (D) ચંદ્રગુપ્ત બીજો, ચંદ્રગુપ્ત પ્રથમ, સ્કંદગુપ્ત, સમુદ્રગુપ્ત

## 8. ભારતવર્ષની ભવ્યતા

- નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

- (1) પ્રાચીન ભારતીય કલાના સંદર્ભમાં નીચેનામાંથી કયું વાક્ય અયોગ્ય છે ?
- (A) નિર્દર્શન કલામાં નૃત્ય અને નાટકનો સમાવેશ થાય છે.
- (B) લલિત કલામાં ચિત્ર, સાહિત્ય, સ્થાપત્ય, સંગીત, માટીકલાનો સમાવેશ થાય છે.
- (C) ઈતિહાસવિદો કલાને ત્રણ ભાગમાં વહેંચે છે.
- (D) કલાના બે ભાગ લલિતકલા અને નિર્દર્શન કલા
- (2) પ્રાચીન ભારતીય સાહિત્યના વારસાની નીચેનામાંથી બંધબેસતી જોડ બનાવો :

અ

બ્ર

- |                     |               |
|---------------------|---------------|
| (A) વેદોની સંખ્યા   | (a) 4         |
| (B) પુરાણોની સંખ્યા | (b) 18        |
| (C) મહાભારત         | (c) ત્રिपિલ્ક |
| (D) બૌદ્ધ ધર્મગ્રંથ | (d) ૪૫ સંહિતા |
- (3) સાહિત્યિક ગ્રંથ અને તેના રચયિતાની અયોગ્ય જોડ શોધો :
- |                             |                                    |
|-----------------------------|------------------------------------|
| (A) રામાયણ - વાલ્મિકી       | (B) મહાભારત - વેદવ્યાસ             |
| (C) મિલિન્ડ પાન્ડો - નાગસેન | (D) અર્થશાસ્ત્ર - ચંદ્રગુપ્ત મૌર્ય |
- (4) દક્ષિણ ભારતનાં સાહિત્ય સંદર્ભ નીચેનામાંથી કઈ બાબત યોગ્ય છે ?
- |   |
|---|
| (A) સંગમ સાહિત્ય કહેવામાં આવે છે.                         |
| (B) રચના ઈ.સ.ની પ્રથમ ત્રણ સદીઓમાં થઈ.                    |
| (C) મદુરાઈમાં ત્રણ સંગમ સભામાં 1600 વીર કાવ્યોની રચના થઈ. |
| (D) ઉપર્યુક્ત તમામ  |

## 9. આપણું ઘર : પૃથ્વી

- નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(6) સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણ માટે નીચેનામાંથી કઈ બાબત સાચી છે ?

- (A) સૂર્યગ્રહણ - સૂર્ય અને પૃથ્વી વચ્ચે ચંદ્ર  
(B) ચંદ્રગ્રહણ - ચંદ્ર અને સૂર્ય વચ્ચે પૃથ્વી  
(C) સૂર્યગ્રહણ અમાસે અને ચંદ્રગ્રહણ પૂનમે થાય છે.  
(D) ઉપર્યુક્ત તમામ

## 10. પૃથ્વીનાં આવરણો

• નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

- (1) ખડકો અને ધન પદાર્થી બનેલ આવરણ ક્યા નામે ઓળખાય છે ?  
(A) જલાવરણ (B) ખડકાવરણ  
(C) જવાવરણ (D) વાતાવરણ
- (2) હું મનુષ્યના આહાર, આવાસ અને અસ્તિત્વનું પાયારુપ આવરણ દ્રુત્યારી છું.  
(A) મૃદાવરણ (B) ધનાવરણ  
(C) ખડકાવરણ (D) આપેલ તમામ
- (3) નીચેનામાંથી કઈ બાબત મહાસાગર સાથે જોડાયેલ છે ?  
(A) પ્રોટીનયુક્ત આહાર (B) જળમાર્ગ  
(C) ખનીજો (D) આપેલ તમામ
- (4) નીચેનામાંથી કઈ બાબત વાતાવરણ સાથે જોડાયેલ નથી ?  
(A) તે સ્વાદરહિત છે. (B) વાયુઓનું બનેલું છે.  
(C) ખડકોનું બનેલું છે. (D) એક પણ નહિ.
- (5) જોડકાં જોડો :  
અ (A) મૃદાવરણ (B) પૃથ્વીસપાટીનો મહત્તમ વિસ્તાર ધરાવતું આવરણ  
(B) જલાવરણ (C) સૌર પરિવારમાં ફક્ત પૃથ્વી ગ્રહને જ મળેલ આવરણ  
(C) વાતાવરણ (D) પર્વતો, ઉચ્ચપ્રદેશો, મેદાનોથી રચાયેલ આવરણ  
(D) ધન, પ્રવાહી અને વાયુતત્ત્વો ધરાવતું આવરણ

## 11. ભૂમિસ્વરૂપો

• નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

- (1) નીચેનામાંથી કઈ બાબત ‘પર્વત’ સાથે જોડાયેલ છે ?  
(A) તેની ઊંચાઈ સમુક્ષસપાટીથી આશરે 900 મીટરથી વધુ હોય છે.  
(B) તે તીવ્ર ઢોળાવ અને સાંકડાં શિખરો ધરાવે છે.  
(C) (A)  
(D) (A) અને (B)

## 12. નકશો સમજુએ

- વિવિધ પ્રદેશોની આપેલ વિગતોનું નકશાના પ્રકારને આધારે વર્ગીકરણ કરો :
    - પર્વત, પરિવહન, મેદાન, ઉદ્યોગ, ખેતી, ઉચ્ચપ્રદેશ, સિંચાઈ, નદી, સરોવર, વસ્તી, મહાસાગર

प्राकृतिक नक्शा	सांस्कृतिक नक्शा

- નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

- (1) આપેલ વિકલ્પમાંથી નકશાનું મુખ્ય અંગ જણાવો :

(A) દિશા (B) રૂટ સંક્ષારો  
(C) (A) અને (B) (D) એક પણ નહિં.

(2) જોડકાં જોડો :

અ

(A) ઈશાન

(B) અજિન

(C) વાયવ્ય

(D) નૈત્રક્રત્ય

બ

(1) ઉત્તર-પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો

(2) દક્ષિણ-પશ્ચિમ દિશા વચ્ચેનો ખૂણો

(3) ઉત્તર-પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો

(4) દક્ષિણ-પૂર્વ દિશા વચ્ચેનો ખૂણો

(5) ઉત્તર-દક્ષિણ દિશા વચ્ચેનો ખૂણો

### 13. ભારત : ભૂપૃષ્ઠ, આખોહવા, વનસ્પતિ અને વન્યજીવ

• નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :

(1) 'સુંદરવન' મુખત્રિકોણ પ્રદેશ કઈ નદીઓ દ્વારા રચાયેલ છે ?

(A) બ્રહ્મપુત્ર - યમુના

(B) ગંગા - યમુના

(C) બ્રહ્મપુત્ર - ગંગા

(D) બ્રહ્મપુત્ર - ગોદાવરી

(2) યોગ્ય જોડકાં જોડો :

અ

(A) શિયાળો

(1) સમુક્ર પરથી ભેજવાળા પવનો ફૂંકાય છે.

(B) ઊનાળો

(2) આકાશ વાદળો વિનાનું સ્વર્ચ દેખાય છે.

(C) ચોમાસું

(3) કુદરતી આપત્તિઓ અનુભવાય છે.

(D) પાણ ફરતા મોસમી

(4) ગરમ-સૂકા પવનો ફૂંકાય છે.

પવનોની ઝતુ

(5) સૂર્યનાં કિરણો ગ્રાંસાં પડે છે.

(3) નીચે આપેલ વૃક્ષોનું જે-તે જંગલ-પ્રદેશોમાં વર્ગીકરણ કરો :

વાંસ, સાગ, મહોગની, લીમડો, નેતર, બાવળ, ચીડ, દેવદાર, બોરડી, થોર, સુંદરી

જંગલપ્રદેશ	વૃક્ષો
ઉણા કટિબંધીય વરસાદી જંગલો	
ઉણા કટિબંધીય પાનખર જંગલો	
સૂકાં ઝાંખરાવાળાં જંગલો	
પર્વતીય જંગલો	
મેન્ચુવનાં જંગલો	

## 14. વિવિધતામાં એકતા

- નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
  - (1) કબીરસિંહ ગુરુદ્વારામાં પ્રાર્થના કરવા જાય છે, તો કબીરસિંહ ક્યો ધર્મ પાળતા હશે ?
    - (A) હિન્દુ
    - (B) મુસ્લિમ
    - (C) શીખ
    - (D) જૈન
  - (2) હું પણ્ચમ બંગાળના લોકોની પ્રિય મીઠાઈ છે ?
    - (A) રસગુલ્લા
    - (B) જલેભી
    - (C) પેંડા
    - (D) મોહનથાળ
  - (3) ભગવાન જગતાથની રથયાત્રા ક્યારે નીકળે છે ?
    - (A) દિવાળી
    - (B) હોળી
    - (C) અષાઢી બીજ
    - (D) અખાતીજ
  - (4) જ્યાપુરમાં યોજાયેલ લગ્નપ્રસંગે ત્યાંના નૃત્ય કરતા હશે ?
    - (A) રાસ-ગરબા
    - (B) કુચીપુડી
    - (C) ભરતનાટ્યમ्
    - (D) ધૂમર
  - (5) તમારા પિતાજીની રાષ્ટ્રભાષા કઈ છે ?
    - (A) ગુજરાતી
    - (B) કણક
    - (C) હિન્દી
    - (D) અંગ્રેજી

## 15. સરકાર

- નીચે આપેલ વિકલ્પોમાંથી સાચો વિકલ્પ પસંદ કરો :
  - (1) નીચેનામાંથી કઈ બાબત લોકશાહી સરકાર ધરાવતા દેશને લાગુ પડતી નથી ?
    - (A) ચૂંટણી-પ્રક્રિયા
    - (B) લોકોનું પ્રતિનિધિત્વ
    - (C) વારસાગત શાસન
    - (D) લોકોની ભાગીદારી
  - (2) નીચેનાં વિધાનોમાંથી ક્યું વિધાન ખોલ્દું છે ?
    - (A) ભારતમાં રાજશાહી શાસન-વ્યવસ્થા છે.
    - (B) રાજશાહીમાં રાજા કે રાણી તમામ નિર્ણયો લે છે.
    - (C) રાજા કે રાણીનું પદ વારસાગત હોય છે.
    - (D) રાજા પાસે સલાહકારોનું એક નાનું મંડળ હોય છે.

- (3) નીચેનામાંથી કયું કાર્ય સરકારનું છે.

  - (A) સરકારી આરોગ્ય કેન્દ્રો ચલાવવાં.
  - (B) ફુદરતી આપત્તિ સમયે લોકોને મદદ કરવી.
  - (C) વિશ્વના અન્ય દેશો સાથે મૈત્રીપૂર્ણ સંબંધો જાળવવા.
  - (D) ઉપરના તમામ સાચા છે.

• નીચેના પ્રશ્નોના ઉત્તર એક-બે વાક્યોમાં લખો :

  - (1) ગુજરાત સરકાર એ કયા સ્તરની શાસન-વ્યવસ્થા છે?
  - (2) તમે સરકારનાં કયાં-કયાં અંગો વિશે જાણો છો ?

## 16. स्थानिक सरकार



અ	બે
1. ગ્રામપંચાયત	1. ચિક્ક ઓફિસર
2. જિલ્લા પંચાયત	2. તાલુકા વિકાસ અધિકારી (TDO)
3. નગરપાલિકા	3. તલાટી-કમ-મંત્રી
4. તાલુકા પંચાયત	4. ભૂનિકિપલ કમિશનર
	5. જિલ્લા વિકાસ અધિકારી

- (4) લોકઅદાલતના સંદર્ભે નીચેના પૈકી કઈ બાબત યોગ્ય છે?

(A) બંને પક્ષકારોને ઘણો ખર્ચ કરવો પડે છે.

(B) બંને પક્ષકારોને સમાધાનકારી રીતે ઝડપી ન્યાય મળે છે.

(C) બંને પક્ષકારોએ કોર્ટમાં હાજર રહેવું પડે છે.

(D) સમયનો બગાડ થાય છે.

## 17. ଜୀବନନିର୍ଭାଷ

